

# પ્રભુ પદ્માર્થ

જવેરચંદ મેઘાળી



ગુજરાત ગંધીરલા કાર્યાલય

ગુજરાતિયા નાકા સામેં . ગંધી માર્ગ . અમદાવાદ . ૩૮૦ ૦૦૯



ક્રમાંક: ૩. 100

પુનર્મુદ્રણ: જાન્યુઆરી 2013  
પ્રથમ આવૃત્તિ: 1943, બીજી - , તૃતીય 1945, ચોથી 1950  
પુનર્મુદ્રણ: 1958, 1968, 1990, 1997, 2003,  
'મેધાલી ગંથાવલી' (પંદરાં 2)માં 1975, 1981

### PRABHU PADHARYA

a novel by Jhaverchand Meghani  
Published by Gurjar Grantha Ratna Karyalaya,  
Opp. Ratanpolenaka, Gandhi Road, Ahmedabad - 380 001 (India)

©

ISBN : 978-81-8480-822-3

પૃષ્ઠ : 12+180

પ્રતિ : 1250

#### ■ પ્રકાશક ■

અમરભાઈ ટાડોરલાલ શાહ

ગુજરાત ગ્રંથરલન કાર્યાલય

રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380 001

ફોન : 22144663 e-mail : goorjar@yahoo.com

#### ■ વાઈપરોટિંગ ■

અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ, 10 બીરવા રો હાઉસિસ, બોપાલ,

અમદાવાદ - 380 058

ફોન : 3735590, ઈ-મેલ : apu@vsnl.com

#### ■ મુદ્રક : ભગવતી ઓફસેટ ■

સી/૧૬, બંસીધર ઓસ્ટેટ, બારડોલપુરા,

અમદાવાદ - 380 004

મુદ્રણ: જાન્યુઆરી 2013  
સીલ 1945, ચોથી 1950  
8, 1990, 1997, 2003,  
(નંદ 2)માં 1975, 1981

eghani  
Karyalaya,  
Road - 380 001 (India)

પૃષ્ઠ: 12+180  
પ્રત: 1250

380 001  
yahoo.com

ગુરુસિસ, બોપલ,

.com

ચ.

અર્પણ

સૌજન્યમૂર્તિ

શ્રી ચૂનીલાલ પારેખને



**‘મજુ પદ્ધાર્ય’** (‘ફ્યા લારે’) શીર્ષકની કથા મેધાભી પાસેથી મળેલી વિલખણ પ્રાદેશિક કથા છે. એમાં બલટના સામાજિક જીવનનું ચિત્રણ થયું છે. ત્યાંની ભૂમિમાં જઈ વસેલા હિંદીઓ અને ત્યાંના સ્થાનિક બર્મા લોકો વચ્ચેના સંબંધો અને વ્યવહારો વર્ણવવાનો અહીં તેમનો મુખ્ય ઉદેશ રહ્યો છે. કૃતિના અંતભાગમાં; 1942માં બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિંદીઓએ આસામને માર્ગ સ્વદેશ આવવા જે હિજરત કરી હતી તે ઐતિહાસિક ઘટનાનું મર્મસ્પર્શી આવેખન થયું છે. એ રીતે આ નવલકથાને એનો સીમિત પણ સધન ઐતિહાસિક સંદર્ભ મળ્યો છે. મેધાભીનો ઉદેશ તો આપણી પાડોશી પ્રજાના જીવનના અંતર્પ્રવાહોને પ્રકાશિત કરવાનો અને હિંદીઓના તેમની સાથેના વ્યવહારનું દર્શન કરાવવાનો છે. બર્મા લોકોનું કુઠુંબજીવન, તેમના જીવનને ડિલ્લોળે ચાચવતો તથુલાનો ઉત્સવ, ફો સેઈનું નૃત્ય, મૃત્યુનું મહાત્મ, તધીન્નોનું પર્વ - એમ ત્યાંની પ્રજાના જીવનની જાંખી કરાવતા ભિન્નભિન્ન પ્રસંગો વાચકના દર્શિફલકમાં એક પછી એક આવતા રહે છે. વળી બર્મા પ્રજાના જીવનવ્યવહારમાં ‘હુંગીઓ’ તરીકે ઓળખાતા બૌદ્ધ સાધુઓનું સ્થાન કેવું તો અસાધારણ છે તે પણ તેમાંથી પ્રગટ થઈ જાય છે. કેટલાક પ્રસંગોમાં ત્યાંની રાજકીય અને ધાર્મિક ચણવળોના ઉલ્લેખો થયા છે. એવા સંદર્ભોનો આશય બર્મા પ્રજાના અંતર્પ્રવાહોને ઓળખવાનો અને એની સાથેના હિંદી વસાહતીઓના વ્યવહાર વર્ણવવાનો પ્રયત્ન રસપ્રદ બને છે. ચોખાની મિલોના માલિક બનેલા અને રંગુનમાં જરૂરવેરાતનો ધંધો કરતા હિંદીઓએ સ્વાર્થરત રહીને પોતાની ધનસંપત્તિ વધારવાનો જ ઝ્યાલ કર્યો છે. બર્મા લોકોનાં હિતનો રજમાત્ર વિચાર કર્યો નથી. બર્મા મજૂરોની કંગળ દરશા અંતરને હચમચાવી મૂકે છે. સમાજ ભારતનો હો યા બર્માનો, અન્યાય, શોષણ અને જુલ્મના બનાવોથી મેધાભીનું અંતર વ્યથિત બની રહે છે. ‘તથુલાનો ઉત્સવ’, ‘મૃત્યનો ઉત્સવ’ અને ‘તધીન્નો’ જેવાં પ્રકરણોમાં નિર્મિત થયેલાં મનોહર ચિત્રોમાં મેધાભીની આગવી કથનશૈલીનો પરિચય મળે છે.

પ્રમોદકુમાર પટેલ

કૃતી પાસેથી મળેલી  
 ક્રેદિક જીવનનું ચિત્રજી  
 યાંના સ્થાનિક બમ્મા  
 તેમનો મુખ્ય ઉદ્દેશ  
 સચ્ચયુદ્ધના દિવસોમાં  
 જરૂરત કરી હતી તે  
 રીતે આ નવલકથાને  
 છે. મેધાશીઓનો ઉદ્દેશ  
 ને પ્રકાશિત કરવાનો  
 કરવવાનો છે. બમ્મા  
 નો તથુલાનો ઉત્સવ,  
 એમ ત્યાંના પ્રજાના  
 ના દાખિફલકમાં એક  
 અવહારમાં 'કુગીઓ'  
 સાધારણ છે તે પણ  
 રાજકીય અને ધાર્મિક  
 વાશય બમ્મા પ્રજાના  
 હિંદી વસાહતીઓના  
 રહોના માલિક બનેલા  
 રહીરત રહીને પોતાની  
 નેનાં હિતનો રજીમાત્ર  
 રને હચમચાવી મૂકે  
 રૂપજી અને જુલ્મના  
 નો ઉત્સવ', 'મૃત્યનો  
 ના મનોહર ચિત્રોમાં

## નિરેન

(પહેલી આવૃત્તિ)

'ક્ષયા લારે' ભલુ પધાર્યા: દેવ આવ્યા: એ બરમા લોકોની સ્વાગતવાળી છે. સકળ હિંદુવાસીઓમાં વધુ પ્રિય એવા ગુજરાતીઓને તેઓ આ વાક્યે સત્કારે છે; મતલબ કે ગુર્જર-બરમા પ્રજાના સંસ્કાર-સંપર્કને આવેખતી આ વાર્તા છે.

1942ના વર્ષમાં બ્રહ્મદેશથી હિંદુવાનોની જે હિજરત થઈ તે હિતિહાસમાં અપૂર્વ બની ગઈ છે. એ હિજરતનાં જ પ્રસંગ-ચિત્રો એકનિત કરીને પુસ્તકારે આપવા ઉમેદ જન્મી હતી.

પછી થયું કે એ સંકલ્ય દુઃસાધ્ય છે; વધુ આવેખવાને પાત્ર તો હિતર પ્રાંતોની પ્રજાઓ સાથેના ગુજરાતી પ્રજાના સંપર્ક-સંઘર્ષો છે. ગુજરાતીઓ મહારાષ્ટ્ર ને સિંધ, બંગાળ ને મદ્રાસ, બમ્મા ને આફિક, બધી જઈ પેઢાનપેઢીથી વર્સે છે; તે છતાં તેમના અને સ્થાનિક પ્રજાના સહચારમાંથી પ્રકટનું સુવિશાલ જીવન કલામાં, સાહિત્યમાં કે ચિત્રપત્રમાં ઉત્તરનું નથી એ એક મોરી ખામી છે, અને એક પહોળા સાહિત્યપત્રને ગુમાવી દેવા બરોબર છે.

આ ચિત્રારે મન પરની પકડ વધુ મજબૂત બનાવી, અને મન ઉપર બ્રહ્મદેશમાંનું ગુજરાતી પ્રજાજીવન પહેલો કબજો લઈ બેઠું. કરવા એ બન્યું કે મારાં કેટલાંક અતિનિકટનાં આપ્તજીનો બ્રહ્મદેશનાં ચિરવાસીઓ હતાં; તદુપરાંત ત્યાં લાંબો કાળ રહી આવેલા તેમ જ છેલ્લી હિજરતમાં મણિપુર માર્ગ નીકળી આવેલા કેટલાંક ભાઈઓનો સમાગમ થયો. આ ભાઈઓમાં નોંધપાત્ર સુન્દર જે વાગી તે બ્રહ્મદેશની સંસ્કારિતા પ્રત્યેની તેમની લાગણીભરી દર્શિ હતી. અંદ્દી

ખાતેની રાજ્યભાવનાથી અંકિત ઉચ્ચ આત્મસંકારિતા, અને ત્યાંના બહુભાવી સંસારના સીધા સંબંધમાંથી ઉદ્ભવેલી માનબુદ્ધિ: એ બેઉંનું મિશ્રણ મને નવાઈબન્ધુ લાગ્યું. તેમણે મને વાતાવરણ બાંધી આપ્યું, કેટલીક વિગતો પૂરી પાડી, પછી વાતાસૂચિ મેં ખડી કરી. મારુ એ સહાયકોનાં નામો ઠરાદાપૂર્વક અહીં આપ્તો નથી.

તમામ પાત્રો કલિપત છે. વાતાની સંકળના કલિપત છે. છતાં આ કૃતિની પરિપૂર્ણ પીઠિકા વાસ્તવનિષ્ઠ છે. વલણોનાં વહેણ સાચાં છે. પાછાં પ્રકરણોમાં યુદ્ધકાળનું આવેખાન જેમ દર વિગતે વફાદાર અહેવાલ ન હોવા છતાં એનું કલ્યાણરૂપ તથ્યાવળણી છે, તે જ વાત આખી વાર્તા પરતે સાચી શમજી લેવાની છે.

ગુજરાત-ભાવી અંતરચલનો, ઝેરબાટી પુરાણ, કુલલડો, કુગીઓને લગતી વાતો, ભર્ભીજનો પ્રત્યેની ધૂર્તતા વગેરે સાચાં છે. આઈ વાસાના બાળને લઈને સુલાવડી માતાં, તેમ જ લેગનાં દરદી, મણિપુર-માર્ગને પાર કરીને જીવતાં હિંદ પહોંચી આવ્યાના કિસ્સા બન્યા છે. અને ગોરા સાંદેલનું દુઃખૌરવ પણ મેં બિલકુલ નિરાધાર નથી ગાયું; એવો કિસ્સો બનેલો છે.

આ લખાણ એકધારું કર્યું છે, અને એક સર્જક તરીકે મારી પ્રત્યેક કૃતિના સર્જન દરમ્યાન તેમ જ તે પછી જે સુખસંવેદન મને દેવી શારદાનો વરદ હસ્ત આપે છે, તે તેણે આ વેળા તો મૂળી ભરીને નહીં, પણ ખોલ્યે ભરીને આપ્યું છે. આ પુસ્તક મેં સંતોષનો ધૂંટડો ભરીને સમાપ્ત કર્યું છે.

છતાં લોભી વાચક! તમે તો કલ્યા વગર રહેવાના જ નથી કે પછી શારુહુ-સુભાઈનો હસ્તમેળાપ કેમ ન કરાયો? પેલી બાંગીજી તારણું શું? ન પાછળ મૂકેલ શિવને, માન્દ્યાને, નીમ્યાને, ડોસ્યેને કેમ લટકતાં જ મૂક્યાં? અરે, શામજી-શાંતિદાસની શેઠ-જોડલીને પહાડો વચ્ચે હજારો રૂપિયાની નોટે છતાં 'આશી! આશી!' કરતી તરફથી મરતી કેમ ન બતાવી?

જને ત્યાંના ભણી  
ને ઉનું જિશ્વાં  
આધું, કેટલીક  
એ સહયકનાં

તે છે. ઇતાં આ  
વહેણ સાચાં છે.  
વિગતે વણાદાર  
છે, તે જ વાત

દુલકડો, કુળીઓને  
છે. આઈ વાસાના  
નું, મણિપુર-માર્ગને  
યા છે. અને ગોરા  
આધું; એવો ડિસ્ટો

તરીકે મારી પ્રત્યેક  
સંવેદન મને હેવી  
મૂળી બરીને નહીં,  
નો ઘૂંઠડો બરીને

વાના જ નથી કે  
? એવી બનીજી  
નાને, હોસ્યેને કેમ  
લીને પણડો વચ્ચે  
તરફડી મરતી કેમ

કરાણ કે ભાઈ! અથવા બાઈ! હું વિષનો વિધાતા નથી. અરે,  
ખૂદ વિદ્યાનીએ બાપડી આપણા જીવનના કેવા અભિષદ થાડ મૂળીને રક્ખ  
થઈ જાય છે!

ગાંધીજી: 11-6-1943

### [વીજ આવૃત્તિ]

આ વારતાના વાચન પરથી, બ્રાહ્મણામાં વરી આવેલા  
ગુરુજીના ખૂનાં જ હદ્યમાં ત્યાંના વસવાટનાં મધુર સમરણો  
જાગ્રત થયાં છે. એ પોષક ભૂમિને માટે ઊંડી મમતા તેમ જ એના  
વિચ્છેદ માટે તીવ્ર મનોબ્યા પેદા થઈ છે. તહુપરાંત, એ કેવળ સારાંખાંની  
સાધનો દ્વારા કમાણી કરવાનો જ દેશ નહોતો, પણ સંસ્કારદિનિએ  
ઓળખયા જેવો, એને આત્મક ભાવે ચાહવા-પૂજવા જેવો દેશ હતો  
એવું ભાન આ પુસ્તકના વાચને જન્માયું છે. મારી વારતાના સાહિત્યનો  
સર્વોપરી સંતોષ હું આ કારણે જ લઈ રહ્યો છું.

બ્રાહ્મણ રહી આવેલા સંખ્યાબંધ ભાઈઓએ પત્રો વખી વખી  
'પ્રભુ પધાર્યાનું આવેખન શુદ્ધ અને સત્યનિષ્ઠ હોવાનું જાણાયું છે,  
અને વધુ કંઈ નહીં તો છેવટે બ્રહ્મી ભાષાપ્રયોગોમાં રહી ગયેલા હોષોના  
પણ સુધારા લખી મોકલી, જીજાવરથી એ ભાષાની વ્યાકરણની-રૂપના  
પર પણ માંડું લક્ષ હોરી, એ દેશની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે.  
એ સહૃદો હું ઝડપી છું, અને મૂળની ભાષાક્ષતિઓ મેં કણજ રાખી  
સુધારી લીધી છે.

આ નિવેદન તો આટલેથી સમાપ્ત કર્યું હોત, પણ દરમિયાન એક  
સ્નેહીનું પણ આવ્યું તે થોડીક ઉમેરણને અનિવાર્ય બનાવે છે. પતામાં  
લખ્યું છે કે:

વોદરા સાહિત્ય પરિષદમાંથી પછી ફરતાં મારે વીરમગામ  
સ્ટેશને જ કલાક રોકાનું પડેલું ત્યારે એક સહપ્રવાતી સાચે વાતચીત  
થતાં, તે બર્મામાંથી છેવટમાં દેશમાં આવી પહોંચેલામાંના એક  
ભાઈ છે એમ જાણવામાં આવ્યું, તમારા 'પ્રભુ પધાર્યાની વાત

નીકળી. એમજો એ પુસ્તક વખાણ્યું, એમાં વર્ણવી છે તેથી પણ વિશેષ મુશ્કેલીઓ એમને વેઠવી પડેલી એમ પણ એમજો કલું. છીવતમાં એમજો એમ કલું કે, આપણા દેશના ભાઈઓ બરમાઓને છીતરતા-લુંગતા વગરે જે ઉલ્લેખ થયો તે ક્રીક નથી થયું. વાત સાચી હોવા છતાં, આપણા જ એક પ્રતિજ્ઞિત લેખક એ લખે છે એટલે સરકાર આજ સુધી જે વિધાન કરતી આવી છે. તેને સમર્થન મળે છે. આવી આપણને નુકસાન છે વગરે. ભાષા આ જ ન હતી, આવા અર્થની હતી.

પરંતુ લખનાર સેહીએ મને આવી આ પુસ્તકલેખન પાછળનું માતું દસ્તિબિંદુ રજૂ કરવાની, તેમ જ એક કલાકારનો એકદર સ્વધર્મ જનતા આગળ મૂકવાની તક પૂરી પાડી છે. કોઈ પણ કલાકારનો ધર્મ જેમને પોતે આવેણી રહેલ છે તે લોકોને માટે સરકાર શું ધારી લેશે - અને એમ ધાર્યા પણી એ લોકોને આર્થિક, રાજકારણી શી શી હાજિ પહોંચાડશે - એનો વિચાર કરવાનો કદાપિ હોઈ શકે નહીં. હિંદી તરીકે હિંદ્યાવાનોની કે ગુજરાતીએ લેખ ગુજરાતીઓની સાચી ને ભયંકર એબો ચાજદારી કારણસર હાંકી છુપાવી રાખવાને કોઈ પણ કલાકારને કહેણું, અથવા તેની પાસેથી એવી આશા સેવવી, એ - વધુ આકરી ભાષા તો નહીં વાપરું - સાહિત્ય અને કલાનાં કર્તવ્યો વિશેની ગેરસમજ સૂચવે છે, એ વાત બર્માવાસી હિંદ્યાવાન ભાઈઓને મારે કહેવી જોઈએ.

એથી ઊલટી દિશામાં જોઈએ તો, પારદી કે પોતાની, કોઈ પણ પ્રજાની એકલી નબળી બાજુઓને જ આવેખનાર સાહિત્યકાર બેશક પોતાનું દૂષિત કલુષિત માનસ દાખવે છે અને કલા નાપાક કરતો હોય છે. સાચી હોય તે છતાંયે નિજની કે પરની, હેતુપૂર્વક નરી બદબોઈ કરવાનો કસબ કલાદેવીને દારે મંજૂર નથી; પછી ભલે એ કસબ ચાહે તેટલો મનમોહક અને ચોટદાર હોય.

'પ્રભુ પદ્ધાર્યાની કથા લખવા બેસતી વેળા મારી નજર સામે ભલાદેશને ઠાળી, લુંટી કે શોધી આવેલા ગુજરાતીઓ ચડવા નહોતી; એમને ઉઘાડા પાડવાની દૂર દૂરનીયે ઠંકણ નહોતી; તેમ નહોતું મારી

નજર સ  
નર્ધુ દય  
વડીલાત  
અને બ  
એ એક  
છાયા  
હતી. ૨  
ક્રોતુકને  
પછી ૨  
સર્જન  
પામવા  
સંવેદન  
ઉદાવ  
નથી  
વાતાન  
સંસ્કર  
ઠગણ  
વાત  
રાણ

1 પણ  
કલું.  
તરમાઓને  
વાત સાચી  
એટલે  
નિન  
ન હતી,

ન પાછળનું  
દર સ્વધર્મ  
કરનો ધર્મ  
ધારી લેશે  
શી હાનિ  
હિંદી તરીકે  
કંકર એબો

રને કહેતું,  
ભાષા તો

મજ સૂચવે  
ઈએ.

કોઈ પણ  
દર બેશક  
કરતો

બદલોઈ  
સબ ચાહે

જર સામે  
નહોત્તા;  
હોતું મારી

નજર સન્મુખ બલદેશીઓનું આપણા લોકોના શોચિતો-પાડિતો લેખનું  
નર્ધુ દ્વારાનક દશ્ય. એમના ઉપર કૃપા કરવા કે એમના હુગુણોની  
વકીલત કરવા મેં મારી કલમ નહોતી ઉપાડી. મારી સમજ તો હિંદીવાનો  
અને બર્મા જનોના સામુદ્ઘારિક લોકસંપર્કનું એક નીતમ દશ્ય રમતું હતું.  
એ એક એવી તસવીર હતી કે જેમાં રૂપ અને રોખાઓ હતાં, તેજ અને  
છાપા હતાં; ઉધા, સંધ્યા અને અંધારાભરી કે ક્રીમુદી-ભીજળી રચિતો  
હતી. એ સમગ્ર દશ્યે (નર્ધી કે એમાંના કોઈ એક ધૂટક ટુકડાએ) મારા  
ક્રોતુકને ઉદ્દીપન કર્યું અને મારામાં શુદ્ધ કલારસલક્ષી સંવેદન થોળ્યું.  
પછી મને પરવા નહોતી કે એમાંનો કથો વર્ણ કે કઈ વ્યક્તિ મારા આ  
સર્જન થકી આર્થિક અથવા રાજદ્વારી હિસાબે કથાં લાભહાનિને  
પામવાનાં છે. સર્જનને તો જોવું એટલું જ હતું, કે એવી કૃતિમાં ગેનું  
સંવેદન સત્યનિષ્ઠતાને ચૂક્યા વગર કોઈ એક સર્વમંગલકર આકૃતિનો  
ઉઠાવ કર્યો જાય છે કે નર્ધી.

આ હિસાબે મને મળેલો આત્મસંતોષ એકસો ટકાથી જરીકે ઉછો  
નથી રહ્યો, ને મારા વાચકગણની પણ મેં કશી દુર્ગતિ કરી નથી, તે  
વાતનો હવાલો સંખ્યાબંધ કાગળોએ આપેલ છે. ગુજરાતીઓના ઊજળા  
સંસ્કારોમાંથી એમનાં નબળાં તત્ત્વોને બાદ કરી દઈ વિલુપ્ત કરવાની  
ઠગવિદ્યા મેં વાપરી નથી, એ તો એક ગુજરાતી લેખ મારા ગૌરવની  
વાત છે.

રાખપુર: 3-2-1945

### [નીજ આવૃત્તિ]

આ નીજ આવૃત્તિની પ્રસિદ્ધ રેણાએ વિશ્વુદ્ધ નં. 2 ખતમ થયું  
છે અને વિશ્વુદ્ધ નીજાનું નેપથ્યવિધાન ચાલતું જણાય છે.

આ એક એવું ભયાનક, તથાપિ એવું મંગલ, વધાણું વાય છે કે  
જ્યારે પ્રજા-પ્રજા વર્ષેની ડેવળ આર્થિક, ઔદ્યોગિક અને રાજકારણી  
એકલાલ્ખિતા વડે ઉગાર કરવો હશે તો સાંસ્કારિક એકરૂપતાની સમજ

અવા દરજે જરૂરી બનશે ભારતીય અને ભાબદેશી પ્રજાઓની વચ્ચે  
એવી સાંસ્કૃતિક તથા પાત્રાનું હેઠાં સંવેદન છે એવી આ વાર્તા આપણા  
ભારતીય ભાઈબહદેનોનું ભાબદેશ ખાતેના પુનઃપ્રયાસ વખતે, આત્મિક  
પાત્ર બનો; બર્મા જનાર્થ હિંદુલાલને પોતાની એ પોષક-પાત્રક ભૂલાય  
પ્રત્યે મમતા જન્મો, ભાબદેશી માનવતામાં ભારતીય માનવતાનું એકરસ  
સમિક્ષા બની રહો, એવી આ વેખનની આશિષ્યો છે.

દોષાદ: 16-11-1945

1. .
2. .
3. .
4. .
5. .
6. .
7. .
8. .
9. .
10. .
11. .
12. .
13. .
14. .

પાત્રાંની વર્ણના  
વાતાં આપણા  
વખતે, આમિક  
પાત્રક ભૂમાપાટ  
વત્તાનું એકરસ

## ક્રમ

### નિવેદન

[5]

1. તથુતાનો ઉત્સવ	3	15. શે-સેઠિના નૃત્યમાં	90
2. 'કો ભાગ?' .	10	16. કિન્નો	96
3. વધુ ઓળખાજા	20	17. પતિ પલાયન	102
4. ચારલની મિલમાં	24	18. કુટુંબ	104
5. રિસો માણપવદી	31	19. દીકરાની સિંહામાં	108
6. પરસી વિધુ	38	20. શારદુ અતી	111
7. તેરનું જમા	43	21. બાળીનાં તોશન	122
8. બાળલો	46	22. કાળ-વાઢી	129
9. હુલ્લડ	51	23. વાનના બજારમાં	135
10. પ્રેમ-મંત્ર	58	24. તદીનો	139
11. ગ્રંથ દિવસ	65	25. બાગો! બાગો!	143
12. મૃત્યુનો ઉત્સવ	74	26. ઘર ભરી	148
13. 'મણાં નાઈ બુ'	78	27. પ્રભુ સિધાયા	157
14. બર્માનાં ઉદ્ઘારકો!	82		

જવેરચંદ મેધાલી: સાહિત્યશાળન . . . . . 175

મેધાલી-સાહિત્ય . . . . . 178

મેધાકુલીની સર્જકપત્રિભાના સૌથી પ્રભાવક આવિષ્કારો અલગ વૃત્તાંતોની  
માવળતમાં તેમ અલગ પ્રકરણોના સંવિધાનમાં જોવા મળે છે. તેમની મોચ  
ભાગની નવલકથાઓમાં એ રીતે અસંખ્ય પ્રકરણો અલગઅલગ રીતે જોતાં  
સુરેખ અને એકાગ્ર સર્જકતાનો સુખદ પરિચય આપે છે. સોરઠી લોકજીવનનાં  
પાત્રોની છબી કંડારી કાઢવામાં, તળ ધરતીનાં દશ્યો આદેખવામાં અને  
પ્રસંગના સંચલનમાં તેમની અતિ લાઘવભરી પણ તેથી અસાધારણ બળ  
પ્રાપ્ત કરતી કથનવર્ણશૈલી તેમની સર્જકશક્તિનો વધુ પ્રભાવક આવિષ્કાર  
દર્શાવે છે. તળપટી બોલીનાં પ્રાણવાન તત્ત્વોને આત્મસાત્દ કરીને તેઓ  
આગવી શૈલી નિપણવવા વિરલ પુરુષાર્થ કરતા રહ્યા છે.

પ્રમોદકુમાર પટેલ

પ્રભુ પદ્માય્ય

જ વૃત્તાંતોની  
તેમની મોટા  
જ રીતે જોતાં  
લોકજીવનનાં  
જવામાં અને  
ધારણ બળ  
ક આવિષ્કાર  
કરીને તેઓ

ડૉ. નીલ  
રોનક  
જલદી

મ્યાનવન  
હતો.  
ઉભાડી  
નિર્મળ  
ત્રણોધન

બેસ્તા  
જબાન  
ફ્યા!

પઢાઉ  
તેમ  
મનુષ  
મહોન

1. 'c'

## 1 તધૂલાનો ઉત્સવ

ડૉ. નોતમ પોતાના ઘરની પરસાળ પરથી ઉત્તલાસભરી નજરે એ શહેરની રોનક નિધાળી રથ્યા હતા. એણે ઘરમાં હળવો સાદ કર્યો: “હાથથી! જલદી અહીં આવ.”

જવાબમાં અંદરનું દાર ઉઘાડીને જે હાજર થઈ તે સાચે જ માનવ-હાથથી હતી. એ એની પત્તી હેમકુરવર હતી. તેનો દેહ ભરાવદાર હતો. એના હાથ બે સૂંઠની શોભા આપત્તા હતા. પરિએ એને બાજુએ ઉભાડીને નીચેનાં માર્ગો—ગતીઓનું દશ્ય દેખાજ્યું. પાછી, રેલમણીલ નિર્મલ પાછી, સુગંધવતી પૃથ્વી, અને ત્રીજી આનંદપેની માનવ-પ્રજા, એ ત્રણેયની ત્યાં સહકીડા મરી ગઈ હતી.

આખા બ્રહ્મદેશમાં આજે ‘તધૂલા’નો ઉત્સવ હતો. તધૂલા એટલે બેસત્તા વર્ષના પ્રથમ માસ ચૈત્રમાં વરુણદેવનું આવાહન-પર્વ. એ પર્વની જબાન છે પાછી. પ્રજા જળરૂપે પોકારી જળદેવને તેડાં કરે, ‘ચ્યાબા, ફ્યા! ચ્યાબા!’ ‘પધારો, ટેવ! પધારો.’

ગઈ કાલની સાંજ સુધી બિલકુલ ખાલી, કૂલો વગર અડવાં લાગતાં પઢાઉ વૃક્ષો એકાએક જાણો રાતમાં કોઈ વનદેવતાએ મઢી દીધાં હોય તેમ પીળાં, નાનાં સુવાસિત પુષ્પોએ લૂંબળૂંબ બની ગયાં હતાં. બે કરોડ મનુષ્યોએ નક્કી કરેલા એ ઉત્સવના જ પ્રભાતે પઢાઉ<sup>1</sup> કૂલો કોણો મહોરાવ્યાં હતાં, તે અક્ષળ વાત હતી. વર્ષોવર્ષ માનવી અને પ્રકૃતિ વચ્ચે

1. ‘તાંજઉ’ પણ કહે છે.

મેળ લેતો આ અગમ્ય સહકાર એ દેશનો સદાનો સંસ્કાર બની જતે  
ઘરઘરને અંગણો પાછીના દેગડા ગોઠવાયા છે. મ્યુનિસિપાલિટીની  
મગફૂર રહોતી કે વૈત્ર માસની પાછીની તાજી વખતે પણ આ પર્વથીને  
માટે પાણી પૂર્ણ પાડવાની ના પાડી શકે. ઘરની અંદરના નણોને બહારને  
દેંગો સાચે નળીઓ જોડી દીધી છે. બાલદીઓ ભરી ભરીને ભર્ણા  
રમણીઓ વાટ જોતી ઊભી છે. પગનાં કંડાંથી કમ્મર લગી લપેટેલી  
એક પણ કરચલી વગરની તસોતસ રંગબેરંગી રેશમી લુંગીઓ (આપણી  
કાઢિયાણી-આહીરાણીઓ પહેરે છે તે જીમી જેવી) તેમના સાગના સ્પેદી  
સરખા સીધા દેહને દીપાવી રહી છે. મલમલની એંજી (અંગડી) નીચે  
તેમની સ્પાટ છાતીઓ ધબકે છે. લમણા અને કપાળ પરથી ઊંચ્યા  
ઓળેલા વાળના સંદોઉં(અંબોડા)ને તેમણે માથાની હોચ પર છત્રી કે  
દોપી આકારે વાળી લીધેલ છે. અને તેના ઉપર ગુંથેલ છે નાનાં પીળાં  
પઢાઉનાં પુષ્પો. એવી છટા ભણી સ્વીઓ સ્વિવાય કોઈએ કેળવી જાણી  
નથી. કોઈના હાથમાં કેળનાં પાંદમાંથી વાળેલી લાંબી લાંબી ચિરું  
સળગે છે.

ઘરેયાનાં વૃદ્ધો પર વૃદ્ધો વધ્યાં આવે છે અને હાકલા પડે છે -  
“નંગો એબા! નંગો એબા!” “મને પાણી નાખો, મને પાણી  
છાંટો!”

છાંટે છિટેથી પાછીની જાલકોના પછડાટ સંભળાય છે, અને સામેથી  
આવતા દેખાય છે - ઘર ઘર જેવડા વિરાટ ઢાંઓ (ભોરલા), બબે માળની  
આગબોટો, અને એવા તો કંઈ કંઈ આકારો.

મોટરો અને મોટરના ખટારાઓ માથે કરેલી આ લાકડકામના  
કરામતો હતી, અને અંદર ઊભા હતા યુવાન ભણી પુરુષો. ઢાંઓ અને  
આગબોટોની અંદરથી તંતુવાદ્યોનું સમૂહ સંગીત વાગતું હતું. મર્દી ભરપૂર  
કંઈ ગાતા હતા - ઠિન્ઝનાં કીર્તિંગીઠો. તેમના લેબાસ એક જ સરખા  
ગજાવેશી હતા. ગલીએ ગલીએ અને ઘરેઘરેથી છંટાતી ચૌખ્યાં  
રંગવિઠોણાં પાછીની જાલકોએ તેમને તરબોળ કર્યા હતા. કોરાં હતાં

તથુલાને  
કેવળ તે  
દોપીઓ  
નારીમંડા  
ઘરેયાને  
બાલદી  
બોલતો,  
પાર ન  
વહેન  
શહેર ઉ  
ફક્ત ર  
કોમળ  
એબા!

નહોતો  
હતો,  
નીકળી  
પણ ?  
ખાવા  
ઝેરબા  
ખૂણાં  
આ ર  
અમે  
બોલ  
રૂપે

એ બની જતો  
નિસ્તિપાલિટીના  
જ આ પર્વાંગ  
અણે બહારના  
ભરીને ભ્રમા  
લગ્ની લપેટેલી  
દીઓ (આપજી)  
સાગના સોય  
(અંગડી) નીચે  
પરથી ઊંચા  
પર છન્હી કે  
છે નાનાં પીળાં  
કેળવી જાણી  
લાંબી ચિરુંદી  
લા પડે છે -  
નો, મને પાણી  
, અને સામેથી  
, બબે માળના  
લાકડકામના  
દુષ્પો. ઢાંઓ અને  
નું. મર્દી ભરપૂર  
એક જ સરખા  
યાતી ચૌખાં  
તા. કોરાં હતું

તથુતાનો ઉત્સવ

5

કેવળ તેમનાં એગેલાં માથાં, કારણ કે માથાં ઉપર તેમણે રહ્યારની  
દોપીઓ ચડાવી હતી.

એક પછી એક વાહન પસાર થતું હતું અને બેઉ બાજુનું પ્રત્યેક  
નારીમંડળ આ ઘેરેયાઓને ચોખાં મીઠાં જો રોળતું હતું. કોઈ કોઈ  
ઘેરેયાને શુરાતન ચડી જતું તો તે નીચે કૂદકી મારી, યુવતીના હથમાંથી  
બાલદી ખૂચવી, પાણીની જાલક એ સ્ત્રીઓ પર નાખી “ઈરાપો!”  
બોલતો, પાછો ઝડપનેર વાહનમાં છલાંગી જતો. પગપાળાઓનો તાં  
પાર નહોતો.

વધુ વાર થઈ નહીં ત્યાં તો રાજમાર્ગો પર નદીઓનાં સજીવન  
વહેન બંધાયાં. રાષ્ટ્રનો તહેવાર હતો, બજારો બંધ હતાં, પાણીની જ એ  
શહેર ઉપર પ્રભુતા હતી. શાસન હતાં - સરકારનાં નહીં. પણ ઈન્દ્રદેવનાં,  
ફક્ત એકલા બ્રહ્મદેશને જ વનશ્રીએ આપેલ પગાઉ પુષ્પોનાં, લયમધુર  
કોમળ સંગીતનાં, સ્ત્રીઓનાં, સ્નેહનાં, સ્વરોનાં - “નંગો એબા! નંગો  
એબા! ઈરાપો! ઈરાપો!”

એ કોઈ એક જાતિનો કોમળો તહેવાર નહોતો, કોઈ એક વર્ગનો  
નહોતો, કારણ કે બ્રહ્મી પ્રજા વર્ગમાં વહેંચાડી નથી. એ ઉત્સવ રાષ્ટ્રનો  
હતો, રાષ્ટ્રવાસી દેશી-પરદેશી તમામનો હતો. બ્રહ્મીઓની ગાડીઓ  
નીકળી, ચીનાઓના ઘેરેયા-ઘેર પણ નીકળ્યા, સિંહાલીઓ ને જાપાનીઓ  
પણ જુદા ન રહ્યા. વ્યાજભાઉ ધીરધારિયા કાળ સીસમ ચેરીઓ પાણી  
ખાવા ચાલ્યા, મુસિલિમ અને બર્મા વચ્ચેનાં લગ્નમાંથી નીપજેલી નૂતન  
જેરબાઈ ઓલાઉ પણ લાંબા કાળનાં કંદર વૈરને ખોપરીઓના એક  
ખૂણામાં સંઘરી મૂકી, પોતાનાં ખુનસ છીડી, ટોળ ટોળ બહાર નીકળીને  
આ રાષ્ટ્રોત્સવમાં સાદ પુરાવ્યો: “નંગો એબા, નંગો એબા: પાણી છાંટો,  
અમે પણ પાણી ખાનારા છીએ, અમને છાંટકોરો, અમને રોળો.”

“એ... એ... એ, જો પેલી બ્રહ્મીને હે... હે... હે - ” એમ  
બોલતા ડૉ. નૌતમે પોતાની પત્ની હેમકુંવર હથણીને રોળવાની ચેષ્ટા  
રૂપે એને ખંબે હથ મૂકી દીધો. અને જોયું તો એક માર્ગથી બીજે માર્ગે

જતી એક બણી નાચી શાંતિથી શિર નમાવીને પુડુષોની સામટી પાંચદસું  
બાલદીઓના ધોધમાં વડુણ-સાન કરતી હતી. પોતાનાં અંગ પરસાં નકોર  
રેશમ લદબદ થયાં તેનો એ સ્ત્રીને અહ્સોસ નહોતો. એ હસતી હતી,  
અને વીજાયેલ અંબોડમાંથી હીરાજડાઉ 'ભી' (કંચકી) કાઢીને ઉભી  
ઉભી લાંબા વાળ સમારતી હતી.

"શું તમે પણ ઘેલા થયા છો!" હેમકુવરે દેહને હળવેથી હલાણી  
ડૉક્ટરનો છથ પોતાના ખંબા પરથી લસરાવી નાખ્યો ને કંધું  
"નાનપક્ષમાં કદ્દી હોળી રમ્યા નથી કે શું?"

અને જોતી રાખી ડૉક્ટર ચોરીચૂપકીઠીથી ખરી ગયા, અને થોડી  
વારે બારીમાં ઉભેલી પટ્ટીએ "ઓય મા!" પોકાર્યું.  
પોતે પણ નખશિખ તરબોળ બની ગઈ હતી. ડૉ. નૌતમે અંદરથી  
ડોલ ભરી લાવીને એના ઉપર ઠબકારી દીધી હતી.

"મને શું નાખો છો? શૂરા હો તો ઉત્તરોને ડેઢા! જાવને આ  
બણીઓની આલકી ખાવા."

"જાઉં ને?"

"હા, હા, એ ડૉક્ટર!" બાજુએથી બીજા ગુજરાતીઓ નાચી  
ઉઠ્યા. "અંહીં તો રિવાજ છે. હિંદીવાનો પણ નીકળે છે. અમે તો  
જામડાંમાં હોઈએ ત્યારે અચૂક જોડાઈ જઈએ. કાઢોને મોટર! આપાણ  
નગરમાં ચક્કર લગાવીએ."

"ના લૈ! મોટર તો બગડે."

"ભલે બગડે, અવતાર તો સુધારો!" હેમકુવરે હસીને કંધું.

"પણ આ લોકોનાં પાણી ખાઈ નહીં શકો હો, દાક્તર!" પાડોશી  
જુવાને કંધું.

"બસ! બાઈડિયુંના ધથનું પાણી નહીં ખાઈ શકો એવા જ

તથુવાનો

પાણિયાળ

..

ચડી

..

રણજાણી

ટય

ગુજરાતી

રાષ્ટ્રોત્સવ

નંગો ઘેણ

ગુણ

સુધી આ

પારકા પ

બણીઓને

પાંદની વા

બેઢાં. તેમ

કુમારી યુ

નહોતો, ર

સંવિશેષ

ગુજરાતી

પદ્ધારો

ગુજરાતીને

થાય ત્યાં

બી

સામે પાર

'બાબુ'

એ

અંદર પર

પ્રભુ પદ્માવતિ  
ની પાંચદસ  
અનંત નક્કે  
સત્તી હતી,  
થીને ઊભી

થી હલાવી  
ને કલું  
અને થોડી

અંદરથી

અવને આ

તા ઉપર  
રદો આ

નાચી  
અમે તો  
આખા

હું  
પદોશી

વા ૫

## તથુલાનો ઉત્સવ

7

પાણિયાળા છોને, કાઠિયાવાડીઓ?" હેમકુવરે પાનો ચડાવ્યો.

"અરે, વાત છે કાઈ? કાઢો મારી મોટર!" ડૉ. નૌતમને ચાનક ચર્ચી.

"ચંગયા! ચંગયાને શું?" હેમકુવરે તાળીઓ પાડી. બંગડીઓ રષાજાંદી.

ટ્રોટ્ય કછોટા જિડાયા. ઠેકાણે ઠેકાણે ટેલિફોન થયા. કેટલીક ગુજરાતી પેઢીઓમાંથી મોટર અને મોટરટ્રકો નીકળી પડી. ગુજરાતીઓએ રાષ્ટ્રોત્સવના સમૂહનાદમાં સૂર પુરાવ્યો: "નંગો ઘેબા! નંગો ઘેબા!  
નંગો ઘેબા!"

ગુજરાતી યુવાનોને પણ બ્રહ્મી યુવતીઓએ કૃડી રીતે રોજ્યા. બાપોર સુધી આ રાષ્ટ્રોત્સવમાં ધૂમતા ડૉ. નૌતમને યાદ જ ન રહ્યું કે પોતે પારકા પરદેશમાંથી અહીં નવોસવો આવેલ છે. સાંજ નમવા લાગી. બ્રહ્મીઓને આંગણે આંગણે બુઢુંં સ્ત્રીપુરુષો ચચાઈ બિધાતી અને કેળનાં પાંદની વાળેલી હથ હથ લાંબી ચિરુટે ચૂસતાં આ રાષ્ટ્રોત્સવ નિહાળતાં બેઠાં. તેમની અંખોમાં અમી ભર્યું હતું. પરદેશવાસીઓ અને પોતાની કુમારી યુવતીઓ પર્વ જેલે છે તેનો કોઈ અવળો ભાવ તેમના અંતરમાં નહોઠો, અને ડૉ. નૌતમ વગેરે ગુજરાતીઓની ગાડી નીકળતી ત્યારે તેઓ સવિશેષ આનંદ પામીને બોલતાં: "ફ્યા લારે! બાબુ લારે!" (ફેવ આવ્યા, ગુજરાતી બાબુ લોકો આવ્યા!) "ચ્યાબા બાબુ! લાબરો બાબુલે!" (પદ્મારો ગુજરાતી જન, પદ્મારો લાડકવાયા બાબુ!) બાબુ એટલે ગુજરાતીને માટેનું માનભર્યું સંબોધન, અને એમાં 'લે'નું મુલાયમ મિશ્રણ થાય ત્યારે સમજવું કે બોલનારનાં અંતર લાડ વરસાવે છે.

બીજાં સર્વ હિંદીવાનોને આ બ્રહ્મીજનો 'કલારે' અર્થાત્ સાગરને સામે પારથી આવેલા એવા સહેજ તુચ્છકાર દાખવતા શબ્દે નિર્દેશ છે. 'બાબુ' 'બાબુલે' જેવા શબ્દે તેઓ વધાવે છે એક માત્ર ગુર્જરને.

એક ઘર આગળ નવોઢાઓ અને કુમારિકાઓનું ઝૂમખું હતું અને અંદર પરસાળમાં એક પ્રોફિલ સ્ત્રી ઊભી હતી. એજે ડૉ. નૌતમને પહેલે

૪

જ દર્શને હદ્દયમાં એક ઊડો ઘલકાર અનુભવ્યો અને એ મોટર પાસે  
ઓપડતે પગવે આવી. એણે પૂછ્યું, "તમે કોણ છો? તમે આંહી નવા  
આવ્યા છો?"

ડૉ. નૌતમ બર્મા ભાષા જાણતા નહોતા. રતુભાઈ નામના એન્ના  
સાથીએ બાઈને કહ્યું, "હું, હો-સ્વે! નવા આવ્યા છે. ડોક્ટર છે."

બાઈ બોલી: "તમે...! તમે હજુ આવડા ને આવડા જ રહ્યા

છો?"

આ ઉદ્ઘારો અકળ અને અગમ હતા. રતુભાઈ જેવો છેલ્લા એક  
વર્ષથી બર્મા ભાષાનો અનુભવી પણ આ શાબ્દોનો અર્થ તારવી શક્યો  
નહીં. એણે બાઈને એ પિછાનાંતો હતો. એણે કહ્યું, "હો-સ્વે, તમે શું  
કહેવા માગો છો?"

હો-સ્વે નામની પ્રોફેશન પોતાના મનને કાબૂમાં લઈને ધીમેથી  
પૂછ્યું: "તમારા પિતા અહીં કઢી હતા?"

"હું, મારા જન્મ પહેલાં." ડૉ. નૌતમે રતુભાઈ દ્વારા જવાબ દેતાં  
દેતાં હો-સ્વેને કોતુકભેર નિહાળી.

"તું એનો જ પુત્ર! બાબુલે, આબેહૂલ એની જ મૂર્તિ! એ  
ક્યાં છે?"

"ગુજરી ગયા છે."

"ઓઉં તારે! ગુજરી ગયા! હો... હો! છોકરીઓ!" એણે પાણી  
ભરીને થંભી ગયેલ યુવતીઓને કહ્યું, "એને ધીરે ધીરે રોળજો. એ કૂલ  
સમાન છે. નહીં સહી શકે."

પોતે એક બાલદીમાંથી ખોબો ભરીને નૌતમના શિર પર અભિષેક  
કર્યો ને પછી કહ્યું: "તારા પિતા મારી માની દુકાને હતા. તું ક્યાં  
રહે છે?"

ડૉ. નૌતમનું સરનામું લઈ, એક વાર એને શિરે હાથ ફેરવીને  
હો-સ્વેએ ગાડીને જવા દીધી

"રહો રહો!" તુરત એણે ફરી એક વાર થોભવાનું કહી ઘરમાં

તથુલાનો બ

દોડી, નેતા

વિદ

બર્મા બાઈ

સાદ સંભ

આવું કરીં

હે બાબુલુ

પણ

"ર

આજે તો

થારાવાડીન

"ર

"ર

બળવો જ

તોડવા તો

"ર

"ર

થયો છે."

"ર

"ર

સોનાંચાંદ

દુકાન રા

પિતા આં

"ર

"ર

તથુલાના ઉત્સવ

દોડી, નેતરની ટોપલી ભરી ફૂલો આણ્યાં અને મોટર ઉપર ઢોળ્યાં.

વિદ્યાય વેતી મોટરમાં ડો. નૈતમ તો ચઢક બની બેઠો રહ્યો. આ બર્મા ભાઈના પ્રત્યેક શબ્દમાંથી એને કોઈક નિગૂઢ માતૃત્વના કુમારાભયાં સાંદ સંભળાતા હતા. પોતે દરેક વર્ષનો હતો ત્યારે દેશના ઘરમાં પિતા આવું કંઈક ગાત્રાં હતા તે એને વાદ આવ્યું -

બાબુજી! લાલા લાલા!

ચમા તયારું મર્યાદાનું

ખીમ્યા બાબુજી લાલા લાલા!

[હે બાબુજી! તું આવ આવ! હું એકલી રહી શકતી નથી.]

પણ એ જીતના અર્થો પિતાએ કદી કરી બતાવ્યા નહોતા.

“આ છોસ્ટે અંહીં એક સોનાચાંદીની દુકાન ચલાવતી હતી. આજે તો બાપડી ખલાસ થઈ ગઈ છે. એના ભાઈનું નામ સયાસાન થારાવાડીવાળો.” રતુભાઈએ કહ્યું.

“એ કોણા?”

“એઝો 1929-30માં થારાવાડી ડિસ્ટ્રિક્ટમાં સરકાર સામે બુલંદ બળવો જાણ્યો હતો. સરકારી તંત્રને ખોરવી નાખ્યું હતું. એના બળવાને તોડવા તો મોરી મિલિટરી પણ અશક્ત બની હતી.”

“આજે કયાં છે?”

“આજે તો કહે છે કે ચીનની સરહદ પર ગોળીએ આવીને ખલાસ થયો છે.”

“આ બાઈ શું કરે છે?”

“એને રંગૂનવાળા આપણા શાંતિદાસ શેઠે ઝોલી ખાધી. એનાં સોનાચાંદી કુલજીપટ સાફ થઈ ગયાં. હવે તો માર્કિટમાં એક નાનકડી દુકાન રાખી છે. તે ઉપરાંત પોતાની જમીનનો વહીવટ કરે છે. તમારા પિતા અંહીં કઈ સાલમાં હતા?”

“1908-10માં.”

“બસ ત્યારે, તે દિવસે એની માતાનો ધંધો ધીકતો હશે. સંભવ

10

છે કે તમારા પિતા એને ત્યાં પોકરી કરતા હતે.”  
 “મારો ને પિતાજીનો ચહેરો એકદમ સરખા છે. આજે પણ  
 પિતાની જુવાનની તસવીર જોઈને ઘણા ભૂલ ખાઈ જાય છે.”  
 “ત્યારે તો તમને એકો સાચા પિછાની લીધા.”  
 હેર જઈને ડો. ગૌતમ ગંભીર બની ગયો. એના અંતરમાં પિતાનું  
 બ્રહ્મદેશ ખાતેનું ધોવન કર્યાનારંગે ઘોળવા લાગ્યું.

## 2 ‘છો ભમા!’

ઘીમના ગામમાં આ તણુલાનો ઉત્સવ ચાલુ રહ્યો. વરુણાદેવ હજુ જવાબ  
 વાળ્યો નહોતો. વૈશાહ-જેઠના વાયદાની હજુ એકો સાખ પૂરી નહોતી.  
 એકાદ વૃષિ, એકાદ જાપણું, એકાદ આછેરી જરમર પણ આકાશ ન  
 વરસાવે ત્યાં સુધી એકો વર્ષની આબાદીનો કોલ આપ્યો ન ગણાય. વૃદ્ધો  
 અને કુંગીઓ (બર્મા ધર્મગુરુઓ) ફ્યાન્ડિંગ્ (મઠો)માં અને ચાંટિ (મઠો)માં માળા  
 લઈ, ભૂખ્યાતરસ્યા, વરુણને આરાધવા બેઠા હતા, અને તરુણ પ્રજા  
 ભૂખ્યાતરસને ભૂલી જઈ જળબંબાકાર કરી રહી હતી.  
 આખરે ઠંડે (તાંગ્મિઓ) પુઢ્યીને કોલ આપ્યો. ધરતીને ખાલે એક  
 આછેરા મલમલિયા મેઘનો પવા (હુપણી) પહેરાવીને વરુણે નવા વર્ષનો  
 નહ જાહેર કર્યો. એટલે એ છેલ્લે દિવસે બ્રહ્મી ઘેરેયા અને ઘેરેયાકીઓ,  
 સ્ત્રીઓ ને પુરુષો, શહેર બહારના તળાવ પર ગયાં. ખાવા કે પીવાનું  
 તેમને ભાન નહોતું. ભીનાં વસ્ત્રો બદલવાની વેળા નહોતી. યુવાન  
 બ્રહ્મદેશીઓ જળનાં જ જીવડાં બન્યાં હતાં. પાણી ખાનારો પાણીદાર  
 હરતો. છેલ્લી સાંજના એ જળમેળામાં રાંધીલા ચાવલ દેચાતા લઈ લઈને  
 જરા ટકાવ મેળવતાં જુવાનિયાં ફરી પાછાં પાણીએ રમવામાં પાગલ

‘છો ભમા!’

બન્યાં વળતે દિ  
 પાછા વળ્યા તે  
 જાંખી પડી હતી  
 ઓળા લઈને મ  
 આબાદ હતા—  
 હતા. પાણી અ  
 બીજે દિ

ભિન્નવિચિઠન

“છો ભ-

રેશમી

થયેલ એક વિરાસતો હતો. એ  
 જ કંગાળને કી  
 અંખોના ડેણ  
 ને પાંપણો વર

અની

અંગારની સા

“આ

“એ

રાજદ્વારી પક્ષ  
 બ્રહ્મદેશ અનુ  
 સ્વતંત્ર જોદ

“આપ

“આપ

છે તેટલા અનુ  
 મારો છે. મ  
 મારવાડીઓ

ધાર

પક્ષ

તાનુ

ડવાબ

હેતી.

શ ન

વૃદ્ધો

માળા

પ્રજા

એક

વર્ષનો

રીઓ,

રીવાનું

યુવાન

કીદાર

લઈને

પાગલ

“હો ભાર્યા!”

11

બન્યાં વળતે દિવસે ઘેરેયાના થેર ‘ઠોરાપો’ ગતા બજાવતા ગામ ભજી પાછ વળ્યા. તેમાંના કંઈકનો શરીર શીતે થરથરતાં હતાં જોર કોતિ જાંખી પડી હતી. રણીઓનાં માથાં ટપકતાં હતાં, છતાં વળની લટેલ ઓળી વઈને માથાના ભબસેંધ ઉપર છનીયાટે સજેલા અંબોડા અણીચૂક આબાદ હતા—અને તેમાં પડાઉનાં નાનાં પીળાં પુષ્પો નવેસર મહાયાં હતાં. પાણી અને પુષ્પોનો ઉત્સવ ચોથા દિવસની સંધ્યાએ પૂરો થયો.

બીજે દિવસે આ ગામના તથુલાનાં શાંત શીતળ વાતાવરણને છુનવિચિન કરી નાખનાર એક ઓર તરેહની ડિકિયારી સંભળાયી:

“હો ભાર્યા હંજુલા! હો ભાર્યા હંજુલા! હો ભાર્યા હંજુલા!”

રેશમી રંગબેરંગી લુંગીને બદલે સફેદ હાફ-પેન્ટ અને શર્ટમાં સર્જણ થયેલ એક વિશાળ વિકરાળ પુવક-સમૂહ ફૂકળતો ઊછળતો માર્ગેથી પસાર થતો હતો. એ પ્રતેક હાકમાં રણહાકનો રણકાર હતો. એ રણહાક પોતે જ કંગાળને કોષિયત અને શાંતને રૈદરૂપ આપનારી હતી. બોલનારાઓની અંગોના ડોળા બેઉ બાજુનાં મકાનો સામે જોઈ જોઈ લાલ લાલ પોપચાં ને પાંપણો વચ્ચે ઘૂમતા હતા.

એની આગળ ચાલતા યુવાનો માંહેનો એક તો બળતા કોયલાના અંગારની સાક્ષાત્કાર માનવમૂર્તિ હતો.

“આ વળી શું રોનક?” ડૉ. નૌતમ બીધા.

“એ છે તખીન પાર્ટી નામનો અંહીનો સ્વાધીન ભ્રબદ્ધેશવાળો રાજદ્વારી પક્ષ. કહે છે કે ‘હો ભાર્યા: અમે ભ્રબદ્ધેશીઓ, અમે ભ્રબદ્ધેશીઓ! ભ્રબદ્ધેશ અમારો છે, અન્ય કોઈનો નથી.’ એમને ભ્રબદ્ધેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઈએ છે.” રતુભાઈએ કહ્યું.

“આપણો વિરુદ્ધ છે!”

“આપણો ઇન્કિલાબ લિંદાબાદ જેટલા અંશે પરદેશીઓની વિરુદ્ધ છે તેટલા અંશે. આપણો જે કંઈ બથાવી બેઠા છીએ તે એ છોડાવવા માગે છે. મદાસી ચેણીઓ જમીનો દબાવી બેઠા છે. ગુજરાતી અને મારવાડીઓ ચાવલની મિલો પચાવી પડેલ છે. પંજાબીઓ વગેરે એનાં

લાકડાનાં જંગલોના ધકી થયા છે. એના તેલના કુદા પજી આપણા  
ધારમાં છે."

"દાક્તરોનું કેમ છે?"

"બસ સલામત છે હિંદી દાક્તરો. એકી બમ્મી પુરુષો દાક્તરો છે  
જ નાની સ્ત્રીઓ કોઈ કોઈ નાની રહી છે, પજી ભીડાભીડ નથી."

"ત્યારે તો જીવ મારે છે!" ડૉ. નૌતમે પત્નીને કહ્યું: "આપણે  
નિરાંતરના રહેણે"

આ વાતો થતી હતી ત્યાં જ બારણાની ઘંટડી વાગ્દી અને ઉઘડતાં  
દાર વચ્ચે એક પ્રોફીલ પાકટ સ્ત્રી ઢેખાઈ. એ બે દિવસ પર મળેલી હોસ્પિટ  
હતી. સ્વે એનું નામ હતું. 'છો' એની ઉમર દર્શાવનાર પ્રત્યય હતો.  
બ્રહ્મદેશમાં યુવાન સ્ત્રીના નામ આગળ હંમેશાં 'મા' (બહેન) ને પ્રોફીલ  
પાકટના નામ આગળ 'હો' લગાવીને જ બોલાવાય છે. મા-સ્વે એટલે  
સ્વે બહેન, હો-સ્વે એટલે સ્વે કાકી જેવું. સ્વે એટલે સોનું. આપણે કહીએ  
છીએ 'સોનાં આઈ' એના જેવું જ.

એને ટેઝી એક તો ડૉ. નૌતમ પિતાનાં સ્મરણોમાં અટવાઈ ગયો,  
ને બીજું એને સલ્કારણનાં નહોઠો આવડતો. પજી રતુભાઈએ કહ્યું:  
"ચ્યાલો, હો-સ્વે." (પદ્મારો, સ્વે કાકી.)

"એ ભૂત!" ડૉ. નૌતમે પત્નીને કહ્યું, "એને મળ તો ખરી."

હેમકુંવરબહેન બાપડાં કાઠિયાવાડમાંથી પહેલી જ વાર બહાર  
નીકળેલાં, એમાં આ બ્રહ્મદેશને તો કામરૂ દેશ જ સમજીને બેઠેલાં. પતી  
પર કામણ્ણામણ મંત્રધારણના પ્રયોગો થવાની ધાર્સ્તી, વળી દેશમાં સાસુ  
પાસેથી ત્રૂટક એવું કાંઈક સાંભળેલું કે સસરા માંડ માંડ એક બમ્મી  
સ્ત્રીને ઘેર બોકડો અથવા પોપટ બનતા બચીને દેશ ભેગા થયેલા -  
ઉપરાંત પાછો જેનો ધકી રૂપાળો તે સ્ત્રીની જંજાળનું તો પૂછિવું જ શું!

એ તો આ બાઈને રાત્રીને ટાકો આવેલ જોઈને હેબતાઈ જ ગયાં.  
છતાં હો-સ્વે પોતાની જાડો જ હેમકુંવર પાસે ગઈ અને જગતમાં  
ભાગ્યે જ બીજે ક્યાંદ સાંભળવા મળે તેવી કુમારાથી પૂછિયું: "ધીમા

રૂપો દક્ષતાએ કૃ  
પાદ નથી...”

કહ્યું: “આપણે

જી અને ઉઘડતાના  
મળેલી હો-સ્વે  
પ્રત્યય હતો  
(બહેન) ને પ્રૌઢ  
મા-સ્વે એટલે  
આપણે કહીએ

અટવાઈ ગયો,  
તુભાઈએ કહ્યું:

“તો ખરી...”  
જ વાર બહાર  
ને બેઠેલાં. પણ  
દેશમાં સાસુ  
પાંડ એક બર્મા  
મેગા થયેલા -  
પૂછ્યાં જ શું!  
જ ગયાં.  
અને જગતમાં  
પૂછ્યાં: “ધીમા

‘ઓ ભાયા!’

કાઉંડ મહીલા? (અંહીં તને સાંદુ લાગે છે ના?) કો જી લાભા ભારે ઘેર  
આવો) તો હું ભાયા શીખવું જુન્ને, કોઈ આવે તેને આમ કહેવાયઃ  
લાભા (સાવો), ચાંદીભા (બેસો), સાભા (જાઓ). હું, તુ મારે ઘેર આવીશ  
ને?”

મોમાંથી ફૂલ જરે રેવા જરતા આ બધા શબ્દોના અથો રતુભાઈ  
કરતા જતા હતા અને ડેમકુવર તો વધુ ને વધુ ડેબતાતી હતી.

“સાચે સાચે, હું હો-સ્વે!” રતુભાઈએ વિનોદમાં કહ્યું, “એને એ  
પણ બતાવોને કે સ્ત્રી કોઈના ઉપર ખીજે ત્યારે શું કહે?”

“અરે જાવ જાવ, બાબુ! એવું તે કંઈ શીખવાનું હશે?”

“તમે ભૂલી ગયાં હશો, હો-સ્વે, પણ હું નથી ભૂલ્યો. અમારા  
શાંતિદાસ શેઠના મહેતાજીએ તમારી દીકરીના હાથમાં ગીની આપતી  
વખતે અણાજતું વર્તન કરેલું, ત્યારે તમે શું કહેલું?”

તુરત હો-સ્વે બોલી ઉठી: “જો આમ કહેવાયઃ તે મધ્યો બાને  
(બહુ બોલીશ મા), ધીમા મ્યામે (મુશ્કેલીમાં આવી જઈશ), ફના છામે  
(જોડો લગાવીશ).” એમ કહેતાં કહેતાં આ ભક્તિ સ્ત્રીએ પોતાના પગમાં  
પહેરેલ રેશમી ચંપલ લેવાનો અભિનય કર્યો.

“જેણું, ડેમકુવરબહેન! આ છે અંહીંની સ્ત્રીઓની ખુમારી ને  
કુમારા બેઉ જોડાજોડ.” રતુભાઈએ સમજાવ્યું.

“તું હમજાં કેમ દેખાતો નથી, બાબુલે!” કાકીએ રતુભાઈને પૂછ્યું.

“હો-સ્વે! હું તો હવે યાંગાઉ (રંગૂન) રહું છું.” રતુભાઈએ  
ઓળખાગા તાજી કરી; “પણ તમે પૈસેટકે ઘસાઈ ગયાં એ જાહી દિલગીર  
થયો.”

“હો... ઓ... ઓ! પેસા ફ્યા યુત્વારે (પૈસા તો પ્રભુ જ લઈ  
ગયા). ફ્યા પેમે (પ્રભુ જ પાછા આપશો). કેસા મશીબૂ, બાબુલે (કુચ્છ  
પરવા નહીં, બાબુ)! પણ હવે હું જે કામે આવી છું તે કહું, ડૉક્ટર  
બાબુ! મારી દીકરીને સખત શરદી છે. અત્યારે ચાલશો ઘેર! હું તમને  
મળ્યા પછી તો બીજા કોઈ ડૉક્ટર પાસે જવા માગતી નથી. ભલેને

ગોપાલસ્વામી હોશિયાર રવા. બેનરજી બાબુને પણ નહીં બોલતું. તમે આવ્યા એટલે મારે તો ફ્યા વારે (દેવ આવ્યા). રતુબાબુ, તમે પણ ચાલશો? નહીંતર ડૉક્ટરને અમારી વાત કોણ સમજાવશો?"

હેમનુંવરબહેનને ઊડા ઉચાટમાં મૂકીને ડો. નૌતમે પોતાની મોટર કઠાવી અને પોતાની બાજુમાં બેઠેલી આ બાઈ નીસ વર્ષ પર, એટલે કુ વીસેક વર્ષની વધે, કેવી સુંદર અને સુવાસિત હશે, કેવી આકર્ષક અને દ્રવક હશે, પિતાએ બર્મા એકાએક કેમ છોડયું હશે - શું આપની જ યોવનાળાથી ઘૂંઘળે? એનું ચિંતવત્તા ચિંતવત્તા હો-સ્વેને ઘર પહોંચ્યા આતલી ઉમરે પણ એ બાઈના દેહમાંથી તનાખા (ચંદનનો લેપ) મહેકતો હતો. બલ્લી નારીને તનાખા વગર ચાલે નહીં.

ધરતીથી અધ્યર રોપેલું લાકડાનું ઘટેલું એ નાનું ઘર હતું અને એને ફરતો બાગ હતો. હો-સ્વે જે કણો મા-સ્વે હતી તે સમયની સમૃદ્ધિના અવશેષરૂપે રહ્યા હતાં એક ફક્ત પુષ્પે મહેકતો બાગ અને આ કાણની સુંદર હિમારત: માતાનો મળેલ વારસો. બ્રહ્મદેશમાં વારસદાર પુરી બને છે, પુત્ર નહીં.

પિતાનું યોવન અહીં કઢીક કઢીક ચૈત્રની ચાંદનીમાં બેઢું હશે? કોક જાણો! હો-સ્વેનું હદ્ય એ હિતિહાસ સાચવીને બેઢું હશે?

અંદર એક વૃદ્ધ છતાં આવીડ જેવો જ્ઞાપતો પુરુષ પરસાળમાં નેતરની ચટાઈ પર બેઠો બેઠો શાંતિશી ચિરૂટ ચૂસતો હતો. ઉશકેરાટને સહેલાઈથી વશ થતાં છતાં ચોમેર ફ્યાઓની અંદર બુદ્ધદેવની ધ્યાનમણ, સ્વસ્થ, શાંત, ધીરંગભીર પ્રતિમાઓનાં ધ્યાન ધરતા બ્રહ્મદેશી પુરુષનો આ નર એક નમૂનો હતો. એણે ફક્ત એટલું કહ્યું: "લાલા" (આવો).

પરસાળમાંથી દરદીને ઓરડે (ઓરડા એટલે બલ્લી ઘરમાં લાલ મધરાસીના ચક જડાને લાકડાને ચોગટે પાડેલ પાર્ટિશન) જતાં તેને દ્વારે ઊભેલ યુવાનને જોતાં જ ડો. નૌતમ ખચકાયા. હજુ જે જ કલાક પર એને દીઠો હતો. હજુ એણે કપડાં બદલ્યાં નહીંતાં. એ જ સેત હાણ-પેન અને શર્ટ; અને હમણાં જ જાણો કે એ ગરજી ઊઠશો: 'હો ભમા હિંજલા.'

હો ભમા  
એ તો ઠ  
બા  
જેવડી છુ  
વિન્ને જ  
હોતી? જે  
ધા, અરે  
'હો ભમા  
એ  
અને સા  
કુવા થર  
જ!  
"આદેશ  
આપ્યો.  
નામ આ  
પ્રત્યય  
"  
પદેલી  
અંખો  
"ન  
માથાનો  
બલ્લી સ  
વગર ન  
લેકાઉ  
જડાવ!

પણ પદ્ધયા  
 બોલાનું તમે  
 બુનું, તમે પણ  
 ??"  
 પોતાની મોટર  
 રન, એટલે કે  
 આકર્ષક અને  
 શું આપની જ  
 ર પહોંચ્યા,  
 (પ) મહેકતો  
 હતું અને  
 સમૃદ્ધિના  
 આ કાઢની  
 પુત્રી બને  
 બેઠું હશે?  
 ?  
 પરસાળમાં  
 ઉશ્કેરાટને  
 ચાનમળન,  
 પુરુષનો  
 (આવો).  
 માં લાલ  
 તને દારે  
 લાક પર  
 ડાફ-પેન્ટ  
 ઈઝલા.

‘થો ભમા!’

15

એ તો ઠીક પણ કયાંક ‘ધા’ ઉપાડીને ગાટકશે તો!

બલદેશનો અતિ બિધામજો શબ્દ ‘ધા’: ધા એટલે એક હાથ  
 જેવી છૂટી. ડૉ. ચૌતમને ઘણાએ ચેતવેલા કે જોઈતપાસીને અસૂરસવાર  
 વિનિટે જાણે, ધા લેતાં બરમાને વાર નથી લાગતી. ને ધા કયાં કયાં નથી  
 હોતી? જેરબાદીના ગજવામાં ધા, મજૂરની બગલમાં ધા, સ્નોની અંજમાં  
 ધા, અરે ધર્મગુરુ હુંગીનાં પીળાં ઉત્તરીય હેઠળ પણ કાતિલ ધા! તો આ  
 ‘થો ભમા’વાળા ભાયડા ધા વગરના હોય જ કેમ કદી!

એક પલ યાદ આપ્યો હિંદનો રણલલકાર ‘ઠિન્કિલાબ જિન્દાબાદ’!  
 અને સાથે સાંભર્યો બોંબાન. એ ઠિન્કિલાબ અને એ બોંબાન પરદેશીઓને  
 કેવા થરથરાવતા હશે! પોતાને આ ‘થો ભમા’ ને ‘ધા’ ડરાવે છે તેવા  
 જ!

“રસ્તો આપ, માંઓ-માંઓ,” માતાએ પોતાના એ પુત્રને શાંત  
 આદેશ દેતાં એ ખસી ગયો; એષો અજબ નમ્રતાથી ડૉક્ટરને આપદર  
 આપ્યો. દીકરાનું નામ માંઓ-માંઓ હતું. એ યુવાન હશે ત્યાં સુધી એના  
 નામ આગળ માંઓ પ્રત્યે લાગશે અને પ્રૌઢ વયમાં પ્રવેશશે એટલે ઉ  
 પ્રત્યે લાગાની ઉ-માંઓ કહેવશે. ઉ એટલે કાકે.

“મા-નીમ્યા! મા-નીમ્યા!” માતા પોતાની તાવમાં શેકતી ઘેનમાં  
 પડેલી પુત્રી નીમ્યાને ઢંઢોળતી હતી: “ડૉક્ટર બાબુ લારે, ફ્યા લારે,  
 અંખો ખોલ. જો હમણાં જ તારો રોગ મટી જશે.”

દિવસમાં ત્રણ ત્રણ વાર નાહીને દેહ સ્વર્ચ રાખનારી અને છટાથી  
 માથાનો સઢોઉ વાળનારી યુવતી તાવમાં પડેલી છતાં હીરે મઢેલી હતી.  
 બ્રહ્મી સ્ત્રીઓ ચાવલ ને માછલી નહીં મળે તો ચલાવી લેશે, પણ જવાહિર  
 વગર ન જીવી શકે. ગળામાં લેઢો (હાર), કાનમાં નદ્યા (બૂટિયાં), કંડે  
 લેકાઉ (બંગડીઓ) અને અંબોડમાં ભી (કાંચડી): બધાં જ આભરણો  
 જડાવ!

શરદી સખત હતી. શું થયું હશે?

“તધુલાનો પ્રતાપ,” સુભાઈએ દાક્તરને કહું.

“રતુભાઈએ સાચું કહું.” બોલે એકદમ બોલી ઉठી, “ચાર દિવસ પાછીમાં તરબોળ રહી હતી, ને તળાવે એક રાત ઉઘાડામાં ગાળી આવી છે.”

“હિકર નહીં” કહીને તાત્કાલિક ઇન્જેક્શન વગરે આપી નૌતમે દવાખાને દવા લેવા આવવા કહું.

“માંટ-માંટ!” માંગે પુત્રને આજ્ઞા કરી, “બાબુ જોડે જા..”

બાપ રે! આ બો ભમાવણો માંટ-માંટ ભેણો આવશે!

“હિકર નહીં, ડોક્ટર સાહેબ!” રતુભાઈએ મિત્રની અસ્વસ્થતા જોઈને કહું: “એ બધા જ બૂમબારાડા આપણા ઇન્જિલાબ જિન્ડાબાદ જેવા છે. કાલે સવારે જ આ ભાઈ વિદેશી ડગલા વગર અને શાંતિદાસ શેઠની દુકાનની ઘડિયાળની સોનાની રોઈન વગર બીજો ઘા નથી કરવાના. ઉપરાંત, મેં પણ આંહી અખાડા ચલાવ્યા છે.”

લળી લળી મારગ કરતી ગૃહિણી છેક મોટર સુધી બહાર ગઈ અને રૂપિયા દરશાની નોટના બે કટકા દાંકતરના હાથમાં સેરવવા લાગ્યું.

“નહીં, નહીં, આજે તો નહીં જ,” ડૉ. નૌતમે ના કહી.

“હા...આ...આ, બાબુલે! લેવા જ જોઈએ, ફ્યા સુ (દેવના સોંગાં)!”

“કુપા કરી આજે માફ રાખો, સોનાં કાકી.”

“પણ કારણ?”

“કારણ શું! તમે મારા પિતાની પિછાન તાજી કરાવી છે.”

“તારા પિતાનો તો અમારી પાસે છેલ્લો પગાર પણ બાકી છે, ગાંડા! એ તો ખબર પણ દીધા વગર ઉપડી ગયેલા. સાચું થયું. જમાનો બહુ ખરાબ આવ્યો, બાબુલે! જો આ અમારા જીવાન છોકરા! તમને કાઢવા ઉઠચા છે. તમારા મજૂરો પણ અમને સાલે છે. તારા બાપુ! ઓહ! એ તો બચી ગયા. જોને રતુબાબુ! તમને તો ખબર છે, આપણા મનસુખબાબુની કેવી દુર્દશ્ય છે આજે!”

“શું કહે છે આ સોનાં કાકી?” ડૉ. નૌતમે પૂછ્યું.

પ્રભુ પદ્માલિ  
લી ઊરી, "આરુ  
ઉદ્ઘાડામાં ગળુ

ને આપી નોતરે

જોડ જ."

પારો!

વની અસ્વસ્થતા  
લાબ કિન્દાબાદ  
અને શાંતિદાસ  
નીજો ધા નથી

ધી બહાર ગઈ  
સેરવવા લગ્ની  
કહી.  
યા સુ (દેવના

વી છે."

ધા બાકી છે,  
થયું. જમાનો  
શેકરા! તમને  
તારા બાપુ!  
છે, આપણા

"જો વચ્ચા!"

17

"મનસુખલાલ બાપડા અંદીની બમ્માને પરછ્યા છે. આજે વેર  
એક સતત વર્ષની પુત્રી છે. કોઈ ગુજરાતી એને પરછાવા તૈયાર નથી."

"અહોહો! કેવા મનસુખબાબુ! કેવી એની વહુ માન્યે! ને કેવી  
એ બેઉની દીકરી!" કકી અફસોસ કરવા લગ્ની. "બાબુલે! કોઈ કરતાં  
કોઈ બાબુને હિંમત નહીં! ને હિંમત કરે છે તેવાઓમાં કાંઈ માલ નહીં.  
છોકરાની કેવી વલે! માબાપે શાં પાપ કર્યું? તમારા પિતાએ ડહાપણ  
કર્યું બાબુ! ભલે ચાલ્યા ગયા. પણ હવે તમે ફી..."

"બોલશો જ નહીં, કયા સુ!" ડૉ. નૌતરે સામા પ્રભુ-સોંગંદ દીધા  
અને મોટર હંકારી મૂકી. આ બાઈનો પિતા વિશેનો પ્રત્યેક બોલ એના  
હિલમાં જણાજણાટી બોલાવતોહતો.

પાણેલા કબૂતર જેવો પ્રશ્નાંત સીનો ધારણ કરીને માંઉ-માંઉ  
મોટરમાં બેઠો હતો. માર્ગ એક ગલીમાં વચ્ચે રસ્તો રોકી કેટલાક લોકોનું  
દોણું બેતમા બની પડ્યું હતું. તેમની વચ્ચેથી મોટરને કાઢતાં ધણી  
મુશકેલી પડી. ડૉ. નૌતરમ નિયર પછી નિયર બદલતા હતા, હોન્ન બજાવતા  
હતા, પણ રસાના રોકનારાઓને મન એ બધું રોનક હતું. થોડા થોડા  
ધૂરકાટ પણ ટોળામાંથી આવતા હતા.

"હા..." માંઉ-માંઉ તિરસ્કારથી હસ્યો અને અંગેજમાં બોલ્યો,  
"ધોટ ઈજ અવર મેઠન પ્રોબ્લેમ: એ જ અમારી મુખ્ય મૂલ્યવણ છે!"

"ઓહો, અંગેજ જાણો છો?" ડૉ. નૌતરમ રાજી થયા, "શી છે  
એ મૂલ્યવણ?"

"આ ન જોયા?"

"કોણ છે એ?"

"અમારા હિતશત્રુઓ, ઝેરબાદીઓ."

બ્રહ્મદેશરિઓના જેવા જ લુંગી-અંગના લેબાસ, એ જ ઢબનું માથે  
ઘાંઉલાંઉ (માથાબંધણાનો રૂમાલ), અને એ જ ભાષા, છતાં આ યુવાન  
આમને શત્રુઓ કેમ કહે છે? "કારણ શું છે?"

"એનાં નાક સામે જુઓ ને અમારાં નાક તપાસો. અમારાં ચયપટો

છ, તેમનાં લાંબાં છે, એના ચહેરામાં જુઓ, અમારા કરતાં ફરક છે. એ અમારા નથી, એ એના નથી, એ અમારી પ્રજાનું પાપ છે." માંટ-માંટનું અંગેજ ધોધમાર વણું.

ઉત્સિદ્ધ બનેલા માંટ-માંટને દવાખાનામાં લઈ જઈને પછી ડોક્ટરે

દવા બનાવતાં બનાવતાં ચર્ચા ચલાવી -

"એ તમારું પાપ કઈ રીતે?"

"આ ઝેરબાદીઓ હિંદના મુસ્લિમ મરદો એને અમારી બમ્મા ઓરતોની ઓલાદ છે. તેઓ વશસંકર છે."

"પણ બમ્મા સ્ત્રી તો દેશી-પરદેશી કે ઉંચનીય કોઈ પણ કોમણું લેદ વગર પરણો છે - જાપાનને, ચીનને, ગુજરાતીને, પંજાબીને, ગોરનેય."

"એટલે જ કહું છું કે બીજુ કોઈ પ્રજા કે જાતિ જોડેનાં લગ્નમાંથી છે કદી નથી નીપણું તે પરિણામ એક ફક્ત આમાંથી જન્મયું છે. અંધી તેઓને બીજું હિંદ ઉભું કરવું છે."

"એટલે?"

"એટલે કે તમારા હિંદુ-મુસ્લિમ ઝડપા અને હિંદની બે કોમ્પુના ભાગલાની બમ્મા આવૃત્તિ."

"શા માટે પણ?"

"બસ, ધર્મ માટે. તેઓનો ધર્મ જુદો બન્યો. બન્યો તો બન્યો, પણ અમારા ધર્મનો વિરોધી બન્યો. છાપાં વાંચો છો કે નહીં?"

"અંગેજ છાપાં વાંચું છું."

"બમ્મા છાપાં વાંચો. આજે દિવેદિલમાં રોલ લાગી છે. સાત વર્ષ એક ઝેરબાદી ધર્મપુરુષે એક ચોપડી લખી હતી. એની કોઈને ખબર પણ નહોતી રહી. આજે કોઈક તમારા જ હિંદી મુસલમાને એ ચોપડી ફરી વાર છાપાવી અમારા દેશમાં ફેલાવી છે. અમારાં અખબારો એના પર ઉકળી રહ્યાં છે. અમારા કુંગી-ચાંટિમાં હજારો કુંગીઓ એ વાંચીને સણજી ઊંઠ્યે છે."

ફરક છે. એ  
માંટ-માંટનું  
પછી ડોકટરું

અમારી બમ્પા

પણ કોમનું  
ન, પંજાબીને,

લગ્નમાંથી  
યું છે. આંહી

ની બે કોમ્પો

તો બન્યો,  
ડી?"

સાત વર્ષ  
કોઈને ખબર  
એ ચોપડી  
બારો એના  
એ વાંચીને

બે લયા!"

19

"એમાં શું છે?"

"બૌદ્ધ ધર્મની નિદા અને ઠરલામનું પ્રતિપાદન."

"એવી ચોપડી પ્રસિદ્ધ થવા કેમ પામી?"

"ફ્યાને ખબર. શું કરીએ? કોને કહીએ! ધર્મની અવહેલના,  
કુંગારોની બદનક્ષી. અમારા કુંગારો જોયા છે? આગના કટકા છે!"

"હા, સાંભળું છું કે વૈરાગ્યનાં વસ્ત્રોમાં તેઓ ધા છુપાવે છે."

"સાચી વાત છે, ડોક્ટર! અમારી ઓરતોની અતિધળાં મોરી  
સંખ્યામાંથી અને લગ્નસ્વાતંત્રયા અતિરેકમાંથી સળગોલી એક રાજ્યોભક્ષી  
જવાળારૂપી આ તેરલાદી કોમ છે."

"નહીં, ભાઈ! કોમનો વાંક ન કાઢો. વાંક દોરનારનો છે. - ધાર્મિક,  
રાજપ્રકરણી બેઉ પ્રકારે ઊંઘી દોરવણી દેનારનો છે."

"તે હશે, પણ અમારા પૂરતાં તો અમારે પગલાં લેવાં પડશે."

"તમારી સ્ત્રીઓને શું પરજાતિમાં લગ્ન કરતી અટકાવવી પડશે?"  
એમ કહેતા ડૉ. નૌતમે રતુભાઈ સામે અર્થસૂરક દસ્તિએ જોયું. રતુભાઈ  
હજુ અવિવાહિત હત્તા.

"ના, એ તો એમે કદી નહીં કરીએ. એમે બ્રહ્મીજનો વિશ્વબંધુત્વના  
વ્યવહારું ઉપાસકો છીએ, એમે રુધિરના વૈવિધ્યમય મિશ્રણમાં માનીએ  
છીએ. ઉપરાંત, અમારું સ્ત્રી-તેજ મુક્ત પ્રેમના પ્રદેશમાં વર્ગ, વર્ણ કે  
જાતિની, ઉચ્ચતા-નીચતા કે અમીરી-ગરીબીની પાળોને ગાંઠશે નહીં. પણ  
એમ એક વાત તો નક્કી કરશું. અમારી બહેન-દીકરીને પરણવા  
આવનારને એમે અમારા ધર્મનો દીક્ષિત કરશું."

"તેથી શું તમારો પ્રશ્ન ઉકલી જશે?"

"નહીં ઉકદે તો આગે આગે ગોરખ જાગે."

"જેર, આપણે નિરાંતે બેસ્સીને વાતો કરશું. જરૂર આવજો."

તે જ વખતે અંદરનું બારશું ઉઘાડી એક સ્ત્રી આવી. એની સામે  
આંગળી બતાવીને ડૉ. નૌતમે કહ્યું, "મારો ભય ન રાખશો. હું તોઈ  
બ્રહ્મી સાથે પરણવાનું નામ લઉં તો શું મશકરી કરું તોય મને આ કાચો

20

ને કાચો, વગર શેક્યો ખાઈ જવા તૈયાર બેઠી છે! તમારી ધાનીએ જરૂર  
ન પડે તેવી એની અભ છે.”

યુવકે ઉઠી સન્માન દીધું. એ હતાં હેમકુંવર. યુવકે મોં મલકાયું  
અને કહ્યું, “અમે બલ્લીઓ પરણોલ સ્ત્રીની હંસી કરતા નથી. અને ધાનો  
ડર આપ રામશો નહીં.”

“મેં તો બહુ સાંભળ્યું છે.”

“નહીં, અમે ધાને ફક્ત એક જ વાર તસ્વી આપીએ છીએ. કોઈક  
અમારી સાથે કલી કમા (દગ્લબાજુ) રમે છે ત્યારે જ.”  
એ નિખાલસ યુવકને દાક્તરે પાછો પોતાની જ મોટરમાં વિદ્યાય  
કર્યો, અને પ્રભુમાં કદી ન માનવા છતાં એણે પ્રાર્થના કરી કે “હે હૃદા!  
આની બહેનને આરામ કરજો! નહીંતર ક્યાંદિક દવામાં દગ્લબાજુ  
સમજુને એ ધા ઉપાડતો ધરી આવરો!”

3

### દધુ ઓળખાજી

બ્રહ્મદેશમાં ડૉ. ગૌતમ પહેલી જ વાર આવતા હતા તે છતાં પત્નીને  
જલદી તેડાવી હતી તેનું કારણ હતું. આ પ્રદેશના ગુજરાતીઓએ જ  
એમને સારી પ્રોક્ટિસનું ચોક્કસ વચન આપીને રાજકોટથી તેડાવ્યા હતા.  
વળી હેમકુંવરબહેનને પણ ખબર હતી કે બ્રહ્મદેશ એ તો જૂની વાર્તાઓ  
માંહેલો મશાહૂર કામડુ દેશ છે. ત્યાંની કામડુ ત્રિયાઓ હજુ પણ પતિને  
પગે દોરો મંત્રી પોપટ કાં ઘેટો બનાવી દેશે એ વાતની એમને ધાસ્તી  
હતી. પોતે સત્વર આવવાની હઠ પકડી હતી. ઉપરાંત બાળકનો બોજો  
નહીંતો. કાવશો તો રહેશું નહીંતર ફરી તો આવશું, એ ગણતરીથી પોતે  
બ્રહ્મદેશ મેડ્યો હતો.

પ્રભુ પદ્માવતિ

નીયે જરૂર

મલકાલ્ય  
અને ધાનો

એ. કોઈક

માં વિદ્યા  
“હે ફ્યા!  
દગલબાળ

પત્નીને  
ઓએ જ  
આ હતા.  
વાર્તાઓ  
જા પતિને  
ને ધાર્તી  
નો બોજો  
થી પોતે

ડૉ. નૌતમને પહેલેથી જ એક વાતની ચીડ હતી. કોઈ માસ્ટર્સ એમ કહે કે આ દેશ અથવા આ ગામ તો ખરાબ અને ખટપત્રી છે, કંજૂસ અને નીતિભાઈ છે, આ ગામમાં તો ચેતીને ચાલવા જેવું છે, ત્યારે એની ખોપરી શરી જતી. પોતે કાઠિયાવાડ-ગુજરાતનાં ત્રણેક સ્થળો બદલાવ્યાં હતાં, છતાં પોતાને કોઈ ગામની બદમારી નહી નહોતી. જે કાઈ બદમારી-બઢી હતી તે તો પ્રત્યેક ગામે સર્વસામાન્ય હતી. જે કાઈ ખાનદાની અને સુજનતા હતી તે પણ પ્રત્યેક ગામની વસ્તીમાં સરખી જ હતી. એટલે પોતાના જ ગામની બદબોઈ કરી ભલું લગાડવા આવનારાઓને પોતે સખત અવાજે સંભળાવી હેતા: “જે ભૂમિ આપણને સુખેદુઃખે રોટલી રણી ખાવા હે, પાણી પીવા આપે અને રાતવાસો રહેવા હે, જે ભૂમિમાં આપણી રોટીમાં કોઈ ઝેર લેળવી ન હેતું હોય, પાણીના માટલામાં કોઈ કોલેરાના જંતું ન મૂકી જંતું હોય, અને ઊંઘવા રાજો જે ભૂમિ ઓચિતા ભૂકૂપથી આપણને ગળી ન જતી હોય, તે ભૂમિ આપણને સંઘરનારી મા છે. એને વગોવવા હું તૈયાર નથી.”

બાબદેશમાં આવતાં પણ એમને એ જ અનુભવ થયો હતો. તધુલાના ઉત્સવમાં ફર્યા પઢી એક સોનાચાંદી અને જવેરાતના મોટા વેપારીએ જ એમને શિખામણ આપેલી કે બર્મામાં બહુ ચેતીને ચાલવા જેવું છે, સાલી બહુ ક્રૂ ને ધાતકી પ્રજા છે; વિલાસી તો બેહદ છે, ચારિન્ય ખાતે તો મીંડું છે; બેઈમાન બનતાં ને કંજિયો કરતાં વાર ન લગાડે. ત્યારે ડૉ. નૌતમ, આ વેપારી પોતાને તેડાવનારાઓ પૈકીના એક અગ્રાણી હોઈને, ચૂપ તો રહેલા, પણ એમના અંતરમાં ખેદ થયેલો. છતાં દિલમાં થયેલું કે હશે ભાઈ! આમ તો એ ભારી પરોપકારી અને હિંદમાં ગાંધીજની ખાદી વગેરે પ્રવૃત્તિના પોષક છે, વરસોથી અહીં વસવાટ કરે છે, એટલે કાઈક કડવા અનુભવને કારણે જ ચેતવણી આપતા હોવા જોઈએ. પણ આ રતુભાઈ નામનો યુવાન કંઈ વધુ જાડાવા-સમજવા જેવો જણાય છે. એનામાં દાક્તરનું કુતૂહલ જન્મ્યું હતું. એ વણપરણેલો યુવાન દેશની થોડીએક પિછાનને દાવે અહીં પોતાનો માર્ગદર્શક બન્યો હતો.

એને પોતે પૂછ્યું: “હું રતુભાઈ, આ લોકોના આચારવિચારમાં કંઈ શિક્ષિવિપદ્ધિનું તો ખરું હો?”

“દાક્તર સાહેબ!” રતુભાઈને જવાબ દીધો: “એ રીત જ મિલે મેળોવાળી છે. કેટલું સ્વાભાવિક જીવન છે, તેટલું નીતિધીન ન કહેવાનું અહીં જે કંઈ છે તે બહીઓનું સ્વાભાવિક જીવન છે.”

સાંજ પડતી અને દાક્તરના રહેણાણની પાછળ થોડે હું દેખાતું એક મકાનમાંથી સંગીતના સ્વરો આવતા અને કોઈક હિંદી વાચીઓ ગાતો સ્વીકિર્તન બલદેશની પાર્થિવ શીતળતામાં આકાશથી સુગંધ સીચતો ત્યા કોણ રહેતું હો તે પ્રથમ તેમજો સોનાચાંદીવાળા શેર શાંતિદાસને પૂછતાં શાંતિદાસે કહેતું: “દાક્તર સાહેબ! એ હું કહેતો હતો તે જ છે, આ બહી સ્વીકારોનું કંઈ પૂછવા જેવું જ નથી. મદાસ તરફના ચોલિયા મુસલમાનનું ઘર માંડજું છે, છોકરીઓ પેદા થઈ છે; તેની બર્મા માત્રા કોણ જાણે શીયે તાલીમ દઈ રહી હોય!”

પછી રતુભાઈને પૂછતાં એમજો સમજ પાડી તેમાં વાત તો એકની એક હતી પણ સમજજી જુદી હતી: “લગ્ન એ આંહિની બહી સ્વીકારોની સંપૂર્ણ રવતંત્ર જીવનપ્રદેશ છે. આંહિની સ્વીકારો બચપણથી જ શિક્ષણ દે છે. પુરુષો કરતાં પણ વધુ ભજાતી હોય છે —”

“બધી જ?”

“એકેએક - ગામડાની સુધ્યાં!”

“એટલી બધી નિશાળો છે?”

“હા, પણ તે સરકારી નહીં, સાધુઓની. કુંગાયોના ચાંઉ (મઠો)માં પ્રત્યેક બર્મા બાળક ફરજિયાત ભાડો છે. એક ગામડું પણ લોકોમાં સ્વાભાવિક શિક્ષણકાર કુંગી સાધુ વગરનું નથી. આ સ્વી પણ ભજીગઢીને પછી માબાપ કે વડીલ કોઈની પણ રજાની પરવા વગર મદાસી મુસલમાનને પરછી છે. પણ એ પોતે પતિની તામિલ ભાષા પકડી શકી નથી. પતિ સાથેનો બ્રવહાર બહીમાં તેમ જ હિંદીમાં કરે છે. અને વખતે હિંદ જવું પડે તો શું થાય, એટલે પોતાની દીકરીઓને

“એ રીત જ મિશે  
તિલીન ન કહેવાન  
કું.”

થોડે દૂર દેખપણ  
ઈક હિંદી વાસીમાં  
થી સુગંધ સીંચતો  
શેડ શાંતિદાસને  
હતો હતો તે જ છે.  
તરફના ચોલિયા  
તેની બર્મા માત્રા

વાત તો એકની  
ભર્હી સ્ત્રીઓનો  
પણથી જ શિક્ષણ

ચાંઉ (મઠો)માં  
દું પણ લોકોમાં  
આ સ્ત્રી પણ  
ની પરવા વગર  
તામિલ ભાષા  
જ હિંદીમાં કરે  
ની દિકરીઓને

## દક્ષ અંગઘાસ

23

હિંદી શીખવે છે.”

“તમને કેમ ખબર?”

“હું અહીં રહેતો ત્યારે મે જ એને હિંદી શિક્ષક શોધી આપ્યો  
હતો.”

“પિતા એને પોતાની ભાષા ભણવવાની ફરજ ન પાડી શકે?”

“ફરજ તો ભર્હી સ્ત્રીને કોઈ ન પાડી શકે. પરણે ગમે રેને, પણ  
સ્વત્ત્વ સાચવીને જ સ્વમાનથી જગે.”

તે રચિને અધ્યરાત વાળે નજીકમાં કશોક આકરો કોલાહલ  
સંભળાયો અને દાક્તર નીતમના દવાખાને કોઈ ઘટઠી બજાવવા લાગ્યું.  
બારણું ઉધાડતાં રતુભાઈ ઊભેલા સાથે એક લોહીલોહાણ માણસ હતો,  
નીચે એક ટોળું હતું.

“શું છે?”

“ધા! ધા!” લોહીલોહાણ માણસ ફક્ત બે જ અસરની બૂમો  
પાડતો હતો.

“કોણ છે એ? શું કહે છે?”

“તલી, તલી,” ચીનો બોલતો હતો. રતુભાઈએ સમજ પાડી -

“તલી એટલે ચીનો. આ બાઈ ચીના છે. આંહીં સામે જ  
સોડાવેમન વગેરેનું કારખાનું ચલાવે છે. એની ભર્હી સ્ત્રીએ એને ધા  
લગાવી છે.”

“ભર્હી સ્ત્રી ધા લગાવે! પતિને!” દાક્તર વિમાસક્ષમાં પડ્યા.

રતુભાઈએ કહ્યું: “મૈં સાંજે જ આપને જે કહેલું તે જ આ બનાવનું  
રહસ્ય છે. મૈં બારીએ ઊભા રહીને નજરોનજર આ નીરખ્યું છે અને  
કાનોકાન કળિયો સાંભળ્યો છે. ઘણાખરા ચીના આંહીં આવીને જ પરણે  
છે. વરવહુ વરચે કંઈક વાતમાં તકરાર થઈ પડી. પતિ ધમકાવતો હતો.  
એટલે સ્ત્રીએ કહ્યું કે ‘હું ભર્હી છું. મને ડરાવી નહીં શકો’. આ કહે કે ‘અબરદાર,  
ભર્હી મરદોને બાયલા કર્યા છે તો! એ તો છે અમારા લહેરી લાલાઓ,

24

બાવલાંનો નથી. એટલે ધક્કી કહે કે 'તો જો બહુનું ઘર માંડ'. પેલું  
કહે કે 'એમ? હવે પદર વરસે તું મને જવાનું કહે છે? મેં તારી સાચે  
પરલાતાં પંચ કર્માણ સોગંદ લીધા. પાંચમું તારાં ફાટેલાં કપડાં સાંધવાનું  
ધર્મકર્મ બજાવ્યું અને હવે-'! એમ કહીને એ ધા ઉપાડીને છલાંગી, ધા  
કાઢી; પણ વર્ષે થાંબળો આવી ગયો, એટલે આને થોડુંક જ લાગ્યું છે.."  
તે રાત્રિથી દાકતર નીતમને બહુની લોકોની ધાનો ડર પેસી ગયો  
અને એણે જાગી ઉઠેલ હેમદુંવરને જઈને કહું કે "હવે તું તારે કામડ  
વિદ્યાના કામકાનની વેશમાત્ર બીક રાખીશ નહીં".

"કા?"

"કા શું! ધા... આ... આ!"  
એમ કહી પોતાનું મોં પટીની ગોદમાં સંતપ્તિ સૂઈ ગયા.

4

## ચાવલની મિલમાં

રંગૂન નહીં, યાંગંગું-ખ્યો.  
નામો બગાડવાની કળામાં કુશળ એવા કયા પરદેશીએ આ  
યાંગંગું-ખ્યોનું રંગૂન કરી નાખ્યું તે તો ખબર નથી. એ જે હો તે, એણે  
મોઢું પાપ કર્યું છે.

યાં એટલે વિગ્રહ, ગંઉ એટલે ખતમ થયો, ને ખ્યો એટલે નગર:  
ભલદેશના પરસ્પર લડયા કરતા રાજકર્તાઓએ જે સ્થાને લડવું બંધ  
પાડી શાંતિની સ્થાપના કરી, તે સ્થાનનું નામ યાંગંગું-ખ્યો.  
આપણો એને રંગૂન રંગૂન ફૂટીએ છીએ. અંગ્રેજોને મન એ રંગૂન  
કેવળ એક નિરર્થક સ્થાનસૂચક શાલ્ફ છે. સરકારનો મુકરર કરેલ એ  
શાલ્ફ આપણો જુખ મારીને વાપરવો પડે છે. કોઈ પણ ભલદેશી રંગૂન

૨૨ માંડા. પેલી  
માં તારી સાચે  
કપડાં સાંધવાનું  
ને છલાંગી, ધ્યા  
જ લાગ્યું છે..  
૨૩ પેસી ગણે  
તું તારે કામકૃ

ઈ ગયા.

પરદેશીએ આ  
તું હો તે, એજો  
એટલે નગર:  
તું ને લડવું બંધ  
મન એ રંગૂન  
કરર કરેલ એ  
ભલદેશી રંગૂન

### ચાવલની ચિવમાં

25

કહેતો નથી એને વહાલું છે યાંગાઉ નામ, એ નામ એનો શાંતિમંત્ર છે:  
શાંતિસ્થાપનાનું સ્થાન

પીમનાથી રજ પૂરી થયે પાણો વળેલો રતુભાઈ બડભાગી હતો.  
યાંગાઉની જેટી પર એષે એક અનુપમ દશ્ય દીકુ. કોઈ બડા ગોરાની  
ભલદેશને આંગણે પદ્ધરામજી થતી હતી. બર્મા ભલદેશીઓનું જ છે  
અને એ હમેશાં તેમનું જ રહેશે એવો એક વધાઈનો સંદેશો લઈને આ  
બડા સરકાર-પ્રતિનિધિ પદ્ધારતા હતા, અને ભફીજનો એનું જગતમાં  
કઢી કોઈએ ન કરેલું, કોઈને નહીં સ્ફૂર્તેલું એવું સ્વાગત કરતા હતા.

બંદરની એ સુવિશાળ જેટીને દૂરથી નિખાળો તો કાળા રંગના  
કોઈક રેશમે ઢાંકેલી દેખાય. તસ્યે ખાલી નહીં, પાંચ કે છ પંક્તિઓમાં  
હારબંધ ગોઠવાઈને સુંદર ભક્તી યુવતીઓ જેટી પર ઘૂંટણ વાળીને બેસી  
ગયેલી અને એ દરેકે પોતાના જમણા ખભા પરથી જેટીની ભોંય પર  
પોતાના કાળા પેનીફક વાળની લાંબી વેણીઓ બિછાવેલી હતી.

આગબોટ આવીને ઊભી રહી. મહાન પરોજાએ પગ મૂક્યો –  
એ વેણીઓની મુલાયમ બિછાત ઉપર. જીવતા સુંદરી-કેશની જાજમ પર  
થઈને એ ચાલ્યા. એના કદમોમાં આપસરાઓનાં મસ્તક જૂક્યાં હતાં.  
દ્વોનેયે લોભાવે તેવું એ સ્વાગત હતું.

ઉંડો નિઃશાસ નાખીને રતુભાઈ ખનાન-ટો ચાલ્યો ગયો.

ખનાન-ટો પણ બગડેલો શબ્દ છે. સાચો શબ્દ કાનાં-ટો છે. કાનાં  
એટલે નદીનો કાંઠી, અને ટો એટલે જંગલ-ગામનું.

પણ ખનાન-ટો એ જંગલ પણ નહોતું રહ્યું, ગામનું પણ નહોતું  
રહ્યું. સાગરની રાણી ઈરાવદીના પહોળા પટને પાર કરી બેક માર્ટિલ હૂર  
સામે પાર જાઓ, એટલે કિનારે હારબંધ ઊભેલાં ચાલીસ-પચાસ ભૂંગળાં  
ધરતીના મૌંમાંથી ધૂમાડા કાઢી આકાશને અપમાનતી ચિરુટો જેવાં જલી  
રહે છે. એ ચાલીસ-પચાસ ચોખાની મિલો છે.

એક વખત ભલદેશને આંગણો આંગણો આ ચોખાની કમોદ  
ખાંડનારી પગ-ફેંકીઓ હતી, તે ટળીને હવે મિલો બની હતી. ગોરાઓની

મિલો, મારવારી અને ગુજરાતીઓની મિલો, કાઠિયાવાડી મેમજોની મિલો  
અને ચીનાઓ-ભરમાઓની મિલો બે જાતની મિલો: એક સાથ ચાવત  
છડવાની ને બીજી પાક ચાવલ તૈયાર કરવાની બંગાળા અને મદાને  
આ પાક, બાસીને સૂક્રેલા ચાવલ ખાય.

સુભાઈ જ્યાં મેનેજર હતો તે હતી જોહરમલ-શામજની પાક  
ચાવલની રાઠીસ મિલ એક મારવારી અને એક કાઠિયાવાડીની એમાં  
બાળીદારી હતી. મેનેજર સુભાઈને રૂ. 35નો પગાર હતો. બીજા  
પાંચ-સાત 'બાબુઓ'ને 15થી 30 સુધીના દરમાયા હતા. માલિકો એ  
મિલમાંથી લાખો રૂપિયા રણતા. તેઓ આ મિલમાં આવતા માત્ર સંચે  
મોટર-બોટમાં બેસીને અને કલાક-અધ્યો કલાક જોઈને યાંગાઉ ચાલ્યા  
જતા. મિલોના પ્રદેશ પછી ત્યાં મોટે ભાગે બલદેશીઓની જ ગ્રામ્ય  
વસાહતો હતી. એમના ઘરો લાકડાનાં હતાં. પાકાં મકાનો હતાં ફક્ત  
મદાસી ચેણીઓનાં, કારકો કે તેમની ગાંડે લાખોનાં જોખમ હતાં, તેમની  
તિજોરી માટે પાકાં મકાનની ગરજ હતી. ગુજરાતીઓ પડા ભાડાંવડીએ  
આ ચેણીઓનાં મજબૂત મકાનોમાં પોતાની તિજોરીએ મુકાવતા.

રાતધાળી પૂરી કરીને પોતાનાં મોં ધોઈ પાછા અંબોડા બાંધતી  
બહી મજૂરકો મલકતે મુખડે એક પછી એક સુભાઈને કહેતી હતી:  
"બાબુ, આવી એબા!" (બાબુ, હુ રજા લઉ છું.)

કોણ કહી શકે તેમજો રાતભર ધીખતી વરાળમાં બસ્તાં મજૂરી  
કરી હશે! તેમજો પાછી બહુરંગી લુંગી-એંજી પહેરી લીધી હતી. વળી  
એકાદ સાચુંખોડું નંગ તો તેમનાં શરીરો પર ઝણકતું જ હતું. વાલની  
વીઠી વગરનો અડવો તો ભાગ્યે જ કોઈનો હથ હતો. ખાતી હતી કેવળ  
ચાવલ ને મરદી, પોખડા તો દેહને અધૂરું પડતું. પોષતી હતી બસ  
એકલી રસિકતપાને - રેશમ, હેમ ને હીરા વડે. અને ઓહોલો, પુષ્પો  
વગર તો એને પોસાય જકેમ?

નવી આવેલી મજૂરકોએ વસ્ત્રો બદલી, મજૂરીનાં વસ્ત્ર પહેરી  
લીધાં હતાં. સંઢોઉં છોડી છોડી ફરી વધુ કાળજીભેર વાળી લીધા હતા.

ચાવલની /  
દેશીમાંથી  
કગલા ક  
સા (વા)  
જતું હતું  
દુઃખ અ  
ધવરાવી  
"ચીનાં  
નહીં?"

167 [  
જતા.  
કમોદ  
ધાતુર  
લાવ  
હતું.

કમે  
ઓ

પ્રભુ પણથી  
નેમજોનો જિવુ  
સાંચ ચાવત  
અને મદ્દાસુ  
અમણની પણ  
ચાવતની એમાં  
હતો. બીજુ  
માલિકો એ  
તા માત્ર સાંજે  
યાંગાંડ ચાલ્યા  
ની જ ગ્રામ્ય  
નો હતાં ફક્ત  
ન હતાં, તેમની  
ડા ભાડાંવડીએ  
કવતા.

બજાતાં મજૂરી  
દી હતી. વળી  
ર હતું. વાલની  
તી હતી કેવળ  
તી હતી બસુ  
ઓહોહો, પુણ્યો  
િ. વસ્ત્ર પહેરી  
ની લીધા હતા.

### ચાવતની મિલમાં

27

દેખીમાંથી ફુલો ઉતારીને તેઓએ આ પુષ્પબોગ્યો મેનેજરના મેજ પર  
કળા કરી નાખ્યા હતા. છથમાં તેમજે ખેપાળીઓ લીધી હતી અને  
શા (વક્કડાની ચાખરીએ) પર ચરી ચરી તેઓનું એક રૂમાંદું ચાલ્યું  
જરૂર હતું. બાંકેલા ચાવતને સુકૃવવાની પોટના ઉકળતા વિલાગમાં.

“અને તું મા-પ્રો” રતુભાઈએ એક મજૂરશને જોતાં જ કલું. “તું  
હજુ છાવતી છે શું? કૂરી પર કામ કરી શકે છે?”

“નહીં કેમ કરી શકું, બાબુજી!” એ બાઈ પોતાના બાળકને  
ઘરચાવી લઈને પછી ઘોઉંયામાં નાખી ચાલતી ચાલતી ઊંભી રહી.  
“ચીનાની મિલમાં કૂરી પરનું કામ અમે જ કરતી, તો આહી શા માટે  
નહીં?”

“પણ તું રહેવા કે..”

“અને કઈ નહીં ચાય બાબુજી, ડરો નહીં.”

એમ કહેતી એ કૂરી પર ચડવા ચાલી.

ઊંભી મોટી મોટી કૂરીઓ હતી. એક નળ પાણીનો, ને બીજો નળ  
167 ડિઝી ગરમી આપતી વરણનો: બેઉ નળ એ કૂરીને માથે સંધાઈ  
જતા. અને એ બંને સર્પોના સંધાઈ ગયેલ મોઢમાંથી કૂરીમાં ભરેલી  
કમોદ પર જે ધોધ પડતો તેનું પાણી - પાણી કહેવાય કે ઉકળતો  
ધાતુરસ! - એ તો લાવા હતો, લાવા.

બેતાળીસ કલાક સુધી આ લાવામાં કમોદ બફાતી. પછી એ  
લાવારૂપ પાણીને નીચેની જળી વાટેથી બહાર કાઢી નાખતા.

એ પાણી પાસે ઊભા રહેવું. એ રૌંબ નરકમાં વાસ કરવા જેવું  
હતું. પાણી બદબો મારતું, બદબો અસર્ય હતી.

એ બદબો ભલી મજૂરો નહીં, પણ હિંદના ઉડિયા મજૂરો ખાતા.  
બેતાળીસ કલાકના 167 ડિઝી ગરમ જળ-લાવામાં બફાયેલ એ  
કમોદના ધાનને સુંડલે સુંડલે બહાર કાઢતા આ ઉડિયા મજૂરો - આ  
ઓરિસાનાં હાડપિંજરો.

બરમાઓની એ મગદૂર નહીંતી. સુકુમાર ભલી સ્ત્રીઓ એ

કુંડિઓથી ફૂર નાસતી  
બાળક ધવરાવીને આ એક જ ભાલ્યિણી ફૂરી પર ચાલી ગઈ અને  
સુભાઈ હિલમાં ગભરાતો ગભરાતો પાછો વળ્યો.  
ભલી નારી ફૂરી પર ચરીને એના કઠોડા ઉપર દેહ જુકાવતી હતી  
તે સુભાઈને એક વખત જોયું હતું. અને એનું હિલ ઘડકયું પણ હતું,  
કઠોડો જાહેર થઈ ગયો હતો, શેઠિયાઓને કેટલીય વાર કષું હતું, પણ  
સિધે કરાવશું, કરાવશું એમ કલ્યા કરતા હતા.

તોબાદ તો છે આ બરમા મરદ મજૂરોથી: ઉકા પડી ગયા છે  
તોયે હજુ બેઠા છે લિજજતથી, અને ચીપિયા લઈ લઈ દાઢીમૂછના વાળ  
ચુંટી રખ્યા છે!

“પણ ત્યારે તમને દાઢીમૂછ મુંડાવતાં શું થાય છે?”  
પોતાના આ પ્રશ્નનો જવાબ મેનેજર સુભાઈને બહુ ભારી પડ્યો:  
“આરે બાળુ, ઠોડાં વાગે છે.”

“વાગ્યાં હવે.”

“પૂછો અમારી જીઓને. તેમને વાગે છે, અમને નહીં.”

“છેને નાગા!” એમ કહેતો મેનેજર અંદર ચાલ્યો ગયો. ભલી

મજૂરોને બહુ છેડવામાં જોખમ હતું. અમુક સંખ્યા-પ્રમાણમાં તેમને દરેક  
કારખાનામાં રાખવાનું કાયદાથી ફરજિયાત હતું. કજિયા માટે ભલી મજૂરો  
સદા સજજ હતા. ધા તો તેઓ પણ ધારણા કરતા, ધા અને બેતારો:  
બંને સાથોસાથ. બેતારો તેમનું વાદ્ય હતું. બેતારા પર આંગળીઓ  
ઝંકારતા તેઓ કારખાનામાં પણ ગીતડાં આરડતા. એને ગીતો ગાવાં  
કુમ કહેવાય? ગીત તો હતી નારીના કિનર-કંઠની પેદાશ. આ તો  
બચાડતા. તેમને માંડ પટાવીને કામે લગાડવા પડતા.

પાણી કાઢી નાખેલ ફૂરીઓમાંથી સુંડીઓ ભરી ભરીને ઉડિયા  
દીડવા આવતા હતું, કમોદને ઊંચી મોટી કોઈઓમાં ઠાલવતા.  
કોઈઓની વરચ્છોવરચ્છ વળી પાછી સ્ટીમ-પાઈપ સણસણતી હતી. એ  
કોઈઓ ફૂરીમાં બણાયેલ કમોદ પર ઓર એક બાણણ-ક્રિયા અજમાવતી.

કોઈઓ પોતાનો પ્રયોગ પૂરો કરીને આ કમોદના પુજેપુજે સ્વીમપ્લેટ પર સોંપી હતી. આ પ્લેટેને નીચેનાં બડાહિયામોણી વરાળ લાગતી, ઉપર કમોદ ચુકતી. કમોદને ઊલટસ્લુલટ, ફેરવ ફેરવ કરવાનું 'હળવામાં હળવું' કામ હેમ, હીરા ને પુષ્પો પફ-પાઉડરની ભોગી જાતી નારીઓ કરતી.

હળવામાં હળવું! રતુભાઈ જ્યારે ત્યા પ્રવેશ કરતો ત્યારે માં બેન્ઝા મિનિટ ઊભો રહી શકતો. એના આજા શરીરે લાય ઊઠતી, આંખે અંધારાં આવતાં, એ દોડીને બહાર નીકળી જતો.

હળવામાં હળવું! બર્મી મજૂરણોની અકેક બેચ એ પ્લેટ પર પંદર મિનિટથી વધુ ઊભી રહી શકતી નહીં. પંદર મિનિટ તો કાયદાએ ઠરાવેલ હતી. પા કલાક કમોદ હલાવીને એ બેચ બહાર નીકળી આવે અને બીજી બેચ હલાવવા જાય. પા કલાકની પાળી.

રતુભાઈ બહાર આવે છે ત્યા તો બુરામજા કરતો કૂરી પરનો ઊડિયો મિસ્ટ્રી દોડી આવે છે: "બાબુજી બાબુજી! મા-પૂ કૂરીમેં જિર પડી."

"હું!" રતુભાઈનો સ્વર ફાટી ગયો.

"હા, કઠોડો તૂટ્યો ને મા-પૂ અંદર જઈ પડી."

રતુભાઈ દોડિયો. બાઈને બહાર કાઢી હતી. પણ એ એકલું ખોળિયું હતું. કમોદ ભેળી એ માનવકાયા પણ બફાઈ ગઈ હતી. કમોદ અને માનવીનું શરીર, બેમાં શો ફરક છે! ફરક તો આપણે પાડ્યા છે.

પણ ના, ફરક મોટો છે. કમોદ પર તો બેતાળીસ કલાકના સંસ્કારો થયેય એનું કવચ ભેદાનું નથી. પછી વરાળકોડીમાં બફાયેલ પણ એનું જરીક જેટલું માથું જ શીતરીમાંથી બહાર દેખાય છે.

ઉપરાંત, કમોદના દાખાને તો બાળક હોતું નથી ના?

મા-પૂનો દેહ બફાયેલો પડ્યો હતો ત્યારે એનું બાળક પણ ઘોડિયામાં રહતું હતું.

મિલમાં દાક્તર નહોતો, કારણ કે કાયદો એ ફરજ પાડતો નહોતો.

‘કર્ણ એઠાંનાં સાધનો હતો, કેમ કે કાયદો એટલી જ ફરજ પણ હતો. પણ કર્ણ એઠાંના સીમાડાને મા-પૂનું શરીર વટાવી ગયું હતું. હજ સવારે જ રતુભાઈએ જેટે પર વેણીઓનાં ઝુંડ બિલાયેલા જોયાં હતાં. મા-પૂ પણ એમાંની એકાઉ બની શકે તેટલો લાંબો અનું ચોટલાં હતો. એ ચોટલાંનાં ફૂલો હજુ રતુભાઈના મેજ પર વણકરમાયાં પડ્યાં હતાં.

યાંગાઉ ટેલિફોન ગયો, શેડિયા મોટર-બોટમાં હાજર થયા ફેફરી-છન્સેક્ટરને ખાલ્ય ટેવાયા હતો. પણ એના આવી પહોંચા પહેલાં જ શામજી શેઠ ચાલી નીકળું હુરસ્ત માન્યું.

“પણ ઓલ્યો હમજું જ આવશે.” રતુભાઈએ કહ્યું.

“તમે જ પત્તાવી દેજો ને, માસ્તર!” શેડિયાએ રતુભાઈને સમજ આડી, “જેમ ઠીક લાગે તેમ કરજો.”

“પણ આ કઠીડાનું શું? મારી જ ગરદન પંકડશે.”

“ઠીક પડે તેમ પત્તાવી દેજો ને!” શામજી શેઠ એક આંખનું

સૂચક મિચકારો માર્યો.

“પણ મને અદાલતમાં ઘસડશે તો!”

“તો કંપની તમારો દંડ ભરી દેશે. એમાં મૂંગાઓ છો શું?”

શામજી શેઠ બીજો મિચકારો માર્યો.

આંખને એક જ મિચકારે જગતને સમજાવી દેવાની કરામત જાહીરી છે.

- ન શેડિયાને પાછા યાંગાઉ પહોંચાડવા લઈ જતી મોટર-બોટ હરાવદીનાં પાકી ઉપર ગાજતી ગઈ.

જ ફરજ પાંડુલિ  
ચાવી ગયું હતું  
નું બિલાયેલા  
ટલો લાંબો એનો

કાકરમાયાં પડ્યાં

અંગર થય્યા  
પહોંચ્યા પહેલાં

કણું.

ટુભાઈને સમજ

."

એક આંખનું

ઓ છો શું?"

દેવાની કરામત

મોટર-બોટ

## શિવો માણાવદરી

કવચિત પચિત થતો આવો 'અકસ્માત' બાદ કરતાં જોહરમલ-શામળની ચાવલ મિલ રોજિંદા રવૈયા મુજબ શાંતિથી ચાલ્યા કરતી. ઠિરાવદીમાં પાણી-લાઈન વાટે ત્રણ ત્રણ હજાર મજા કમોદની ગીગ ભોડી (હોડીઓ) આવતી, આઠસો-નવસો મજા કમોદવાળી સંપાનો (નાની હોડીઓ) આવતી. નદીકાંકે એ ખરીદવા ને તોલ કરવા માટે શેઠના ગુજરાતી મહેતાઓ નાની એવી ઝૂપડીઓમાં બેસ્તા, કાળા રેશમની ચોરણીઓવાળા ચીનાઓ અને લાંબા લાંબા ચોટલાવાળા અંતર્પ્રદેશના બ્રહ્મી લોકો સાથે તોલના ધમરોળ મથતા, ખાસ પઢવી રાખેલા ચાર મજૂરો તોલમાં કસ કાઢતા, તો વેચનારાઓ કમોદમાં ભૂસાં ખડકિને મિલના શેઠિયાઓનો સામો કસ કાઢવા મથતા. પોતાના શેઠિયાઓને આવો લાભ કરી આપવા માટે આ લોકો સાથે જાનનાં પણ જોખમ ખેડતા કાઠિયાવાડી જુવાનો સસ્તામાં મળી જતા. દિવસભર ઢાંચીમાં (નદીકાંકના ઘાટ, જ્યાં કમોદનાં વહાણ વેચાવા આવતાં) બેઠાં બેઠાં તોલ કરીને રાતના બે વાગતાં સુધી એ જુવાનો નામાં પણ ડસ્ટતા, અને એવી નિમકહલાલીની નોકરી બજાવવાની ચોવીસેય કલાકની અનુકૂળતા માટે મિલોમાં જ શેઠિયા બાસા રાખતા. બાસા એટલે રસોડાં.

જોહરમલ-શામજી રાઈસ મિલ કાઠિયાવાડી જુવાનોને માટે ભાંગ્યાના ભેરુ સમાન હતી. આગલી નોકરીમાંથી રખડી પડેલો શિવશંકર ઢીક ઢીક રજાયા પછી આંહીં ત્રણ મહિનાથી ઉમેદવારીનું કામ કરતો હતો. જમવાનું શેઠ તરફથી મિલમાં ચાલતા બાસામાં હતું. એના પગારદાર સાથી બાબુઓ પાંચ-સાત હતા. તેમના પગાર પંદરથી લઈ ત્રીસ સુધી હતા. તેમની હજામત, કપડાં, ધોલાઈ ને ખોરાકી શેઠને શિર હતાં. તેઓ ચોવીસેય કલાકના નોકર હતા, કારણ કે તેમને રહેવાનું જ મિલમાં હતું.

તરફ મહિને શિવશંકર શેઠ આગળ પગારના નિર્ણય માટે ખબો થયો.

“આમ તો તમારું નાનું ઘણું કાચું છે.” શામજી શેઠ છેવટે નખી કરતી વખતે કહ્યું. “પણ હવે બીજે ક્યાંય તમારો ટેટો બાજતો નથી, તો અમે રૂપિયા બાર દેશું.”

“અરે શેઠ! ભાઈસાહેબ!” શિવશંકરનું પાણી ઉત્તરી ગયેલ હતું.

“તરફ મહિનાથી હું ઘર માને દસ રૂપિયા પણ મોકલી શક્યો નથી, કાંઈક મહેરબાની કરો. જે વરસનો તો હું અહીં અનુભવી છું.”

“ઠીક જાઓ, પંદર આપશું, વધુ આપવાનું તો ધોરણ જ નથી..”  
ધોરણનું કામ પાડું હતું.

વીસ વર્ષ પર આ શામજી શેઠ મેટ્રિક સુધી ભણીને બબદેશ આવેલા ત્યારે તેના શેઠિયા ગાડી લઈને રેમને બંદર પર જાતે લેવા આવેલા અત્યારે હવે જમાનો બદલી ગયો હતો. કાઢિયાવાડમાં કેળવણી અને લેકારી બંને બહેનપણાં સાધીને આગળ દોડતાં હતાં. રંડવાળ માતાઓએ ઉછેરેલા અને જાતિજનોએ છાણાલયો કરી કરીને ભણાવેલા છોકરાઓ છાણી અંગેજ અથવા મેટ્રિક સુધી પહોંચીને પછી માનું છાણાવસીદું પડ્યું મુકાવવાની લાગકીથી અને એકાદ બેરી પરણવાની મહેરણાથી આફિકા-બર્મા તરફ ટોળાબંધ દોટ મૂકતા. બબદેશમાં બાબુઓ સસ્તા બન્યા હતા. થોડું અંગેજ જાણનારાઓની પ્રાપ્તિ દસ વર્ષ પર આકરી હતી, હવે તે સહેલી બની હતી.

જે વર્ષ પર શિવશંકર આવ્યો ત્યારે માંડ વીસ વર્ષનો હશે, જુનાગઢની એક બ્રાહ્મણ બોર્ડિંગ છોડીને એ પહેલવહેલો પોતાના ગામ માણાવદરમાંથી ગાડીમાં બેઠી, ત્યારે એની દશા માતાનું ધાવણ છોડતા શિશુ સમાન હતી. નાનપણે ધાવણ છોડાવતાં માઝે જેમ છાતીએ કડવાણી ચોપડી હતી, તેમ સ્ટેશન પર વળાવવા ટાકો પણ માઝે કડવા બોલ સંભળાવ્યા હતા: “ત્યાં જઈને પાછો રજાતો નેં અને જતાંવેંત ખરચી મોકલજે. પગાર આવે તી પાછો ઉડાવી દેતો નેં, ને ભાઈબંધુને

શિવો  
કાગળ  
અહીં  
કરવા  
વચા  
એટે  
ટ્યાલ  
શેહ  
કહી  
અહીં  
જ :  
એક  
બે  
એને  
આ  
ભા  
નિ  
લા  
પર  
લદ  
અ  
વિ  
પ  
અ  
પ  
અ

શેડ છેવટે નક્કી  
થે બાળતો નથી

તરી ગયેલ હંસું  
લી શક્યો નથી  
નવી છું."

એરકા જ નથી.."

મહિને ભ્રમદેશ  
પર જતે લેવા  
વાડમાં કેળવજી  
હતાં. રંડવાળ  
કરીને ભણાવેલા  
ને પછી માનું  
બેરી પરણવાની  
દેશમાં બાબુઓ  
ન દસ વર્ષ પર

ક વર્ષનો હશે,  
પોતાના ગામ  
ધાવણ છોડતા  
જેમ છાતીએ  
જી માટે કડવા  
અને જતાંવેત  
ને ભાઈબંધુને

કાગળ ચોડા લખજે. ખબર છે, ગાંડા! હવે તો છ મહિના પછી અંદી અનાનાની ટિકું ચોડવી જોશે. સરકાર મૂવા આનાના અંદી આના કરવાના છે, તી અભાગજી રંગીરાંકું કાગળ લખશે કેવી રીતે, ઈનો કાઈ વચાર જ ન કર્યો! એમાં પાછા છોકરાવને આજકાલ ભાઈબંધુ બૌ વધ્યા, એટલે ઈ ટાઈલાં કરવામાં જ ટપાલું ફરડશો! ઘરે હતો તંયેપ કાઈ ઓછી ટપાલું ફરડતો! કવર વગર તો ધા ન કરતો. પતે તો હાલનું નહીં શેહજાદાને! હવે ત્યાં કમાવા જાઓ, હવે તું કોઈ છોકું નથી. હું તને કહી રાખ્યું છું કે તારે મનેય બેત્રણ મહિને કાગળ બીડવો, અઠવાડિયે અંદી-અંદી આનાની ઉઠાડતો નહીં."

ગાડી ઊપરી તે વખતે માઝે જાણીબૂજુણે આંસુડાં રોકવા માટે જ આવાં ઝેરકોચલાં પુત્રને પિવરાવ્યાં હતાં. પછી પોતે પાછી વળીને એકલી એકલી લાંબે રસ્તે ચાલતી, રોતીરોતી ઘેર પહોંચી હતી અને બે દિવસ સુધી પોતાને રંધવું ફાયું નહોતું. ચૂલામાં જે ધૂમાડો થતો તે અને કોઈ પાડોશી ન જાણી જાય એ રીતે રોવાની અનુકૂળતા કરી આપતો.

માઝે પાપેલી શિખામણને તો શિવલાએ નવાગઢ સુધી પહોંચીને ભાઈરના પાછીમાં જ પદ્મરાવી દીધી હતી. અને આંદ્રિકા જવા માટે નીકળેલા બોર્ડિંગવાળા દોસ્તની સાથે કાગળો નિયમિત અઠવાડિયે લખવાની જિકર માંડી દીધી હતી. બેઉ જણા ખરાવી ખરાવીને પરસ્પર પત્રવ્યવહારમાં પ્રમાણી ન રહેવાની સૂચનાઓ દેતા હતા. પંદર વર્ષથી લઈને યુવાન લગ્ન કરી કાઢે છે ત્યાં લગ્નિનો વચગાળો પ્રત્યેક ડિશોરને અને યુવાનને મિત્ર સાથેના 'પ્રશ્ના'નો, 'ખાર'નો (માત્ર સ્નેહનો નહીં), વિરહની યાતનાઓનો, જૂરવાનો અને તલસવાનો હોય છે; અને એ પત્રોમાં, પાછળથી સગી સ્ત્રી પણ જો ફાઈલ જુબે તો ઈર્ધાની આગ અનુભવે તેવા, ઉમળકાના ધોધ વહાવવાનો હોય છે. અને પાછળથી પરણો-પણે પછી બેશક તેઓ 'પ્રિય સુહુદ' અને 'વહાલા' મટી કેવળ પરસ્પર 'ભાઈશ્રી' બની જાય છે.

પ્રભુ પદ્માય

શિવ

34

એવા એક આહેકા જઈ રહેલ મિત્રથી વીરમગામ સ્ટેશને જઈ પડેલો શિવશંકર બ્રાહ્મણ પહોંચ્યા પછી પહેલો પત્ર માને નહીં, પણ મિત્રને લખવા લેતો હતો.

સેલી સુહું આસીએ ...ભાઈ!

પત્ર મળ્યો, વાંચ્યો; જે આંદ અને સંતોષ અનુભવ્યા તેનું વજન નહીં જ યાએ કરી પત્ર એ આશાએ પ્રતિપત્ર પાઈનું છું ને માનું છું કે આશા નિષ્ફળ નહીં જાએ. તેવાં સુધી એ આશા રાખીશ, કારણું કે આશા એ તો મધુર-કડવો અંશ છે જિંદગીનો! એની સફળતા તમારે હાથે છે.

લિ. તારો શિવ

આનથી જુદી જ ઢબે બાને કાગળ લખ્યો. તેમાં આશાની મધુરું કડવાશ કે એઠું કાંઈ નહોંનું, હતું નક્કર નિર્દ્ય વાસ્તવ -  
... ભાઈએ પેસા આસ્યા હશે. ન આસ્યા હોય તો મંગાવી લેશો. હમણાં તો હું ખાસ મોકલી શકું તેમ નથી. પગાર ફક્ત વીશ થયેલ છે... કોઈ જાતની ફિકર ચિંતા કરશો નહીં...ભાઈને ત્યાં ભાબીને વંદન તથા છોકરાને સંભાયાનું કહેજો અને ઘ્યાર કરશો. નીમું ભાબીના ઘરમાં લઘાંને સંભાયાનું કહેજો. નાની તથા મોરી ભાબી અને કારીને યાદ કર્યાનું ને વંદન કહેજો. એ જ. જે સંભારે તેને સંભાયાનું અને શારદુલેનને ઘાટિત લખજો.

લિ. છોડુ શિવ

દોળટીખળ પત્ર સુહુંદો પરના પત્રવ્યવહારમાં જ ટપકતાં -

સુહું ધીરેનું!

પત્ર મળ્યો, વાંચ્યો, એક વાર નહીં, પત્ર અનેક વાર. કાંઈ વૈચિધ્ય કે વૈચિધ્ય તો નહીં હતું છતંય મારે માટે સાકૃષ્ણ હતું જ. પેલો હડમાન, દેવેનું જગતશંકર બાબરાવાળો, અહીં છે. અચાનક જમણ વખતે લેતો થઈ ગયો. ક-ક-ક કેમ છે? પૂરી જીયું હતું, વ-વ-વ વીરાઙ્માણ પત્ર છે?

લિ. તારો શિવ

કરવ  
ભેડુ

બા પરનો તે પછીનો એક પત્ર -

પૂજ્ય તીર્થસ્વરૂપ માતુશ્રી,

આદ્ધિકાશી વિનુંનો કાગળ છે. તમને યાદ કરે છે. અને હું અને  
તે, બંને એક થાળીમાં સાથે બેઠીને જમતા હોઈએ અને તમે જમાડતા  
હો તેવાં સ્વાના ઢાંઢે છે, અને એવો અવસર ફરી ક્યારે આવે તેની  
ચાહ જુઓ છે.

લિ. છોડુ શિવો.

પણ જૂના શેઠની નોકરી છોડ્યા પછી બે મહિના પત્રબ્યવહાર  
કરવાની 'સો' (તપકત) જ કયાં હતી! એ તક ફરી વાર છેવટે ભાંગ્યાના  
લેનું જીહરમલ-શામજાની ચાવલ-મિલમાં આવ્યા પછી મળી.

એય સુષુપ્ત ભાઈ વિનયભાઈ,

તા. જનો પત્ર એક મહિને મળ્યો. ઘણા સમયથી વિચારતો હતો  
કે ક્યારે આવે? આવ્યો ત્યારે ઓફિસનું કામ પણ વેગળું મૂકીને  
વંચવાની તીવ્ર વૃત્તિને આદર આપ્યો.

વાંચીને ઘણાયે વિચારો નજર સામે તરવરવા લાગ્યા, કેશમાં  
ગોકાદને ભૂલો કરીને પણ સુધારી. ઘણાયે વિચારો આવે છે ને શરીર  
જાય છે. હું-તું-બાવલો વગેરે ઘણાં ઘણાં જુદાં સ્વરૂપો નજરે તરે છે.  
તેમાં બર્મા, આદ્ધિક, કાઠિયાવાડ, રંગ્ઝાન, ક્રિયમું ને માણાવદરમાં હું, તું,  
મિનો, સગાં, ભાઈ, ભાબી વગેરેનો એકસામટો વિચાર-ખીચડો મગજમાં  
ભડબડાટ કરે છે... અને પાછો શોંટ થાય છે.

હમણાં થોડો વાત થયાં મજાજ શોંટ નથી. અનેક વિચારો  
ઘોળાયા કરે છે. તબિયતનું પણ ડેકાણું નથી. ક્યાંથી હો?

નિયમિતતાનું નામ જ નહીં. ક્યારેક ખુરશી પર આજો દિવસ કામ કરવું  
પડે, તો ક્યારેક આખી રાત. અને ઓફિસનું કામ તો જ્યૂટી મુજબ  
કરવાનું. નહીં મળે ફરવાનું કે હરવાનું. બધુંય આ મિલમાં જ. બધામાં  
અમે સાત ગુજરાતીઓ, બાબુ લોકો કહેવાઈએ, પણ બધાએ ચોવીસ  
કલાકની જ્યૂટી ભરવી જોઈએ. કારક કે બધું મિલમાં જ, બહાર જવાનું  
નહીં. એક જેલ જેવું છે. કોઈને માટે નિયમિતતા રહી નથી.

અત્યારે પણ હું રાતના બે વાગ્યા સુધી આંદોલને જ સેવા  
જઈશ આ પાકા ચાવતની મિલ છે. કમોનને બાક્ષા પછી એ સુખની  
પડે છે, અને તે બારાબર સુકાય છે કે તેમ તે વારંવાર જોવા જરૂર  
43 છે. આજે રાતે જે ધ્યાન સુકાય છે તે ચાખી જોવાનો વારો છે. આ  
કાજની ઢુકે ઢુકે લખાય છે, કારણ કે વારંવાર જોવા જરૂર પડે છે.  
વળી હમજું એક ભાઈ અમૃતજીથોતિ ધૂપછાંં અને બીજી રેકૉર્ડ્સ વાવેલ  
છે તે સંભળીએ છીએ તેમાં 'જીવનકા સુખ આજ પ્રભુ' એ પણ છે.  
બીજી ગુજરાતી અને હંસ પિકચરની પણ છે. એટલે આ જીવનમાં પણ  
થોડી મોજ કરીએ છીએ હજુ તો અજીવાર થયા છે, પરંતુ પત્ર પૂરો  
ધ્યાય તેમ વાગતું નથી (કામને અંગે).

વહાલા વિનુ! હું તો ત્યાનો મેનેજર થયો છે, ને હું એક માપૂલ  
કલ્વક છું. હો! વાંદ્યો નહીં, હું પણ કાંઈક કરી બતાવીશ.

અમારે આંદોલન મુંબઈ જેવો એપોલોમેટિક ટેલિફોન નહીં હોવાથી  
એપેરેટિંગ ડાઉનસમાં નંબર જગ્ઘાવવો પડે છે. ત્યાના એક એપેરેટર  
સાથે મારે થોડી દોસ્તી છે. રાતે તે જગ્ઘી પર આવે ને અમે નવરા  
છોઈએ તો રિંગ મારીને બે ઘરી ગળાં મારીએ અને બીજી મિલોની,  
તેઓની ડેડઅ૱લિસ્ટોની વગરે વાતો ચુપકીદીથી સંભળીએ - થોડી  
ગમત સાથે જગ્ઘાવાનું મળે. જોકે ખાસ કરીને તેમાંના બધા ઉલ્લુ જેવા  
જ જગ્ઘાયા છે. પણ ગમત બહુ આવે.

(તા. વળતા દિવસની)

સુખદુઃખ દેનું એક બચાબદ,

દ્વારાની મહેમાન.

જો ભી દેખા, પહું ભી દેખ લે,

દોનોકો પહેચાન;

મૂરખ મન હોવત ક્યો હેઠાન?

તિનુભાઈ, કાલે બહુ જ વિચાર હતો કે પત્ર પૂરો કરું, પણ ન  
કરી શક્યો. કાલના પત્રમાં રીતસરનું લખાણ નહીં મળે, કારણ કે તે  
બધું કુલીઓ અને બર્મા કામ કરનારાઓ સાથે વાતો, ઓર્ડર અને  
સમજાવટ વગરે જાતની 'ડિસ્ટ્રબન્સ'માં લખાયેલ છે.

તું કહે છે તેમ મહેનત-મજૂરી સાથે બુદ્ધિને અણાલનાવ રહે છે.  
તેનું શું? હમજું હમજું મહેનત કરું છું તો મગજ ઠેકાડો નથી. પરંતુ તે

શારીરિક મહેનત નથી એટલે એમ પરું હશે - જે હોય તે મારું તો  
શરીર અને મગજ બેઠ બગરજું છે. ઉજાગરા અને અનિયાપિતતાને  
અંગે દિકર નહીં, ઘોડા વજતમાં તેને પછોળી વળીશ.

આઈના ભરમા લોકોનું જીવન બારે વિચિત્ર અને જીગતી જેણું  
હોય છે. અહીં ધાન સુકવવા આવતી બર્મા સ્નીઓને પોશા છ આના  
મળે. એમાં એક દિવસ વચ્ચે પડે તો બીજે દિવસે ખાવાનાય સાંસા જે  
મળે તે વાપરી નાખવાનું અને શેકલીઓ થઈ કરવાનું પણ ભરતેને  
ધાનની પચાસ પાઉંડની ટેકરી ઉઠાવતી હોય, પરંતુ વાપલાનું ભરતવાળું  
ફોક તો જોઈએ જ. ભરમાઓની ચામરી ગોરી હોય છે, પણ જેને 'ચામિંગ  
બ્યૂટી' કહીએ તેણું બહુ જોવામાં નથી આવતું. આપણે અણીઆળા નાકને  
'ચામિંગ' કહીએ, તો તે લોકો જેમ વધુ ચીંબું તેમ વધુ પસંદ કરે. મેં તો  
સાંભળ્યું છે કે બાળક નાનું હોય ત્યારથી નાક દાઢ દાઢ કરીને  
છારાદ્યપૂર્વક ચીંબું બનાવે છે. નીતિનું ધોરણ પણ બહુ ઊંચું નહીં. કાંચાં  
હોય? ગરીબી હોય ત્યાં નીતિ પાળવી બહુ મુકેલ છે.

આજે પણ લગભગ 11 થયા છે. સવારે પોશા રજે  
જાહીદાનું છે. એટલે પત્ર પૂરો કરીશ.

મારી પેઠે તને તારા શેઠ અમારા પરામાણી શહેરમાં નહીં  
બોલાવતા હોય. એકએક મેનેજર પર ટેલિફોન આવે કે શિવશાંકરને  
રવાના કરો, જરૂરી કામ છે. ઘોડાક મોડા થઈએ તો શેઠજી કહેશે કે  
'કુમ મોડા થયા? મને તમારા પર બહુ ગુસ્સો આવે છે. તમને શું  
કહેણું?' પછી પૂર્ણ કે શું કામ હતું? ત્યારે 'ઓરા આવો, ક્યાં આઢશું?'  
એંતું જ બતાવે. મનમાં મનમાં ભારે હસતું આવે છતાં મોંઝે ભૂલ  
કબૂલ કરી લેવી પડે, અને ત્યારે એને મોંઝે જેંગ જાત્યા જેણું લાગે.

આઈના અમારા મેનેજર પણ જુવાન અને હુંવારા ફક્કડ છે.  
પણ બર્મા લોકોનો દ્રેષ્ટ કે કદરપાપણું અમને હિલે વસતાં નથી, એથી  
અમે એ જાણી જાય તેમ બર્મા લોકોના અવગુણ ગાતા નથી.

એને પગાર શું મળે છે, કહું? ચક્કિત થતો નહીં. રૂપિયા રોકડા  
પાંત્રીસ, અને અમારી સાથે શેઠિયા તરફના બાસામાં અમારી જેમ જ  
ખાતું, પીંચું તથા ધોબી-હજામત.

દ. તારો શિવો.

## પરક્ષી લિધુ

મિશ્રો પરના કાગળોમાં બતાવેલા વિચારો ભલ્લી સ્વીઓ પ્રત્યે  
 શિવશંકરના ફદ્દયમાં ધીરે ધીરે પવટાતા જતા હતા, એ રસૂભાઈ  
 મેનેજરની રીશી આંખોએ પકડવા માંકણું હતું. સુકાતા ચાવલ તપાસવા  
 પોતે વાંદવાર એ સ્વીમથી ધગધગતી પ્રેર પર જતો ત્યારે પાંચ મિનિટ  
 પછી જે ઠેકાજો ઉભાતાં એની આંખે જંજબાં વળી જતાં, તે ઠેકાજો  
 શિવશંકર ઉભો હોય અને એકબે મજૂરણો પાસેથી બમ્મા બોલીના  
 પ્રયોગો શીખતો જ હોય! એ ઉકળતા ચુકુ જેવા ઓરડામાં બમ્મા મજૂરણો  
 દિવસચાત ઘંઘાળી ફેરવતી હતી. પા પા કલાકની તેમની એકેક ઢુકડીની  
 પાળી હતી. પા કલાકે તો તેઓને બહાર નીકળણું પડતું. આ પા કલાકમાં  
 કોઈ મજૂરણને મૂર્ખ આવી જતી. મૌંબે પાછી છાંટીછાંટીને એનો  
 સાથીઓ એને શુદ્ધિમાં આકાતાં. શુદ્ધિમાં આવીને તુરત એ સ્ત્રી માથે  
 ઘાલેલી ભી કાંકીનેવાળ એળતી હતી. એ કોઈની સામે ફરિયાદ કરતી  
 નહીં. કોઈને કરગરતી નહીં કે માણું કામ બદલી આપો. કોઈને વીનવતી  
 નહીં કે મને વધુ રોજ આપો. દિવસપાળી પૂરી થતાં સાંજે, કે રાતરપાળી  
 પૂરી થતાં પરોઢિયે એ મજૂરણો હાથ-પગ-મોં ધોતી, કપડાં બદલતી,  
 અને હસતી હસતી ઘેરે જતી. કલાકો સુધી બૂજાયા શેકાયા પછી તેમનો  
 વિસામો ને દિલાસો એક જ હતો: સારાં કપડાં પહેરવાં ને સુગંધી પુષ્પો  
 અંભોડી ઘાલવાં. કોઈ વાર તો કોન્ટ્રાક્ટર તેમને. ત્રણ-સાડા. ત્રણ આના!  
 જ મજૂરી આપી શકતો, છતાં પુષ્પોમાં ફેર ન પડતો!

શિવશંકરને આ બમ્માઓમાં 'ચાર્મ' (સ્લોન્ટદ્ય)નું દર્શન થવાનું બીજું  
 કારક તેની માત્રાનો છેલ્લો કાગળ હતો. આગલા કાગળોમાં મા લખાવ્યા  
 કરતી કે હજારેક રૂપિયા જરૂર બચાવીને મને જાણ કર તો હું તારુ  
 દેશવાળનો તાકડો કરું. કયે કયે ઠેકાજો કેવી કેવી કન્યાઓ છે ને તે  
 દરેકની કેટલી કિંમત બેસે તેમ છે તે પોતે જણાવતી. તેના જવાબમાં

પરલી  
 શાવશી  
 શકે ન  
 મૂતી  
 સ્વર્ગાત  
 પણ  
 ચંત્યા  
 રહેશે  
 બેસંચ  
 પાડી  
 500  
 રાહ  
 રૂપાણ  
 પરછ  
 ને મ  
 છ.  
 રાત્રી  
 લેસ  
 કરાત  
 સોન  
 ઢગા  
 સુંદર  
 અને  
 શાલ

શિવરંકર લખતો કે, આંદો તો મરતાં સુધી હજાર રૂપિયાનો જોગ થઈ શકે તેમ નથી.

મા લખતી કે “દીકરા હું તો આપણા ઊંચા કુદુલનું અભિમાન મૂડી દઈને નીચળાં કુળોમાં પણ તપાસ કરું છું. તારા પિતૃઓ કદમ્પિ શ્વર્ગલોકમાં કચવાશે, કે પહેલી જ વાર આપણા ઘરમાં અસંસ્કાર પેશે. પણ સંસ્કાર સંસ્કાર કરતાં તો તું કુવારો રહી જઈશ તેની મને ઘણી ચંત્યા રહે છે. સંસ્કાર તો આપણામાં હશે તો પારકી દીકરીમાં આવી રહેશે. માટે તું કબૂલ કર તો હું તજવીજ કરું. તોય તે રૂ. 500 તો નેસશે જ. માટે તેટલાની તજવીજ કરજે.”

જવાબમાં શિવે રોકડું પરખાવેલું કે “બા, આપજો કુણે ડેઠ પાડીને પિતૃઓને કોચવવાની જરૂર નહીં જ પડે, કારણ કે મારી કને રૂ. 500નો મેત કદમ્પિ થવાનો નથી. તમે એ સૌ કન્યાઓનાં પિતામાતાઓને રાહ જોવરાવી રાખશો નહીં.”

બસ, તે પછી શિવાની આંખોએ કબૂલ કર્યું કે બર્મા સ્ત્રીઓ રૂપાળી છે! બીજો એકરાર એણો એ કચો કે કાઢિયાવાડની કન્યાઓ પરણવા લાયક નથી. ત્રીજી ગાંઠ એણો મનથી એ વાળી કે કાઢિયાવાડને ને મારે હવે શો સંબંધ રહ્યો છે! મારું સાચું વતન તો આ ભક્તદેશ જ છે. મા મરી જોશ; પરણોલી બહેન તો જીવતે મૂઽાલી છે!

પછી રાતપાળીના સુકાતા ચાવલાની દેખરેખ એને ગમવા લાગી. રાત્રીએ પોતે દિવસભરની ચાવલ-ખરીદીઓનો રિપોર્ટ તૈયાર કરવા નેસતો તેવામાં મજૂરણોનાં પુષ્પોની મહેક અનામાં મીઠી બ્યથા પેદા કરતી અંબોડા છોડી છોડી કરી જોઈ, કરી વાર ભાંધતી જાઈએ જોના મેજ પર અંંતા મારવા આવતી અને પુષ્પોની એનું મેજ ઉપર ફરજલો કરતી. માતાછીન, બહેનવિહોશા, સંસારમાં કોઈ પણ સ્વભાવનાં સુંવાળા સંપર્ક વગરના, નોનમેટ્રોકિયા છતાં સાહિત્યના જીણ સિચામણ અને વેરાનવાસી છતાં ગ્રામોફિનનાં સિનેમા-ગોલોએ સુદુમણ શાબ્દસંગીતનાં સાર્વથી જ્વાનમાંને બીજેદેલા અથ યુવાન રિચને

અભદેશની જૂમિની માંડક સોડમ આવવા વાળી.  
મિલના બાસામાં જે જમવાનું મળતું તે ધરમૂળથી ખરાબ તો હતું  
જ. પણ એક દિવસ શિવશંકરને એનો કુસ્વાદ એકાએક અસહ્ય બન્યો.  
થોડા વખત એકો બાચો છોડ્યો, અને પરામાં એક દૂરને સ્થાને ઓરડી  
લીધી. એના પોશાકમાં નવી ચેમક ઊરી. એ દીન મટી કુઆબદાર બનતો  
ગયો. અને એકો એક નવી બાઈસિકલ વસાની. રોજ એ દૂરથી સાઈકલ  
પર જતો-આવતો થયો. સાથીઓમાં ચણભણ ચાલી. રતુભાઈને કને  
એક દિવસ એ વિસ્મયકારી વાત આવી. એકો શિવશંકરને એકાંતે લઈને  
પૂરી જોયું. શિવે શરમાતાં શરમાતાં કહું -

“હું તમને બધું કહેવાનો જ હતો. આજે જો આવી શકો, તો મારે

ઘેર ચાલો.”

રસ્તે શિવશંકરે પોતે એક બર્મી સ્ત્રી સાથે લગ્ન કર્યાની વાત  
કહી: “દેશમાં મને કોણ આખણાની કંન્યા દેવાનું હતું? હું પરછ્યા વગર  
રહી શકું તેટલું માઝે સામર્થ્ય નહોતું.”

રતુભાઈએ શાબાશી આપી અને

એને ઘેર ચાલ્યો.

એક ગોટા મકાનની બે ઓરડીઓમાં શિવે ગૃહસંસાર માંડ્યો  
હતો. મહેમાનને જોતાં જ એક ગુજરાતી પોશાકવાળી સ્ત્રી પાછલા  
કમરામાં જઈને લપાઈ ગઈ, અને ત્યાંથી એકો શિવની સાથે મહેમાન  
સારુ મેવાની રકાબી અને પાનનો ડલો મોકલ્યા.

રતુભાઈએ આ મુલાકાત કંઈક ભારે હદ્દે પૂરી કરી અને બહાર  
નીકળી શિવને કહું: “એનાં માબાપ છે?”

“હા, આ ગમમાં જ રહે છે.”

“એમણે સંમતિ આપી હતી?”

“હા, પૂરેપૂરી.”

“સંબંધ સાચબો છે?”

“ખાવાળીવા સિવાય જેટલો સચવાય એટલો.”

પરછ્યા

મને

જાય

ભગવ

ચલા

તેમણે

ગયો,

છાંટ

આર્જિં

બર્મા

પરછી વીજુ

“કેમ?”

“એ લોકો એની પુત્રીને પોતાનો મર્યાદિનો ખોરાક ખવરાવે છે. મને પસંદ નહોંદું.”

“પણ એને પોતાને પસંદ હતું કે નહીં?”

“ના, એ પણ હવે તો મર્યાદિને વિકારે છે..”

“ધર્મ?”

“ધર્મ બાબત મેં એની સ્વતંત્રતા સ્વીકારી છે. એ છૂટથી ફયામાં જાય છે.”

“તું સાચે જાય છે ખરો?”

“ના..”

“ત્યારે હું કહું છું કે તારે એની સાચે ફયામાં જવું જોઈએ. બુદ્ધ ભગવાનના દેવળમાં આપડો શા સારુ ન જવું?”

“હુદેથી જઈશા..”

“નેર, હવે એક નાજુક પ્રશ્ન પૂછું. તું એને ઓળખ પળાવે છે?”

“ના..”

“લાજ કઢાવે છે?”

“ના..”

“તો એ પાછલા કમરામાં કેમ પેસી ગયાં?”

“એની જાડો જ. એને એક કડવો અનુભવ થયો છે..”

કડવો અનુભવ! રતુભાઈના પેટમાં ફણ પડી. કોઈ મિત્રની મેલી ચલગતનો અનુભવ હશે!

“મારા કેટલાક સગાસંબંધી બ્રાહ્મણો આંહી આવી પહોંચેલા. તેમણે મારી સ્ત્રીની હાજરીમાં જ મને ગંદાં વેણ સંભળાવ્યાં, કે તું વરલી ગયો, ભષ થયો, બાબણ દેહને નષ્ટ કર્યો; હવે તું જોઈ લેજે, તારી છાંટ સરખી તો અમે નહીં લઈએ, પણ તું મરશો તો તારા શબને ઉપાડી અનિસંસ્કાર કરવા પણ અમે નહીં ડોકાઈએ. ભલે પણી આ તારી બર્મા મન્દ્યમરી તારા મડદાને ઘરમાં સાચવીને તારી પાછળ મહેદ્ધિલો

૪૨

ઉડાર વગેરે વગેરે..”  
“આની હજરીમાં બોલ્યા?”

“હા..”  
“આને એમાં શી સમજી પડી?”  
“એકો હિંદી શીખી લીધું છે..”

“શું કહે છે!”  
“સાચું કહું છું. મને ગાળો દઈને એ બધા માટે સન્પાનસૂતક કાઢતા

હોય તે રીતે ચાલ્યા ગયા. ત્યાર પછી મારી સ્વી ગુજરાતીઓથી ડે

છે, એમનાથી મોં છુપાવી રાખે છે..”

“મારે તો તારી સ્વીને અભિનંદન દેવા હતા..”

“ફરી વાર તમે આવશે ત્યારે એ નહીં છુપાય. હું એને સમજ

પાડીશ..”

“મને તો બીજું કંઈ નથી, પણ એકો એક ગુજરાતીને પરણવામાં

કમનસીબ ભૂલ કરી છે એવી અસર ન જ રહેવી જોઈએ. એકો ગુજરાતી

પોશાક ધરણ કર્યો લાગે છે..”

“હા..”

“તે પણ આપખુશીથી?”

“હા, એને આપણો છૂટે, ઘેરદાર પોશાક બહુ ગમે છે..”

“પણ એના બલ્લી સંસારમાં જે ઉચ્ચ તત્ત્વ, સ્ત્રીની પુરુષ સમોવરી

કક્ષાનું જે તત્ત્વ છે તેને આપણે નાચ ન કરવું - ન થવા દેવું જોઈએ.  
પુરુષોથી અશાદભાતી, પુરુષોને ખખડાવી નાખતી, પુરુષની ગુલામીને  
બદલે આપખુશીથી પુરુષોની સેવા કરતી બલ્લી નારી ગુજરાતી બનવામાં  
ગર્વ ધરે તેવું કરવું જોઈએ. આપણા ધરમાં આવીને એને અમુક સ્વતંત્રતા  
ગુમાવવી કે જતી કરવી પડી છે તેવું તો એના અંતરમાં કદાપિ ન  
આવવું જોઈએ..”

“ઓછી કોઈ ગુજરાતી રહેતું નથી. ચોપાસ બલદેશીઓ જ છે,  
એને તેમનામાં એ છૂટથી જાંય-આવે છે..”

“પણ તું એની જોડે કખામાં તો જરૂર જતો રહેજે. હું ફરી વાર આવીશ.”

“હું તમને જરૂર તેરી લાવીશ.”

“તારે કોઈથી શરમાવું નહીં. તે લેશમાત્ર બૂઝું પગલું ભર્યું નથી. તને ગાળો ભાંડનારાનો દોષ નથી.”

“તેમાંના બે-ત્રણ જણા તો ગરમીના ગુપ્ત રોગના બોગ થઈ પડ્યા છે.”

રતુભાઈને હસવું આવ્યું. તેમણે કહ્યું: “બીજું શું થાય!”

હું એને સમજ  
એને પરણવામાં  
એણે ગુજરાતી

છે.”  
કુદુરુષ સમોવરી  
દેવું જોઈએ  
ની ગુલામીને  
તી બનવામાં  
મુક્ત સ્વતંત્રતા  
માં કદાપિ ન  
પાઓ જ છે,

રતુભાઈ પાછો આવીને જ્યારે બાસામાં જમવા બેઠો ત્યારે એને ગ્રાસ છૂટી ગયો. ખાદ્ય પદાર્થોનાં દુર્ગંધ અને કુસ્વાદ તે દિવસે હંડ વટાવી ગયાં હતાં. ચોખ્યું વેજિટેબલ ધી, હલકામાં હલકી સોંઘાં દૂધિનું શાક, રબ્બરની બનાવેલ છે કે આટાની તે નક્કી ન થઈ શકે તેવી તેવે તળેલી પૂરીઓ: ખાદ્યા વગર જ એ ઊઠી ગયો અને એણે પોતાના પાંચ ગુજરાતી સાથીઓને પહેલી જ વાર કહ્યું: “તમે બધા હં કરો છો. આ રસોઈ તો ઢોરના પેટમાં પણ રોગ પેદા કરે તેવી છે. તમે આ કેમ કરીને આરોગો છો?”

“શું કરીએ?” દિક્કાંફચ મોઢાં માંડ માંડ બોલ્યાં: “બાપોરે ઢાંઈ (નનીના ઘાટ કે જ્યાં વેચાવા આવતી કમોદની ખરીદી થતી) ઉપર તો અમને ચા અને આવી પૂરીનું જમજા પહોંચાડે છે. કણી ગરમીમાં એ ખાઈને અમારે ખરીદીની ઘડાપીટ કરવી પડે છે. કોણે કહીએ?”

“શોઠિયાઓને.”

“અમારી શી ગુજરાત? તુરત કાણી મૂકે.”

“હું કહું તો?”

“તો મહેરબાની.”

“પણ તમે મારે પક્ષેથી ખરી જો નહીં ને?”

“ના;” કહેતા છયે જગ્ઘાએ એકબીજા સામે જોયું.

“જોણો હો, હું તો એક ધા ને બે કટકા કરીશ.”

“હો.”

વળતે દિવસે શોઠિયાઓની મોટર-બોટ ગાજ અને કોઈ કોઈ મોરલા ઊડ્યા. બધા બાબુઓની વર્ષે ઓફિસમાં જ રતુભાઈએ તાંડવ માંડયું.

“તમે તે શોઠ, અમને શું હોર ધારો છો? અમારા પેટમાં જેર શ્યામાદુર રેડો છો? અમે બે હજાર માઈલથી આંહીં એક ફક્ત પેટ પૂરવા આવીએ છીએ, અને તમે અમને વિષ જમાડીને છેતરો છો, નજીવા પગાર આપો છો. અને કહો છો કે જમાડીએ છીએ. શું જેર જમાડીને અમારી પાસેથી કામ વેવું છે?”

“તમને, મિસ્ટર!” મારવાડીના ભાગીદાર કાઠિયાવાડી શોઠિયા શામજીભાઈએ શાંતિથી દાઢીને શબ્દો કાઢ્યા: “બોલવાનું ભાન નથી; તમને અમે ભાઈબંધની ભલામજથી રાખ્યા એ જ ખોટું કર્યું.”

“ખોટું કર્યું હોય તો ભૂલ સુધારી લ્યો, શોઠિયા. બાકી આવો ખોરાક તો નહીં જ ચાલો.”

“તો તમારે શું હુલ્લડ જગાવવું છે?”

“એમ પણ થઈ શકે.”

“તમારામાં ગરમી બહુ છે.”

“એ ગરમીનો ભડકો કરનારું આ તમારું ગાયથાપનું ચોખ્યું રેણ્ટિબલ છે અને સસ્તામાં સસ્તાં ખરીદાતાં શાકભાજ છે.”

“ધેર શું ખાતા?”

“ધેર તો મા ધૂળ રાંધીને દેતી તે પણ ખાતા. આંહીં અમારી મા

કેરણ જગત

નથી, શેઠ, અંહીં તો પાછી પાઈને મૂતર જોખી લેનારા તમે છો..”

“ભાઈ, અંહીં કાઈ તમે સાયબી માગો તો અમે ક્યાંથી દઈએ?”

“સાયબી! અરે શેઠ, હું તમને જાણું છું. જેતલસર જંકશને તમે વીશ વર્ષ પર ભજિયાં તળતા હતા. આજે અહીં બે-ત્રણ મિલોના ધારી બન્યા છો. એ કોણે રળી દીધું? તમારી સાહેલી તમને મુખારક બલે રહી, ફક્ત અમને ઝેર ન જમાડો.”

“ઠીક, મને કલબમાં એકલા મળજો. બધું ઠીક કરી દેશું..”

ત્રણચાર દિવસમાં જ રતુભાઈને શેડિયાઓએ અમૃતનો સ્વાદ ચાખાડ્યો. ધાનની ખરીદીમાં કાંઈક ગોયાં ઉભો થયો, અને તેમાં રતુભાઈની ભાગીદારીને બોપાળપુરે બહાર પાડવામાં આવી. કાઠિયવાડી શેડિયા રતુભાઈની ગરદન પર ચડી નેડા. જેવા રતુભાઈને સૌની વચ્ચે શેઠને બદનામ કરેલા તેથી સો ગણા કલંકિત રતુભાઈને શેઠ કર્યા. પછી એને પોતાની ઓફિસમાં એકલા લઈ ગયા, અને મારવાડી ભાગીદાર જોહરમલ શેઠ પાસે હાજર કર્યા.

એક અંખનો ઊંચો મિચકારો મારીને મારવાડી શેઠ કહું, “દેખો મેનેજર, એક દંડે ગલતી કબૂલ કર દો, પાછે બસ, હમ યહ મામલા બંધ કર દેંગે..”

“શું કબૂલ કરું? તરકટ? એ કરતાં શેઠ, હું છૂટો થવું પસંદ કરીશ..”

“તથ તો અર્થાત, પગાર લે જાના..”

“લે જાના નહીં, અભી જ દે દો શેઠજી..”

“ને, ઓફિસ પર આ કે લે જાના..”

“સાંદુ..”

રતુભાઈ છૂટો થઈને રહેમાન મિલમાં રહ્યો.

## આબલો

ડૉ. નૈતમંતું માન ભાવદેશની નદી ઠરાવદીના પાણી માટે એક દિવસ  
એકએક અતિધિયું વધી ગયું.  
‘હેમર હથણી’ને પાંચ વર્ષના પરણોત્તર પછી પહેલી વાર પ્રસ્તુ  
થયો - એ પણ પાછી પુત્રનો  
વળી પાછું એક દિવસ બારણું ઉઘડ્યું અને મીઠો ટહુકાર કરે  
પડ્યો: “આબુલે!”

બીજું કોણ હોય? સોનાં કાકી (બોસ્વે) જ તો!  
પણ એ એકલી નહોંતી. જોઉ નીમ્યા પણ હતી. અને બેઉના  
ધાથમાં ભયાનક વસ્તુઓ હતી! બમી છતી, નેતરના દાબડા,  
ભરતગૂંથણના રૂમાલો, વાંદી, રમકડાં, ફૂલો... ઘણું ઘણું.

“આબુ! મી મૈમાની કાઉંડ મહોલા!” (તારી સ્ત્રીની તબિયત તો  
સારી છે ને?) પ્રોઢના હેતાળ સ્વર રેલાવા લાગ્યા.  
“હાઉંડ.” (સારી છે.) નૈતમે હવે તે ભાષા પકડી લીધી હતી.  
પણ હજુ ‘હાઉંડ’માં ‘હ’ને ‘સ’ વચ્ચેનો ગ્રામ્ય કાઠિયાવાડીઓ કરે છે  
તેવો મીઠો બમી ઉચ્ચાર તેનાથી પકડાયો નહોંતો.

“કાઉંદ પ્યાબાંઆઉ,” (છોકરો તો બતાવો) નીમ્યા અધીરી બની

ઉઠી.

‘હેમર હથણી’ બાળકને લઈ આવ્યા. એને જોઈને નીમ્યા તો  
બચીઓ જ ભરવા લાગ્યી. અને પછી બેટની વસ્તુઓ હાલવી દીધી.  
નીમ્યા પોતાની માતાને કહેવા લાગ્યો: “કાઉંદ તૈલ્હારે...નો!!”

(બાળક બહુ સુંદર છે ને!)

- અને ફરી હેમકુંવરબહેનને હૈયે ધ્રાસકો પડ્યો: “છોકરાને ક્યાંઈક  
નજર ન લાગે. છેય પાછી છોકરાને ભરખી જાપ તેવી!”

ખરેખર નીમ્યાનાં જોબન હવે હેલે ચડવાં હતો.

નજર સાવ નજીક હતી. એમાં જેવેરી બાળકની પછવાડે જ હોસ્પિટની દુકાન હતી. ત્યાં દુકાને બેસતી નીમ્યા વાર્ષિક આ હેમકુંવરબહેનના રાખડા બાળકને તેડી લઈ જવા લાગી.

દુકાને દુકાને બેસતી ભલ્લી પુવતીઓ આ બાળકને દેખે કે તુરત કાંચિલ તૈલહારે! 'કાંચિલ તૈલહારે!' (કેવો રૂપાળો બાળક!) નાં રટણ કરવા લાગે, એકબીજી બાળકની ઝૂટાંગું કરે, અને બાળક પાછો થેર આવે ત્યારે એના ગળામાં કંઠ તો સોનાની એકાદ ચેઠિન પડી હોય, કંઠ એના કંઠામાં એકાદ કરું પડ્યું હોય. રમકડાંનો તો પાર ન રહે.

એક દિવસ તો હેમકુંવરબહેનનું હૈયું અધ્યર આકાશો ચરી હૈયું, બાબલાને લઈને નીમ્યા કોણ જાણે ક્યાં ચરી ગઈ. ગોતાગોત થઈ પડી. પત્તો મળે નહીં. નીમ્યાને આટલા વખતથી ઓળખવા છતાં બાબલાની બાનો જૂનો ભય પાછો જીવતો થયો. છોકરાને ભરાયો હશે આ કામનું ત્રિયાએ? કે ઢાંચ (ભોરલો) બનાવી દીધો હશે? કે શું એનો જીવ નમીઓના ઘારા પશુ સીં(હાથી)ના ઘોળિયામાં મૂકી દીધો હશે? હાય રૂ. પોપર બનાવીને પાંજરામાં તો નહીં પૂરી દીધો હોય!

ડૉ. નૌતરમની મોટરે દોટાદોટ મચાવી મૂકી, મોટર નદીકિનારા ખૂંધી વળી.

નીમ્યા તે વખતે બાબલાને લઈને એક ફ્યાન્-ચાઉમાં (મહામાં) પેઢી હતી. એક કુંગી પાસે એ બાબલાના સાથળ પર છૂંદણું મંતરાવવા મથતી હતી.

"હ્યા!" એણે વિનંતી કરી, "આને મારા મામાને હતું તેણું જિલાડીનું જ છૂંદણું પાડી દેજો હો!"

"તારા મામા કોણ?"

"સયા સાન થારાવાડીવાળા—"

નીમ્યાએ આ નામ લેતાં જ કુંગી ચમકી ઊઠ્યા. એણે કહું: "આઈ, તું જા અહીંથી."

"કેમ? એ છૂંદણાના પ્રભાવથી તો મારા મામા સયા સાન

મુજુ પદ્ધયા

48

બિલ્લીપગા બન્યા હત્થા. આખી સરકારને એણો હંશવી હતી. કોઈ એ  
બિલ્લીપગાને પકડી નહોતી શકતા, ખબર છે?"  
"અરે છોકરો! એનું નામ અહીં ન ઉચ્ચાર. ગવરમેન્ટ અમારુ

ચાંઝ ચૂંધી નાખશે."

"દીક, તો કઈ નહીં ઠો પેલાયબા." (એક ચૂનાની મંતરેલી ગોળી  
આને ખવરાવો કે જેથી આ વહાબું બાળક એવું વીર બને કે તેને કોઈની  
ધા ન લાગે.)

એમ વાત કરતી હતી તે વખતે પાછળથી એના બરડા પર કોઈક  
સંચાર થયો. કટ એવો અવાજ થયો: પાછી ફરીને જુઓ છે તો એક  
બીજો કુંગી હાથમાં મોરી કાતર લઈને ઊભો હતો ને એ રોષભથ્યો  
તિરસ્કારથયો હસ્તો હતો.

"શું કુઝ?" કહેતાં નીમ્યાએ પાછળ હથ ફેરવ્યો, એની અંજી  
કપાયેલી હતી!

"શરમ નથી આવતી?" કુંગી ઠપકો દેવા લાગ્યા, "હજુ પણ  
પરદેશી પાતળાં વાયલ પહેર છ? આ છોકરું કોઈક લોકટોળમાં તારી  
અંજી પકડીને ઊભું હશે, તો અંજનો છેડો ફાટી જઈ એના હાથમાં  
રહેશે, ને તું તો ક્યાંઈ આગળ ચાલી ગઈ હોઈશ! બર્મા ઓરતો!  
પરદેશી પાતળાં વસ્ત્રોને ત્યાગો. હો ભમા! (આપણે બબાદેશી છીએ.)"

નીમ્યા ચૂપચાપ લજવાતી ઊડી ગઈ. બલ્લી સ્ત્રી બીજાં બધાં પાસે  
સિંહણ સરીઝી, પણ કુંગીઓ આગળ મિયાની મીની બનતી. કાતર  
લઈને કુંગીઓ તેમની અંજનો કાપતા. પ્રદર્શનોમાં એવાં ચિન્તો બતતાવતાં  
હત્યાં કે બલ્લી સ્ત્રી પરી બનીને કોઈ સાથેના ઘારમાં ઊડી જતી હોય,  
ને બાળક નીચે ઊભું ઊભું રોંધું હોય; એના હાથમાં માની તકલાદી  
અંજનો ટૂટેલો ઢુકડો બાકી રહ્યો હોય; વિટેશી વસ્ત્રોનો બલ્લી બહિખાર  
આટલી આકરી હદે પહોંચી ગયો હતો.

બાબલાને લઈને એ તો ઊપરી એક ફોટોગ્રાફરને ત્યાં. "મારુ  
બાબલાની જલદી તસવીર પાડી આપો, એવી તસવીર ઉતારો કે જોનાર

બાબલા  
છક થઈ જ  
"આ  
પાડી લીધી  
"શું  
બેસાડ્યો પ  
તમે રોયા  
એવ  
સીધી પહોં  
લળી  
શાંતિથી ની  
હાથમાં જિ  
અનેક પો  
પોત ગમશે  
"કહો, આ  
ગમશે?"  
મૂકો." "વ  
તો ભાગયે  
પોતે  
નથો ચકર  
થયું. સાર્ય  
અને જ્યાં  
પણ હેમકું  
તે  
એકો જાપ  
ઝંખવાડાં  
"હું  
ફોટોગ્રાફરે

આબાદી

છક થઈ જાય."

"આલો જલદી બેસો જર અહીં હવે બરાબર ધ્યાન રાપો ઓડે.

પાડી લીધી, બસ ઉઠો," બર્મા શ્લોગ્રાફરે લબડધકડ કામ પતાવ્યું.

"શું દૂળ ઓ.કે.!" નીમ્યા છેડાઈ પડી, "હજુ તો છોકરાને સરખો બેચાઈયો પણ નથી, હજું હું પૂરી તૈયાર પણ થઈ નથી, ત્યાં બસ ઓ.કે.!

ત્યે રોચા બર્મા શ્લોગ્રાફરો તે છબી પાડો છો, કે મશકરી કરો છો!"

એવા પાંચ-પચીસ બોલ પકડાવીને નીમ્યા બાબલાને લઈ ત્યાંથી

સીધી પહોંચી જાપાની શ્લોગ્રાફરને ત્યાં

લળી વળીને મીઠા આદરબોલ ઉચ્ચારતા જાપાની સ્ટુડિયોવાળાએ શાંતિથી નીમ્યાની બરદાસ્ત માંડી. પ્રથમ તો એઝો બાબલાના હાથમાં લિસ્કિટ પકડાવી દીધી. પછી એઝો નીમ્યાની સામે જુદા જુદા અનેક "પોઝ"ના નમૂના મૂકીને વિનયથી પૂછ્યું: "આમાંથી તમને કયો ગમશે?" પછી એની પાસે અનેક પ્રકારના વસ્ત્રો-પોશાકો પાથર્યાં પોઝ ગમશે?" "આ બેદક આમાંથી કોઈ એક પોશાક પહેરીને પડાવશો?" "આ બેદક કુછો, આમાંથી કુંડાં મૂકું?" "લો, આ રમકડાં એના ખોળામાં ગમશે?" "આ જાડનાં કુંડાં મૂકું?" "લો, આ રમકડાં એના ખોળામાં મૂકું." "વાહ ર! મા ને બાળક બેઉ કેવાં સુંદર છે! આવાં મા-બાળક તો બાળ્યે જ અમને બરદાસ્ત કરવા મળે છે," વગેરે વગેરે.

પોતે મા ને આ પોતાનું બાળક, એ વાતનો તો નીમ્યાને મીઠો નશો ચડ્યો. પોતે આની મા નથી એટલું કહેવાનું પણ એને મન ન થયું. સાચી માસ્વરૂપ બની જઈને જ એઝો જુદા જુદા પોઝ પડાવ્યા; અને જ્યારે એ ડૉ. નૌતમને ઘેર ગઈ ત્યારે તો હષઠોલી બની હતી. પણ હેમસ્કુલરબહેને એના હર્ષનો કેફ બેચાર શબ્દોમાં જ ઉડાડી મૂક્યો.

તે વખતે તો નીમ્યા ક્ષમા માગીને ચાલી ગઈ, પણ વળતા દિવસે એઝો જાપાની શ્લોગ્રાફર પાસેથી તસવીરો લાવીને હેમસ્કુલરબહેનને ગંગવાળાં પાડી દીધાં.

"હું તમને કહું દું ને!" નીમ્યા બકવા લાગી: "કે અમારા બરમા શ્લોગ્રાફરો તો રહી છે રહી. આ જાપાની લોકો ખરેખર અમારા મિત્રો છે.

પ્રભુ પદ્ધય  
દાની. કોઈ એ  
મેન અમાર  
તરેલી ગોળી  
તેને કોઈની

એ પર કાંઈક  
છે તો એક  
ને રોખબધ્યો  
એની એંજી

"હજુ પણ  
પમાં તારી  
પ હથમાં  
ઓરતો!  
દીએ.)"

અધાં પાસે  
દી. કાતર  
બતપવાતાં  
તી હેઠ,  
તકલાદી  
અહિઝાર

"મારા  
ઓનાર

મારો કો-માંડુ મોટે ભાઈ માંડુ સાચું જ કહેતો હતો કે આ જાપાનીઓની આપણા સાચા ભિન્નો છે. બાબલો પણ કેવો ડાખ્લો! સમજતો હતો કે પોતે છબી પડાવે છે. બરાબર ડાખ્લોમરો બનીને બેઠો હતો. મણી ગોદમાં બરાબર ફિલોફિટ સમાઈ જાય છે. હો! અને જાપાની ફિલોફિટને તો બચાવા ભુલવામાં જ પડી ગયા કે આ માનું કાંઈલે છે. હી-હી-હી.."

"તને તાડું કાંઈલે ગમે?" હેમકુવરે હંતી કરી.

"હી.. આ.. આ! કેમ ન ગમે? બહુ ગમે. મારા કાંઈલેને તો મારા મામા જેવો બધાદુર બનાવીશ એની જાંદે તો હું બરાબર મારું મામાના જેવું જ બિલ્લી-ધૂંદણું પડાવીશ."

"કોણ પાડે?"

"અમારા કુંગીઓ પાડે. મંતરી આપે. પછી એ બિલ્લી જેવો દૂરે, કોઈના હાથમાં ન આવે, કોઈના હાથે ન મરે. હું તો બાબલાનેય પડાવવા ગઈ'તી. પણ પાડી ન આયું."

"હાય હાય! આને તું ધૂંદણું પડાવવા ગઈ'તી!" હેમકુવરબહેન

ચોકી ઉઠાવ્યા.

"નહીં ત્યારે? મારા મામા સથા સાન જેવો એને શૂરવીર કરવું હતો. પણ કુંગી માન્યા નહીં. અમારા કુંગીઓ તો જબરા કામરું! આવાં આવાં કામજી જાડો. મામાને એમણે જ અજિત બનાવ્યા'તા. કાંઈ ફિલ્ડ, નહીં. હવે તો મારો કો-માંડુ મોટે ભાઈ માંડુ કુંગી બન્યો છે ના? એની પારે ધૂંદણું મંતરાવણું."

"માંડુ શું કુંગી બન્યો?"

"હા જ તો દોરથી સંટકી ગલ્યો છે, તે કે ઉંમણો જઈ કુંગી બન્યા. તે છુપો કુંગી હાં કે? કોઈને ખબર નથી. મને જ જણાવ્યું છે." આમ નીમ્યાની વાતોને થોભ નહોતો. ડૉ. નૈતમ દરદીઓને રજાળતાં મૂર્ખીને વારંવાર નીમ્યાની લિવેચના આલોચના સાંભળવા દરમાં માર્ગ માર્ગ હના; અને એની કલ્યાણ ભૂતકાળમાં જઈ જઈ જોતી હતી: પિતા જથ્યારે અહીં હથે, ત્યારે આજની બુઢુંકી ઢોરવે પણ આવતી જ

પ્રભુ પદ્મા  
ક આ જાપાનીએ  
સમજતો હતો ક  
નેટો હતો, માણ  
ની કોટેગ્રાફને  
છે. હી-લી-ની..

કાંઈને તો હ  
બરાબર માણું

હીલી જેવો હોડે,  
લાનેય પડાવવા

હેમકુંવરબહેન

શૂરવીર કરયો  
કામરુ! આવાં  
ન. કાંઈ ફિક્ર  
નંદો છે ના?

એ જઈ હુણી  
જથ્થાવ્યું છે."  
દરદીઓને  
મળવા ધરમા  
જોતી હતી:  
આવડી જ

## કુલ્લક

51

હો, પિતાની જોડે આવી વાતો કરતી હો, આવું જ માધુર્ય રેલાવતી  
હો, આવી જ નિષાવર બનતી હો, હું જો આ કો-સેવનો જ પુત્ર હોત,  
તો શું વધુ સારો, વધુ રૂપાણો, વધુ સુકુમાર ન બન્યો હોત! પિતાના  
છાંગ કંદયસંવેદનનોને ગૌતમ પોતાના અંતરમાં અનુભવી રહ્યો, એનું ડિલ  
એકલું એકલું બોલવા લાગ્યું:

નેટે પાત્ર બાંધીને પક્ષ બચત કરી પોતાના ટેઢ શાકાગારવા  
વસ્તાવેલાં આભરણોને ભલ્લી રમણીઓ પારકા બાળક પર ન્યોધાવર  
કરતી, બાળકને લાડ લડાવવામાં જે અગાધ સુખની પળો રેમને સાંપડી  
જતી તેને મુકાબલે સોનાં-હીરા શા હિસાબમાં હતો! ને બાળક સમ  
અમૃત્ય નિજ આભરણને પૃથ્વીકોટે પહેરાવતા ફ્યાશ પ્રભુ પોતે જ શું  
ઉડાઉ નહોતા? ભલ્લી નારીઓના કંઠની અવ્યક્ત વાણીને ઉકેલીએ તો  
આવા કોઈક ભાવો એમાં રમતા લાગે.

હેત અને નિષાવરપણાની આ છોળો ભલ્લી નારીને હેથે કોણે  
મૂર્તી? હજાર ખોળલાવાળી જળભરપૂર ઠિચાવઠી નહીંએ? ટીબરનાં ને  
ઘાસનાં અઢળક જંગલો વેરનારી સભરભર વનશીએ? કરોદના અગાણીત  
પાક આપતી વસુંધરાએ? કે બુદ્ધ ભગવાને?

ફ્યાને માલૂમ!

9

## કુલ્લક

ગ્રામેગામના હુંગી-ચાંટુ ખળભળી હાલ્યા હતા.

ફ્યાજીનાં મંહિરો કરતાં પાંચ-પાંચ દસ-દસ મહોનાં જૂમખાં  
આવેલાં હતાં. પ્રત્યેક મહિમાં હુંગાઓની મોટી સંખ્યા રહેતી.  
પીતવસ્ત્રધારી, મુંડન કરાવેલા, કરાલકણ હુંગીઓ.

દેવમૂર્તિઓના દેહ પર ભલદેશીઓ સોનપદ્મપાણાં જે પટરાં ચોડાનાં  
એની માત્રાની કુળાંઓની હતી. એ સાધુઓ રેલવે વાહનોના વ્યવહાર  
કરી શકતા, પેસાટક રાખી શકતા, મનગમતી વસ્તુઓ ખરીદી શકતા,  
શાસ્ત્રાભ્યાસની માયાકુટમાં જગ્યા ઉત્તરતા નહીં. ઠિન્ડિયસુખો પ્રત્યે જાણી  
સુગ રાખતા નહીં. શ્રદ્ધાળું પ્રજા એમને ગમતી. શાનવિવિધામાં અનુરક્તા  
કુળાંઓ હતા, પણ પ્રમાણમાં ઘણા થોડા.

બધી છાપાં તેમણે વાંચ્યાં હતાં. સુરતના કોઈ પટેલ નામે હિંદુ  
મુસ્લિમે પ્રકટ કરાવેલી સાત વર્ષ પૂર્વની એક ચોપડી તેમની પાસે પહોંચ્યી  
ગઈ હતી. એ ચોપડીમાં કુળાંઓના આચારવિચારો પર કાતિલ રોશની  
છિયેલી હતી. પણ તેની સામે ઠસ્વામનું પ્રતિપાદન હતું. હિંદમાં 'સંગીતા  
રસૂલ' લખનારની જે વલે થઈ હતી તે કરતાં ઘણી વધુ ભયકર  
પાનામરાણી આ લેખક-પ્રકાશકે અહીં પોતાની કોમને માયે નોતરી.  
કુળાંઓના પકોપની ઘણી છલકાઈ પડી.


યાંગાઉ નગરમાં કુળાંઓનું રોષ-સરધસ નીકળ્યું અને  
નગરવાસીઓમાં હાલકલો મર્યાદા ગઈ. જીવતી મશાલો જેવા સાધુઓએ  
નવે નવે આગ લગાડી. ધર્મનીનિંદા, પ્રભુ બુદ્ધના પંથની બદબોઈ: બાળક  
ભલી પ્રજા એ બદબોઈની બરદાસ્ત કરી ન શકી.

કુળાંસરધસનો રસ્તો ઝંધતી સરકારી પોલીસમાંથી એક ગોરા  
સાર્જનનું ખૂન થયું.

આખા દેશવ્યાપી કોમી સંહારને મંજૂર રાખતી લીલી જંડી રોપાઈ  
ગઈ. લાંબા કાળથી એકત્ર થયેલા દારુખાનામાં દીવાસળી ચંપાઈ ગઈ.  
“જ્યાં દેખો ત્યાં મુસ્લિમોને અને ઝેરબાદીઓને કાપી નાખો!!”  
કોઈક અનામી હાકલ પડી. “ન જોજો ઓરતો, બાળકો કે બુદ્ધાઓ..”

- અને હજારો તાતી ધા ઝેરબાદીઓ તેમ જ ભલીઓની  
બગલમાંથી ઉછળી પડી. નગરે, ગામે, ગામડે; મોલમીનથી માંડલે લગ્ન  
મરછી કાટનારી ધાએ માણસોને રેસ્યાં.

“બિનમુસ્લિમને અડકશો નહીં.” એ હતો ભલીઓનો આદેશ.



“બિનબમીઓને છેડશો નહીં.” એ હતી તેરબાદીઓની સૂચના. હિંદુઓ આમ બેઉ પકેથી સલામત હતા. શોલિતની સરિતાઓ વચ્ચે થઈને તેઓ ચાલ્યા જઈ શકે. પણ કોણ હિંદુ! કોણ કકા! જ્ઞાને ચઢેલી પ્રજા બે વચ્ચે ક્યાં બેદ સમજે? હિંદુઓ પણ ઘરમાં લપાઈ બેઠા હતા. બધી પડેશીઓ એમને રખી રહ્યા હતા.

\*

રતુભાઈ યાંગાઉમાં હતો. એજો મિલ બદલાવી હતી. રહેમાન રાઈસ મિલમાં એને નોકરી જડી હતી. એનાથી ઘર જાલીને બેસી ન રહેવાથું. એને એની જૂની મિલના એક મુસ્લિમની દશાનો ઉચાટ લાગ્યો. પોતે હિંદુ લેણે સલામત હતો. એજો જેટી પર જઈને પોતાની મિલની લાંઘની શોધ કરી. લાંઘ મૂકીને માણસો નાસી ગયા હતા. બાદ્યૂતી સંપાનો ઊભી ઊભી પાકીમાં જળકમળ જેવી ગૂલતી હતી.

“આરે છે અલ્યા ખનાન-ટો?” એજો એક સંપાનવાળાને સાદ કહ્યો.

“હા બાબુ! લાબા..” સંપાનવાળો બરમો હોંશે હોંશે હાજર થયો. સંપાન રતુભાઈને લઈને ઠરાવદીમાં ઊપડી.

બેએક માઈલની જળવાટ હતી. સંપાનમાં બે જ જણ હતા: એક રતુભાઈ, ન બીજો સંપાની બરમો. રતુભાઈ કોટપાટલુન અને હેટમાં હતા, સંપાની એક લુંગીભેર હતો. હલેસાં ચલાવતા એના ખુલ્લા હાથની ભુજાઓ પર માંસના ગણ્ણ રમતા હતા. છાતી ગજ એક પહોળી અને ગંડાના ચામડા જેવી નક્કર હતી. માથે ઘાંઉબાંઉ હતું.

રતુભાઈ અને એ બેઉ સામસામા હતા. સાગર-શી વિશાળ ઠરાવદીનાં મધ્યવહેણમાં નરી નિર્જનતા વચ્ચે રતુભાઈ જોતો હતો અને સંપાની સંપાનના બંડકમાંથી કશુંક શોધતો હતો.

પલમાં તો સંપાનીના પંજામાં ધા ઊપડતી દેખાઈ.

1. મલબારી મોપલા મુસ્લિમને બર્મામાં ‘કકા’ કહે છે.

“કેમ રે?” રતુભાઈને તો કશા ઓસાજા વગર લિનોફ કરેલા કરતું પૂછ્યું: “અહીં તો કોઈ મુસલમાન કે ઝેરબાદી નજરે પડતો નથી,

કોઈ સંપાન પણ નાણક નથી, ને તું કરે છે કેમ?”

“મીં કાકા, મીં ખોતોકલા,” સંપાનીએ જરાક વાર રહીને પૂખ શાંતિથી જવાબ વાળ્યો, તે વંચતે તેની આંખોમાં રતુભાઈએ ચાતા ટણીયું

કૂટા જોયા

“મીં કાકા!” (તું મોપલો મુસલમાન છો) “મીં ખોતોકલા!” (તું બંગાળી મુસ્લિમાંછો)

કલા એટલે સામે સાગરપારથી આવેલો હિંદી, “ખોતો” એટલે ‘કોથાપ’ (અર્થાત് ‘ક્યાં’) એવો શબ્દ વારંવાર બોલનાર હિંદી, એટલે કું  
બંગાળાનો ચટગાંબ બાજુનો મુસ્લિમ.

ઇરાવદીના ડહોળાં પાણીમાં સરી જતી સંપાન પર ઉચ્ચારાત્મા આ શબ્દી, અને આ લોખંડની ભોગળાંશ ખલાસી-પંજામાં બિડાયેલી ધા, બેઠુંને રતુભાઈની ને મોતની વરચેનું અંતર તસુભર જ કરી દીઘું હતું. બરમાની ધા દેખા દીઘા પછી કેટલા વેગે માણસને કાપે છે તેની એને ખબર હતી.

“તું ભૂલ કરે છે, નાવિક!” રતુભાઈએ ખામોશથી જવાબ વાળ્યો:

“હું હિંદુ છું.”

“નહીં, તું કાકા છો તારો લેબાસ હિંદુનો નથી.” ધા ટણાર થતી

હતી.

“નાવિક, આ લેબાસ તો અમારામાં સૌ કોઈ પહેરે છે..  
રતુભાઈની દલીલો હેઠળ છાતીના જડ્યી થડકાર છુપાયા હતા.

“બતાવ તારી ચોટલી..”

“અરે ભાઈ, બધા હિંદુ ચોટલી રાખતા નથી..”

“તો બતાવ જનોઈ..”

“ગાંડા, જનોઈ પણ અમુક હિંદુ જ પહેરે છે..”

“તો ખોલ તારું પાટલૂન..”

પ્રભુ પદ્માવતિ  
 વન્દેદ કરતો  
 પડતો નથી  
 રહીને પૂર્ણ  
 વાતા ટક્કોયા  
 કલા! (ત)  
 એટલે  
 એટલે કે  
 ચરાતા આ  
 બેલી ધ્યા  
 દીધું હતું  
 નેની એને  
 . વાખ્યો:  
 સાર થતી  
 રે છું

કાલ્પનિક

..કુમ?" રતુભાઈ ન સમજ્યા.  
 ..દેહ દેખાડ, જોવા દે સુન્નત છે કે નહીં." યાદોબોળ બરમો  
 નશયને દેઢ કરી ચૂક્યો હતો.  
 "નાવિક, હું તને ખરું કહું છું કે મારે સુન્નત નથી, મારી એબ  
 જોવાનો આગ્રહ છીડી છે. અને હું કહું એમ ખાતરી કર. તું કિનારે જ  
 મને આ સંયાનમાં મૂકી રાખીને ખનાન-ઠોની કોઈ પણ મિલમાં જઈ  
 ખાતરી કર. મારું નામ દેજે, ને પૂછજે કે રતુભાલુ હિંદુ છે કે મુસ્લિમ.  
 પછી તને ખાતરી ન થાય તો મને ઓંદી પાછો આવીને મારી નાખજે.  
 તને કોઈ નહીં રોકે. મારું નામ સૌ જાણે છે. ચોથી મિલમાં હું મેનેજર છું.  
 હું તારે પહેલી મિલમાં જઈને પૂછી આવ; નહીંતર તું મને કાપી નાખીશ  
 રે પછી જો તને સત્યની ખબર પડશે, તું જ્યારે મારા મુદ્દાની એબ  
 શે, ત્યારે તને કેટલો પસ્તાવો થશે તેનો તું વિચાર કર. પછી વાત  
 તાર હાથમાં નહીં રહે."  
 બરમો સહેજ વિચારમાં થંબ્યો. વળી એણે કહ્યું, "તો તને શરીર  
 ખુલ્યું કરતાં શું થાય છે?"  
 "નાવિક," રતુભાઈને લાગ્યું કે પોતાનો હાથ કંઈક ઉપર આવ્યો  
 છે એટલે એનામાં વધુ સમજાવટ કરવાના હોશ પ્રગટ્યા; "અમે હિંદુ,  
 અમારી એબ ઉઘાડી કરવામાં મહાપાપ સમજ્યાએ. અમે એવી  
 જનેતાઓના બેટાઓ છીએ, કે જેમણે પોતાની એબ દેખાડવા કરતાં  
 જીવતી સળગી જવું પસંદ કર્યું છે. અમે તારા કૃપાળુ પ્રભુ ગૌતમના  
 દેશના છીએ, કે જેમણે જગતના એક જીવડાને પણ ન હણવાનો સુભોધ  
 દીધો છે. અમે ગુજરાતીઓ છીએ. કીડીનેય ચંગાતાં પાપ ગણીએ છીએ.  
 એબ જોવી ને એબ દેખાડવી, બેઉ અમારે મન મહાપાપ છે."

"તું બહુ મીઠુ મીઠુ બમી બોલી શકે છે!" એ શબ્દો સાથે

- આ બુલ્લડમાં માણસોને નન કરાવી સુન્નત છે કે નહીં તેની ખાતરી  
 બહીજનોએ કરી હતી અને ચાંદીના રોગે પીડાતા કેટલાક હિંદુઓને પણ  
 સુન્નત ધારણ કરનાર મુસ્લિમો માની હાર મારેલા.

નાવિકની ઘા પરની પકડ હીઠી પડી એકો કહું, “આજે સવારથી આ સંપાનમાં મેં પાંચ કાકાને કાપી નાખી છિરાવદીમાં ફેંકી દીધા છે, પણ તું છુટો મારા માથાનો મળ્યો!”

“આઈ, હું તો હિંદુ છું. પણ ધાર કે હું મુસ્લિમ હોત, તોયે મન

મારીને તું શું લાભ ખાતર?”

“હિંમા.” નાવિકને એક જ શબ્દ સૂચાયો.

“ધર્મ?” રતુભાઈએ સારે પૂછાયું.

“હા, બૌદ્ધનો હિંમા! ગોઢમાનો હિંમા!”

“નહીં રે નહીં. એ ધર્મ ગૌતમ બુદ્ધનો ન હોય. કોઈક ક્ષાંક ભૂલ ખાધી છે ને ભૂલ ખવરાવી છે. ઐર! બસ હવે તો તું મને આ પહેલી મિલમાં જ ઉત્પારી દે.”

“નહીં રે, હવે તો તને હું તરી મિલમાં જ મૂકી જઈશ. હવે તું

કર ના.”

“તો કહે નાવિક, કલીકમાં મલ્લી બાને?” (હવે લબાડી નહીં કર ને?)

“હવે કલીકમાં કરું નહીં કરી, બાબુ! માનું દિલ ખાતરી પાસ્યું છે કે તું કાકા કે ખોતોકલા નથી, તું બાબુ છે; તારો વાળ પણ વાંકો નથી કરું. ફ્યા સુ.”

ફ્યા સુ (પ્રભુના સોગંદ) કથા પછી બરમો દંગો દેતો નથી, સર્વ વાતોનું પૂર્ણવિરામ ‘ફ્યા સુ’.

“બસ, તો પછી મને પહેલી જ મિલમાં ઉત્પારી દે.”

“પણ શા માટે?”

“તું નથી જાગતો કે ચોથી મિલ કોની છે?”

“હા... હા... હા, બાબુ! એ તો ખોતોકલાની, તું ત્યાં કામ

કરે છો?”

“હા, ભાઈ. એ અમારા હિંદુ માલિક કરતાં વધુ ઉદાર માલિક છે. પણ તને હું ત્યાં નહીં લઈ જાઉ.”

બૃહા  
..કુમા  
..કુદા  
પ્ર. તે મને  
જ મિલે ઉત્ત  
પોતા  
..હવે તું ના  
..ના,  
..ચાલ  
ખાતો જ.  
..કલી  
નાવિકનો વ  
..ફય  
દાર  
શૈહરીમલ-સ  
વળાયો, તે  
..કાકાને કા  
..આ  
પહેલો જ  
..શિ  
..અ  
..સા  
રતુ

પ્રભુ પદ્મા  
સવારથી આ  
દીધા છે, પણ  
તે, તો એ મને

કોઈક ક્ષયં  
તું મને આ  
દીશ, હવે તું

ડી નહીં કર  
રી પાણું છે  
વાંકો નહીં

નહીં, સર્વ

ત્યા કામ

પાલિક છે.

કૃત્તિક

57

“ક્રમ?”

“કદાચ ત્યાંનો કોઈ મુલિલમ તને કાંઈ કરે, તો મારે જાન જ ઢેવો  
43. તું મને જીવતદાન દીધું છે, પણ બીજા તને ન હે તો? મને પહેલી  
જ મિતે ઉત્પાર.”

પોતાની આગળી મિલના ઘાટ પર ઉત્તરીને રતુભાઈએ કહું:

“તું નાસ્તો કરવા ચાલ અંદર.”

“ના, બાબુ.” બરમો જંખવાયો.

“ચાલ, તને કોઈ ન છે. હું બેગો છું. મારું દિલ છે કે તું કાંઈક  
આતો જા. અહીં કોઈ મુસલમીન નથી.”

“કલીકમાં મલ્લો બાને!” (લલાડી કરતો નહીં હો કે) આ વખતે  
નાવિકનો વારો હતો.

“હ્યા સુ.” રતુભાઈએ શપથ ખાધા.

ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની  
જીહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાણું, વધુ નાણાં આપી  
વળાવ્યો, તે વખતે પાછળી બાજુ કણા કિક્કિયારા સંભળતા હતા:  
“કાકાને કાપો!” “કુંગીઓને કાપો!”

“આપણો અલી કયાં છે?” રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને  
પહેલો જ પ્રશ્ન આ કર્યો.

“શિવશંકર એને ઘેર લઈ ગયા છે.”

“અલીની બર્મી સરી?”

“સાથે જ ગઈ છે.”

રતુભાઈને ફાળ પડી.

## પ્રેમ-મંત્ર

રતુભાઈએ શિવશંકરના ઘર તરફ ઝડપ કરી.  
 કૃક્ષિયારા અને ખૂનરેણુની વચ્ચે થઈને એ ચાલ્યો જતો હતો.  
 છાત્રી થડક થડક થતી હતી. પણ મોરો સાવજનો રાખીને એ ચાલ્યો.  
 જેમ શિવશંકરનું ઘર નજીક આવતું ગયું તેમ તેમ એને ક્ષણ  
 પડતી ગઈ. કૃક્ષિયારા એ દિશામાંથી જ આવતા હતા. ટોળાં એ જ  
 લાટામાં ધૂમાધૂમ કરતાં હતાં. જ્યાં જુઓ ત્યાં ધા ઉછળતી હતી.  
 અસ્સરા-ભુવન જેવો બ્રહ્મદેશ નવી સરજાવેલ નરક-શો ભાસતો હતો.  
 ઘર સામે પહોંચતાં જ રતુભાઈના મોતિયા મરી ગયા. જબરદસ્ત  
 ટોળું ધા ઉછળતું એ જ બારણે ખડું હતું. બારણાં બહાર ઊભો ઊભો  
 શિવશંકર એ ટોળાના અગ્રણી એક જન્મને ટપકતા કુંગળીને હાથ જોડી  
 અંદર પેસતો વારતો હતો.  
 “હુઠી જા,” કુંગળી ધા છિલોળીને ફરમાવતો હતો: “તારા ઘરમાં  
 જ ગયો છે એ કાકા.”

“હ્યાને ખાતર અટકો. મારી લાજ લો નહીં.”  
 “તોડો, કાપો, આગ લગાવો અના ઘરને. એ આંહી જ  
 છુપાયાં છે.” ટોળું પોતાના કુંગળી પાસે તરિત પગલું માગતું હતું.  
 રતુભાઈ નજીક જતો હતો. પણ કુંગળીનું મોં જોઈ શકતો ન હતો.  
 નિરદી કુંગળીને વિંટળી વળીને ખીચોખીય ઊભી હતી.  
 કોણ જાડો કેમ, પણ રતુભાઈના કાનને આંખો ઝૂટી. એજે  
 અવાજમાં ઓળખાડા ઉકેલી. પણ બોલનાર કુંગળીનું સ્મરણ થયું નહીં.  
 કાકલૂદી કરતા શિવશંકરને ઘડેલી દઈને કુંગળી ઉપર ચડવા ગયો,  
 શિવશંકર ગડથોળું ખાઈ ગયો. એક કણ - અને ધસારો કરતું ટોળું  
 એને ચંગાઈ નાખત. પણ તે કાંઈ બને તે પૂર્વે આ મેડી પરથી એક  
 યુવાન સ્ત્રી સડસડાટ ઊતરતી - ઊતરતી નહીં, પણ જાડો કે સરકતી

- કોઈ પક્ષી ઉત્તરે તેમ આવીને નીચે ઊભી રહી ને આપણા હથ ધરીને બોલી:

“તિખાંબા ફ્યા! તિખાંબા!” (શાંત થાઓ, પ્રભુ! દ્વા કરો!)  
પરિચિત સ્વર કરે પડતાં જ કુંગળનો ધસારો તૂરી પડ્યો, એ

ચમક્યો “કોકા...”

“હાઉકે માંઉ!” (હા એ જ, ઓ માંઉ!)

‘માંઉ’ એ શાંત રતુભાઈને પણ સ્મરણ-દ્વારે જાગે ઘંટડી રજાકાવી.

કુંગળ જોઈ રહ્યો. આ સ્ત્રી! ગુજરાતી સાડીનું અંગારોઢણું, છૂટી વેણી, કાપાળે કંકુનો ચાંદલો: આ કોકા? મોં બમ્મા, વાણી ઠિચાવદીના અંતસ્તલમાંથી ઉઠતી હોય તેવી, અવાજ બ્રહ્મદેશના ધ્યારા પુનિત હાંઉ (મધૂર)-શો મીઠો, નાક ચીબું, છાતી સાપાટ, આ કોકા?

કુંગળની ધા નીચી ટળી.

“એમને પ્રથમ ઉભા કરો, કો-માંઉ! એ મારા પતિ છે.” સ્ત્રીએ ચગદાતા પડેલા શિવશંકર તરફ અંગળી ચીધાડી.

પણ રતુભાઈ શિવશંકરની નજીક પહોંચી ગયો હતો. એની મદદથી ઉભા થતા શિવશંકરે હર્ષવિશેમાં કહ્યું: “રતુભાઈ, તમે! પહોંચ્યા!”

રતુભાઈ નામ સાંભળીને સ્ત્રીએ પોતાની સાડી સંકોડી. પતિએ વાતો કરી હતી. એક વાર આવેલ ત્યારે દીદાર પણ કર્યા નહોત્તા. ફરી આવવાનો હતો. અત્યારે વખતસર આવ્યો છે!

“હવે તમે એકલા આંહી આવો, ફ્યા!” સ્ત્રીએ કુંગળને કહ્યું,  
“અને પછી જેને શોધો છો તેને લઈ જજો.”

કુંગળ વેશધારી માંઉને રતુભાઈએ નિહાળ્યો યાદ આવ્યું: આ તો પીમનાવાળી સોનાં કડીનો પુત્ર, ‘ઢો ભમા’ તખીન પક્ષનો અનુયાયી, તે રાત્રીએ ડો. નૌતમને ધેર દીઠેલો તે યુવાન! આંહી ક્યાંથી! કુંગળ ક્યારે બન્યો! એને આ સ્ત્રી ક્યાંથી ઓળખે?

ટેણું પોતાની મેળે જ જરા આવે ખસી ગયું. કુંગળ શિવશંકર

અને રત્નભાઈ મેરી ઉપર ચક્કા  
“અને ધોળો તો નહીં આપે ને?” હોળામાંથી એક બજી  
અનુધયાદીએ બીક બતાવી

“મગફૂર નથી કોઈની!” બીજાએ કહ્યું, “આ ઊરીનો સંયા સાનું  
ધ્યાયાવાચીવાળા સગ્યા છે. એની માફક આણે પણ પીઠ પર અભય  
ધૂંદણું મંત્રાયું છે. એના પર કોઈની ધાનો ઘા છુટે જ નહીં!”

“ધાનો ઘા ન છુટે, પણ વાંસની અહીં કોઈ ધોંચી દે તો!”  
બજી લોકો માનતા કે કુણી લોકો અમુક ધૂંદણાં મંતરીને ગોજી  
આપે તો તે માણસને બીજું કોઈ હથિયાર ન વાગે, ફક્ત વાંસની અહીં  
વાગે, વાંસ કોઈ મંત્રના કશીકરણના કાબૂમાં આવતો નથી.

“અરે ઘેલા થાઓ ના, ઘેલા!” બીજાએ કહ્યું. “આપજાને સૌને  
ઠોં ખવરાવનાર પોતે શું કમ હશે!”

ઠોં એટલે ચૂનાની મંતરેલી ગોળી. આ હુલ્લડ વખતે કુણીઓ  
હોળામાંના સૌને ઠોં ખવડાવતા હતા, અને એમ મનાતું હતું કે ઠોં ખાય  
તરે ઘા વાગે નહીં.

“કો-માંઉ!” ગુજરાતજારેશી બજીએ ઘરમાં આવી સીનો ટકાર  
કરીને કહ્યું: “હવે તો યાદ આવે છે ને?”

“હું અહીં?” કુણીનો સ્વર મૃહુતાભેર ધૂજયો.

“હા, અહીં છું. તમારા વિચારો તમે તે રાત્રીએ ઠાલવ્યા તે પછી  
હું મારે ન્યારે માર્ગ વળ્યું ગઈ છું. હું તમારી સ્ત્રી ન બની શકી, તો હું  
એક બાબુની સ્ત્રી બની છું. તમે છોડી...”

“પણ અહીં શી રીતે?”

“મજૂરણ બની હતી ચાવલ-મિલમાં એ તો પત્યું. પણ હવે શો

વિચાર છે?”

“એ કાકાને, એ ખોતોકલાને બહાર નિકાલો.”

“રહો, કો-માંઉ!” એમ કહી સ્ત્રી ઘરમાં જઈ, પાછી આવી. એના  
હાથમાં ઘા હતી. એ બતાવીને એણે કહ્યું: “ચાલો નીચે. અહીં તો

પ્રેમ-અનુ

સંકદ છે. આપણે બંને એક વાર ધરાએ મેલીએ. મારું મુડું તમારાં  
ચરણોમાં પડે તે પછી લઈ જાઓ તમારાં અપરાધીઓને!"

પોતાની સામે એક સ્વીને ધા ઉદ્ઘાવતી દેખી જુવાન કુંગી થડક્યો.  
એણે પૂછ્યું: "કોણ છે એ?"

"છે મારા જ જેવાં: નર છે કલા અને નારી છે બહી. ને કોન્માઉ! એમનો ઈષ્ટદેવ છે પ્રેમ. બહી નારીઓએ પ્રેમના કરતાં કોઈ બીજું  
વાતને ઊંચું આસન આપ્યું નથી. કુળને કે કુળપરંપરાને, વગને કે  
દરજાને, માબાપની મરજી કે દબાજાને, હીરા, હેમ કે સંપત્તિને,  
મો'લાતોને, કોઈ કરતાં કોઈને બર્માં નારીએ પોતાનું જીવન નથી આપ્યું.  
આ નારીએ પણ એ જ કર્યું છે. એ વટલાઈને મુસ્લિમને વરી નથી. એ  
પરદાબીબી બની નથી. એ આજાદ રહી છે. એણે પરધર્મ સ્વીકારી  
નિજ્યધર્મને ત્યાર્યો નથી. એણે બલદેશની સર્વોપરી પરંપરાના ઈષ્ટદેવ  
પ્રેમને ઉપાસ્યો છે. એ જો અપરાધ હોય તો ભલે કટકા કરો. - પણ  
પહેલાં કાં મારા ને કાં તમારા ટુકડા પડે તે પછી..."

કુંગીના બેઉ હાથ પીઠ પછવાડે લિંગાયા. ત્યાં પાછળ ધા ગૂલતી  
રહી. એણે કહ્યું: "તું ભાડોલી-ગાડોલી થઈને દેશનો પ્રાણપ્રાણ સમજી જ  
નહીં!"

"પહેલાં એ કુંગીઓને સમજાવો, ઉઝી! કહો એમને કે દેશને  
સમજે, દેહને એકલાને જ ઉપાસતા અટકે. હ્મા! ધા ન હોય તમારા  
હૃથમાં; તમારા કરમાં તો શાંતિ-અહિસાનું કમલ શોભે."

"આજે તો જાઉ છું."

"હા, ને હું ચરણોમાં વંદું છું, ઇયા! એક વારના આપણા સ્નેહનું  
પગાઉ વૃક્ષ આજની આપહીં કરુણાધારે સિંચાઈને નવપલ્લવિત રહેશે.  
થોડી વાર ઊભા રહો."

અંદર જઈને ઘોડિયામાંથી એ પોતાના નાના બાળકને લઈ આવી  
અને સાધુના ચરણોમાં નમાયું.

આશીર્વાદના ધર્મબોલ કુંગીની જીબ પર ન ચડી શક્યા. એના

માંથી એક બમ્બા  
જી તો સથા સાન  
પીઠ પર અભય  
જ નહીં!"  
ચી દે તો!"

મંતરીને રોકી  
તાં વાંસની અજી  
ને નથી.  
"આપણને સીને

વખતે કુંગીઓએ  
હતું કે ઠોડી ખાય

વી સીનો ટકાર

નાલબ્યા તે પછી  
ની શકી, તો હું

પણ હવે શો

આવી. એના  
ચે. અહીં તો

કરડા મોં પર પહેલી જ વાર કુમારની ટથારો છુટી.

“ને જરા વધુ થોલો,” કહીને એ અંદરથી બે જગતને બોલવતી લાવી ચટગાવના મુસ્લિમ અલીને અને એની બમ્મી ઓરતને.

“આનીએ વંદના સ્વીકારો, ધર્મપાલ! ને નિહાળો, એનાં મોં પર

છે કોઈ કોમ કે પંથ?”

“આખું છુટી” કુળી બોલ્યો, “આ કલાકાકા આજે દીનતાની મૂર્તિ છે, પણ એ આંદોં એનું રક્તબીજ મૂક્તો જશે - ઝેરબાદી બાળરૂપે એ આજે અમૃત હશે, કાલે એની ઓલાદ વિષનિંદુ બની આપણું જીવતરમાં રેડાશે. તમાંનું સ્ત્રીઓનું સેહસ્વાતંત્ર્ય તમને આજે પ્રિય છે.

મને દેશનું દેહસ્વાતંત્ર્ય સર્વોપરી લાગે છે.”

“આપણા વર્યેનો એ મતલેદ: એ પર જ આપણે ધૂટાં પડ્યાં..”

“આજે પણ એ લેદ પર આપણે વિદાય લઈએ. હું તો એ પાપને

ઉચ્છેદવા જ જીવિશ ને મરીશ..”

“કુલૂલ છે. પણ જલ્લાદારી કરીને ઉચ્છેદી શકશો? પાંચને

કાપશો, પચીસને, પાંચસોને... કેટલાને?”

“વાતો નકામી છે. પણ આજે હું હાર્યો છુટી, રજા લઉં છુટી..”

કહીને કુળી હેઠે ઉત્તરી ગયો, ટોળાને દૂરદૂર દોરી ચાલ્યો ગયો, ગડગડતા જતા વાદળા જેવું લોકવૃદ્ધ ‘ઢો ભમા’ની ગર્જનાને કયાંય સુધી પાછળ મૂક્તં ગયું.

તે પછી શિવશંકરની સ્ત્રીએ મુખવાસનો દાબડો લાવી, ઘૂંઠણભર થઈ, નમીને રતુભાઈની સામે ઘર્યો. રતુભાઈની મીઠ હજુ નાનકડા બાળક પર ઠરી હતી. એ શિવશંકરને કહેતો હતો: “આને ગુજરાતી બનાવવો છે, કે બરમો?”

“બરમો..”

“ના, એ બાબુ જ બનશો.” સ્ત્રી મીઠ કંઠે બોલી.

“પણ એને કોઈ ગુજરાતી દીકરી નહીં દે!”

“પચીસ વર્ષ પછી પણ?” સ્ત્રી હસેલી.

..“પચીસ વર્ષોથ અમે નહીં પલટીએ, દુનિયા ભવે પલટી ગઈ

તોય.”

..“પણ અહીંથી ગુજરાત જવું જ છે કયા ભાઈને?” શિવશાંકરે

જીવે કે સોગંદલીધા.

..“આ હો ભમાવાળાની સરકાર થશે અને કાયદો કરીને કાઢ્યો

તો?”

..“તોય નહીં જઈએ.” શિવનો નિશ્ચય હતો..

..“અમે રોટલી લાંબી ચિંતા કરતાં નથી.. અમે તો ભ્રમાઓ..”

શિવની પત્ની બોલી.

..“બાળક જેવાં!” રતુભાઈએ મર્મ કર્યો.

..“બહુ મધુર દશા,” સ્ત્રી બોલી, “થપાટ મારી કોઈ રડાવે તોય

. પાછા પળ પછી એને ખોળે બેસીને ખેલીએ..”

..“પણ તમારી ધા તો સાથે ને સાથે જ ના!”

..“એ જ અમારું બાળકપણું ધા ન હોત તો અમારો પ્રેમ અને

અમારી લાલાઈ પણ કયાંથી હોત?”

..“ચાલો. હવે આજ તો જમાડશો ને?”

..“હા જ તો. હમણાં રોટલી કરી નાખું છું..”

..“રોટલી પણ વણો છો? ત્યારે તો પેંટું બાળકપણું ગુમાવ્યું!”

..“કયું?”

..“હંડીમાં પાકી ને ચોખા નાખી, ચૂલે ચડાવી, બહાર લટારે

નીકળી પડવાનું. કૂલો ને આભૂષણો લીધા કરવાનું..”

..“પણ રોટલીની બધી જ કિયાઓ બાળકની જ કીડા જેવી છે. હું

કુંઈ એમને ગુજરાતી ખાણું ખવરાવવા ખાતર નથી કરતો, હું તો બાળક

જેવી થઈને રોટલીએ રમું છું..”

..“શિવા!” રતુભાઈએ ગુજરાતીમાં કહ્યું, “તારો સંસાર પાકે પાવે

ચણાયો છે..”

..“મને તો એ કંઈ વિચારો જ નથી આવતા. મૂળાને પાંદડે મોજ

કરું છું હું તો.” શિવશંકરે પત્ની સામે જોયું.

“ત્યારે તો તું ખરો બરમો બન્યો કાંઈક ધંધો મૂકી દેતો નહીં..  
..” “શા મારે નહીં? આ રળવા માટે એટલી વાત જોઉ છું!..

“કાઈ ધંધો માટેલ છે?”

“હા, એની માનું હાડકું સંભાળશે. પછી તો મારે નિરાતે બાધવું  
છે, બેઠા બેઠા લાંબામાં લાંબી સવૈ (ચિરૂટ) ચૂસ્યા કરવી છે. હિંદમાં તો  
હેરાન થઈ ગયા. રળી રળીને એકલા તૂટી મરીએ. સ્ત્રી આપણે ઐસે  
શાશગારો કર્યા કરે ને છોકરાં જાણ્યાં કરે. મોતની ઘડી સુધી કોઈ દી  
ખાશ કરીને બેસવા ન પામીએ. હું તો ભાઈસા'લ, એ હિસાબે ન્યાલ  
થયો છું.”

“એ તો ઠિક, પણ આ બેઉને તો હવે ઠેકાણે પહોંચતાં કરો!..  
સ્તુભાઈએ ડેબતાઈ ગયેલા અલી અને એની બર્મા સ્ત્રી વિશે કહ્યું.

“નહીં” શિવની સ્ત્રીએ કહ્યું, “એ વધુમાં વધુ આંહી જ  
સલામત છે. અમે બર્મા સ્ત્રીઓ છીએ. આસપાસ કોઈ સલામતીનું  
ઠેકાણું નથી, ને આંહીંથી કુંગળી પાણ ફરેલ છે એ વાત જાણ્યા પછી  
કોઈ નજીક પણ નહીં આવે. તેમ ઇતાં મરવાનું હશે તો સહુ બેળાં  
હશું.”

“પણ અલીને એકલાને...”

“ના, હું એકલો તો ડગાણું પણ નથી દેવાનો. મારે હવે એકલા  
જીવીને શું કરતું છે?” અલી બોલી ઉઠ્યો.

પછી તો શિવની પત્નીએ રાંધ્યું ને સૌ જમી ઉઠ્યાં. સ્તુભાઈએ  
શિવને ગુજરાતીમાં પૂછ્યું: “એલા, આ માંઊ અને તારી પત્ની વચ્ચે  
કાંઈક ઇતિહાસ લાગે છે!”

“હા, એ પણ એઝો મને કહેલું, કોઈ વાતે એઝો મને અંધારામાં  
રાખ્યો નથી. રંગૂનમાં બેઉ ભણતાં હતાં. માંઊ કોલેજમાં હતો ને આ  
હાઈસ્કૂલમાં સાતમી ભણતી હતી. માંઊ વળી ગયો ઉગ્ર ઉદ્ઘામ વિચાર  
તરફ; માંઊ કહે કે તારે નૃત્ય કરવું નહીં. આ કહે કે નૃત્ય તો મારા

નું  
દેતો નથી..  
નેં છું!!

નિરાસ જાંધવું  
છ. હિંદમાં તો  
આપણે એસે  
સુધી કોઈ દી  
હિસાબે ન્યાબ

ન્યાચાં કરો!!  
વિશે કલ્યાણ  
કું આંદ્રી જ  
સલામતીનું  
જાણ્યા પછી  
સહુ ભેળા

### ગ્રંથ દિવસ

65

કલમા છ. કોચેઈનું નૃત્યમંડળ આંદ્રી આલ્યું તો તેના તિન્જામ  
પે(ઠન્ડાલીના નૃત્યનાટક)માં જવાની માંઉએ એને ના પાડી એના માણા  
ઉપર થઈને એ તિન્જામ પ્રેમાં આવી હતી. હું પણ ત્યા ગણો હતો.  
અમારો ગેણાપ ત્યા થયેલો. તે પછી જ એ આપણી મિલમાં થોડા દિવસ  
મજૂરી કરી ગઈ. એને અમે ચાવલ સૂક્કવતાં સૂક્કવતાં વધુ નિકટ આવ્યા..

“ત્યારે તો એ ભજોલી છે. એથી કોકડું ગુંચવાનું નથી ને??”

“ના, ઊલંડું સરલ બને છે.”

“નૃત્યમાં જાય છે??”

“હવે નથી જતી..”

“કેમ??”

“મોં એની નૃત્ય કરવાની સ્વતંત્રતા કબૂલ રાખી એટલે..”

“એ જ ખરો ઉકેલ છે. બંધન ન મૂકો તો આપોઓએપ સંતુષ્ટ

રહે છે કેટલીક સ્ત્રીઓ..”

રાત ત્યા વિતાવી, વળતા દિવસે હુલ્લડ શાંત પડ્યા પછી જ આ  
ગાનકડો કુંભ-મેળો વીખરાયો.

11

### ત્રણ દિવસ

મૈઠીયા મયુ  
ને મૈઠીયા મયુ  
લેંઓ નાભા ઘેભવ ભારેદુ  
શાફવે તોંજા  
યાંગૂન મયોદુ

(એક બર્મી લોકગીત)

હું એવી સ્વીને પરલોલા  
હું કેવી સ્વીને પરલોલા?  
જે સ્વીને પાંચ કર્મને પાળવાની હોય  
એવીને હું પાંચુનાંટ્રોનામાંથી જ મેળવાશ.

\*

ક્રિટિક દિવસથી નીમ્યા ડૉ. નૌતમને ઘેર ફરકતી નહોતી  
હેમકુવરબહેનનો બટક વારંવાર દાદરે દોડાંનો જતો ને વાટ જોતો બજારમાં  
જઈ હુકાનની ભણી લલનાંનોનું લાલન પામવાની એને લત પરી  
ગઈ હતી. હેમકુવરબહેનને પણ હવે તો ખાતરી થઈ હતી કે બેએક  
વર્ષ સુધી પતિને કોઈએ પોપટ કે ઘેરો બનાવી મૂકેલ નથી, તેમ બટક  
પણ એકેય વાર આ જુવાનજોધ અસરાઓથી નજરાયો નથી, એટલે  
એમને પણ નીમ્યાનું અલોપ થવું ગમતું નહોતું. એને ખરેખર ચેન પડતું  
નહોતું. હવે તો પોતે પણ કડકડાટ બર્મા બોલતાં હતાં. નીમ્યાને જોડે  
લઈ શહેરની બજારે બજારે ઘૂમતાં હતાં. નીમ્યા ભેગી હોય પછી કોઈના  
બાપની લિક નહીં. કોઈ વાર ચાંદનીભરી રાત નીમ્યાને કાઠિયાવાડી  
વસ્ત્રો પહેરાવી અને પોતે બર્મા લુંગી અંજી ધારણ કરી ચૂપકીદીથી  
બધાર ફરી પણ આવતાં.

એ તો ટીક, પણ બાબલાને તો બચીઓ વરસાવી અકળાવી  
નાખતી અને ઊંચે-નીચે ફંગળતી નીમ્યા હવે બાબલા વગર રહી કેમ  
કરીને શકતી હશે!

ત્રણાચાર દિવસ થઈ ગયા.

પાંચેક દિવસ પર પોતે આવી હતી. પૂછાં હતું હેમકુવરબહેનને,  
“તમારા ઘરમાં ત્રણેક દિવસ રહેવું હોય તો રાખો કે નહીં?”  
“કેમ ન રાખું?”

“પણ લાગટ ત્રણ દિવસ ને ત્રણ રાત!”

રાતનું રોકાણ ફણ પડાવે તેવું હતું. આ ડોક્ટરોનું કંઈ કહેવાય  
છે, જ્યાં! — એમ હેમકુવરબહેન વિચારતાં રહ્યાં, ત્યાં તો નીમ્યા બોલી:

“એકલી નહીં હોઉં છે. મારો જોડે કોઈક હો..” કહેતો કહેતો એ  
નહીં પડી હતી.  
“તો તો કેમ રાખી શકાય? કોણ હરો જોડે? તારો માતાપિતા  
જે છું પડે તો રાખું.”  
“ના, એમને તો કહેવાનું જ નહીં. એ શોધવા આવે તોપણ પણો

અપવાનો નહીં.”  
વિમાસલમાં પડી ગવેલાં હેમકુંવરબહેને કહ્યું: “હું ડોક્ટરને પૂછ્યું..”  
“ના, એમને તો પૂછ્યશો જ નહીં. કાઈ નહીં. હું તો અમસતી  
અમસતી પૂછ્યી હતી..”

“પણ વાત શી છે?”  
“કાઈ નહીં. ખાલી ગમ્મત કરતી હતી.” એમ કહીને નીમ્યા  
ખાલી નીકળેલી.

એક સંચે બાબલો બષુ બષુ રોવા લાગ્યો, એટલે હેમકુંવરબહેન  
કુંકરને લઈ સોનાંકડીને ઘેર ચાલ્યાં. નૌતમ પોતે રાત્રિસ્વભાવનો પારખુ  
દીલો, એટલે નીમ્યા નથી આવતી એ પોતાને પણ સાલેલું તે છત્તા પોતે  
દરમાં એ વાત ઉચ્ચારેલી નહીં. હેમકુંવરે કહ્યું તેના જવાબમાં એ ફક્ત  
જેણું જ બોલેલ: “વાસુ! ચાલો, જઈ આવીએ..”

“ચાલા!” નીમ્યાની માતાએ મહેમાનાનું સ્વાગત કર્યું અને પતિ  
અગ્નિચામાં હતો ત્યાં એ ઢોરી ગઈ.

“જોયું, હાથથડી!” દાક્તરે પટીને કહ્યું. “તમે કાઢો લાંબા ધૂમટા,  
જે પણી લફર લફર લુગડે પુરુષોની પડાયે થઈને જતાં લાજો નહિં;  
તે આજે તસોતસ લુંગી પહેરી છે, સાંકડી લુંગીમાં જકડાયેલા પગ માંડ  
દીન્યે ડગલાં ભરી શકે છે, બુઝ્યી ખોખર થઈ ગઈ છે, છતાં કેટલી  
સ્ફૂર્તિમાન છે! કેટલી સંકોડાઈને ચાલે છે!”

હેમકુંવરબહેનનું હાર્ય પણ એના દેહ જેવું જ ગૌર અને ગરવું  
કર્યું; એણે છણકો કરવાને બદલે હસીને કહ્યું, “આટલા વખતે પણ હજુ  
આપની સરખામણી પૂરી ન થઈ. એક સલ્લા ભરો તો હું જહેર કર્યું કે

ગુજરાતમાં બર્મા પોશાક કાપવો કરીને દાખલ કરાવો. બાકી કોઈ હી કાઉટિયાફી કે મેરાથી જોઈ છે? પણ મદદાં ચીરે તેને દોષો કાઢવા રિન્સ શું સૂઝે!"

હેમકુવરલહેને આગળ ચાલતાં ચાલતાં પોતાનું શરીર ડેલવાને પાછળ મરોડકું, એટલે દાક્તર સાહેબે કબૂલ કર્યું: "છે - ખરેખરું, ગુજરાતખોમાં શાશ્વતારની કળા છે!

"પરાયા દેશોનાં દૂધલા જોનારી પરગજુ આંખો અને પણયાં ભૂખણ્ણોમાં જ અંજાઈ જનારી આંખો, વેળ આંખો નાંસી છે."

"એ નાંસાનું નસ્તર તમે અચદી તરહથી કર્યું મારાં સર્જનના!..  
"નસ્તર થયું હોય તો હવે બેહને સીધી નજરે જ જુઓ અને  
માણો, મારા દાક્તર-દરદી!"

"દાક્તર તો બીજાનો તારો તો સદાનો દરદી."

નિમ્યાનો પિતા ઊભો ઊભો એક નવો પાયો ખોદાવી તેનું પુરાણું જોતે હતો. તેમજે પણ ત્રણેને 'ચ્યાબા' કહ્યું. ઉપકારભરી દણિએ એ દાક્તર તરફ નીરખી રહ્યો. એવામાં એકાએક એકો પાયામાં એક માછલું  
તરફડતું જોયું, અને એના મૌંમાંથી અરેરાઠી નીકળી ગઈ. મજૂરે પીપળાંથી  
ડબલું ભરીને પાયામાં જે પાકી નાખ્યું તેમાંથી જવતું માછલું પાયામાં  
પડ્યું હતું.

ઘડીનો પણ વિલંબ કર્યા વગર એકો પોતાના માથા પર લપેટેલું  
રેશમી ઘાંઉભાંટ ઉતારીને તરફડી રહેલ માછલાને જતનભેર એ  
ઘાંઉભાંટમાં લીધું, ને પછી પોતે છેક નહી સુધી એને નાખવા ગયો.  
પણીને કહેતો ગયો કે પરોક્ષાને અંદર બેસારાજે.

દાક્તર તો હિંગ જ બની ગયા.

"એ ઘાંઉભાંટ ચાર-પાંચ રૂપિયાનું હશે, હો હાથડી," ડૉ. નૈતમે  
કહ્યું, "માંસમથીના આખરી છત્માં આ લોકો..."

નિમ્યાની માતા આ ગુજરાતીમાં ચાલતી વાતને પોતાના હુતૂહલથી  
અપમાન્યા વગર જ અંદર જઈ પાનનો દાબડો લઈ આવી, અને

બાકી કોઈ હી  
દોષો કાઢવા વિના

નું શરીર હેલવિને  
: "છે - ખરેખર,

ધ્યાનો અને પચાણ  
સંસી છે."

મારાં સર્જનના!

ત્રૈ જ જુઓ અને

"

નોદાવી તેનું પુરાણ  
રભરી દસ્તિએ એ  
યામાં એક માછલું  
ડ. મજૂરે પીપળાથી  
નું માછલું પાયામાં

નાથા પર લપેટેલો  
ને જતનબેર એ  
ને નાખવા ગયો

નથી," ડૉ. નૌતરે

પોતાના કુતૂહલથી  
ની આવી, અને

હેલા-સમાજા હાથે એ દાખલો (આપણો બે હાથમાં કોઈ શુભ પ્રસંગે  
શ્રીકણ ધારણ કરીએ તેવી ધાર્મિક અદાદી) ઉપારી લાવાને, દોઢે ડગલાં  
ભરતી હળવે સન્મુખ આવી, નજીક પહોંચી, ઘૂંઠશાબર બનીને,  
અને પોતાના પગની પણ ન દેખાય તેવી કાળજીયી પગ પાછળ  
રાખી દાખલો બાજાઠ ઉપર ધરી આપ્યો અને શિર જુકાવ્યું. માથાનો સંકો  
દીયે નમતાં એની કેશાંગુંથણી દેખાઈ.

“લે જો, તારી કાઠિયાણી કે મેરાણી એની જમી પહેરીને આમ  
ઘૂંઠશાબર બેસી શકશો?” ડોક્ટરે ફરી પાછી બર્મી છયાને આગળ કરી.  
“કૃતલી સુગંધ આવે છે!”

“એ એના શરીરની છે.” હેમદુંવરબહેને જાગ્ર કરી. “શરીરે આ  
પ્રયોક બણી સ્વી ચંદનનો લેપ કરે છે.”

દાકતરે સોનાંકાડીને પૂછ્યું: “પેલી દુતી કયાં?”

“કોડા, મા-નીમ્યા!” હોસ્પિટે ઠેડ કલેજ કથ્યું: “એ તો તમને  
લઈને નાસી જવાની હતી ને!”

ડોક્ટર-દંપતી તો આભાં જ બની ગયાં. એમના મોં પરથી લોહી  
બીજી ગંધું. હોસ્પિટ સમજી ગઈ. એ હોઠને સહેજ માત્ર સ્મિતમાં પવાળીને  
બોલી: “ગભરાયા! કુવારી છિકરીઓની મશકરી અમે કરી શકીએ.  
કાલથી આપણે કોઈ નીમ્યાની ઠેકડી નહીં કરી શકીએ. આજે સાંજે  
એના ત્રણ દિવસ પૂરા થાય છે. અમે એનું ગુપ્ત સ્થાન પકડી શક્યાં  
નથી.”

“એ વળી શું?”

પછી માતાએ સ્પષ્ટીકરણ કર્યું: “નીમ્યા અમારી હુસ્તા મુજબ  
પરણવા નહોતી માગતી, પોતાના કોઈક પ્રેમિકની સંગાથે ચાલી ગઈ છે.  
ત્રણ દિવસ એ પ્રેમિક પોતાના કોઈક સગાસંબંધી મિત્રને ઘેર સંતાડી  
રાખેશ. અમે શોધ કરી; એ પકડાઈ ગયાં હોત તો લગ્ન ઝીક થાત,  
પણ ન પકડાયાં એટલે હવે એ લગ્ન અમે માબાપ મંજૂર રાખશું. આજે  
સાંજે તો બેઉ આવવાં જોઈએ.” માતાએ ખાતરી આપી.

“જોઈ છે કોની સાથે?”

“આવે એટલે જાહેરાને”

પુત્રના આવા આચાર વિશે પેટમાં પણી પણ ન હલણું હોય  
એવી જનેતાને જોઈ હેમકુવરબહેનને વિચિત્રતા લાગી. એવો પૂછ્યું:

“મારે ઘેર મેં સંતાકયાં હોત તો તમે રોષ ન કરત?”

“ના રે, રોષ શાનો? આ પ્રકારનું લગ્ન એ તો અમારી સંઘાનિત  
પરંપરા છે. માત્ર એટલું જ કે તમારે ઘેર એ બેઉ અમારાથી પકડાઈ  
ગયાં હોત તો લગ્ન ફોંક થત.”

“પણ નારી શીંદ જાય? સંતાપ શા માટે? તમે ગોત્રવા કાં જવ?”

“એને અમારી પસંદગી મુજબ શાદી ન કરવી હોય એટલે નાસે..”

“તો તો પછી એ પાછાં આવશે ત્યારે-”

“ત્યારે અમે આશીર્વાદ જ દેવાના.”

“સંબંધ રાખવાનો?”

“શા સારુ નહીં?”

“પણ જ્માઈ તમને અણગમતો હોય તોપણ?”

“પછી તો ગમતા-અણગમતાનો પ્રશ્ન જ નહીં. જે હોય તે સોના

સરીખો.”

નહીંએ માછલું નાખી આવીને નીમ્યાનો પિતા પાછો આવ્યો ત્યારે  
રેશમી ધાંટિબાંદુ બગડ્યાના કશા જ અફસોસ વગર નવું રેશમ માથે  
લપેટીને એ બેઠો. પછી દાક્તરે એને પૂછ્યું: “તમે જવ ખાનારાં છતાં  
આવી જીવદ્યા કેમ?”

“અમે ખાઈએ ખરા, પણ જાતે ઊઠીને સંહારતા નથી. જળ  
નાખનારા અમે નથી. અમારાથી મરતા જીવનો ત્રાસ જોવાય નહીં.”

ગૃહિણી થાળમાં ફળમેવા લઈ આવી, ફરી વાર એ જ વિનયછટાથી  
પગલાં ભર્યા, ફરી ઘૂંઠણાભર જૂકી અને થાળ મૂક્યો.

પરોણા આરોગવાનો આદર કરતાં હતાં ત્યાં જ ધારણા મુજબ  
બે જણાંએ ફળિયાનું ફાટક ખોલ્યું. ગૃહિણીએ પૂર્જી સ્વર્ણસ્થતાથી કહ્યું:

જીજી દિવસ

“મા-નીમ્યા આવી..” બેઠ બહાર ગયાં. માબાપો બેઠએ સાથેના જુવાનને જોયો. એ બલી યુવાન હતો, કેરબાદી કે હિંદી નહોતો. બેઠનાં હૈયા હૈયા. યુગાં ઉપર આવીને વડીલો સન્મુખ ટૂટ્યાભર નમન કર્યું. વડીલોએ શાંત આશરીવંદ આયા. પિતાનું મન ઉદ્દેશિત બન્યું તે દેખાઈ આવતું હતું. પણ માતાનો મનસંયમ જરીકે ચણ્યો નહીં. બલી નર અને નારી બેઠ વર્ચેનો આ પ્રકૃતિ-શીખબ્યો સંસ્કારભેદ છે.

“અંદર તો જા - જો, કોણ આવ્યું છે?” માબે નીમ્યાને કહ્યું. ત્યાં તો નીમ્યાએ બાબલાનો અવાજ સાંભળ્યો. એ અંદર રોડી જઈને બાબલાને ભેટી પડી. “પાંચ દિવસથી તને દીઠો જ નથી, લુચ્યા! તારી બાબે મને ના કહી એટલે જ તો! નહીંતર સેતત તારી જ પાસે રહી હોત.” એમ કહેતી એ હેમકુંવરબહેન તરફ ફરીને દાઢવા લાગ્યો: “કાં, તમે અમને સંઘરવા ના પાડી તો શું અમે રજાળી પડ્યાં? પૂછો માને, ત્રણ દિવસથી પરેશાન થતી થતી અમને ગોતતી હતી, તોપજા હું પકડાઈ?”

“ઓ રે દોલી!” હેમકુંવરબહેને કહ્યું, “તમે તમારો ચાલ પૂરેપૂરો સમજાયો હોત તો હું કહી ના કહેત જ નહીં. એ તો ઠીક, પણ તું લાવી છે ક્રોને? કોઈક લાગે છે માલદાર!”

“કુમ જાહ્યું?”

“જોને તારા આખા શરીરને મન્દિરું છે. આ ચે (સોનું), આ નુંં (યાંદી), આ સેંઈ(હીરા)માં તો લેટી રહી છે!..

“હા હા, બધું એનું જ હશે, એમ ને?”

“ત્યારે કોનું? માનું?”

“બિલકુલ નહીં.”

“ત્યારે?”

“કહું? —” જઈને કાનમાં બોલી: “એક રેપારીનું છે. જોવા લઈ જવાનું કહી ઉકાવી લાવી છું.”

“તો હવે?”

“હવે શું? જઈને પાછું આપી દઈશ માટે કામ પતી ગણું મારે  
તો અને રાજુ કરવો હતો.”

“પછી એ ન જુઓ તો?”

“તો શું કરશે? એની લૂંગી વેચીને મને શાંકણારે તો છે!..

“કેમ, કાંઈ નું વેજ મોઈઝા(રૂપિયા)વાળો નથી?”

“અરે રાતો ટખ્યો (પૈસો) પક્ષ પાસે નથી.”

“એવાને કેમ પસંદ કર્યો?”

“બર્મા છોકરીને એ પ્રશ્ન જ ન પુછાય. માએ તો પસંદ કરેલો  
સોનારુપા અને હીરાવાળો. મને ગામ્યો મજૂર. રાણીને ગમે તે રાજુ..”

“પક્ષ મા તને વારસામાંથી ગડગડિયું પકડાવશે તો પૈસા ક્યાંથી

કાણીશ?”

“પૈસા ફાય પેમરે - પૈસા તો પ્રભુ દેશો. પૈસા પૈસા શું કરો છો?

બાકી તો મેં એને પસંદ કર્યો છે. હું એનાં કંપણાં સાંધીશ.”

વાક્યે વાક્યે નીમ્યા હીરે ને હેમે લળકતી હતી. વાક્યે વાક્યે  
એનું હાસ્ય રેલનું હતું. એની અંજળીની પહોળી બાંધ્યો ઝૂલતી હતી. પોતે  
પોતાની પસંદગીનાને - ભલે મજૂરને - પરછી શકી હતી તેનો નશો  
એનાં નયનોમાં ઘોળતો હતો. બહાર માબાપ પાસે એનો પત્તિ બેઠો  
હતો અને પ્રશ્નોના જવાબમાં પોતાની પિછાન દેતો હતો. સામાન્ય મજૂર  
જેવો હતો. માબાપ બેઉ હતાં. થોડી જમીનાં ધડી હતાં. ઢોસ્વેએ કુ  
એના પત્તિએ જમાઈની ગરીબીની આ આખી વાત સાંભળ્યા પછી પક્ષ  
છોકરીએ ગાંડપક્ષ કર્યું એવો અથવા તો છોકરા પ્રત્યે કોઈ ટોષામહેષાનાં  
શબ્દ ઉચ્ચાર્યો નહીં.

જમાઈ ભાડી ફરીને ઘરધણીએ કહ્યું: “હવે તો અહીં રહીને મારી  
જમીનનો ભાર ઉપાડી લે, બાપુ. હું થાક્યો છું.”

“નહીં.” સાસુએ શાંતિથી કહ્યું: “તમે વળી શું કરીને ઢગલો  
વળી જાવ છો? એનાં માબાપ એકલાં જ છે. ગરીબ અને અશક્ત છે.  
અંહીનું તો હજુ સંભાળનારી બાર વરસની બેકી છું. નીમ્યાની અને

પ્રભુ પદ્માવતિ  
પતી ગણું મારે

તો છે!..

પસંદ કરેલો  
તે રાજા..  
પૈસા કયાંથી

શું કરો છો?

વાક્યે વાક્યે  
હતી. પોતે

તેનો નશો

પતિ બેઠી  
માન્ય મજૂર

દોસ્તેએ કુ

પછી પણ  
શામહેણાનો

રહીને મારી

ને ડગલો  
નશકત છે.  
યાની અને

જીજ દિવસ

આની ફરજ તો ત્યાંની સ્થિતિ સાચવવાની છે. વળી છેટે પણ ક્યાં છે?..  
નાસ્તો વગેરે પતાવીને પરોણા ઉઠાયા. મા-દીકરીએ ઉડીને  
વિનયબેર રસ્તો કરી આપ્યો, અને દાક્તરાણીએ જતાં જતાં નીમ્યાને  
બર્દી હથ ફેરવીને કહ્યું: “જ્યારે કંઈ જરૂર પડે ત્યારે આવજો, હં

ઢ?” નીમ્યાએ શિર નમાવ્યું. એ નમને એની કમરના અદ્ભુત વળાંક  
બતાવ્યો.

“ભગવાન આપણી જરૂર ના પાડે.” દાક્તરે નીમ્યા પ્રત્યે નિષાળી  
એની ગુલાબી તંદુરસ્તીને અવળવાણીમાં આશ્રિતો આપ્યો.

“તમારી તો નહીં જ, પણ મારી તો પડે ના!” હેમકુંવરે કહ્યું.

“હા; કદાચ આજથી નવ મહિને...”

દાક્તર એટલું જ બોલ્યા ત્યાં હથણીએ ભેક ચંપ્યો: “હવે એ  
પરણોલી છે, હો કે! જરીકે વિનોદ કરશો નહીં; નકર આવડો આ એનો  
વર ઓલી ધાને કાનો ઉપાડશો. આમેય એની આંખ તો ફાટેલ છે જ.”

“હા ભાઈ! મૂસા પડ્યા.” કહેતાકને દાક્તર ઝડપથી મોટર પર

પહોંચ્યો ચડી બેઠા.

“સાચોસાચ જો કોઈ ‘ધ’ને કાનો લઈને આવે તો તો તમે આમ  
પહેલા જ ભાગો ને!” હેમકુંવરબહેને ટોણો લગાવ્યો

“તમને સ્ત્રીને તો રક્ષણ છે પુરુષોની ‘શિવલી’નું, બાપુ! તમને  
ઘોડો કોઈ પુરુષ હથ પણ લગાડવાનો હતો!”

“ઈ વાતમાં કંઈ માલ નહીં, હો દાક્તર!” હથણીએ ચાલતી  
મોટરે કહ્યું: “આ ખોપરિયું નોખી છે. શિવલી કે શિવલી; કંઈ આડે  
ન આવે. ઈ તો ‘ધ’ને કાનો ધા!”

## મૃત્યુનો ઉત્સવ

પહેલે વરસાને મારી પલળી ગઈ હતી; ને નીમ્યાનો સસરો પોતાના જેતરમાં કાગેદ છાંટી, પણ બંધ કરાવી, નફકરો બની સલે ચસકાવતો પોતાને થેર જઈ નેટો હતો. જેઠમાં જેતરદાં છલોછલ ભરાઈ ગયો અને નીમ્યાની સાસુએ ઘણીને તાકીદ દીધી. પણ બલાદેશી મદને કામે ચડવાની તાકીદ કરવી એ પાડા માથે પાણી ઢોળવા બરાબર છે. તોસો તો હોટેલોનો રસિયો હતો. હું હાસ્ય કરીને ઘરમાંથી સરકી જતો.

ડાંગરના રોપને છાતીબૂડ પણીમાં ઊભીને ખેંચી કાઢવાનું કામ કરવા કોઈ બરમો મજૂર મહેનતાનો આવવા તૈયાર નહોતો. ઘણાખરા શ્રમજીવીઓને યાંત્રિક મિલોએ આકર્ષ લીધા હતા; બાકીના ઘણા દગડા બન્યા હતા. મોરી બીક ડાંગરનાં જેતરોમાં જળો ચોંટવાની લાગતી. જેને જેને નીમ્યાની સાસુ બોલાવવા ગઈ રેણે પહેલાં તો ઘરમાં જઈ તપાસ કરી. પછી બહાર આવીને કહી દીધું, “આજે તો મજૂરીએ નથી આવવું.”

“હા, આજના ચાવલ હાંડીમાં બાકી લાગે છે. શેનો આવ?” એમ બોલીને તોસી બીજાને કહેવા ચાલી જતી. બધા કેવળ ‘આજનો લહાવો લાજીયે રે, કાલ કોણે દીઠી છે!’વાળી મનોદશમાં હતા.

આખરે નીમ્યાની સાસુને હિંદી મજૂરોનાં જૂથ જડી ગયાં. હિંદુસ્તાનની ફુષિ ભાંગતી હતી; મજૂરી અતિ સસ્તી હતી; એટલે હિંદે વ્યાપારીઓના કરતાં સો ગણી સંખ્યામાં એના કિસાનોને આંહીં હાંડી ચાવલની શોધમાં દરિયાપાર ધકેલ્યા હતા. ઔરિસાનો ઊડિયો મજૂર આ ભયાનક મજૂરીને માટે પણ સસ્તો વેચાતો હતો.

પગે ચોંટતી જળોને જીવતી ઉખેડવાની કરામત ઊડિયા પાસે હતી. જળો જ્યાં ચોટ ત્યાં ઊડિયો થૂંકતો, એટલે જળો ખરીને નીચે પડતી. પાર વગરની જળો ચોટતી, તાણે તો કદી ન તૂટતી, લોહીને ઝપાટાંધ ચસકાવતી; પણ ઊડિયો થૂંકતો થૂંકતો ઉખેડીને કામ કરતો. રેણે ડાંગરના

કૃત્યાં ઉત્સવ  
કોડ પોચી પોચી પાણીભરપૂર જમીનમાંથી મેંચી કાંકળા, જી ઉપર  
ઘૂમીઓ તરતી મૂકી પછી પાળો બોલી નાની ખેતરને ખાલી કર્યું ને  
પછી એ જ જમીનમાં અકેક રોપ કરી કરી રોપી આપ્યો.

કાઠિયાવાડમાં કહેવત છે કે, "પાંડડા લીલાં દેખીને પણો પાંચ વાર  
પરછ્યો". મતલબ એ છે કે પોતાના ખેતરના કાપાસનાં પાંડડા જ્યાં સુધી  
લીલાં જુએ ત્યાં સુધી નવો નવો કાલાંનો પાક લેતો લેતો ખેડૂત નાનાં  
ખર્ચીને પાંચ વાર લગ્ન કરતો રહે. એ રીતે બહારી ભૂમિપુર નીમ્યાના  
વે પોતાના બાપના ખેતરમાં હંદિયાળી ઘાટી ડાંગર દેખીને શું કર્યું?

એનું નામ હતું માંઉં-પૂ. એ એક ચાવલ-મિલમાં નોકરી કરતો.  
મહિને વીસેક રૂપિયા મળતા. પરછ્યા પછીના પહેલા મહિનાના વીસમાંથી  
એકો પહેલે જ તડકે રેશમી લુંગી ખરીદી, બીજે મહિને સરસ લાફકોટ  
લીધો, તીજે મહિને એક ઘડિયાળ ખરીદું. ચોચે મહિને એક મોટા કુંગી  
ઘરમારુડ ગુજરી ગયા હતા તેના ઉત્સવનું આખરી અઠવાડિયું હતું. આખા  
ગામને અને આસપાસની ગ્રામ્ય પ્રજાને, લાખો માણસોને ઉત્સવ  
સાંપડ્યો. બ્રહ્મદેશમાં જન્મોત્સવ કે લગ્નોત્સવ નથી, પણ એ બંનેનું  
વેક વાળી હે તેવો મરણોત્સવ છે.

કુંગીના મૃતદેહને મસાલા લીંપી, સુગંધી દવ્યો છાંટી, નકશીદાર  
સુખડની પેરીમાં ત્રણેક માસથી મૂકવામાં આવ્યો હતો અને હવે એના  
શેષ સંસ્કાર ટાણે પ્રત્યેક ફ્યામાં, એકેએક ચાંઉમાં, ઘરેઘરમાં નાટરંભ,  
જલસા, મહેન્હિલો અને જુગારની રમજાટ બોલી. નૃત્ય બહારીને વેલી કરે  
છે; હજારો બહારી સ્ત્રીઓએ પોમેડ, પાઉડર અને પહીની દુકાનો પર  
ગિરઠી મચાવી; હજારો લુંગી અને ઘાંઉબાંઉવાળા રેશમના વેપારીઓ  
રણવા લાગ્યા. ચાલતી નોકરીને ઠોકર લગાવીને ઉત્સવમાં શામિલ  
થનારાઓમાં માંઉં-પૂ પણ હતો. કાગળનાં ફૂલો બનાવીને વેચવા બેસતી  
નીમ્યા પણ બીજી હજારો સ્ત્રીઓ સાથે અદશ્ય બની, અને નીમ્યાના  
સસરાએ એક મદારી ચેઢીની પેઢી પર જઈ ડાંગરનું પાકેલું ખેતર ગીરો  
મૂકી નાકાં ઉપાડ્યાં. મદાસથી આવીને ધીરધારનો ધીકતો ધંધો

ચલાવવામાં પાવરદ્યા બનેલા આ રોડીઓ ભબદેરાની હજારે માઈક  
જમીનના સ્વામી બનીને બેઠા હતા શાંતિદાસ રોઠની સોનાચાંદીની દુકાને  
પણ એટાં જ તરફે પડ્યો.

દાક્તર નૈતમ અને હેમિકુરલબેન પોતાની મેરીએ ઊભા ઊભા  
આ મરણોત્સવનું પાગલ સરથસ જોતાં હતા મુલિલમોના તાખુણની માફક  
કાળળના બનાવેલા મોટા કલાયુક્ત ફ્યા (પેગોડા) નીકળયા દ્વારા અને  
પતાકાઓ, ગાન અને તાન વચ્ચે ઊંચે ઊંચે એક મંદિરના ઘુમ્માર જેવું  
એક કમળકૂલ નિરાયેલી અવસ્થામાં નજરે પડ્યું. કમળકૂલ ચાલ્યું આવે  
છે, એક કેલાગાડીમાં લોકો એને ખેંચ્યા લાવે છે. ધીરે-ધીરે, ધીરે-ધીરે,  
ધીરે-ધીરે, કેમ જાણે કોઈક વસંતના મલધાનિલાની લહરે લહરે ઊઘડની  
છોય તેમ એની મોરી મોરી પાંદડીઓ સરખા પ્રમાણમાં ગોળકૂડાને  
ઊઘડતી આવે છે.

સહેજ ઊઘડી, વધુ ઊઘડી, અને અંદરથી એક આસરા જેવી  
પાંખાળી જગ્યાતી કો નર્તકાએ ડોર્કુ કાંદ્યું. જનપદે પાગલ બનીને  
હરધોષણ દીધી.

આસરાનું સુંદર ઓળેલ સંકોઉવાળું મસ્તક દેખાયું, હીરાના હારે  
હીંડળતી ડેક દેખાઈ, આધા વાપલની એંજ્યમાં હંકાયેલી  
પીનપયોધરવિહોળી, તસતસત્તા બાંધિલા કપડા વડે સપાટ કરી મૂકેલી  
પહોળી ચાપી છાતી દેખાઈ. એના કમ્મર સુધીના દેહને પ્રગટ કરીને  
પદ્મ પૂરેપૂરું પ્રકૃતિલિત બન્યું. કાંસાની કટોરીઓને ફૂડાળે ગોઠવીને બનાવેલ  
બહી જળતરંગ પર ઝીણી ડાંડીએ સૂરો જગાડ્યા. તંતુવાધોના તાર પર  
બજીવૈયાના હાથનાં આંગળાં ફર્યા. (બજીવૈયાના પવન-વાધેને વિક્કારે છે.)  
અને પદ્મમાં ઊભેલી પદ્મશ્રીએ નૃત્ય આદર્યું.

આ નૃત્યને ચંગાવવા લહેરાવવા ત્યાં ચણિયાના ચાળીસહથ્યા દેર  
નહોતા, ચૂંદડી-ઓઢણીના ચકડોળ ફરતા પાલવ નહોતા. પગને રૂધી  
રહેલી તસોતસ આસમાની લુંગી આપણી કાઠિયાળી-આહીરાણીએની  
જમી કરતાંયે વધુ ચાપોચપ હતી. એમાંથી જે નૃત્ય નીકળ્યું તે નૃત્ય

જુણે હત્યા

એ આપણે રીપેલું નાજુક કરીન્તય હતું, પદશીની કમર તાથે તાથે  
ને સુરે સુરે પોતાના પાતળિયા લાંક પણ જાણે કે છઠે જવરાણી રહી  
હતી કોઈમાં આવી જાય તેટલી જ એ કેડવમાં માનવીને મહાશૈખો  
અણી આપે તેટલી બધી કરામત કોણ જાણે ક્ષયારે લુપાવી રાણી હતી.

પદ પાસે આવ્યું અને હેમકુવરબહેને હર્ષનાદ કર્યો, “અરે, અરે,  
આ તો આપણી નીમ્યા, અરે વાહ રે વાહ, નીમ્યા!”

પદમાં નૃત્ય કરતી નીમ્યાની અને હેમકુવરબહેનની ચાર આંખો  
ભેણી થઈ અને પદ-ગાડી પસાર થઈ ગયા પછી હેમકુવરે પતિને કહ્યું,  
“કુણે ન કહો, પણ આ બાઈની આંખોમાં પોતે નાચે છે તેટલો બારોભાર  
ઉફાસ નથી.”

“જોયું નહીં!” દાક્તરે કહ્યું, “નીમ્યા હવે માત્રા થવાને માગે  
જીવાય છે.”

“તો તો થાકીને લોથ થવાની.”

“તેનું બ્રહ્મીને શું! આજનો લખાવો લીજિયે રે, કાલ કોણે  
હીં છે!”

“માણાં નાનાં બાળકો જેવાં.”

“બસ, તેં બરાબર કહ્યું. આ બ્રહ્મી પ્રજા એની મધુર મુગ્ધ  
બાલ્યાવસ્થા જ વિતાવી રહી છે. અને ઓટ્ટય શું છે?”

“પણ એ અવસ્થા ઉત્તરશે ત્યારે શું થશે, દાક્તર?”

“આપણો પરદેશીઓ કદાચ એ બાળાપણનો વહેલો અંત આડી  
દ્યું. આ નિર્દોષતા લાંબી નહીં રહે. આપણો એનું સુખ-સોણલું ઉડાડી  
મૂકશું!”

“એટલે શું?”

“એટલે રતુભાઈ રોજ કહે છે તે. એમને - એ બ્રહ્મીઓને -  
હવે ભાન થવા લાગ્યું છે કે તેઓ ભીસાય છે. તેઓને કોઈક છતરી  
રહેલ છે. અને તેઓની ભૂમિને કોઈક પરાયાં શોષી રહેલ છે.”

તે જ વખતે છાપું આવ્યું. અને ડૉ. નૌતમે મોટાં મથાળાં વાંચ્યાં.

“બમા કંઈ વી બમાઝા: બમા બમાઓનું જ બનરો! બમા મજૂરોની સાથે  
હિંદી મજૂરોની મેળી હરીશાહી: આ મજૂરીનું પ્રમાણ નક્કી કરેયા  
અભિનેત્રીઓનો પુકાર વગેરે વગેરે.

### મામા નાઈ એ”

ઉત્સવ પૂરો થયો હતો. કુંગાના શબને અજિનસેસ્કાર થઈ ચૂક્યો હતો.  
સગામા નીમા મચ્છીનો મોટો ટોપલો ઉપાડી બજારે જઈ વેચવા બેઠી  
અને નોકરીવિધોખા એના ઘણી માંટ-પૂરો બે જ મહિના વાપરેલ રેશમી  
લુંગી, કોટ તથા ઘડિયાળ સાથે લઈ, જૂનાં વસ્તો પહેરી, અપાંટ-શોંપ  
(પોન-શોંપ)નો રસ્તો પકડ્યો.

અપાંટ-શોંપ એટલે ચીનાઓના હથનો ભલદેશમાં ધીકતો ધધો  
કેર કેર એ દુકાનો ચાલતી હતી. માંટ-પૂરો ત્યાં પહોંચી નજોય ચીજે  
પાકીને મૂલ ગીરો મૂકી. બાકી રહી હતી એક વીઠી. સોનપાની એ વીઠી  
પાછા પોતાના ઘાર મૂળ ઘણી શાંતિદાસ શેરની દુકાને ચાલી અને  
એના કંટામાં જઈ પડી.

“એ તોલું નહીં, સમજતો જ નથી!” મુખ્ય મહેતાજાએ દુકાનના  
નવા પલોટાના એક કાઠિયાવાડી જુવાનને આ વીઠીનું વજન કરતો ટોક્યો.

“ત્યારે?”

“તોલો નહીં, ટીકલ લે, અને ઓલી ચઙ્ગોઠિયું લે.”

પણ આપણો એને વેચેલ ત્યારે તો તોલાથી તોલ કરી આપેલ છે..”

“હવે ભાઈ, વેદ્ધિયો થા મા ને! દુકાનની રસમ પ્રમાણો કર ને..”

“પણ તોલે જોગેલ તે ટીકલે પાછું તોળું? એને નુકસાન કરું?”

જુવાન ચિંડાયો.

બાળ ચહેરે

‘ક્રીક’ એટલે લગભગ ઢોડ તોલાનું વજન થાપ માઉન્-પુ વાતી  
અરીની અપેલ ત્યારે તોવે જોખેલ, હવે પાછી લેતી રેણ ક્રીક જોખવાનું

હત્તે ...એને બબર આપતો લાગે છે!” મહેતાજીને દોસો માયો... “કંઈ

કમીશન કરાયું છે?”  
માઉન્-પુ તો કશી સમજણ વગર ચૂપ ઉભેલો. એને તોલનાં  
ગતીગમ નહોતી. એ તો પેસા પાછા મળવાની રાહ જોતો હતો.

જુવાને તોલાનાં વજન પ્રમાણે જોખી આંકડો કરવા મહેતાજીને  
કહું. એણે ખોઢું લખયું અને મૂળ વેચતી રેણ જે વાતીની ઘડાઈ મૂકેલી  
તે ન મૂકી માઉન્-પુ તો જે ઓછા પેસા મળ્યા તે લઈ રાજુ થતો થતો  
આલ્યો ગયો. એને તો નવું ધાંટિબાંટ ખરીદયું હતું. લાયમાં રોકડા પેસા

આવ્યા તેને એણે નવી કમાશી સમજી લીધી.  
આમ શાંતિદાસ શેઠની દુકાને બે પ્રકારનો તોલ રહેતો. વેચતી  
વાતે હાજરો તોલ, ને પાણી ખરીદતી વાતે ભારે તોલ. ચંદોલીઓની  
પક્કા બે જાત હતી: એક વજનદાર, અને બીજી હળવી ઝોંકાં. બાળક  
જેવા ભર્ણી લોકો તો હિંદીઓને ‘ફ્યા લારે: પ્રભુ પદ્ધાર્યા’ સમજતા  
ઉપરાંત છેતરાનું એ શું તેની તેમને બબર નહોતી. તેઓ સુધી હતા.

જુવાનનો બબડાટ શરૂ થયો. એ બબડાટ આણી દુકાનનું  
વાતાવરણ ડહોયું. રીઠ મહેતાજીને તો આ છોકરાની સંજાઈ અસરથ  
થઈ પડી. એણે જઈ શાંતિદાસ શેઠને કહ્યું. શાંતિદાસે જુવાનને ઓફિસમાં  
બોલાવ્યો અને કહ્યું: “તમારે દુકાનમાં બીજાં માણસોને બગાડી મૂકવાં  
ન જોઈએ.”

“પુણ આવો દાગો...”

“દાગો દાગો કરવાની જરૂર નથી. અહીંની તો રસમ જ એ છે.  
બે હજાર માર્ટિલ કાળે પાણીએ આવ્યા છીએ તે જ્યે મારવા નથી  
આવ્યા.”

“તો શેઠણું, આ રીતે મારાથી નોકરી નહીં થઈ શકે.”

“તો બીજે શોધી લ્યો નવા નવા છો એટલે નાચણું સૂઝે છે; રીતે  
થણો એટલે તમે પણ એ જ કરવાના છો.”  
જુવાન ચાલ્યો ગયો અને શાંતિદાસ શેડે હિસાબ મૂક્યો રોકડ  
માંડ નજી હજાર લઈને પોતે પંદર વર્ષ પર આવ્યા હતા આવે  
ચાળીસ-પચાસ લાખના ધરી હતા. પોતાની પ્રામાણિકતાનો અને  
સોનાંરૂપાંની જાતનો સિક્કો પડતો. પોતાને રોટલાનું કામ હતું ટપટપનું  
નહીં. પચાસ-પોશોસો દેશભાઈઓને પોતે નભાવતા, ઉપરાંત કોશેસના  
કામમાં હજારોની બેટ આપતા. માણસ આથી વધુ શું કરી શકે? પણ  
ઓલ્યો રહુ બધાને બગાડી રહ્યો છે! એ હમણાં પીમનામાં આવીને બેઠે  
છે ન!

માઉં-પુનર્વી લુંગી, જૂનો કોટ ને નવું ઘાંઠિબાંંટ પહેરી ઘેર જતો  
હતો ત્યારે એને યાદ આવ્યું કે કેરી હજુ માર્કિટમાં માછલી વેચતી હતે.  
પોતાના નવા શાકાંગાર બતાવવા એ ત્યાં ગયો અને દૂરથી હર્ષના લલકાર  
કર્યા. માછલી વેચી કરીને નવરી પડેલી નીમ્યા નળે હથમોં ધોઈ કરી  
સઢોઉમાંથી ‘ભી’ કાઢીને લાંબા વાળ ઓળતી હતી. તેણે પણ સામ્ને  
હર્ષ લલકાર્યો.

‘આજનો લહાવો લાજિયે રે, કાલ કોણે દીઠી છે!’ એ મુંગું જીત  
આ બેઠનાં નયાણામાંથી નીતરસું હતું.

“ચાલ ત્યારે, હુંયે મારાં લેકાંટિકન્કડા) ને નઘાં (બૂટિયાં) વેશી  
આવું.” પોતાની કાનની બૂટીઓ અને હથનાં કાંડાં ચંચવાળતે ચંચવાળતે  
નીમ્યાએ પતિને કહ્યું.

“શા માટે?”

“ચાવલ લેવા પડશે ને?”

“ચાવલ તો આપણા ખેતરમાં થયેલા ને?”

“ગંડું! એ તો ખેતર જ આખું ઐયાને ત્યાં મૂક્યું.”

“ચાલો ત્યારે.”

ઇમિટેશનના નંગે જરૂલાં નઘાં અને લેકાંટ લઈને પાછાં બેઉ જણાં

જાતીદાસ રોકાને આવી ઉભાં રહ્યાં ત્યારે મહેતપાણનું મોં મલવી રહ્યું પોતાને ત્યાંથી જ બે મહિના પર ગયેલાં ઘરેઝાં પાળેલાં પારેવાં પેઠે પણું આવીને કાંચામાં બેઠાં. આ વખતે તો એણે પેલા જુવાનને બદલે વીજાન જ તોલ કરવા નેસાડ્યો હતો. તોલનો આંકડો મૂલીને એણે પેસા આપવા માંકવા ત્યારે નીમ્યાનું મોં પરી ગયું. "લઈ ગઈ ત્યારે તો તોલ ક્રિયાલો ને?" એણે કહ્યું. બહી નારી તોલ ભૂલી નહોતી.

"યાઈ!" મહેતપાણને કહ્યું: "ધસારો લાગ્યો છે એ જ વાત ભૂલી

ગઈ છે?"

"ધસારો વળી કેવો?"

"પૂર્ણી જો કોઈને પણ. સોનું તો પહેંચ ધસાય જા!"

"પણ આટલું બધું ધસાય? મેંયે બહુ સોનાં વેચ્યાં છે!"

"તમારા કાન મજબૂત ખરાને એટલે ધસાય."

"સોનું ધસાય, પણ નંગ કાંઈ ધસાય?"

"ધસાય જા."

"ના, ન ધસાય, ઉલ્લુ ન બનાવ." નીમ્યાએ રક્ગાક આદરી.

"બાઈ!" મહેતપાણને માહુ લગાડીને કહ્યું: "માથાકૂટના અમે

કાયર છીએ. જેમ થતું હશે તેમ થશે."

"ના, નહીં થાય." નીમ્યા રોષે ભરાવા લાગી.

"હુવે ચાલ ને, જે આપે તે લઈ લે ને." માંઉં-પૂને ઉભો ઉભો

પરેશાન થતો હતો.

"તું શું સમજે? તોલ બરાબર નથી. તારામાં પાણી નથી શું?

ફંડર રુપિયા ઓછા લઈ જઈને ખાવું શું? ખેતર રહ્યું નહીં, કાંઈ રહ્યું નહીં ને તું તો લહેરી લાલો વગરધધી બેઠો છે."

આ ટોણાએ માંઉં-પૂને ઉત્તેજિત કર્યો. એણે મહેતપાણને કહ્યું, "તો ચાલો તઠે આગળ." તઠે એટલે શેઠ.

"તઠે ફઠેની પંચાત ન કર. હું જ તઠે છું. તું તારે જોઈતા હોય તે લઈ લે આ પૈસા." મહેતપાણને તિરસ્કાર કર્યો.

મધુ પદ્ધાલ  
ચચું સૂર્યે છે: રીબ

સાલ મૂક્યો રોકડ  
ત્યા હતા આજે  
માણિકતાનો અને  
કામ હતું ટપટપનું  
ઉપરાંત કોચેસના  
હું કરી શકે? પણ  
આમાં આવીને બેઠી

પહેરી ઘેર જતો  
છલી વેચતી હતો  
થી હર્ષના લલકાર  
ધાથમાં ધોઈ કરી  
તેણે પણ સામો

!" એ મૂંગું ગીત

(બૂટિયાં) વેરી  
ગાળતે ચંચવાળતે

પાછાં બેઉ જણાં

બહું ભાગમાં 'હું' માટે 'મી' નામનો એકાકારી શબ્દ છે. વાર્ષિક  
 'મી' શબ્દ વપરાવા લાગ્યો. મહેતાજીએ 'મી' શબ્દ નીમ્યા માટે પણ  
 વાપર્યો. આ 'મી' શબ્દની તોછડાઈ બહું માણસની ઓપરીમાં ખીલો  
 ઢોકવા બચાવર છે. માંઉ-પૂએ તુરત કહ્યું: "કેમ કાંઈ હીંડ ઉપર ચરબી  
 બહું વધી ગઈ છે!"

"હવે જાજા, ચભોજી! તારા જેવા તખો તો બહુ જોયા છે.  
 ચભોજી એટલે મૂળ માંકડ; તે પરથી ગઠિયો. તખો એટલે ચોર.  
 તખો અને ચભોજી જેવા શબ્દો વપરાયા ત્યારે છેવટે માંઉ-પૂએ પ્રત્યેક  
 બલદેશીની પરેશાનીની પરાકાણા દર્શાવનાર બોલ કાઢયો: 'માણં નાઈ  
 બુ.' (આ હું સહન નહીં કરી શકું.)

"તો થાય તે કરી લેજે."

બસ, ચુપચાપ જે પૈસા મળ્યા તે ગણી લઈને માંઉ-પૂ નીમ્યાને  
 લઈ ચાલ્યો ગયો. મહેતાજીએ પેલા રેણ્યા જુવાન તરફ ફરીને કહ્યું:  
 "જાખ મારીને લઈ ગયાં ને! આ લોકો સાથે સતનાં પૂછાડાં થયે કાંઈ  
 લાભ નથી. આખી પ્રજા દળદરીનો અવતાર છે. એને તો ઓલ્યા ઐથા  
 જ પહોંચો."

'ઐયા': મદાસ બાજુના ચેકીઓ.

## બર્માના ઉદ્ઘારકો!

શહેરમાં ગુજરાતીઓની નવીસવી, ખાનગી જેવી એક કામચલાઉ કલબ  
 હતી. શેઠિયાઓ ત્યાં બેસી રાને પાનાં રમતા, જુગાર પણ ખેલતા, ખેલતાં  
 છુકું ત્યારે ચા ને સિંગારેટ પીતા, અને પીતાં થાકે ત્યારે પછી ચર્ચા  
 કરતા.

જીવનના બેદારકો!

“મારા બેટાઓ! શું કાટવા છે આ બમા મજૂરો!” શાંતિદાસ શેઠની ફરિયાદ સૌથી વધુ સખત હતી, કારણ કે એના વ્યાપારમાં હમણાં પરચુરણ વસ્તુની દુકાનનો ઉમેરો થયો હતો. “પરમ દિવસ મારી બિસ્કિટની પેટીઓ આવી, કોણ જાણે ક્યાં તૂટી, અંદરથી એક ટિન કાઢી બોલીને મારા નેરા ગોદામમાં જ રોળે વળી બિસ્કિટનો નાસ્તો જાવી બેઠા. ન આજ લુંગની પેટી તોડીને દરેક જગ્યે અકેક લુંગી પહેરી લીધી. સરકારે જ ઉપર રહીને ફટવ્યા છે.”

“નાજ કાલી બૂ!” યાંગઉથી પોતાની શાખા તપાસવા આવેલા શામજ શેઠ ડિજનાં રમત-પાનાંને ધૂંકળી યાંગળી વડે ફેરવતા ફેરવતા ‘કોંલ’ કરતા હતા.

“એક આ દાક્તરને લીલાલહેર છે!” શામજ શેઠ દોર ઉપાડી લીધો: “બિસ્કિટ ખાઈ જાય, લુંગી પહેરી લ્યે, પડા ડિવનાઈનાંનો કોઈ બરમો બચ્ચો થોડો નાસ્તો ઉડાવી શકે છે!”

“ડોક્ટર સાહેબને તો બરમાઓ બહુ વધાલા છે.” ત્રીજાએ કહ્યું.  
“બરમા બરમી બધાં જ વહાલાં,” એમ બોલીને શાંતિદાસ લિંકનથી પાનાં ફેરવતા હતા.

“ડોક્ટર સાહેબનું ચાલે તો આપણાને ગુજરાતીઓને આંહીના રેપારધિયાથી બાતલ કરીને પાછા હિંદુસ્તાન ભેણ કરી મૂકે.”

“તો શું એમ માનો છો કે આ કપાળ-ગરાસ સદાકળ ભોગવી શકશે ગુજરાતીઓ? તમને તો શેઠ, એ બરમાઓ જ પહોંચો.” ડૉ. નૌતમે નજીક બેઠાં છાપું વાંચતાં વાંચતાં ટમું મૂક્યું.

“આપણા ભજોલાઓ આંહી આવવા મંજુબા તે દિવસથી જ આપણી સાડસતી બેઠી છે.” શામજ શેઠ પોતાના અભજાપજાને આડકંતરી અંજલિ આપી.

ડૉ. નૌતમે ફરી છાપમાંથી મોં ઊંચું કરીને પૂછ્યું: “આપજો શું આંહી પરોપકાર અર્થે બેઠા છીએ, હેં શામજ શેઠ?”

“પણ આપજો કાંઈ કોઈનું પડાવી લીધું તો નથી ના?”

પણ પદ્ધાય  
શાબું છે. વાર્ષાવાર  
નીમ્યા માટે પણ  
ઓપરીમાં પીલો  
ઢીઢા ઉપર ચરબી

નહું જોયા છે.”  
તાંપો એટલે ચોર  
માંટ-પૂંફે પ્રત્યેક  
નંદ્યો: “મખાં નાઈ

માંટ-પૂંફું નીમ્યાને  
તરફ ફરીને કહ્યું:  
પૂછાડાં થયે કાંઈ  
તો ઓલ્યા જૈયા

કામચલાઉ કલબ  
ખેલતા, ખેલતાં  
યારે પછી ચર્ચા

“સરિયામ હૂટ જ ચલાવી છે આપકો,” ડૉ. નૈતમે સાફ કર્યું  
“હિંકુસાનની જમીન દોરડે બાંધીને આંદ્રી લાવ્યા છીએ? સોનું તમે  
દચ્છો છો તે શું હિંકુસાનની ખાલોમાંથી આ ભલદેશીઓના કલ્યાણાંને  
આવેલ છે? ગોરાઓની સરકાર છે, અને રીજાવીએ છીએ ને બરમાને  
ઠગીએ છીએ કઈ નીતિની આપકો હિંદીઓએ છાપ પાડી છે? કયો  
હિંદી આંદ્રી મિશનની બનીને ઘર કરી રહ્યો છે? કયો સાધું કયો  
સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકાર આંદ્રી નિરાંતે રહ્યો છે? આ લોકોને  
આપકી સંસ્કૃતિનો કોણો પરિચય કરાવ્યો છે? કે કોણો એમની સંસ્કૃતિનો  
સમાગમ કર્યો છે?”

“સંસ્કૃતિ? આ બચાડાની સંસ્કૃતિ!” શાંતિદાસ હસ્યા: “તમે  
પણ દાક્તર! હવે તો ભાઈસા’બ ભાષાનો વ્યભિચાર કરો છો હો હો!!”  
‘ભાષાનો વ્યભિચાર’ એ શાંતિદાસ શેઠનો ખાસ પ્રયોગ હતો.  
ગુજરાતીઓનાં કોઈ પણ સભા-સમારંભ થતાં ત્યારે મુખ્ય વક્તા પોતે  
જ બની જઈ પોતે હંમેશાં ઉછળીને ભાષણ કરતા તેમના  
લાક્ષણિક પ્રયોગ આટલા -

જ્યાં જ્યાં વર્તે એક ગુજરાતી  
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

એ કવિ ખબરદારની ઢૂંક; અને બીજું -  
‘બર્મા, ધ લેન્ડ ઓફ પેગોડાસ!’ (બર્મા, ભવ્ય મંદિરોની ભૂમિ!)

ને તીજું -

‘ભાષાનો વ્યભિચાર!’

એમાંથી ‘બર્મા હજ ધ લેન્ડ ઓફ પેગોડાસ’ પોતે પંડિત  
જવાહરલાલની પધરામણી પછીથી વાપરવું છોડ્યું હતું. કારણ કે  
શાંતિદાસ શેઠ સ્વાગત-ભાષણમાં એ શબ્દો વાપર્યા તેના પર પણ  
પંડિતજીએ ટોકો લગાવ્યો હતો કે, “બસ! શું બર્મા ફક્ત પેગોડાનો  
(મંદિરોનો) જ દેશ છે! બાકી શું બર્મામાં કશું જ નથી? ગોરા લોકોએ  
ગોખાવેલું જ ગોખ્યા કરો છો? બર્મામાં માણસો નથી શું? મંદિરો જ

જમણા કોણકે!

છે કોકલા!"

"કાં શેઠ?" ડૉ. નૌતરે માં મલકાવીને પૂછતું, "શું વાંધો આવ્યો?

સંસ્કૃતિ ન કહેવાય?"

"અરે, આ ખરચું જઈને પાણી પણ ન લેનારી રેજા..."

એ વાક્ય પૂરું થતાં પહેલાં તો બે ગોરી મહિલાઓ કલબમાં

દ્વારા થઈ. એને આવકાર આપતાં શાંતિદાસ, શામજી વગેરે ઊભા થઈ

ગયા. ફુક્ત એક ડૉ. નૌતરે માણું છાપામાં દુલ્લાવી રાખ્યું

"જુઓને, શેઠિયાઓ!" ગોરી મહિલાઓએ અંગેજમાં રુઆબનેર

છાંટું: "અમે હર એક્સેલન્સીગવર્નર સાહેબનાં પત્નીના નામથી ભલી

લોકોના ઉદ્ઘારનું મિશન ચલાવીએ છીએ. આ જુઓ હીજ એક્સેલન્સીનું

ભલામજાપત્ર, એને બીજા સંભાવિત ગોરા અફસરોનાં પ્રમાણપત્રો. આ

રહી દ્વારાઓની ટીપ. આ વહેમોમાં એને કુંગીઓનાં ધર્તિંગોમાં ફસાયેલ

પ્રજાનો પુનરુદ્ધાર પ્રભુ કાઈસ્ટના દ્વારાધર્મ વગર થઈ રહે તેમ જ નથી.

કુ જેન્ટલમેન (તમે ગૃહસ્થો) આ ભૂમિમાંથી ઘણ્ણું લૂટો છો. તમારી ફરજ

છુ કે બર્મા પ્રજાના ઉદ્ઘાર-કાર્યમાં અમને મદદ કરવી. તમારી મદદની

હર એક્સેલન્સી બરાબર કદર બૂજશો."

એ ધોધબંધ વહેતા અંગેજના શબ્દપ્રવાહમાં જાહુ હતું. બોલવામાં  
વશીકરણની છયા હતી. બાઈબલનાં સૂત્રો સાથે 'ભગવદ ગી-યા'નો  
ઉલ્લેખ પણ આ મહિલાઓએ વીસેક વાર કર્યો અને 'ભ-ગ-વદ ગી...યા'  
શરૂદે તો શેઠિયાઓને પાણી પાણી કરી નાખ્યા. શેઠિયાઓએ એકબીજા  
સામે જોંયું અને ગોરી મહિલાઓએ ખરડાનો કાગળ ટેબલ પર છાયાથી  
બિછાવી દેતાં કહ્યું, "અમારા બર્મા પુનરુદ્ધારના મિશનના વાર્ષિક  
ઉત્સવમાં હર એક્સેલન્સી અમારા પ્રત્યેક દ્વારાને દુબરુ મળી ઓળખાજ  
કરવા ઉત્સુક છે."

"ભરો તારે, શામજી શેઠ," શાંતિદાસ શેઠે કહ્યું.

"ના પહેલા તમે, શેઠ."

"અરે વાત છે કાઈ? ત્રણ રાઈસ મિલોના ધણી બન્યા છો!"

પ્રભુ પદ્માંશ  
નૌતરે સાફ કહ્યું  
શીએ? સોનું ન મે  
એનોના કલ્યાણાંશ  
શીએ ને બરમાને  
પાડી છે? કયો  
કયો સાધુ કયો  
છે? આ લોકોને  
બેમની સંસ્કૃતિના

મહાયા: "તમે  
કરો છો હો!"  
સ પ્રયોગ હતો  
ખ્ય વક્તા પોતે  
કરતા. તેમના

દિરોની ભૂમિ!

પોતે પંડિત  
દંતું, કારણ કે  
તેના પર પણ  
ફંક્ટ પેગડાનો  
ગોરા લોકોએ  
શું? મંદિરો જ

“લ્યો ત્યારે, બાઈ!” એમ કહીને શામજીભાઈએ પોતાની રકમ

ચડાવી.

“વોટ!” એ રકમને જોતાં વાર જ ગોરી મહિલાએ વિસ્મયબન્ધું હાથ ચમકાવીને શામજી શેઠનો હાથ જાત્યો. એટલા સ્પર્શો તો શામજી શેઠ સાતમા સ્વરગનું રોમાંચ અનુભવ્યું. ગોરી મહિલાએ એમના હથમાંથી કલમ લઈ લીધી અને કહ્યું: “હર એકસેલન્સી મને ધમકાવી જ કરો કે બીજું કાંઈ? મને કહેશે કે સ્ટુપિડ! શામજી શેઠના રૂપિયા પચાસ! હોય કિ? આમ જુઓ. તમારો હથ ન ચાલે, જેન્ટલમેન! હું વધુ કશો ફેરફાર નથી કરતો, ફકત આટલો જ -” એમ કહીને એજો પાંચડા પર જે એક માંડું હતું તેની જોડે બીજું એક માંડું ચડાવી દીધું અને કહ્યું: “હર એકસેલન્સી કેટલું એપ્રિલિયેટ કરશે તે જાણો છો?”

“શામજી શેઠનાં નન્યાનોમાં હર એકસેલન્સીની એ ભાવી ‘એપ્રિલિયેશન’ (કદર) તગતગી રહી.

“અને હવે જેન્ટલમેન, તમે!” કહેતી બાઈ શાંતિદાસ શેઠ તરફ વળી. “તમે તો બર્મા લોકોને ખૂબ લુંટો છો. એનું પ્રાયશિત્ત કરો. પૂર્ણ પ્રાયશિત્ત કરો. કાઈસ્ટ પ્રલુની દયા હશે તો ઘણું વધુ મેળવી શકશો. પંથ ભૂલેલા બર્મન લોકોના એ તારણાણારને ખાતર થેલીની દોરી છોડી નાઓ. હર એકસેલન્સી જે કષ ઉકાવી રહેલ છે તેની સામે જુઓ. બોલો, શું ભરું?”

“આપને ઠિક લાગે તે.” શાંતિદાસ શેઠને હર એકસેલન્સી સાથે હાથ મિલાવવાનું મધુર સોષાલું આવ્યું.

એક હજારનો અંકડો પાડીને ગોરી રમણીએ શાંતિદાસને બતાવ્યો.

“બસ, એમાં મારે તો શું જોવાનું હોય! એજ યુ પ્લીઝ: જેવી તમારી ઈચ્છા!” શાંતિદાસ શેઠ ઢૂંકું પતાવ્યું. મનમાં એમ કે લેવા આવે ત્યારની વાત ત્યારે!

“ને હવે યુ જેન્ટલમેન!” બાઈએ ડૉ. નૌતમને પકડ્યા, “એમ

પ્રભુ પદમાય  
અને પોતાની રકમ  
લાગે વિસ્મયભર્ય  
સ્વર્ગો તો શામણ  
એમના ખાચમાંથી  
ધમકાવી જ કાઢે  
સુપિયા પચાસ!  
નેન! હું વધુ કશો  
એઝો પાંચડા પર  
દીધું અને કશું  
નો?"

ની એ ભાવિ

તેદાસ શેઠ તરફ  
ચિત્ત કરો. પૂર્ણ  
મેળવી શકશો.  
મીની દોરી છોડી  
ની સામે જુઓ.

એક્સેલન્સી સાથે

એ શાંતિદાસને

યુ પ્લીઝ: જેવી  
ન કે લેવા આવે  
પકડ્યા, "એમ

જમાના ઉદ્ઘારકો!

છાપા પાઈળ મોં છુપાવ્યે નહીં ચાલે. બોલો, શું ભરો છો?"  
"એક પાઈ પણ નહીં." ડોક્ટરે હળવે મોંયે જવાબ વળી વળી

પાણું છાપું વાંચવું ચાલુ રાખ્યું.

"કુમ? ભલ્લી લોકોના ઉદ્ઘારમાં તમારી જવાબદારી નથી?"

"તમે ઉદ્ઘારકો છો એમ હું સ્વીકારું તો ને?"

"તો શું એમ બગાડીએ છીએ?"

"કુદાચ એમ જ."

"આ તો ધૃષ્ટાની અવાજ!"

"એમ પણ ગણી શકો છો. કોઈ પણ પ્રજાને કોઈ બીજુ પ્રજાનો

ઉદ્ઘાર આ રીતે કરવાનો હક નથી."

"કંઈ રીતે?"

"એના ધર્મને, સંસ્કારને, રીતરિવાજોને ગાળો દેવાની અને એક

જિસ્તી ધર્મને જ સર્વોદ્ધારક ગણાવવાની રીતે."

"પણ એના હુંગીઓ..."

"એના હુંગીઓ ભલે ભાષ હોય, તમે કંઈ દેવહૂતો નથી. એના

કુંગીઓ એમને નહીં. પોસાય ત્યારે એ લોકો જ એનો અંત આણશે."

"આ સદ્ગ્રૂહ લેવા એમ અહીં નથી આવ્યાં."

"હું આપવા માટે કયાં તમને શોધતો હતો? પણ તમને ગ્રૂહ  
ગમતો નથી, પૈસા ગમે છે: જ્યારે તમે પોતે એવું માનવાની ધૃષ્ટા  
રાખો છો કે તમારો ગ્રૂહ બીજા સૌને ગમવો જોઈએ."

"હુર એક્સેલન્સી બાહું નારાજ થશે, ન ભૂલતા."

"નારાજ થાય તો ઓછેથી પતરો. એ રાજુ થાય તો જ જોખમ."

"તમારું નામ?"

"પૂછી લેજોને નીચે દરવાનને."

બબડતી બબડતી તે બેઉ ઈસુ-સેવિકાઓ ચાલી ગઈ. પછી ડૉ.

નોતમે શેઠિયાઓને કશું: "આમની તો ખબર છે ને? - ખરચુ જઈને  
પાણી લ્યે છે કે નહીં?"

શેડિયા મુંબાયા ડૉ. નૌતમે કહ્યું: “આ ભાવદેશીઓ તો એવો વહેમાં ખુલાસો આપી શકે છે, કે ભાઈ, અમને દેવો ને અપસરાઓ ઉપારી જતાં, એટલે અમારા ટેઇને થોડા મલિન રાખીને દેવોથી જે ઉગ્ર શોધવો પડયો હતો તેની આ પરંપરા અસલથી ચાલી આવે છે; પણ આ લોકોની પણ છે કાઈ વહેમરૂપે પણ ખુલાસો! ઉપરાંત, જેવા છે તેવા પણ આ ભાવીઓ આપણાને શોધવા નથી આવ્યા. આપણે એને શોધતા આવ્યા છીએ ને હેમલીયા વેચવા છેક એમનાં અંતઃપુરમાં પેસી જઈએ છીએ, એ બેટ ધરે છે તે ફણો-મેવા ખાઈએ છીએ, એની પાસેથી વસ્તુનાં વીસ ગણાં દામ પણ છોડતા નથી, એમાં એમની ગોબરાઈ કોઈ ઢકાશે ગંધાઈ છે આપણાને? અને આત્મસુધારણાનું કાઈ કામ એ ઉપાડે છે તો આપણે શું ઉતેજન આપીએ છીએ? આ ગોરી બાઈ તમને ખંખેજુ ગઈ. આઈ હિવસ પર બમી સુધારક-સેવકો આવેલા તેમને આપણે કાઈ કરું નહોંદું આખ્યું?”

“એ બધાં ઊંડાં પાકીમાં ઉત્તરવાથી શું?” શામજી શેડે સમેટવા કોશિશ કરી: “આપણાથી થાપ છે તેટલું કરી છૂટીએ. આપણે તો પરદેશી પંખીડાં! વાણી મારી કોયલ! આંહીં તો જવાહરલાલજી પણ આવે ને ગવર્નર પણ આવે. આપણે તો રોટલાથી કામ કે ટપટપથી? સૌનાં મન સાચવવાં પડે.”

“ભાઈસાહેબ! આંહીં આટલું રળીએ છીએ તો દેશની સેવામાં દાન કરી શકીએ છીએ. છાશવારે ઊરીને ફ્લાણા વિદ્યામંદિરના સંચાલક, ને ફીંકણા હરિજન આશ્રમના આચાર્ય, ને લોંકડા ગુરુકુળની છોકરીઓ, હાલ્યાં જ આવે છે. હુકાળ અને ધરતીકંપવાળાનો કોઈ પાર છે? સાથે ગાંધીજીની ચિહ્ની ને વલ્લભભાઈનો ભલામણનો પત્ર! આપણાને કોઈ દી વિસ્તારો છે! સૌને બાળવું પડે છે.”

“એ આપણી વાત સાચી છે, શાંતિભાઈ!” ડૉ. નૌતમે સ્વીકાર કર્યો, “હું કબુલ કરું છું. આપણાને જેમ આપકી કમાડી સિવાય બીજા કોઈ નૈતિક સાંસ્કારિક પ્રશ્નાની પડી નથી, તેમ દેશમાંથી ઝાળ્ણ કરવા

પ્રભુ પદ્મા  
દેશિઓ તો એવો  
ને અસરાઓ  
ટેવોથી જે ઉગાર  
આવે છે; પણ  
ઉપરાંત, જેવા છે  
આપણે એને  
અંતઃપુરમાં પેસ્ઝ  
એ, એની પાસેથી  
ની ગોબરાઈ કોઈ  
ઈ કામ એ ઉપરે  
ઈ તમને મંબેજી  
મને આપણે કાઈ

જી શેડ સમેટવા  
એ. આપણે તો  
બહરલાલજી પણ  
મ કે ટપટપ્યો?

દેશની સેવામાં  
નિરના સંચાલક,  
નની છિકરીઓ,  
પાર છે? સાથે  
આપણને કોઈ હી

નૌતમે સ્વીકાર  
સિવાય બીજા  
થી ફળા કરવા

બર્માની ઉદ્ઘારકો!

આવનારાઓને આપણી મૂંગવણોની પરવા નથી. તેઓ તો આપણાં નામ  
અને તમારું જેવાની છબીઓ હિંદનાં છાપાંમાં આપી ફૂતાર્થ ચાય છે.  
આપણે આપણો વળ કેવી ઠગાઈ કરીને ઉત્પારશું તેની તેમને કશી ખેવના  
રહ્યે."

"પણ કરવું શું?"

"હવે એમ કરો, શાંતિભાઈ!" નૌતમે કહ્યું: "જે કોઈ સેવકજી  
જીનો ભરાવવા આવે, તેમના ખરડામાં એમ લખાવો, કે આ પચાસ  
બર્માની રીતોને છેતરવાની કમાણી; આ એક બરમાનું ડાગરનું જેતર  
પડાવી વેવાની પ્રાપ્તિ; આ દસ ગુજરાતી પગારદાર નોકરોને ચૂસીને  
બચાવેલી રકમ ફિલાકી સંસ્થામાં આપું છું: બસ, એમ લખીને આપવું."

"તો શું તમને લાગે છે, ડોક્ટર સાહેબ, કે આ હિંદના સેવકો  
ભાવડા ન પાડે? આશા જ ન રાખતા હો કે!"

"હું તો કહું કે બર્માની આપણી કમાણી પર અગ્ર હક બર્માના  
ખુદની ખુદ બહીજનોના હાથના ઉદ્ઘારકાર્યનો રહેવો જોઈએ."

વાત તો બહુ વધી ગઈ. રાત પડી ગઈ. સૌ ઊઠચાં. ત્યાં શાંતિદાસ  
શેડ યાદ દીધું: "અરે ભાઈ, કાલે તો ઓલ્યા ઝો-સેંચીનો જલસો છે.  
ડોક્ટર, તમે આ લોકોની સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ કૂઠો છો, તો હાલો જોવા  
હાલશું કાલે? જાયે, પાંચસોનું ધાડું જ જાયે, ભલે બચારો જાટતો. આ  
બરમાઓ ઝો-સેંચી પાછળ તો ગાંડાતૂર છે. ઝો-સેંચી આવ્યો એટલે હવે  
ખાશોપીશે નહીં, ખુવાર મળી જશે એના નાચ ઉપર."

"મારો વા'લો બૂઢિયો, ભેળો સવાસો નાચનારિયુંનો કાફલો રાખે  
છું હો!" નીજાએ કહ્યું.

"નાચવામાં જ બર્મા જવાનું છે." શામજી શેડ ટકોર કરી. "જાયે  
ત્યારે ખાચીએ બચાડા ઝોશીને અને રાજ કરીએ ડોક્ટર સાહેબને.  
બાળીએ બર્માની સંસ્કરતી ખાતે પચાસ રૂપિયા!"

પરિયાશ કરીને સૌ છૂટા પડ્યા.

## ઝોસેંઠના નૃત્યમાં

સવાસો 'નાતમી'! એક મોટી ઝોજ!

'ના' કહેતાં માછલી, ને 'તમી' કહેતાં દીકરી: નર્તકીને બમ્મિમાં આમ મલ્લયુકુમારી કહે છે. માછલીને મળતો જ દેહ-ઘાટ, માછલી જેવી જ તરફતા, માછલીની જ કુમારી!

અથવા નાતમી એટલે નાટયકાની તમી (દીકરી) કહેતાં અપસરા, એવી સવાસો રંભાઓના ઘેર પીમના શહેરમાં ઊતરી પડ્યા. ઝોસેંઠનાં નૃત્યો બમ્મિને ગાંઠું કરે છે. આપણે ઉદયશંકર છે, તેઓને ઝોસેંઠ. નાટ્યજ ઝોસેંઠ પીમનામાં આવ્યો હતો. તે દિવસ એના નાટમંડળનું 'તીંજાં વે' હતું. 'તીંજાં વે' એટલે ઇન્ડ-ઇન્ડાઇન્નું નાટક.

દીવાલે બાંધીલા ચોગાનમાં કશા જ ભપકા અથવા કરામતો વગરની એક રંગભૂમિ હતી. બેઉ બાજુએ બે પાંખો હતી, બાકી બધું ખૂલ્લું હતું. પાંખો પાછળ થઈને નૃત્યકાર-પાત્રો એ રંગભૂમિ પર આવતાં અને નાટરંભ કરતાં.

ધાવજાં બાળકોને તેડી તેડીને બહી સ્ત્રીઓ જલસામાં ચાલી છે, પુરુષોના હાથમાં બાલોશિયાં અને અક્કેક ચટાઈ છે. બજ્જે રૂપિયાની છિક્કો લઈને પ્રેક્ષકો અંદર પ્રવેશ કરે છે, રંગભૂમિની સામે ધરતી ઉપર ચટાઈઓ પથરાય છે અને કુંદંબો બેસે છે. બાળકોને બાલોશિયાં પર સુવારે છે. કોઈ પોતાની જગ્યા માટે કલાહ કરતું નથી, કોઈને જગ્યાની સંકડાશ પડતી નથી. ધરતીમાતાનો ખોળો પહોળો છે. પ્રેક્ષકોને હૈયે શાંતિ છે. પહોળા બનીને સૌ નિરાંતરાં ઘૂંઠથબર બેઠાં છે.

પ્રેક્ષકશાળાની પાછલી જગ્યામાં, આ ભોંય બેઠેલાંના બ્લોકની તદ્દન છેવાડે કલઠાંઈઓ નાખી છે.

કલઠાંઈ એટલે ખુરશીઓ; કલા કહેતાં સામા કિનારાથી આવેલ હિંદીઓ અને ઠાંઈ કહેતાં બેઠક. હિંદીઓની બેઠક ખુરશી. એ બ્રલદેશનું

લેન્ડિંગ ગુલામા

આતન નથી. હિંદીઓએ પજા એ પારકી ચાટેલી એઠ છે.  
એ કલાઈ ઉપર એક પજા બરમો બેઠો નથી. હિંદીઓ આવી  
આવીને બેસ્તા ગયા. શેઠિયાઓના કુટુંબોએ ખુરશીનાં આસનો રેક્યા.

સાઈઓ પર સૌની સાથે બેસ્તાનો રેમને નાનમ લાગ્યો.  
હુમકુંવરની સાથે ડો. નૌતરમ દાખલ થયા ત્યારે વ્યવસ્થાપક

આવીને એને કલાઈવાળું સ્થાન બતાવી ગયો.

“આઈયે આઈયે, ડૉક્ટર!” શેઠિયાઓએ સાદ કર્યો.

“ના રે ના, આંહીંયે પાછા જુદા ને જુદા તરી નીકળવું? અમે તો

ત્યા સૌની સાથે જ બેસશું.”

એમ કહીને એ તો આગળ ચાલ્યા, ને શામજી શેઠ ટકોર કરી:

“આ ખુરશી ઉપર દાક્તરાજી સમાય પજા નહીં ના, બાપા!”

એમની પાછળ ભાઈ મનસુખલાલનો પરિવાર હતો. મનસુખલાલ  
ગુજરાતી, એને પત્ની બર્મા. સાથે યુવાન પુત્રી હતી.

શાંતિદાસે કહ્યું: “આ મનસુખલાલે તો રહી રહીને વીસ વર્ષ જતું  
પરણોત્તર જાહેર કર્યું.”

“તો આટલાં વર્ષ શું રખાત તરીકે રાખેલી?” બીજાએ પૂછ્યું.

“એમ જ ના?”

“ના રે ના, રીતસર ગૃહિણી જ છે. માત્ર લગ્નવિવિ નહીં કરેલ.”

“દૃશમાં એને પરણોલ સ્ત્રી છે?”

“નહીં.”

“ત્યારે પછી રખાત કેમ કહેવાય?”

“લગન તો કરેલ નહીં ને! પજા હવે દીકરી સાંઢો થઈ, પરણાવવી

જોશે, એટલે લગન જાહેર કર્યું.”

“આ રહ્યા મુરતિયા!” પાછળ ચાલ્યા આવતા એક યુવકને જોઈ  
શામજી શેઠ બોલ્યા. એ યુવક હતો રતુભાઈ. રંગૂનની ચાવલ મિલો  
છોડીને આખરે પાછા ફરી વાર એશે પીમનામાં સોના-જવેરાતનું પોતાનું  
જૂનું કેતે હાથમાં લીધું હતું.

“બાઈને કોઈ વેહુ નથી, ને બાઈને કોઈ દેહુ નથી. સરખાસરખી જોડ છે.”

“લાગે છે એ જ વેતરક્ષમાં.”  
એ બધાં રીધાં ચાલ્યાં ગયાં ને પોતપોતાની ચટાઈઓ બિલાવીને  
બમ્મા લોકોની સાથે બેઠાં  
ચટાઈ પર નુંચે બેઠાં બેઠાં ચોમેર નજર કરતા નૌતમે પણીને  
બતાવ્યું: “નીમ્યા હીઠી?”

“કયાં?”

“ઓ રહી.” આંખથી જ દિશા બતાવી.

“અરે, એની પાસે તો બાળક છે ને શું? કેવી કરી! એને છોકરું  
આયું તેને માટે આપણે કશ્ય ભેટ લઈ જવાનું જ ભૂલી ગયાં!”  
એમ કહેતી હેમકુંવર ઊઠી અને દૂર એક ચટાઈ પર બેઠેલ નીમ્યા  
પાસે ગઈ, નીમ્યાને જબકાવી, કોઈ ન કળે તેમ કેડે ચીમટીનો વળ  
દઈને ઠપકો આપ્યો: “ખબર પણ ન આપી કે?”

“માંડ માંડ બચી છું.” નીમ્યાએ પ્રસવ-પીડાની વાત કરી.

“તો અમને કેમ ન બોલાવ્યાં?”

“આ રૂપાળા શરમાઈને બેઠા રહ્યા!” નીમ્યાએ પતિ બેઠો હતો  
તે તરફ આંખો કરી.

“પણ હવે તું કરે છે શું? માની દુકાને બેસતી નથી?”

“ના, હમણાં તો રતુબાળુ એની દુકાનેથી ચીજો આપે છે તે વેચવા  
મહેનત કરું છું.”

“તું કિંકી પડી ગઈ છે.”

“અરે, હોય કાંઈ?” નીમ્યા બ્રહ્મી નારી હતી. એનો બોલ મોળો  
હોય જ નહીં. “એ તો આ છોકરો ધારે છે તેથી. બાકી તો લહેરમાં છું.  
બાબલો કયાં?”

“ઘેર નોકર પાસે.”

“એમ ઘેર કઈ મુકાય? આ જુઓને, અમારાં બધાં છોકરાં અહીં

ફ્રેન્ચ ગૃહ્યમા

કલેરથી જોવે છે.”

“મને શી ખબર કે આ રીતની બેઠકો હો? હવે તુ આ બધા શોસેના નાચ-મરોડો શીખી લેજે હો કે? તારે પાણી કોઈક ટિવિસ કમળમાં નાચવું પડશે ને? હજુય નાચે કે?”

“હો-હો! ઘરડી થઈશ તોપકા નાચવું નહીં છોકું.” બોલતે બોલતે એકો સઢો સમાયો.

“આ રઠિયાળા તેમ શાંત બેઠા છે?” હેમદુવરબહેને નીમ્યાના સ્વામીની સૂરત પર ટકોર કરી.

“નહીં રે! બેઠા બેઠા લેંથી સેલે (શિરુટ) ચસકાવે છે.”

“કઈ છે નહીં ને?”

“લવલેશ નહીં. આનંદ છે. મોજ કરીએ છીએ..”

બેઠ જીણાંની વાતો બંધ પડી. રંગાલય પર વગર ઘૂઘરે, વગર પૂકરે ન જાઓ થથેડા-લપેડા વગર ફો-સેન્ટિનું નૃત્ય હજારો આંખોને એક જ તારે પરોવી રહ્યું, ત્યારે મા-નીમ્યાનો પતિ કોઈ ન જાણે તેમ કુલઠાઈ(ભુરસીઓ)વાળા સમૂહમાં નજર ખુતાડી રહ્યો હતો.

આવીસ વર્ષનો યુવાન રંગભૂમિ પર હાજર થયો. એ ફો-સેન્ટિ નહીંતો, બુદ્ધદો ફો-સેન્ટ હવે સ્ટેજ પર આવતો બંધ પડ્યો હતો. આ એનો પુત્ર હતો. ચાપોચાપ લુંગીમાંથી એના પગ ચગવા લાગ્યા. એની સાથે રંબાઓનું વૃદ્ધ હતું. એક પછી એક દરેકની પાસે જઈને એ ફૂડાળે સહનૃત્ય કરવા લાગ્યો. પહેલો વિરામ આવી પહોંચ્યો.

કુલઠાઈવાળા ખુરશી-બ્લોકમાં વાતો ચાલી:

“ગોયું ખવરાવી દી એવું જ છે આ ફો-સેન્ટિનું, હુ ભાઈ! વાત તો સાચી. આમાં બરમાઓનાં કલેજાં હથ ન રહે.”

“જુઓ ને જુવાનિયાં ઊરી ઊરીને બહાર જવા લાગ્યાં.”

“સવારે આમાંથી કિર્દિકનાં માવતર ગોતાગોત કરશે, બીજું શું!”

“દીક છે ભલા આદમી! એ હિસાબે આપકાને કઈ નુકસાન નથી. એ બરચાઓ લહેર માણતા હશે તો જ આપજો બે પાંદડે થશું.”

સરખાસરખા

બિલાવીને

નૈતમે પણાને

નીં ગયાં..

પર નેઠેલ નીમ્યા

ચીમટીનો વળ

વાત કરી.

પતિ બેઠો હતો

થથી?”

એ છે તે વેચવા

બોલ મોળો

નો લહેરમાં છુ.

છોકરાં અહીં

“પણ કુંગારો વિકર્ષા છે, હો બાઈ! આ નાચશવેડા સામે એમની આંખ કાઢી છે.”

“તથીન્નયું પ્રદર્શન જોયું ને?”

તથીન્નયું એટલે દિવાળી આપણી દિવાળી કરતાં પંદર દિવસું વહેલો આવતો બલદેશનો દીપોત્સવ. તથુલામાં જીવા તોરથી તેઓ પાછી ઉડાડે તેલા જ તોરથી પાગલ બનીને બર્મા તથીન્નયુંમાં દીવા જલાવે. કાગળનાં ફાનસો, અંદર જલે દીવા, અને અંદર દીવા ફરતી કરીક પશુપણીની રચના કરી હોય. નદીમાં પણ દીવાનાં મોટાં સૈન્ધો તરે.

“શું છે એ પ્રદર્શનમાં?”

“બાવલાં બનાવ્યાં છે. એમાં એક સ્વી પરી થઈને આકાશમાં ઉડી જાય છે ને પાછળ પાંચ છોકરાં પૃથ્વી પર ટળવળે છે. બાવલા પર લખ્યું છે: નાચશવેડાનું પરિજ્ઞામ!”

“મારો રતુ પણ પક્કો લાગે છે હો!!”

“કાં?”

“ઓલી મનસુખલાલની બર્મા છોકરી બહાર ગઈ, પણ પોતે ઉઠ્યો નથી હતું.”

“આપણને જોઈને, બાકી તો ગોઠવાઈ ગયો લાગે છે.”

એટલામાં નવું નૃત્ય ચાલુ થયું.

ઇન્દ્ર બનેલો ઝોસેઈ કુમાર પાછો આવ્યો. ઇન્દ્રનો કોઈ ખાસ વેશ નહીં, માત્ર નવરંગી લુંગી એંજી ને ઘાંઉબાંઊ બદલેલ, પરંતુ ઇન્દ્ર રૂપે ઓળખાય વધુ આભૂષણોથી. જાણે હીરે જાણકતી વીટીઓથી ભરેલા હથનાં આંગળાં, હીરે જુદેલ બટનથી મઢેલી છાતીઃ બસ આટલા જ્યોતિકણો એને સર્વ પાત્રોથી જુદો પાડવા માટે પૂરત્તા હતા. અને એને સર્વની ઉપર લઈ જનાર તો એનું રૂપ હતું, એનું નૃત્ય હતું.

એક વિદૃષ્ટક પણ જોડાજોડ હતો. (આપણાં નાટકોના રાજની પાસે પણ એ જ રહેતો, આપણી ભવાઈનાં મુખ્ય પાત્રો પાસે પણ એ ડાગળારૂપે હતો. અને આપણામાંના નરોત્તમોની નજીક સાચા જીવનમાં

મુંદુના કૃત્યમાં

પજ એ ક્રાંતિની નથી હોતો!

વિદ્યુટ વઢેડ ઉભી કરી: “નાચવાની તકત છે? આ મારા મુંદુના બજીવૈયાને લગ્ની શકે તો કહું કે તું ખરો ઠંડ છો.”

“તૈનાર છું.”

“મોઈ ત્વામે.” (થાકી જઈશ, થાકી.)

“મમો ટેલુ.” (ન થાકું)

પછી તો એ નટરાજના પગ અને મૂંદુના પરની કર-થાપાટે, બેઉ વર્ષે રેગીલી સ્પર્ધા ચાલી. નટરાજે સાંકડા લુંગી-કૂડાને પગની કણીએ કળીએ કરી વેરી દીધી. મૂંદુને એ કળીઓના પજ છૂંદા બોલાવ્યા. હંજની છાતી ચાસે ભરાઈ ગઈ. એ જરીક પસીનો લૂછવા જાય ત્યાં તે વિદ્યુટ ચિત્કારી ઉઠે: “મોઈ ત્વારે!” (થાકી ગયો, બસ થાકી ગયો!)

“મમો ટેલુ, ખીમ્યા! મમો ટેલુ. (નથી થાક્યો, બાયા! નથી થાક્યો!) બજાવો મૂંદુના, ઝપટથી બજાવો.”

આખા પ્રેક્ષકગાળને અધ્યાર ઉપાડી લેનાર એ નૃત્ય હતું. કોઈનો શાસ હાલતો નહોતો. અને તે સૌમાં વધુ થડકાર નીમ્યાના હદ્યમાં હતો. શું થશે! ઠંડ થાકી જશો ને હારી જશો તો શું? હે ફ્યા! મારામાં કુ જોર હોય તે એનામાં સિંચાજો; નૃત્યનો વિજ્ય થજો. બધું હારજો, એક નૃત્ય ન હારજો!”

- ન છેવટે મૂંદુના તાલ ચૂક્યો, અને પ્રેક્ષકોએ તાળીના ગગડાટ કરી હથેળીએ તોડી નાખી. નીમ્યાનું દિલ ફ્યાને જૂડી પડ્યું.

ઈ, પજ, પોતે  
છ.”

ઈ ખાસ રેશ  
રંતુ ઠંડ રૂપે  
ઓથી ભરેલા  
બસ આટલા  
ન. અને એને  
નું.

તેના રાજની  
આસે પજ એ  
ચા જીવનમાં

પરોદિયા સુધી આ તીજ્યાં વે ચાલે. પુરુષો થાકે, પણ બની સ્ટીઅનોની રસ-પિપાસા તો છેવટ સુધી અતૃપ્ત રહે. રાત્રિના ગ્રંથક વાગ્યે કલઠાઈ-મંડળ (નુજરાતીઓ) ઉઠયું, તે વખતે પતિએ કહ્યું: “નીમ્યા!..”

“શીય!” (૩૭)

“મને તો હવે મીઠાં જોલાં આવે છે. હું જાઉ?”

“ભલે જાઓ. હું તો હવે ખતમ થયા વગર નહીં જ ઉઠું..”

“વાકુ!”

એમ કહેતો ઝડપલેર માંઉ-પુ બહાર નીકળી ગયો અને એક અંધારા ખૂઝપાનો ઓથ મેળવીને એકો પોતાની ધા તૈયાર રાખી દાંત એકો લીંસ્યા નહીં, એનો દેહ ધૂળ્યો નહીં, એની આંખોએ ખુન્નસ ટપકાયું નહીં, ફક્ત એકો પંજામાં ધાને મજબૂત પકડમાં રાખી અને લાગ લીધો. એક માણસ પસાર થયો, પાછળથી એની ગરદન પર માંઉ-પુની ધા પડી. એક જ ઝટકે કામ ખતમ થયું.

સવારે નાટકની સમાપ્તિ થયા પછી બાળકને પીડ પર બાંધી લઈ, અને ચારાઈ બાલોશિયું બગલમાં મારીને નીમ્યા થાકેલ પગલે ઘેર ચાલી જતી હતી. રસ્તે એકો પોલીસ અને લોકોનું ટોળું જોયું. ફૂડાળાની વચ્ચે કાંઈક તમાશાની બાબત હશે જાણી એ નજીક પેઠી. પણ જે જોયું તેથી એની છાતી ધડકી ઉઠી. આ તો પેલા શાંતિદાસ ઝરેરીના મોટા મહેતાજનું જ મુડહું! બે જ દિવસ પર એકો સોનાનાં ઘરેણાં બાબત તકરાર કરીને પતિને ‘ચખોજી’, અને ‘તખો’ કહી અપમાનેલો, અને પતિએ કહેલ કે ‘મખાં નંદિ બૂ’. તો શું પતિએ જ આ કાળું કામ કર્યું હશે? પોતે ચકળવકળ જોઈ રહી. અનેક માણસોની આંખો એના પર પડી. પોતાને લાગ્યું કે એ આંખોમાં શંકા ભરી છે. પોતે ઉત્તાવળે સરકી ગઈ. વારંવાર પાછળ જોતી હતી. જાણો દરેક માણસ પોતાની પાછળ

આવતો હતો! વેર પહોંચીને થોડી નિરાંત વળી પતિ બીજાસ્તો હતો.  
આરણું ઉઘાડીને પાછો પતિ તો ઘસઘસાટ નસકોરો જેણવા લાગ્યો.  
નીમ્યાએ માન્યું કે નહીં નહીં, આ તો ન હોય એ કામો કરનારો! એનું  
ખુલ્લો પછી બીજું આવે કદી?

તોપણ મન ન રહ્યું. માંટ-પૂરો ક્રોણીને જગાડ્યો. પેલા ખૂનની  
વાત કરી. પતિ તો સાંભળતો સાંભળતો પાછો ધોંટવા મંડ્યો. ફરી  
ક્રોણી, ચુમ્મી ભરી, પૂછ્યું: “કહો તો ખરા! તમે તો નથી કર્યું ને!”  
જવાબમાં એ જરાક હસીને પાંછો ઉંઘવા લાગ્યો. નીમ્યા સમજું ગઈ,  
અંદરથી કંઠી ઉઠી. પણ ઘૂંટડો પી ગઈ. બસ વાત એટલેથી જ પતી  
ગઈ. બર્મી પોલીસે પણ આ ખૂનને ગાજર કે ચીલઢું સમારવા કરતાં  
કર્ણી જ વધુ મહત્ત્વ આપી નહીં.

એ ખૂન અણપકડાયું જ રહ્યું. પણ તે પછી માંટ-પૂરુ વધુ ને વધુ  
અથી બનીને બેસી રહેવા લાગ્યો; પરસાળમાં ચારાઈ પર પડ્યો પડ્યો  
સેવે ઝૂક્યા કરે, એનાં ધૂમગૂંઘળાંમાં અનેક સર્પાકારો, સિંહકારો,  
છાણી-મોરલાના આકારો કલ્પી કલ્પી ધેનવેરી અંખોએ નિષ્ય નિષ્યા  
જ કરે. ન એ કોઈને પૂછે કે તમે ક્યાં જાઓ છો ને શું કરો છો, ન  
કોઈ અને કહે કે તું કંઈક ધંધી લાગ. બુદ્ધિ હજી પણ મર્યાદી વેચવા  
જતી હતી. બુદ્ધદો પણ પારકી રાખેલી થોડી-નો જરીનમાં કમોરદનું વાવેતર  
કરાવવા જતો હતો. ને નીમ્યા બાળકને પીડ પર બાંધી લઈ બજારે જતી.  
પોતે ટાઢતડકો વેઠતી, નબળાઈના સાંધા દુખતા, પોષજા તો કેવળ  
ભાત-મરણનું જ હતું, છતાં દુઃખ કે પીડા શી ચીજ છે તેનો વિચાર  
કરવા બેસવાનો તો આ ભલી સ્ત્રીમાં સંસ્કાર જ નહોતો. પતિ  
અપાંટ-શોપમાં જઈ કઈ ચીજ ગીરો મૂકી આવ્યો છે તેનો પ્રશ્ન એ કરતી  
નહીં. પતિ ક્યાં જય-આવે છે તેનો નજર એ રાખતી નહીં. પતિ નવી  
દુંગી-અંજળાના કે ઘાંટબાંટના પૈસા ક્યાંથી કાઢે છે એ પણ પૂછતી નહીં.  
ચાટે પતિને મોડા વેર આવવાની ટેવ પડી, તો તે પણ એઝો સ્વાભાવિક  
જ સમજું લીધું. રાતના બે કે ત્રણ બજારે આવીને એ બારણું ઠોકતો

શેકતો બોલવાને કે “નીમ્યા એ...!” એટલે સામ્રો ‘શિંયા’! (જી) એવો ટફુલો  
પડ્યો જ હોય, દાદર પર કણ (ચંપલ) સરકી જ હોય, અને શાંતિથી  
દાર ઉઘડત્યાં જ હોય. બીજુ વાર કદી સાદ કરવો ન પડે, અને બીજે  
કોઈ શાન્દ તે બાદ પણ સંભળાપ નહીં. નિઃસ્તબ્ધ રાત્રિના નિર્જન પદ્ધતિ  
બસ એ જ ટફુલો અને એ જ પડ્યો:

“નીમ્યા એ...!”

“શિંયા”

પાડોશીઓએ બીજું કશું કદી સાંભળ્યું નહીં. આવા તો મહિનાઓ  
પર મહિનાઓ ગયા. રાતે બાળક ઊંઘી ગણ્યું હોય તો પોતે બેઠી બેઠી  
પતિનાં ફાટેલ કપડાં સાંધવાનું પ્રત્યેક બ્રહ્મી નારીનું પાંચાંયું કર્તવ્ય બજાવ્યા  
જ કરતી હોય.

બીજું એક સુખ આ બ્રહ્મી સમાજમાં એ હતું. કે કોઈ પણ  
સગુંસાગવી કે પાડોશી આવીને એવી આધીપાછી નહીં કરે, કે તારે  
વર અમુક કક્ષા(મલબારી)ની હોટલમાં ગાપ્યાં ટીચતો હતો અથવા અમુક  
કોઈ બેઆબરુદ્ધાર ગલીમાં રાતે રજાતો હતો.

કોઈ જો આવતું તો તે હેમકુવરબહેન. એમને નીમ્યાના દેહની  
દશા દેખી ઊંદું લંગી આવતું, અને બેકાર પુરુષનું ઘેર બેઠા રહેવું, પોતે  
કાઠિયાવાડી હોવાથી, એને ખૂબ ખટકતું. એણે બે વાર ટકોર પણ કરી  
કું એ તદ્દન બેઠો શું રહે છે? તારી એને દયા નથી આવતી? આવે  
ડોક્ટર પાસે, તો હું એને કશાક કામે લગાડી દઉં. અને રાતે તો તારે  
એને બાહાર ભાટકતો અટકાવવો જ જોઈએ. તું તો બ્રહ્મી સ્ત્રી છે, અમારા  
જ પરવશ નથી.”

“સાચું,” નીમ્યાએ જવાબ વાળ્યો; “અમારી સ્ત્રી તરીકેની  
સ્વતંત્રતાની એ જ ખૂબી છે. અમે પરણતાં પહેલાં ગમે તેને પસંદ  
કરીએ, માબાપની સામે બંડ કરી ઊભાં રહીએ; પણ લગ્ન બાદ વાત  
જૂદી બને છે. એ મારી આડે આવે તો એને હું પીંખી નાખું; પણ તે  
સ્વિવાય તો એનું મૂંગું ને પૂરું પાલન કરવાનો જ અમારો સંસ્કાર છે.”

(૩) એવો ટંકો  
ય, અને શાંતિથી  
પડે, અને બીજે  
ના નિર્જન પદ્ધતિ

તો મહિનાઓ  
પોતે બેઠી બેઠી  
કર્ત્વ બજાવ્યા  
કે કોઈ પણ  
કરે, કે તારો  
અથવા અમૃત

મધ્યાના દેહની  
ઠા રહેવું, પોતે  
કોર પણ કરી  
આવતી? આપે  
રાતે તો તારે  
છી છે, અમારા

તરીકેની  
તેને પસંદ  
ન બાદ વાત  
આપું; પણ તે  
સંસ્કાર છે.”

બુદ્ધિ

“પણ આમ ક્યાં સુધી?”

“બેમાણી એકના મંત્રું સુધી..”

“બહુ કહેવાય.”

“તમને કેમ બહુ લાગી આવે છે? મને તો કશું જ થતું નથી..”

“તારા શરીર પર એની અસર છે..”

“મન પર જરીકે નથી. ને શરીર તો અમારાં ક્યે દાઢે તમારા  
તરીકાં અધીભર્મ ભાગ્યાંતાં!” કહેતી નીચ્યા હસી.

“પણ આ કઈ લતે ચડી ગયો છે તે તો...”

“ચૂપ!” નીચ્યાએ નાકે આંગળી મૂકી. “એ મારો પ્રદેશ નથી..

મન કશું જ યાદ કરાવશો નહીં.” દરેક વાક્યે એનું હાસ્ય વિરામાચિકનની  
ગરજ સપરું હતું. “ઝું ક્યાં જાઉં છું, ક્યારે જાઉં છું ને શું કરું છું એ  
મારો વર કદી નથી પૂછતો; તો એને એનું પૂછવાનો મારો કયો  
અધિકાર છે?”

“તારાં બા આવું કાંઈ નથી પૂછતાં?”

“અમારા બેની બાબતમાં નીજું કોઈ માથું મારી શકે જ નહીં. એ  
અમારો કુલાચાર છે.”

હુમકુવરબહેન અને ડૉ. નૌતમ વરચે આ વિશે રાતના વાગું પછી  
હંબાણથી વાતો થતી. ડૉ. નૌતમ એક જ સાર કાઢતા, કે જે પ્રજા જે  
શીતે પોતાના જીવનની ગઢય બેસાડતી હોય, તેને તે રસ્તેથી પગલું પણ  
ચુકાવવાનો આપણો હક નથી. હક તો નથી, પણ એમાં એ પ્રજાનું હિત  
પણ નથી. પરિવર્તન કદી આવવાનું હશે તો એના ને એનામાણી જ  
કોઈક કાંતિ જગશે. આપણે તો આપણો એક પણ વિચાર એમના  
દીખમાં સુધીએ કરવારૂપે એને કાને નાખવો જ નહીં.”

“પણ આ ભાયડો...”

“જો ઘેલી! ધાર કે એ ગાંડો અથવા અંગ હેત તો?”

“તો પણીએ એને પાળવો પડત.”

“ત્યારે એમ જ સમજવું કે મનપ્રાણનાં પણ ગાંડપણ હોય છે.”

“પજા આ તો આજી પજાનું ગાંડપજા છે.”

“હા, તો એ લોકો પોતાના સમગ્ર પુરુષવળને કયાં ગોચાની કે ગુજરાતીની ગાંડાની ઇસ્પિત્પાવમાં મૂકવા ગયાં છે? એ કરતાં તો, ઓરતજીની પોતે જ જો અહીં વધુ બળશાળી, વધુ સ્વતંત્ર, અને આર્થિક રીતે સ્વાવલભી છે, તો તેની ફરજ છે કે નબળી મરદજાતનું પાલન કરવું.”

“પજા કોઈ દિવસ એને ભાન પજા ન કરાવવું?”

“કહું છું કે ના. જે દિવસ આ પુરુષોને એ ભાન થશે, તે દિવસ સ્વીઓની સ્વતંત્રતા પજા તૂટી પડશે. હમજીં જે રણ છે તેનો જ ખાંધ માથે રહી શકે છે. બાકી હું તને કહું? હું જો તને પરષ્યા પહેલાં અંદ્રી આવ્યો હોત તો અંદ્રીની જ એકાઉ રળતી વહુનો વર બનીને હળવોકૂલ રહેત.”

“હજુય કરોને અડપ! શું બગડી ગયું છે?”

“તને તો દી-કઠણો ને રળી દેનારો આ મળી ગયો એટલે એમ જ કહે ને!” એમ કહેતાં એકો પાસે સૂતેલા બાબલાનો બરડો ચાબડાચો.

“સ્વાદ નહીં આવે સ્વાદ, બાઈડીનું રળ્યું ખાવામાં.”

“તને મારું રળ્યું ખાવામાં જરીકે એકો સ્વાદ આવતો જોતો નથી. રળી બતાવ ને બાઈ, પછી જો, કે કેવા સ્વાદથી બેઠો બેઠો દિવસો ગાયું છું. સાચું કહું છું, એકાઉમાં એકા સાત જન્મોનો તો ચાક લાગ્યો છે. તારા ગળાના સોગંદ.” એમ કહેતાં એકો એ સોગંદનું સાક્ષાત્ત સ્વરૂપ ગળે હથ મૂર્જીને સરજાવ્યું.

“જોયું ને! રળી ખવરાવનાર છો એટલે કે?” એમ કહીને હથડીએ પોતાની બેઉ સુંધોનો પરતિને ગળે હાર પહેરાવ્યો.

આમ આ નાનકનું બાબુ-કુટુંબ જ્યારે સુખ-સોડમાં સૂતું હતું, તે વખતે પીમનાના એક ફૂટપાથ પર નાનકડો બતાવ બની રહ્યો હતો.

એક ચીનો દુરિયાન વેચતો બેઠો હતો. દુરિયાન એક ખાસ એકલા બ્રહ્મદેશનું જ તિશીષ્ટ પ્રકારનું ફળ છે. એનું કદ નાળિયેર જેવું, ને એનું બહારનું કલેવર બરાબર શોળા જેવું કાંટાદાર! એને ચીરીને ખોલો એટલે

અંદરથી પાંચેક દળદાર ચીરિયાં પડે, એમાંથી નાની પેશીઓ પડે, અને જેનો પીળો ગરબ અમૃતનો આસ્પત્રાદ આપે, એની સોડમ ઘણાને ખરાબ લાગે છે, પણ એ તો ભલદેશીઓના વેનદેરા લહેરી સ્વભાવને વધુ ધૂરી આપતી માદક સોડમ છે.

આવું મીઠું ને મોટું દુરિયાન અનેક માણસો ખરીદી ખરીદી રાનીને કુપણે જાતાં હતાં. તે વખતે એક માણસ થોડે દૂર ઊભીને ટરપરટોયા મારતો હતો.

એને પણ દુરિયાન લેવું હતું. એ ગજવું તપાસતો હતો. એણે હેસા ગજયા. પાસે આઈ જ આના હતા.

“દી દુરેની ભેઝેલે?” એણે ચીના પાસે જઈ એક દુરિયાનનો બાબ પૂછ્યો.

“તૌ-મા.” ચીનાએ તોરથી બાર આનાની કિંમત કહી.

“પણ આ તો નાનું છે. આઈ આને આપીશા?”

“ત્વા, ત્વા, મી મસા નાઈબુ! (જ જ હવે, તું દુરિયાન ખાઈ રહ્યો!) બેરો મા કથી ભૂદ્ધલા?” (કોઈ દિવસ ભાજું છે દુરિયાન?)

“શું કહે છે?” ઘરાકની ખોપરી જાણી. “આ દુરિયાન મારી ભલદેશની પેદાશ. અને તું ચીનો ઉઠીને મને એમ પૂછી શકે કે મેં દુરિયાન ભાજું છે!” એમ કહેતાંક ને ઘરાકે દુરિયાન ઉપાડી ચીનાના નાક ઉપર આપટયું. ચીબલો ચીનો વધુ ચીબો બન્યો, કાંચાળ દુરિયાને અનાં નાકમોં ચીરી નાખ્યાં. મારનાર ઘરાક ઘરીપલમાં પલાયન થઈ ગયો અને દેર જઈ એણે સાદ પાડ્યો: “નીમ્યા... એ!”

“શિંય!” પ્રલંબિત ઉચ્ચારણવાળો અદ્ભુત મીકો ‘જ’કાર પ્રાસ પુરાવતો સામે સંભળાયો.

સો સો દુરિયાનો પણ એ ‘શિંય’ની મીઠાશને પૂરી પાડવા અશક્ત હતું.

છતાં માંંડ-પૂનું મન હજુય જંખતું હતું કે પોતે નીમ્યાને મારે દુરિયાન ન લાવી શક્યો!

## પતિ પલાયન

રોજની માફક એક બીજી મધ્યરાતનો સાદ: “નીમ્યા એ...”

રોજની માફક મેડી પરથી એનો પઠધો: “શિંય!”

અને રોજની માફક મેડીની સીડી પરથી નીચે ઉત્તરતી પટ્ટીના ફનાનો હળવો ઘબકાર.

બારણું ઉઘટે છે. બારણું ફરી બિડાય છે. બીજો કશો બોલાશ કે સંચળ સંભળાતો નથી. જમજમ કરતી રાત્રિ ચાલી જાય છે.

માત્ર થોડી વાર બતીનું અજવાણું જબૂકી જાય છે. સૂતેલી નીમ્યાના મોં પર પુરુષની મીટ બે ઘડી દોડાદોડ કરે છે, અને પરોઢિયા પહેલાં એ ઘરનાં ત્રણ જણમાંથી એક ઓછું થાય છે.

સવારે ઊઠેલી નીમ્યાના બિધાના પર એક નાનકડી ચિહ્ની પડી છે. ચિહ્ની વાંચે છે: “ચિન પાઈસાં ટલ્યામા મયાબુ. ધી લો અલા ફ્યા સુ બુધુ મા મલૌબાને.” (એના જિસ્સામાંથી મને એક પૈસો પણ નથી મળ્યો. પ્રભુને ખાતર, આવું કામ કોઈ કરશો નહીં.)

અક્ષરો પતિના હતા. પણ પૂરો અર્થ પમાયો નહીં: કેવું કામ કોઈ કરશો નહીં? કોના જિસ્સામાંથી એક પૈસો પણ ન મળ્યો?

ચિહ્ની મૂકીને એ ક્યાં ચાલ્યો ગયો?

ધીમે ધીમે અર્થ અંતરમાં ઉગવા લાગ્યો. કાંઈક બુંદું કામ, કશુંક કલીકમા કરીને તો એ નહીં ચાલ્યો ગયો હોય?

પૂરો અર્થ બેસતાં પ્રભાતે વાર લાગી નહીં. પોલીસ આવી પહોંચી હતી. એક ચેદીનું રાતે ખૂન થયું હતું. ખૂનીનો સગડ નીમ્યાને ઘેર નીકળતો હતો. પોલીસે પૂછ્યપરછ કરવા માંડી -

હમણાં પતિ શો ધંધો કરતો હતો? પૈસા લાવતો હતો કે નહીં? નવાં નવાં વસ્ત્રો, ઘડિયાળ અને વીઠીની ખરીદી કરી લાવ્યો હતો? એનાં નાણાં કોણે ચુકાવ્યાં હતાં?

નીમ્યાનાં નેત્રોમાંથી ચુપચાપ પછી રડવા લાગ્યાં. તે જ દિવસ  
૫૨ પતી એના સાડુ ને બાળક સારુ નવીનકોર વસ્તુઓ લાવ્યો હતો.  
કહેતો ક પોતાને સારી નોકરી મળી છે!

પોતે એ નવાં આભરણો પહેલ્યાં નહોતાં. પોતે તો બેઠી બેઠી  
બળજીવાનાં પાંચમું કર્તવ્ય કર્યા જ કરતી હતી: પતિનાં કાટેલાં વસ્તો  
સાંઘ-દૂરી, ધોઈ-ધશોઈ, ગડીઓ પારી આલમારીમાં મૂકવાનું કામ.

પોલીસ પૂરી તપાસ કરીને ચાલી ગઈ. પછી પોતે એકલી ઘરનાં  
બાર બીડીને ઘૂંઠાભર બેઠી બેઠી રડતાં રડતાં એક જ વાક્ય બોલતી  
હતી: મખાં નાંદ બૂ: મખાં નાંદ બૂ! (મારાથી આ સહન નથી થતું.)  
ઓહ! સહન નથી થતું.)

પતી મોડી રાતે ઘેર આવતો, કેમ બેકાર બેઠો બેઠી સેલે ફૂકતો,  
કેમ બાહુ બોલતો પણ નહીં, કેમ પ્રેમ પણ કરતો નહીં તેમ ગુરુસે પણ  
થતો નહીં, તેનું રહસ્ય હવે સમજાયું. શાંતિદાસ શેઠના મહેતાનું ખૂન  
કર્યા પછી એની ધા અસૂરી વેળાના કલીકમા તરફ વળી ગઈ હતી.  
એનો બજીની સ્વભાવ પુરબહારમાં ખોડી ઉદ્ઘો હતો. થોડા નુંએગા  
(ઉપિયા) તો ઠિક, પણ થોડા ટભ્યા(પૈસા)ની લાલચ પણ એને મારફાડને  
માર્ગ લઈ જતી હતી.

થોડું રડી લીધું. વધુ રડવાની વેળા નહોતી. વળતા દિવસે જ્યારે  
એની માતા હો-સ્વે મળવા આવી ત્યારે તો પોતે કાગળનાં ફૂલો બનાવીને  
દેચવા બજારે ચાલી ગઈ હતી. મા બજારે ગઈ, થોડી મિનિટમાં જ  
મા-દીકરીના વિલાપ, આચાસન વગેરે પતી ગણ્ય. વધુ સમય રેડફિવાની  
વેળા નહોતી. દુનિયાદારીની જંજાળો જો માનવીનું લક્ષ રેકી લેવા ઉભી  
ન થઈ હોત તો માણસ દુઃખને કયે ધાડે વિસારે પાડી શકત!

હુમુકુવરબહેન નીમ્યાને ઘેર આવ્યાં ત્યારે એઝો આ કુંભના  
રંગઢગમાં કોઈ મહાન વિપત્તિનાં બાબુ ચિહ્નિન કરી નિહાળ્યાં નહીં ઘર  
એંદું જ ચોખ્યાંકૂલ હતું. સઢોઉંનો શાશ્વત અને અંબોડાનાં પુષ્પો આભાદ  
હતાં. તનાખાનો ચંદન-દેપ નીમ્યાની ચામરીને છોડી નહોતો ગયો.

હેમકુવરબહેનને જોઈ નીમ્યાની આંખોમાં જળજળિયા આવી ગયા,  
પણ તુરત તેણે પોતાના મન પર કાબૂ મેળવી કાઢ્યો અને રોજની રીતે  
વાતો કરતી બેઠી. હેમકુવરે પૂછ્યું: “ક્યાં ગયો હતો?”  
“કોણ કહી શકે? શિર પર મોત છે.”  
“પાછા વળવાની વકી નહીં ને?”  
“નહીં જ તો.”  
“તું બા સાથે રહેવા ચાલી જઈશ ને?”  
“ના રે ના, મારાં ઘરડાં સાસુ-સસરાને કોષ પાળે?”  
“તમારામાં તો માનો વારસો મળે ને?”  
“હા, એની તો બહુ ચિંતા નથી.”

## લૂંગયા

પૃષ્ઠા એ જ મોટી ચિંતાનો વિષય બન્યો. બાપ બીમાર પડ્યાના ખબર  
મળ્યા પોતે માને ધેર ગઈ. બાપનું અલમસ્ત શરીર, મીઠાનો ગંગાડો  
પાણીમાં ઓગળતો હોય તેવી ઝડપે ગળવા લાગ્યું, કારણ કે એને  
દીકરીના દુઃખનો આધ્યાત્મ લાગ્યો હતો. માના મન પરથી જે પ્રસંગ સરી  
ગયો, તે પ્રસંગે બાપની સમતાને અંદરથી કરકોલી ખાવા માંડી. બેઠો  
બેઠો એ તો ચિરૂટ જ પીતો હતો. આઈંડ એ કરતો નહોતો. દીકરીની  
વાત પણ એ ઉચ્ચારતો નહોતો. સેલેના ધૂમાડાનાં ગુંચળાં જ એન્ના  
અંતરનાં ગુંચળાંના આકાર કહી બતાવતાં હતાં. બેઠાં બેઠાં જ એ ગળવા  
લાગ્યો.

નીમ્યા આવી તેને બાપે હમેશાની માફક સિમત કરીને જ સત્કારી;  
વધુ કશો વલોપાત બતાવ્યો નહીં એટલું જ નહીં, પણ બનેલા બનાવની

માય પદ્ધતિ  
ગજનિયાં આવી ગયા,  
એથે અને રોકની રીતે  
છે?"

બીજા પૃષ્ઠી પણ નહીં. મતલબ કે વેદનાના બળતા ઈંધજાને એક  
બંદર ઉત્તર્યું.

ડૉ. નૌતમની સારવાર બર આવી નહીં.

એક સવારે ડૉ. નૌતમને વેર માઝસ આવીને એટલું જ કહી  
ગયો: "રોનાંકાકિના સ્વામી શોંબી" (દેવ થયા). રતુભાઈને વેર પણ  
એ કહેલ પહોંચ્યું હતું. ડૉ. નૌતમ હેમદુવરને અને રતુભાઈને લઈ શોક  
ઘણવા પહોંચ્યા.

ઘરના ચોગાનમાં એક તંબૂ ઊભો કરીને અંદર લાંબી નવી પેટી  
મુક્કવામાં આવી હતી. આ પેટીમાં શબને સુવાર્યું હતું. હવા ન પેસી જાય  
તેવા બંધોબસ્ત સાથે પેટી પેક કરી હતી. પેટી ઉપર ગુજરાતી કુટુંબે  
પુષ્પો મુક્કયાં.

મૃત્યુને ચોવીસેક કલાક થઈ ગયા હતા. એક તરફ ખાંડું (શબની  
પરી) બનતી ગઈ ને બીજી તરફ શબને સુંગધી જો નવરાવી-ધોવરાવી  
નવા વસ્ત્રો પહેરાવી તૈયાર કર્યું. પિતાના પગને અંગૂઠે નીમ્યાના વાળની  
લટે તોડીને બાંધવામાં આવી. એ કલાકોમાં જેને રડવું હતું તેણે રડી  
પણ લીધું હતું.

નજીક ચોગાનમાં તંતુવાદી વગડતાં હતાં. વગડનારાં ભ્રમી  
સર્ગાંવહાલાં હતાં. સૂરો મૃત્યુના અવસરને અનુરૂપ હતા. બીજા કેટલાક  
બેઠા બેઠા કાંઈ ખાતા હતા, કાંઈ પીતા હતા, કેટલાક ગંજફો પણ રીપત્તા  
હતા, જુગાર પણ જેલાતો હતો, દાર પીવાનો વાંધો નહોતો. કોઈ પણ  
વાતે એમ સમજવાનો યત્ન હતો કે મૃત્યુ એ કોઈ આજધાર્યો અસાધારણ  
બનાવ નથી; મૃત્યુ પણ રોજિંદા જીવન જેવો, ખાવા ને પીવા જેવો,  
જેલવા ને ખુશી થવા જેવો બનાવ હતો.

પરસાળમાં બીજા બેઠા હતા ત્યાં ડૉ. નૌતમે ને રતુભાઈએ બેસીને  
ખરખરો કર્યો. ઘરવાળાઓએ જવાબ વાણ્યો કે 'ફ્યા લોણું લું ધી

1. ખાલી પેટીને તીતા અથવા તીયા કહે છે.

મધ્ય પદ્ધતિ

અલો મશીલું' (પલુને જે માણસની જરૂર પડે છે તેનું અહીં કામ રહેણું નથી.)

એક ખૂમચો પડચો હતો. તેમાં ટોપરાના ખમજ વળેરેનું કંઈક ખાવાનું બનાવ્યું હતું. આવેઠુંઓ સહુ એમાંથી મૂઠી મૂઠી લઇને બુકડાવતા હતા.

શોક કરીને પાછાં વળ્યાં ત્યારે હેમકુવરે વાત કહી કે "ઘરની અંદર બધાં બેરામાં આ જલસાની જમાવટ જણાતી હતી, પણ સોનાંકાકીની આંખો ફૂલીને લોલસાં થઈ ગઈ હતી. પોતે જાહેરમાં સૌને જવરાવતી-પિવરાવતી ને ગમત કરતી હતી. પણ મને મળી ત્યારે એકાંતે એની આંખોમાંથી આંસુનો ઢગલો થઈ ગયો હતો."

રતુભાઈને કહ્યું: "આખા પીમનામાં જેની હાક વાગે તેવી જવાંમદ્દ આ કાકીને પણ કેટલું વાગે છે! કોઈ ન કલ્યી શકે કે આટલી ઉમરને ને આટલા ગૃહસંસાર પદી પણ એ રહે."

"શુભને તો પંદર દિવસ ઘરમાં રાખે એમ લાગે છે..  
હેમકુવરબહેને ખબર આપ્યા.

"તો તો નીમ્યા રહ્યા પડશે." રતુભાઈને ચિંતા થઈ.

"કુમ?" ડૉ. નૌતમે પૂછ્યું.

"પંદર દિવસ સુધી રોજ જયાફંત ને જલસા ઉડશે."

"મારે તો કાકીને કહેણું હતું કે આવા કુચાલનો ભોગ દીકરીને ન કરી મૂકે." હેમકુવર બોલી.

"તો એ ન કહ્યું તે સારું કર્યું મેં વારંવાર કહ્યું છે ને કે આપણને આ પરદેશી લોકોને સુધારવા જવાનો હક નથી. એ તો અંગેજોને માટે જ રહેવા દઈએ!"

"હજુ તો એ બુદ્ધની પ્રતિમા પર સોનારુપાનાં પતરાં ચોડવા ચાહે છે."

"બચાડીને ફોલી ખાશો!"

"પણ નીમ્યા પોતે જ માને આગ્રહ કરી કહેતી હતી, કે મારી

મુખ પદ્ધતિ  
નું અહીં કામ રહેનું  
મજા વગેરેનું કરીનું  
ડી લઈને બુકડાવતા  
1. કહી કે “ઘરની  
આતી હતી, પણ  
પોતે જહેરમાં સૌને  
મળી ત્યારે એકાંતે  
ગાં તેવી જવાંમહં  
કે આટલી ઉમ્મરે  
એ લાગે છે..”  
2. થઈ.  
3. હશે..”  
ભોગ દીકરીને  
ને કે આપણને  
અંગેજોને મારે  
પતરાં ચોડવા

ખુલ્લાયા  
વાત દિવચારીને મારા બાપુની સદ્ગતિ ન બગાડજો..  
“કોને રોશું? આપણા અશાનને કે તેમના?” ડૉ. નૈતમે ફરી ફરી  
એકની એક વાત કહી.  
“પણ જંગલીપણાની તો હં કહેવાય ને? ઘરમાં મદહું પડ્યું છે,  
ન ખાંધાંપીણાં ચાલે છે. ગણે શે ઉત્તરે?”  
“તારા ને મારા બાપ મૂળા ત્યારે બારમે જ દિવસે કારજની  
મીઠાઈઓ ઊરી હતી તે ગણે શે ઉત્તરતી હતી આપણા હિંદી લોકોને?  
વાત એમ છે કે મૃત્યુના આચાતમાંથી કોઈ પણ પ્રકારે માણસ પાછો  
ચાલુ સ્થિતિમાં મુકાવા મથે છે.”  
“પણ આ તો ઘરમાં મુડહું...”  
“વત્તા-ઘોણા અંશાની જંગાલિયતની એ બધી એકની એક કથા છે.  
તતે ખબર છે કે સ્મશાને આપણા ગુજરાતીઓ શું કરે છે?”  
“શું?”  
“ચિત્તા બળતી હોય ત્યારે બીડી ને ચા પીએ છે. અને બીજી  
તતે તો ખબર છે કે તું જો આજે મરી જાય તો સ્મશાનમાં તારી બળતી  
ચિત્તા સામે જ મારે માટે નવા વેનિશાળાની વાતો ચલાવાય! બધું એકનું  
એક. ત્યાં આપણાં મૃત્યુ વેળા ભૂઢેવો લૂંટે, અંધી કુંગીઓ લૂંટ્યો..”  
ધર્મના નામે ચાલતી એ લૂંટનો, સ્મશાનન્યાગાનો દિન પણ આવી  
પહોંચ્યો. કતારબંધ કુંગીઓ આગળ ચાલતા હતા. તેમના લાથમાં અક્કેક  
પંખો હતો. પંખા પર સો સો રૂપિયાની નોટો ચોંટાડી હતી. એ નોટો  
કુંગીઓને ગઈ. અને શબની ધામધૂમ ખતમ થયા પછી માને ખબર  
પડી કે પોતે છેલ્લી વાર લૂંટાઈ ગઈ છે.

હતી, કે મારી

### દીકરાની વિચારમાં

હજુયે શિવશંકરની મા દેશમાંથી કાગળ લખાવતી બંધ નહોતી પડી. કાગળનો વિષય એક જ હતો: “દીકરા! હજારેક રૂપિયાનો જોગ કરીને મોકલ, તો હું તારું સગપકા કરું. આટલી રકમ વગર આપણો પાઠે ક્યાંય બાજે તેમ નથી. ત્યાંથી અંણી આવનારા આપણા કંઈક ભાયુનાં ઘર બંધાણાં, કંઈક રંગેચંગે લગન કરીને પાછા વળ્યા. તથેં ભાઈ, તું કેમ કંઈ જોગ કરતો નથી? બધા કહે છે કે તારે તો સારો નોકરી છે. તથેં તું કેમ કંઈ વિચાર કરતો નથી?”

શિવે જવાબો જ લખવા બંધ કર્યા હતા.

પછી એક દિવસ બર્માથી બે'ક સગાઓ માણાવદર નજીકના એક ગામે પાછા આવ્યા અને ગામમાં ચણભણ થતી વાત રાતે માળા ફેરવતી નરબદા ડેશીના કાને આવી:

“હું નરબદા કાકીજી! કંઈ ખબર પડી?”

“ના માડી! શેની ખબર?”

“આ તમારા શિવાની.”

“મારા શિવાની!” ડેશીનો ચાસ ફંડી ઉઠચો. ‘શિવે કંઈ કાજું કામ કર્યું હશે? કંઈ દગ્ગોફટકો કરીને નાણાં ઉચાપત કર્યો હશે? હું મારા શંભુ! હું મહાદેવજી! મારો શિવો તો તમે સમે હાથે દીધ્યો છે. એણે એના પિતુઓને ફૂભવ્યા જેવું કામ કર્યું હોય તો એ સાંભળું તે પહેલાં જ મારી જીવાદોરી જેંચી લેજો! એમ વિચારતી એ માળાના મણકા વધુ જોરથી ફેરવવા લાગી.

“તમે બહુ લાંબું કર્યું ને, નરબદા કાકીજી!” વાત કરનારે વધુ ભેદ ઉભો કર્યો: “તેનું આ પરિજ્ઞામ આવ્યું. તમારી છાતીએથી હીરાકંઠી છેવટ સુધી છૂટી નહીં.”

“શેની હીરાકંઠી, બાપુ! ને શી વાત?”

“હિરાકંઈ તમે ચૂલાની આગોળમાં દાટી છે તે વજી - બીજી કરી, કાકીજી? એ વખતસર વયાવી હોત તો આ દશા ન થાત તમારા શિવાની.”

“પણ શી દશા થઈ છે, મારી?” મા વધુ ને વધુ ચમકતી હતી. પણ એના હાથમાં માળા હતી. મન બોલ્યું કે ‘ઘેલી! મહાદેવને ઉઠાં ભલાવવાં છે? માળા કરતી વખતે પણ મનને સમતામાં નથી રહેવા હેઠું? શીએ મને છીપર માથે લૂગડાં પછાડે તેમ પછાડી રહી છે? શરમિંદી બનીને ડેશી પાછાં મણકા જોરથી ચલાવવા લાગ્યાં, અને વાત કુહેનારને વધુ પૂછતાં અટક્યાં. કહેશે એને કહેવું હશે તો!

“આ લ્યોને ત્યારે કહી નાખું, નરબદ્ધ કાકીજી! તમારે શિવે તો ત્યાં ઘર કર્યું એક બરમણ્ય જોડે.”

માળાના પારા ઘડીભર બંધ રહી ગયા. પછી નરબદ્ધ ડેશીને મનમાં કોઈ ગડ બેસી ગઈ હોય તેમ તેણે પાછી માળા ચાલુ કરી.

“ઠીક, એ તો ડેકાણાસર થઈ ગયો. પણ આ ભાઈશંકર ને લખમો આવ્યા તે કહે છે એ તો બહુ બૂઝું, કાકીજી!”

“શું કહે છે, બેન?”

“કહે છે કે ત્યાં તો બરમણ્ય માછલાં રંધી આપે છે ને તમારો શિવો એ ખાય છે.”

“હશે બાઈ! મહાદેવજી જાણો શું સાચું હશે. છોકરાને કોઈ બામજો દીકરી દીધી હોત તો હું નિરાંતવી ન્યાતમાં પડી રેત, બેન!”

“હા કાકીજી, હવે તો ન્યાતનેય વિચાર પડતી વાત થઈને!”

“માદેવજીએ ધાર્યું હશે એ થશે, બેન! આપજો શું કરશું?”

આમ માળાની સમાપ્તિ થતાં સુધી નરબદ્ધ ડેશીએ વાતને પચાવ્યે જ રાખી, પણ વાત કરનાર પાડોશાંના ગયા પછી એના અંતરમાં યુગો ને યુગો ભડકે બળવા લાગ્યા.

બીજું તો ઠીક, પણ મારા શિવને છોકરાં થશે તેનાં પરષ્પરજણનું શું થશે! અને આ બરમી બાયડી મારા શિવને સાચવશે કેટલા હી! એ

બંધ નહોંતી પરી  
રાયનો જોગ કરીને  
નર આપજો પણે  
દા કંઈક ભાયુંના  
એ તથે ભાઈ, તું  
સારી નોકરી છે.

નર નજીકના એક  
તે માળા ફેરવતી

શિવે કાઈ કાળું  
કર્યા હશે? હું  
હાથે દીધો છે.  
એ સાંભળું તે  
એ માળાના

કરનારે વધુ  
એથી હિરાકંઈ

તો ધંધારોજપાર કરનારી બાયકીઓ હોય છે. એના ધર્મીઓ તો બાપ્તિક  
થેર દોરાં જેવાં ને ગુલામ જેવા થઈ છોકરાં રમાડવા ને રસોઈયાણી  
કરવા રહેતા હોય છે. મારો શિવ શું ઘરની સંજવારી કાઢતો હોય?  
બાયકીનાં લૂગડાં ધોતો હોશે? છોકરાના ઘોડિયાની દોરી તાણવા બેસશે?  
અને શું એને એના બાયકી ધમકાવતી હોશે? કોને ખબર મારતીયે હોશે!

સાંભળ્યું હતું ઘણ્યું ઘણ્યું કે આંદી આપકા દેશમાં જે શાસન  
પુરુષો સ્ત્રી પર ચલાવતા હોય છે, તે જ શાસન ત્યાં બ્રહ્મદેશમાં સ્ત્રીઓ  
પુરુષો પર ચલાવે છે. શાન અને માહિતી દ્વારા એમણે પોતાના શિવની  
ફુર્દ્દ્દ્દા કલ્પી.

બાયકી બીડી કે હોકો પીતી પીતી ખુરશી ઉપર બેડી હોશે અને  
શિવ શું એના પગ તળાંસતો બેઠો હોશે! કે ઊભો ઊભો રસોઈ કેમ  
બગડી છે તેનો ઠપકો સાંભળતો હોશે!

પોતે ન્યાતબહદર ચવાની છે તેનો વિચાર તો ઝપ્તમાં આવીને  
પસાર થઈ ગયો. પોતાનું અમંગળ કલ્પવા એ થોભી જ નહીં.  
પોતાનામાંથી નહીં, પણ પોતાના સંતપ્તનાના સારામારા ભાવિમાંથી જ  
જીવનનો ચાસ જેંચનારી આ હિંદુ નારી આકુળવ્યાકુળ બની ઊરી,  
આખી રાત એકો ગૂણપાટના ડોથળા પર પડખાં બદલ બદલ જ કર્યા  
કર્યું.

પ્રભાતે ઊરીને એકો શિવાલયે જઈને ધાનાંમાનાં મહાદેવજીને  
પૂછ્યું: “હે મારા દેવાધિદેવ! તમે કહો એમ કરું. તમે હસીને જવાબ  
વાળો, તો હું શિવની પાસે પહોંચ્યું. તમારી પોતાની જેવી ઠિક્કા હોય  
તેવું જ મને જળવાજો, મારી સ્વાર્થી વૃત્તિને લક્ષમાં લેશો નહીં, દાદા!!”

તુરત એને મહાદેવનું સર્જેટ બાળ વધુ પ્રકાશિત, વધુ ચમક્યું  
લાગ્યું હતું. પણ રખે પોતે ખોટી હોય એમ વિચારીને એકો પૂજારીને  
પણ પૂછી જોયું: “અંઈ તો જુઓ, લાલગરજ મા’રાજ! આજ તો શિવનું  
બાળ હસી રહ્યું હોય એમ તમને નથી લાગતું? મારો દેવ મોં મલકાવીને  
જાડો કે મારી મનીધાનો જવાબ વાળી રહ્યો છે.”

મુખ પદ્ધય

બાળીઓ તો બાળ  
વા ને રસોઈયાં  
પરી કંભતો હશે?  
જી તથાવા લેસશે?  
નર મારતીય હશે!  
દેશમાં જે શાસન  
બલદેશમાં સરીઓ  
પોતાના શિવના

બેઠી હશે અને  
ઓબ્ઝો રસોઈ કેમ

અપટમાં આવીને  
ઓભી જ નહીં  
ભાવિમાંથી જ  
જ બની ઉઠી  
બદલ જ કર્યા

મણાદેવજને  
હસીને જવાબ  
જ હશા હોય  
નહીં, દાદા!"

વધુ ચમક્તનું  
એણે પૂજારીને  
જ તો શિવનું  
મો મલકાવીને

શારુ આવી

“છ મારી!” પૂજારીએ પણ એટલી જ અનુભૂતિ સ્વીકાર કર્યો:  
“મણાદેવજ તો જેવા બક્તો તેવા જવાબ વાળે છે. બોળિયો નાથ મારો,  
ક્રોછ ક્રોટતો નથી. એ તો છે હજરાદજૂર દેવતા! તમારું કમ ફેલ  
કરો મારી!”

“ત્યારે તો હું જઈશ. પણ એકલી શીદ જાઉ? મારી શારુને  
સાથે લેતી ન જાઉ? એય પરવારીને બેઠી છે. એને હવે જી વાગ્યાન  
છે? એને જોડે લઉં, નીકર ઓળી બળૂકી બરમદ્ય મારાં ને શિવાનાં તો  
જીછાં જ પાડી નાખશે. ઘરને ઉબરે ચડવા તો નહીં હે, પણ મારા  
શિવને મળવાનીયે રજા નહીં આપે!”

તૈયારી કરવાને એક જ રાત બસ હતી.. બે ટેકાણે તાળાં દેવાનાં  
હતાં. પણ ચાવી તૂટી ગયેલી, ને તાળાંને પણ કાટ ચરી ગયેલાં. જ્યાસતેલ  
લગાવીને તાળાં સાફ કર્યો. ગામમાં ભમીને ચાવીઓ હથ કર્યો. ચાર-પાંચ  
દિવસ ચાલે તેટલો સાથવો ઢળી લાધો. પાણીનો ગોળો ઘરમાં ઊંઘો  
વાળ્યો, અને ગૃહરક્ષા મહાદેવને ભળાવી, છેલ્લો દીવો ઘરને ગોખલે  
બળતો મૂકી, નરબદ્ધ ડેશીએ, ‘જરી રીકર્યુ પાસે નગર જઈ આવું છું’  
ઓમ કહીને માણાવદર છોડ્યું.

20

શારુ આવી

“ક્રોછ બાઈ તમને બોલાવે છે, શિવ બાબુ,” ખનાન-ટોની  
જીહરમલ-શામજ ચાવલ મિલના દરવાને ઓફિસમાં આવી શિવશંકરને  
જબર આપ્યા.

“કૃષાં છે?”

“દરવાજે.”

“કોણ છે?”

“બમ્મા તો નથી. લાગે છે તમારા દેશની.”

સાંભળીને શિવ ચમક્યો, અને એના સાતેક ગુજરાતી સાથી ઓફે  
ચોપડામાંથી માથું ઊંચું કરીને પરસ્પર જોયું.

“કેમ શિવુભાઈ!” એક જ્ઞો કહ્યું, “દેશમાં કોઈ વીસનોંની  
વસ્તુનીને તો નોંતા આવ્યા ને? એણો તો તમારો પીછો નથી લીધો ને?”

વીસનોંની એટલે વિસ નહોરવાળી, અર્થાત् વાઘણ જેવી પણ  
કાઠિયાવાડમાં કોઈ પરણો તેને એમ કહેવાય કે “ભાઈ, એને તો હવે  
વીસનોંની વળણી!”

“કેવડીક છે બાઈ?” શિવે અકળાઈને પૂછ્યું.

“જુવાન જેવાં લાગે છે.”

મૂળાયેલો શિવ મશકરીની શરદ્વાણીએ વીંધાતો બહારે નીકળ્યો.  
જઈને જુઓ તો બગલમાં નાનું પોટકું લઈને બાઈ ઉભેલી. વસ્ત્રો સંકોડીને  
ઓભી હતી. માથે વાળ હતા, પણ સેંથો પાડીને સરખા ઓળ્યા નહોતા.  
જોનારને સહેજમાં જગ્યાઈ આવે કે એ કેશ મૂળ તો કાળાભમ્મર હશે,  
પણ થોડીક ધોળી લટો ત્યાં ધસારો કરીને ધીરે ધીરે પેસી જઈને પોતાનું  
અરધું પરિબળ જમાવી બેઠી હશે. કાબરચીતરા કેશનુંયે એક અનોહંનું  
રૂપ હોય છે. ઘણા થોડાને જ એ રૂપની સરત રહે છે.

એ જ પ્રમાણે એ મૌંનો ઘાટ, ચામડીનો વર્ક, આંખોનો આકાર  
અને ડેળાનો પ્રકાશ, - આ બધાં અંગોની શોભા એવી હતી કે જોનારને  
ભૂતકાળમાં જ લઈ જઈ એવા ભણકારા જગ્યાવે કે આ સ્ત્રી એક વાર  
બહુ રૂપાળી હશે. એ ભણકારા જોનારના મનને વિશે વર્તમાન રૂપના  
અવશેષના કરતાં ભૂતકાળનું વધુ આકર્ષણ ને કૌતુક ઝડોણાવી રહે,  
એવી એ બાઈ હતી.

એ વિધવા પણ નહોતી, તેમ સધવા પણ નહોતી. રંડાપો અને  
સુહાગરાપણું, બે વર્ચ્યે એક એવી સ્થિતિ છે કે જેને નિરાણન નિજત્વ છે.

નજીક આવ્યા પછી જ શિવે ઓળખી. એ સ્ત્રી એટલું જ બોલી:

રાતી સાથીઓએ  
કોઈ વીસનોં ની  
નથી લીધો ને?..  
જો જેવી પત્ની  
અને તો હવે

હાર્દ નીકળ્યો  
વરનો સંકોડિને  
પોળ્યા નહોતા  
આમૃત હશે,  
જઈને પોતાનું  
એક અનોખું

નોનો આકાર  
કે જોનારને  
ની એક વાર  
માન રૂપના  
ગોળાવી રહે,  
રંડાપો અને  
નિજત્વ છે.  
જ બોલી:

### શારું આવી

“કું લેલા!” એટલા હોઠના કફડાટે એના દાંતની પાકીનું દર્શન કરાયું.  
દાંતના ઉપરી ગયેલા રંગો બોલી ઉક્ખા કે, એક દિવસ અમે આપીએ  
પોણના પાંદ અને મજૂદનાં તાંબૂલમાંથી ચૂયા હતા. પણ આ સ્ત્રીના  
જીવતરની કોઈક અજાણી ખરાશ અમને ધીરે ધીરે ખાઈ ગઈ છે, તાં  
હવે અમે જેટલા છીએ તેટલા તો દાંતની જોડે જ જગ્યાનું.

“અરે!” શિવે ઓળખી પારીને તુરત જ જે ઉદ્ઘાર કાંદ્યો તેમાં  
આદર અને અકાગમાનું, હર્ષ અને ઉચાટ બેઉનું મિશ્રણ હતું.

“શારદુ! તું!”

“નોણી કાંદ્યો ખરોને, લેલા!” ઓળખાયેતી સ્ત્રીએ સાડીનો  
સભૂગટ સંકોરીને ફરી મોં મલકાયું અને શિવના મોં પર મલકાટ  
આવવાની વાટ જોઈ. પણ એ વાટ શેગટ જતાં પોતે કહ્યું: “હું દેશથી  
જ આવી.”

“એકલી?”

“એકલી જ તો!” સ્ત્રીના એ બોલમાં પોતાની સ્થિતિનો  
વણખચકાયો એકરાર હતો. “આજ સવારે જ અમારી આગજોટ આવી.  
કુમ, ઘેર તો બધાં ખુશીમાં છે ન, ભાઈ? ભાષો તો નરવો છે ન?”

મોટી બહેનનો આ પ્રશ્ન વધુ મુંજુવનાર હતો. એજે જવાબ  
આપવાને બદલે સવાલ પૂછ્યો: “તું જામનગરથી આવી, શારદુ!”

“જામનગરથી ઘેર માણાવદર ગઈંતી, ને ત્યાંથી પરબારી આંદી  
મનમાં થયું કે લેને ત્યારે ભાઈને મળી આવું.”

કુમ જાણે ખનાન-ટો જામનગર-માણાવદરની વચ્ચે આવેલું કોઈક  
પરિચિત ગામડું હોય તેવી અદ્યાથી શારદુ નામની સ્ત્રીએ વાત કરી.  
ધ્યાંગંડ જો સાંભળી શકે તો એને કેટલું ખોટું લાગે! શિવશંકર જરીક  
ચિડાયો પણ ખરો. કાઠિયાવાડ બહાર કદ્દી ન નીકળેલી પોતાની કંગળ  
અનાથ બહેન શારદુની આ ધૂષ્ટતા તો હરકોઈ ભાઈને વધુ પડતી ભાસે.

મનમાં થયું કે હાલ, ભાઈને મળતી જાઉ! વાહવા! શરીરે પહેરેલ  
સાડીમાં તો બે-પાંચ થીગડાં છે. બગલમાં પોટલી છે. નથી સાસુ-સસરો.

ધર્મી ત્યાગ કરીને અદશ્ય થઈ ગયો છે, જામનગરમાં તો દિવસ આથમ્યા  
પછી શરીરોમાં પક્ષ જાય નહીં, પોતાના શહેરના સ્ટેશનમાં પક્ષ જેણે  
વર્ષોથી પગ મૂક્યો નહીં હોય, એવી શારદુ કહે છે કે ‘ચાલ ને ત્યારે  
બાઈની પાસે થતી જઈ’!

“તું તો શરીરે નરવો લાગછ, કાં બૈલા! ધારું ગજું કરી ગયો,  
હો શિવ! મેં તો સાત વર્ષ દીઠો. તું મને ઓળખી ગયો ખરું? મેં તો  
ધારેલું કે તું બે ઘડી ગોંગો ફેંફેં કરીશ ને હું તને છાયીશ. અંહીં નોકરી  
છે ને! સાંદું, સાંદું, બાઈ! બધું સરસ છે. રંગૂન તો રૂપાણું છે, અમારે  
નગરના કરતાં પહોળા રસ્તા. પાણી પીધું તે તો બહુ મીઠું લાગ્યું, હો  
શિવ! હું તો પીતાં ધરાતી જ નથી, અંહીં આવી ત્યાં તો ફરી તરસી  
થઈ ગઈ!”

“લે મંગાવી દઉ.” એમ કહી શિવશંકર પાસે ઊભેલા કૌતુકમળન  
મજૂરને અંદર બાસામાં પાણી લેવા મોકલ્યો. બાઈ કહે: “ના રે ના.  
હવે ઘેર જઈને વાત. કેટલુંક છેટું છે? કોઈને મારી ઓડે મોકલ ને. હું  
મારી જાણે જઈશ. તું તારે છો કામ કરતો.”

“ના, ના! હું આવું છું.” એમ કહેતો શિવશંકર પાણી અંદર  
ઓહિસમાં ગયો.

કમ્પાઉન્ડ વળોટાં તો એની કંધ પર વિચારની થપ્પીઓ પર  
થપ્પીઓ ચડી બેઠી: આ બહેન ક્યાંથી આવી ચડી હશે? એને ઘેર  
લઈ જઈશ તો શું થશે? બર્મા પત્નીના તો બાર જ વાગી જવાના. આ  
શારદુ, મારી એકની એક મોટી બહેન, પરણાવેલી ત્યાં દુઃખી થયેલી,  
એ મારી બર્મા સ્ત્રીને શે પાલવશે? પોતાનું તો બગડ્યું, તે હવે મારું  
ગાડવા શીદ આવી? દેશમાં ગયેલા પેલા મારા ન્યાતીલાઓએ  
ઇરાદાપૂર્વક જ મારું ઘર ભાંગવા અંહીં બહેનનું આકમણ મોકલ્યું  
લાગે છે. માંડ માંડ માળો કરીને બેઠો, ત્યાં કાળી નાગણી-શી આવી!

રજા લઈ, ચોપડા ઠેકાણે મૂકી, એ પાણી દરવાજે ગયો ત્યારે  
શારદુની ચામે ચાર-પાંચ બ્રહ્મી મજૂરણો ઊભી હતી. બહેન અને એ

તો દિવસ આથયા  
ટેનમાં પણ જેણે  
કે 'ચાલ ને ત્યારે

ગજું કરી ગયો,  
ખરું? મેં તો  
શ. અંહી નોકરી  
ઉપાયું છે, અમારે  
મીઠ લાગ્યું, હી  
તો ફરી તરસી

મેલા કૌતુકમળ  
નાં: “ના રે ના.  
મોકલ ને હું  
પછો અંદર

થપીઓ પર  
શે? એને ધેર  
જવાના. આ  
હુંથી થયેલી,  
તે હવે મારું  
યાતીલાઓએ  
મજા મોકલ્યું  
-શી આવી!  
ગયો ત્યારે  
કેન અને એ

### આર્થ આવી

બધા બેઠીને તો વ્યવહાર કરી શકતાં નહોંના. પણ એમની આંખો અને  
એમનાં હાસ્ય પરસ્પર પિછાન કરતાં હતાં. પોશાકનો બેઠ, વાચાનું  
અજ્ઞાતપણું, કંચું જ તેમનામાં રહેલા સામાન્ય સ્ત્રીપણાના સુમેળાની વરબે  
વિક્રોપ કરી શકતું નહોંનું, બહેનના કાબરચીતરા કેશ એની ફાટેલ સાડીનાં  
શંકાં વર્ચેથી આ બધી સ્ત્રીઓને કહી રહ્યા હતા કે એક વાર અમેય  
તમારા વાળ જેવા જ લાંબા, સુધ્યા અને કાજળાદેરા હતાં; અને એક  
દિવસ તો અમે પણ નવાનગરની ફૂલવાડીનાં ફૂલડા રાતીના એકાત્માં  
સજતાં હતાં. એક દિવસ જોબન હતું, મલકાટ હતા, ઉન્માદ હતો, આશા  
હતી, નીલામબર અમારે શિરે હતું, ને નાગમતી નદીનાં નીર અમારી  
ઉનાળાની કંઈ સમીસાંજોની પથારી હતાં.

ભાઈ પાછળ ચાલી નીકળતી બહેન એ સૌને બે હાથ જોડી નમન  
કર્યા રે પેલા ડોકિયાં કરતા કાબરા કેશની લટોએ આ બધી સ્ત્રીઓના  
સંભોંઊ પાસેથી જડાઉ ભો (કાંસકી) પણ મુંગી મુંગી માગ્યા કરી.  
“કંચું ભરાવદાર શરીર છે!” મિલમાં જતી મજૂરણોએ અંદર  
અંદર વાતો કરી, અને ઉપસેલી, છોળો દેતી છતી તેમના ખાસ  
વિચારનો વિષય બની.

“તું એમ ને એમ ચાલી આવી!” રસ્તે ભાઈએ બહેનને સામું  
જોયા વગર જ કાંઈક ઉધારી લેવા માંડી.

“તને ઓચિંતો જોવો હતો.” દુઃખો, અપમાનો અને છેલ્લે પતિના  
પરિત્યાગથી રીઢી બનેલી બહેન વિનોદ ઉડાડવા લાગ્યો.

“પણ અંહીં-અંહીં અમારી કેવી દશા હૈય... અમે કેમ કરીને  
માંડ ઠેકાડો પડ્યા હોઈએ...” શિવશંકર તૂટક તૂટક બોલતો હતો.

“ગાંડા!” બહેને કંચું, “કેવીક દશા ને શી વાત છે! સંસારમાં  
એ તો થતું જ આવે છે. તું ગભરાઈ શીદ જાય છે? આપણે કાંઈ  
ચોરીલબાડી થોડી કરી છે?”

“પણ પહેલેથી મને જગ્યાયું હોત તો બધું પાકે પાયે કરીને કાગળ  
લખત, ખરચી મોકલત. આમ લિખારી જેવી ચાલી આવી?”

શારદા શાંત રહી. એને ભાઈના આ બોલ જરીકે બોકાયા નહીં  
કારણ કે એ તો પેલા ઉંટ જેવી હતી. પીઠ પર નગારાં વગરી ગવાં  
થીએ તેને જોતરવાળો થાણી વગાડીને થોડો નસારી શકે છે!

ઘેર પહોંચયા પછી ભાઈ એને કહે કે, “તું આંદી પરસ્થાળમાં  
બેસ, હું અંદર જઈને વાત કરું છું.”

“હે, રામ રામ, ગાંડા! હું જ અંદર નહીં જાઉં? હું કાઈ મેમાન  
દ્ધું કે અજાણી થોડી છું? ચાલ મારી સાથે, નહીં તો મને લાયા કોણ  
સમજાવરો?”

શીધી જ એ તો ઘોડિયા પાસે ગઈ. એને ઝૂકીને બાળકને ઊંઘતો  
જોયો. બોલી: “વાહ રે, લે! આ તો બરાબર શિવા જેવો ને શું?” એમ  
કહેતાં તે મીઠડાં લેતી હતી, ત્યાં તો અંદરના કમરામાંથી બાળકની માત્રા  
આવી પહોંચ્યો. મીઠડાંની કિયા કરતી અજાણી સ્ત્રીને એણે પહેલી જ  
વાર ઘરમાં દીક્ષા પોતે તે કષેત્રે નખશિખ પૂર્ણ બબી સંજાવટ કરી હતી.  
બાગ જેવી મધ્યમધ્યતી હતી. ગરદન પરથી પવા(દુપદા)ના બેઉ છેડા  
સાથળ પર ઝૂલતા હત્તા.

“આ!” શારદુએ ભાઈને ભયથી પૂછયું.

“હા!” શિવ બીકથી એક જ અક્ષર બોલ્યો.

“ભાભી!” કહેતી જ શારદુ બબી નારી તરફ વળી, થોડી વાર  
થંબી, પછી એના મોં પર મલકાટ છવાયો, શાંત ઊભેલી બર્માના મોં  
પર પણ એ મલકાટનાં પ્રતિબિમ્બો પડ્યાં. શારદુ જરાક નજીક ચાલી  
અને એણે ભાઈની પત્નીને ખલે હાથ મૂક્યો.

શારદુ કાઢે ઉંચી હતી. ઉપલાં વજોમાં આવાં કદાવર ગજન  
કાઠિયાવાડમાં હવે વિરલ બન્યાં છે. ગજાદાર શારદુનો હાથ પોતાની  
સામે પોતાના ખંભા સુધી જ થતી પાતળી બર્માના આખા બરડા પર  
રેલાઈ ગવ્યો. અને પછી હાથ માથા પર ચડ્યો. અંબોડાનાં ફૂલોને અડ્યો.  
ફૂલ એણે ભાઈની વહુના શિર પર સરખાં કર્યાં ને કહ્યું: “હું-અં ને! છે  
તો અસલ કામકું ને શું?”

મહેમાન સ્ત્રીના હોક પરથી મલકાટનું ચંદન લેતી લેતી બાળીએ શિવશંકરની સામે જોયું. એસે હિંદીમાં ઓળખાજી આપી કહ્યું: "બહિન દ્રશ્યાસે આવી."

"આ-પ અ-બ-ર ન-હી દિ-યા?" બમ્મા ધીરે ધીરે હિંદી બોલી અને પછી એની આંખ પતિ તરફથી નજીંદ તરફ અધિગોળાકાર પણ પેડે હૈ.

..હિંદુસ્તાની બોલે છે ને શું! હિંદના લાગે છે આ તો. ચોખ્યાં હિંદના જ. એક લગારીક નાકની અસ્તી જો બાધાર હોત ને..." બોલતાં બોલતાં શારદુનાં નેત્રો ફરતી જગ-કિનારી બંધાઈ ગઈ.

પલ્લીના જવાબમાં શિવે બમ્મા બોલત્યા માંડયું: "મને જ એજે ખલર નહીં આપેલી. હું હિલગીર છું. એ તો પૂછયાગપાછ્યા વગર આવી. પછી એટલે અહીં લાવ્યા વગર છૂટકો નહોતો. તને અગવડ તો પડશે. નરાજ ન થતી. હું ગમે તેમ કરીને વળપાવી દઈશ."

જવાબમાં પલ્લીનાં નેત્રો વિસમયથી ઉંચાં થતાં હતાં અને એના મોં પરસા મલકાટનો ગુલાબ સહેજ કાંઠાની સખ્તાઈ ધારણ કરતો હતો રેટલું જ શારદા જોઈ શકી.

બમ્મા સ્ત્રીએ બમ્મા બોલમાં વાર્તાવાપ ચાલુ રાખવાને બદલે હિંદીમાં જવાબ વાયયો: "નરાજ! ક્યો-મે-નરાજ! બહિન ઘર આઈ ઉસમાં નરાજ કેસે?"

એનો વળતો ખુલાસો શિવશંકર બમ્મામાં દેવા જતો હતો કે તુસ્ત સ્ત્રી બોલી ઉઠી: "ન-હી. હિંદી બો-લિ-યે.." કહેતી જ એ હસી પડી ન શરમાઈ જઈ મહેમાન તરફ જોઈ ગઈ. બોલી: "ખ-ર-ા-બ મ-ન- લ-ગ-ા-નાં, બહિન!"

એમ કહી, શારદાનો હાથ જાલી એને ચાર્યાઈ પર બેસારી અને પોતે દૂધ વગેરે લઈ આવી.

બરાબર પોતે બમ્મા પોશાક પહેરીને બજારે પોતાની દુકાન પર દૂધ જતી હતી. એ પોશાકમાં પોતે દૂધ લાવીને નજીંદ આગળ ધૂટણીયે

જુદી અને પછી એ જ સ્વિયત્તિમાં બેચી રહીને પોતે કુમારથી મુખ્યમાં તૈયાર કર્યા. સામે બેઠેલ શારદાનું શરીર પદોળી પલાંકીએ સુંદર લાગણું હતું. પોતાની સામે કોઈ મંદિરની મૂર્તિ સમક્ષ બેઠેલ ભક્ત સમી ઝડેલી આ સ્ત્રી શારદાને પોતાનાથી જુદી છતાં પોતાના જેવી જ લગ્યા. મનુષ્યની લાગણી સર્વત્ર એવી હોય છે. પોતાનાથી જુદા દેશનું વાસી અપાલું નિકટ આવે ત્યારે મનનો આંદો કીસુકમાં ભીજાઈ છલછલ બને, પવેપવ નવીનતામાં પ્રવેશતા હોઈએ એવું ભાસે, સ્વભાવ સ્વભાવ લાગે, અને રખે આ બધું ખોડું પડે એવી હિકર થાય.

ભાઈએ બહેનને સમજ પાડી: “એ બજારે જાય છે..”

“તે ભલે ને જાય, તમે પકડ લે ઘડી પછી જાવ, એમને કામ હશે

તે કરી આવવા દો..”

સ્ત્રીને જે કામે જવું હતું તે જાણાવતાં શિવશંકર શરમાયો. ખુદ સ્ત્રીએ કહ્યું: “મેં જાતી થી દુકાન પર. મેરી દુકાન..”

“ભલે જાના! અમ ભાગ્યાદું રખ્યુંગી..” શારદાએ ઘોડિયા તરફ આંગળી બતાવીને રજા આપી. અને આવી રૂપાળી ભાભી બજારમાં દુકાને બેચી સેકડો પુરુષો સાથે વેપાર કરતી હશે એવો એક વિચાર પોષ માસના પવનના એક જ સુસવારા સમો એના મગજને ધૂજાવી ચાલ્યો ગયો ત્યાં તો સ્ત્રીએ કહ્યું: “નહીં, પીછે. આપ નહીં લો..” એમ કરતી પોતે નાહવાની ઓરડીમાં જઈ બાલકી સરખી ગોઠવી, પાડળની ચકલી ઉઘાડી આપી અને બચકીમાંથી શારદા પોતાનાં કપડાં કાઢે તે પૂર્વે તો એણે પોતે જે પહેરતી તે સાડીઓમાંથી એક સારી જોઈને ત્યાં ધરી દીધી પછી શિવ બધાર પરસાળમાં જતાં પોતે નાંદને સહેજ સિમત કરીને ધારે સમજાયું કે “મારાં પોલકાં તો તમને બહુ ટૂંકાં પડશે. શું કરું!”

‘હાય હાય! આ તો જો! નજર તો જો, ઝીણી નજર! મારા શરીરનો બાંધો પક્ષ નજરમાં રાખી લીધો.’ એમ આશર્ય અનુભવતી શારદુએ પોતાના દેહ પરનો કર્મરથી ઉપલો ભાગ મનમાં નિહાળ્યો

## શારહુ આવો

અને પોતાને છાપ દીધો: 'આટલી આટલી વિત્તા પણીય શરીર ગળ્યું જ નહીં! ઉલટાનું વધુ વધુ ફૂલનું ગણ્યું! સંતાપવા જતો લાણું હુંકાં પડ્યા. મને કઈ ઓછી હેરાન કરી છે આ શરીરે! મને પણ પણ લોકોની નજરે જૂઠી પાડી છે. મારું મન મેં કરમાવી નાખ્યું છે એ કોઈ માને જ નહીં. આ આગે પણ મને એ જ ઈશારો કર્યો. હજુ તો આવીને ઊભી રહી છું ત્યાં જ કાચાએ ચાડી ખાધી!

"પહેલાં આ શરીરે ચોળજો!" એમ કહીને બોજાઈએ તનાજાનો કેપ નાહવાની રૂમમાં બતાવ્યો. "ઠંડક વળશે. ને હું હમણાં જ દુકાને જઈને આવું છું." પતિને પૂછ્યું કે "થોડી વાર થોભી શકશો કે?"

"હાં, હાં, તમન્તમારે જાઈકે આવ. ભાઈકું અમ રોકેળી." એવું બોલીને શારહુએ એને થોડી વારને માટે પણ હૂર કરવાનું જરૂરી ગણ્યું, અને એ ગયા બાદ શિવશંકરને બહેને કહ્યું: "ભાઈ, તારે સંનાન છે, લુગડાં ઉત્પાર."

કપડાં ઉતારીને ધોતીભર બનેલા ભાઈને બહેને ખબર આપ્યા: "આ ગુજરીનાઈ?"

"ક્યારે?"

"માણાવદરથી મારે ઘેર નગર આવી હતી. એને આંદી આવવું હતું. આધાત લાગી ગયો."

"શોનો?"

"કોઈકે ખબર દીધા હશે. તારો કાંઈ કાગળ નહીં, એમાં ખબર દેનારાઓએ કંઈક ઘરનાં ચિત્તરામણ ઉઠાવીને વાત કરી હશે."

"શા વિશેની?"

"તારા લગન વિશેની. આ એમ કે તું મણી ખાતો હઈશ, ને બાયડીએ તને કોણ જાડો કેવોય કબજામાં રાખ્યો હશે, ગોલાપા કરાવતી હશે. એવું બધું, ભાઈ! તે એને તો જટ આંદી પહોંચવું હતું મને લઈને, પણ એનું હૈયું ત્યાં ને ત્યાં જ ભાંગી ગયું. મરવા યારે મારે હાથે પાછી મુકાલ્યું, કે મરતી મરતીએ રંગૂન પહોંચજે ને ભાઈના સુખદુખના

સમાચાર લેજે. હું બાના અંત્યેલિસંસ્કાર માંડ પૂરા કરાવી, માનુષવદ્દન  
જઈ ખોરડું વગેરે સંભાળી કરી, પછી આંહીં આવી. તને લખવાની વેળું  
જ નહોતી, બાઈ! એ બાપડી તો જવા જોગ હતી, પણ તારું સુખ જોવું  
વગર તારું હુંઘ કલ્પતી જ ચાલી ગઈ."

થોડી વરની શાંતિ બાદ બેઠનાં નયાંના શ્રાવણ-ભાદ્રવો વરસાની  
રહ્યાં. અને પછી સહજ પોકાર પણ શિવના ગળામાં ધૂંટાઈ ગયો.

પોતે સાન કર્યું. બહેને પણ નહાઈ લીધું. બેઠ બેઠાં બેઠાં વાતો  
કરવા લાગ્યાં. બહેને ભાઈના ઘરમાં ચોમેર, ચીજેચીજ, વસત ને વાનાં,  
ગોઠવણ ને સાજાવટ, રાચ ને રચીલું નિહાળી નિહાળીને કહ્યું: "બાને  
બાપડીને આ સાચી ખબર પડી હોત ને, તો સદ્ગતિએ જત. એ તો  
કહેતી ને, કે ન્યાત ગઈ ચૂલ્હામાં, મારો શિવ ગમે તે ઠેકાણે પરણી લે  
તો હાઉં, ગંગ નાયાં. પાંચ-દસ ઘડીમાં જ અહીંની પરખ મને તો થઈ  
ગઈ! રૂપાણું છે, ભઈલા! આફૂડાં વહાલાં લાગે તેવાં છે. વળી ધંધું  
પણ કરે છે!"

"નહીંતર મારી ત્રીસ રૂપરડીમાં તો શું પૂરું થવાનું હતું!" શિવ  
સ્ફોટ કર્યો.

"ત્રીસ જ મળે છે, એમ ને!"

"ત્યારે! પણ એય આ કદ્દી મારો નહીં. કહે કે તમે તમારે ખરચો,  
જોઈએ તો દેશમાં મોકલો."

"ત્યારે ઘરવહેવાર તો એ ચલાવે, એમ ના?"

"નહીં ત્યારે? એક ઘડીય નવરી ન બેસે. ચીજો પોતે બનાવે,  
મજૂરો રાખીને બનાવરાવે, ને દુકાન રાખીને વેચે."

"તો તું નોકરી શીદને કરશે? એના ધંધામાં જ ભળી જા ને?"

"એ કહે છે કે નહીં, તમારે પુરુષને અમારા આંહીનાં બરમા  
પુરુષો જેવા પરવણ ન બનવું. તમે મારા ધંધામાં આવશો તો મારા નોકર  
જેવા બની જશો. એ તો કહે કે તમે નવરા બેઠા રહો તોપણ હું એકલી  
કમાઈ કાઢિશ. પણ નવરો બેઠો નખોટ વાળો. બરમા પુરુષોના જેવું

માર્ગ અચ્છા

આપણે નથી કરવું."

"એ તો સાચી વાત, હો ભાઈ! તો તો એ બહુ સમજુ કહેવાયાં"

"હુકાને જઈને અમસ્તો બેસું, તો તેટલી વાર પોતે ઉભી ઉભી

જ કમ કરવાની."

"હુ બે! એક વાત પૂછું? આ બાઈઓ બીડી પાવે?"

"હા, નાનીમોટી બધી જ બીડી પાવે. પણ ખંડું જોતાં એ બીડી

જ નથી, શારદુ! એમાં તમાકુ જેવું કંઈ જ હતું નથી. મોં ચોખ્યું  
ગાંધારાનો જ ઉદેશ મૂળ તો હશે. આપણાં બેંં ભાંગ ઘસે છે ના, એના  
જેવું."

આમ બાના મૃત્યુનો પ્રસંગ થોડી ઘડી બીજી વાતો આડે ઢાંકણો  
તાં તો ભાલી પાછી આવી પહોંચી. રેણુ બેઉનાં મોં રેલાં દીઠાં. પણ  
એકએક કશું ન બોલતાં ઘરમાં જઈ કપડાં બદલી ગુજરાતી પોશાક  
પહેરી લઈ, અંબોડી પણ સેંચા વગરનો હતો તેને બદલે સેંચો પાડી,  
પોતે બહાર આવીને બેસી જઈને પતિને કહું: "તમે હવે જઈ શકો  
છો" એ ગયા પછી પોતે મહેમાનને પૂછ્યું: "ક્યોં રોચે હું?"

"મા મર ગઈ." શારદાની આંખો પલળી.

થોડી વાર ભ્રલી ભાન્ધીએ મૃત્યુના માનમાં મૌન પાળ્યું. પછી પોતે  
પૂછ્યું: "યાં-ક્યોં નહીં-આઈ, મા? બહુત-દફા ઠનકો કહા થા. તુમારી  
- તો, માલૂમ-ભી નહીં-થી..."

ભાઈએ જ વાત છુપાવી રાખી છે એવું શારદુને લાગતાં તે કંઈ  
બોલી ન શકી.

"શોંબી હો ગઈ માતા! ફ્યા કો જરૂર પડી. યાં કેસે રહ સકે?"  
ભોજાઈ દિલાસો દેવા લાગી.

શારદુના હૈયામાં નવા કુતૂહલે એવા ઘુઘવાટા આદરી દીધા હતા  
કુ એને માતાનું મૃત્યુ જલદી ભૂલી જવાની જ દીચણ થઈ. એણે તો આ  
ભાઈને જ જોયા કર્યું. મનમાં થતું હતું કે આને અંબોડી અડી લઉિ!  
પગનાં તળિયાંને સ્પર્શ કરું! નાક ચીબું છે તે પેંચીને જરા બહાર કાઢું!

“આપનાં નામ કયા?” શારદુએ માંડ પૂછ્યું.  
 “રાતકો બતાઉંગી.”  
 રાત પડી એટલે શારદુને ધ્યાય જાવી બહાર ખુલ્લા ગગળ ડેણા  
 લઈ જઈ આ સરીએ ચંદ બતાવ્યો: “જો ઠસકા નામ વહ મેરા નામ..”  
 “કયા?”  
 “મા-હ્લા હ્લા બોલનેસે ચાંદ. મા બોલનેસે બહિન..”  
 “ચંદા? ચંદ્રિકા? ચંદાબહિન?”  
 “હાં. અથ આપકા નામ બતલાઈએ..”  
 “શારદુ. જે ઋતુમં તુમ - ચંદ્રિકા - સરસ લગ્નો તે ઋતુવાળી  
 અમ શારદુ: વાદળ વિનાની સ્વરચ્છ-સુંદર -” શારદુ ચોખ્યું આકાશ  
 બતાવવા લાગ્યી.  
 “હાં-હાં-હાં-હાં -” મા-હ્લા ખૂલ ખૂલ હસી પડી.  
 શારદુ અને ચંદ્રા એકબીજાને લડાવવા લાગ્યા.

## ભાભીનાં તોક્ષન

“તમારે માટે આંહીં ઘરાકી ફાટી નીકળે તેમ છે. માલ લઈને વેળાસર  
 આવો. વળી રોટલીનો ગોળાકાર પણ હવે તો તમે કદી ન ધારો એવો  
 સંપૂર્ણ નીકળવા લાગ્યોછે.”

આવું નિમંત્રણ શિરે રતુભાઈને પીમના મોકલ્યું. રતુભાઈ  
 ખનાન-ટો આવ્યો અને મા-હ્લાને નમન કરી કહ્યું: “કેમ અમા! પૈસાનો  
 જબરો સંઘરો કર્યો લાગે છે?” ‘અમા’ એટલે મોટી બહેન.

“અકો એ...! ચુનૌરો પાઈસારો ના મલેબુ.” (પૈસાને તો ભાઈ  
 સંગ્રહવાનું અમે જાણતા જ નથી.) એ ભ્રલી જીવનના મંત્ર સરીખું

લાગન હેળા  
વહ મેરા નામ..

દિન..

તો અતુવાળી  
યોજનું આકાશ

ઈને વેળાસર  
ધારો એવો

હું રતુભાઈ  
મા! પૈસાનો

તો ભાઈ  
નંત્ર સરીએનું

પ્રચારિત ગોકું વાક્ય બોલીને માંડલાએ પોતાના લગ્નના એકના એક  
પ્રશ્નાસક ગરવા ગુજરાતીને સંતકાર્યો. પછી રતુભાઈ પાસેની સોનાની ને  
થિમિટેશન હીરાની પેરી ખુલ્લી થઈ.

શારદા તો કાયરની અંદર રસોડાના કમરામાં ભરાઈ બેઠી હતી.  
નંદાં-ભોજાઈ વરચે ત્યાં રકજક ચાલતી હતી. ભાની બહેનને ધથ  
આવીને બહાર જેંચી લાવવા વર્ષા યત્ન કરતી હતી. શારદા શરીરથી  
સાચી સોરઠિયાણી હતી. એનું શરીર બધું બધું તો મૂળથી જ હતું.  
એમાં પાણું ઠરાવથી જેવી ભાબીએ એ કાયામાં સે પૂરી હતી.

“મેં કંદું પકડ્યું છે, તેમાં મોં શોનું લાલચોળ થઈ જાય છે,  
બહિન!” એવા શાબ્દો ભાબી નંદાંને હિંદીમાં કહેતી હતી.

“નહીં, હિંદી નહીં; એ-નું એ બર્મામાં બોલો.” એમ કહેતી શારદા  
ભાલીને મીઠી બર્મા ભાષામાં બોલવાની ફરજ પાડતી હતી.

“નહીં બોલુંગ્યો.”

“તો નહીં આવુંગ્યો. કાયદો તે કાયદો.”

કાયદો તો શારદુએ પોતે આવી તેના વળતા દિવસથી જ એવો  
દાખલ કર્યો હતો, કે ભાબી જે કાંઈ કહે તે તેણે પ્રથમ બર્મામાં બોલીને  
પછી હિંદીમાં બોલવું.

“હ-પિછે-હમારી છૂપી બાત સમજનેકો મંગતી હૈ. સરચ્ય?”

“હ-હ-મનકી બાત જાણ ગઈ કે!” શારદુએ મર્મ કરેલો.

આ નિયમે શારદુને થોડા જ મહિનામાં બર્મા બોલીમાં પાવરધી  
કરી હતી. એને કાઠિયાવાડી બોલી બર્મા પાસે છોતાં જેવી લાગતી હતી.  
બર્મા તો જાડો શેરડીનાં પતીકાં!

“બહાર આવો, તો પછી બર્મા બોલીનાં કેટલાંય રહસ્યો શીખવીશ  
હું! એક એક શબ્દના આઈ આઈ અર્થો થાય છે. માટે કહું છું કે બહાર  
આવો.”

“પણ શું કામ છે?”

“મારે તમને શાશ્વતરવાં છે.”

“જા રે જા. મી નાદાન! મી ધૂતારી!” એમ કહીને મી (તુ) શબ્દના  
દુકાણો કરી શારદુ ભાણીને ચીડવવા લગે.

“એ ‘મી’ તો તમારા મોંમાં મને વધુ મીઠો લગે છે. પણ બોલો,  
શાકાગારનો શો વાંધો છે?”

“મારે નથી શાકાગારાનું. મારે વળી શાકાગાર શા?”

“કેમ?”

“હું તો બુઢુણી થઈ ગઈ છું.”

“બુઢુણી! ગાલ તો ફૂલ્યા છે, ને બુઢુણી! બુઢુણી હો તોપણ શું થઈ  
ગયું? શું શાકાગાર એકલી ઘોવનાનો જ ઈજારો છે?”

“કોઈ જુઓ!”

“કોઈ એટલે કોણ? શું કોઈને સાડુ શાકાગાર પહેરાય છે? હું  
તમારે ત્યાં આહી અમે તો અમારા એકના દિલને રીજવવા માટે પહેરીએ  
છીએ. ચાલો, ઉઠો. ઉઠો છો કે નહીં?”

“પણ —”

“પણ બણ કઈ નહીં, ઉઠો.”

“તમને મેં બધી વાત કરી દીધી છે.”

“હા હા, ન મેં એ સાંભળી લીધી છે. તે બધી વાતોને આંહ્લા  
શી નિસ્બંત છે? એ તો તમે ત્યાં મૂકીને આવ્યાં છો. અમે તો ગઈ  
કાલની શું ગયા કલાકની વાતોનેયે ન સંભારીએ. ઉઠો, અમારાં ઘરેણાં  
તો જુઓ!”

“ના, ના.”

“તો હું મારી બાને ઘેર રહેવા ચાલી જઈશ, હો! ને દુકાને તમને  
આવવા જ નહીં દઉં.”

“દુકાને તો હું આવ્યા વગર જ ન રહું.”

દુકાનની તો શારદુને રહ્યું લાગી હતી. દેશમાં દીઠી હતી, કેવળ  
ખોજણોને અથવા બકાલણોને દુકાનો ચલાવતી. પણ એકસામની  
આલેશાન બજારો ચલાવતી પ્રભાવશાળી બરમણો તો આંહ્લાં જ આવીને

હીં હતી. તેમની અદલ પણતા પુરુષો પજ અહીં જ નજરે પડેલા. કુનાદરી એ દીનતા નથી તેમ આધુકલાઈ નથી એ એંઝે અહીં જ દીકું. વિયારાજની સાંભળેલી વતો અહીં જ પ્રત્યક્ષ નીરાખી અને ભાઈએ પજ ભાવીના ધંધામાં મદદ કરવા જવાની બહેનને અનુમતિ આપી હતી. વળી બર્મા સ્વીચ્છે તો ઢીક, પુરુષો પજ પોતાને એકલી શારદુને બદલે મા-શારદા કહી બોલાવતા. કોઈ મશકરી નહોંનું કરતું. કોઈ તાકી નહોંનું રહેતું. કોઈ કામ વગર પૂછગાળ નહોંનું કરતું. પોતાના ને બર્મા સ્વીના દેહના ઘાટઘૂટ વર્ચે જબરદસ્ત અને આપોઆપ આગળ ધર્મી આવે રો અનેક અંગોપાંગોનો ભેદ છતાં. કોઈ તેની ચોટા પજ કરતું નહોંનું. ઉપરાંત, ભાભીએ તો ધંધામાં થોડો ભાગ પજ કરી આપેલો! એવી બજારમાં જવાનું બંધ થાય તો શું થાય? જીવનું કેમ ગમે?

ટાં દઈને શારદુ ઉભી થઈ, બધાર આવી. મા-હુલાએ રતુભાઈને કહું કે, “આમને મારે પેટ ભરીને શાકાગારવાં છે. બોલો, છે એમના માપની ચીજો? કે નથી ઘડાવવી પડશે?”

ઘડીક તો રતુભાઈ હેબતાઈ ગયો. કોઈ બર્મા બહેનપણીને તો આ પોતાનો ગુજરાતી પોશાક પહેરાવીને નથી લઈ આવી ને?

પજ એ તો અશક્ય હતું. કાયા જ પોકારી ઉઠતી હતી કે હું અંહીની નથી. એ કાયા પરથી દંદિ ચમકીને હોડી અને શિવા સામે ફરી.

શિવાએ કહું: “મારી બહેન છે, થોડા મહિનાથી આવી છે, એનું નામ શારદા. નજાંદને માંડ ભાભી મળી છે, ભાભીને માંડ નજાંદ મળી છે; અને શ્રીમતીને ધંધામાં થોડા પૈસાની કમાઈ થઈ છે, તે હવે જરવી શકતાં નથી. શારદાનું શરીર મહ્બવાની રફ લીધી છે.”

રતુભાઈએ શારદુના હાથ જોયા. કંડે કે ભુજા પર, એક ચૂડી ઉપરાંત કોઈ પજ વસ્તુ પહેરાતી હોવાનું જાંબું આછુંયે ચિહ્ન નહોંનું. વિધવા હશે!

ના, તો તો આ એક ચૂડી છે તે ન હોત, ને ચાંદલો ન કરતી

હોત હેર! જે હશે તે હશે, મારે શી પંચાત!

દાણાં અંતકરણો 'મારે શી પંચાત' એવું જ્યારે જ્યારે બોલ્યાં છે  
ત્યારે હડહડતું અસત્ય જ બોલ્યાં છે. એવી પાર્તી પંચાત કોણ જાણે  
ક્યારથી પણ પોતાની જ પંચાત બની જતી હોય છે!

શિવની સ્ત્રીએ તે દિવસે સાચેસાચ શારદુને દાગીને મણી દીધી  
સુભાઈને એ પોતાનાં સનેહીસંબંધી બર્મી કુટુંબોમાં અવારનવાર માલ  
લઈને તેડાવતી, ત્યારે સુભાઈ માલનું વેચાણ કરવામાં પોતાની  
વાકુલયાનું અદ્ભુત આકર્ષણ ઉભું કરતો, અને પાંચસોનું લેવા  
ઠચ્છનારને બે હજાર ખરચાવતો. પણ આ વખતે એની જીબ કોઈ  
અકળ કારણે સિવાઈ ગઈ હતી. શિવની સ્ત્રીએ વારંવાર ટકોર કરી કે,  
"માલ વેચવાની કળા કેમ આ વખતે પીમના ભૂલીને આવ્યા છો?"

"ધરનાં માણસ પાસે કળા શી વાપરવી?" એવો જવાબ વળનાર  
સુભાઈ અસત્ય વધો હતો. એની કળા મનમાં થનગનતી હતી, પણ  
એનું મન શારદુના રહસ્યાનું વાચન કરવામાં પરોવાઈ ગયું હતું. આવી  
દેહભરપૂર સ્ત્રી ગમગીનીમાં કેમ બેઠી હતી! આ ચહેરો તો અફસોસના  
ધરાડિયા બતાવતો નથી. જેને નિર્મળ કહીએ તેવું આ લાવક્ય છે. અંહીં  
ઉદાસીના ઘુવડનો માળો હોઈ જ કેમ શકે? અંહીં કોઈકની કંઈક ભૂલ  
થઈ ભાસે છે.

પોતે ને શિવ બહાર ગયા ત્યારે શિવે આપોઆપ બહેનનો  
ઇતિહાસ કહ્યો.

"તેર વર્ષે પરણાવેલી. સોળ વર્ષની થઈ ત્યારથી પતિ જામનગરની  
એક ધનવાન વિધવાની સાથે ચાલ્યો ગયો છે. આજે દસ વર્ષ પૂરાં થયાં.  
એક પણ કાગળ લખ્યો નથી. ખરચી કદી મોકલી નથી. બેઉ ક્યાંક  
દરિયાપાર ચાલ્યાં ગયાં છે. શારદુને એના સસરાએ થોડું ભણપ્તિ  
શિક્ષિકા કરી. તે પછી સસરો પણ મરી ગયો ને ધરમાં કાંઈ હતું નહીં.  
ધર પણ સગાંવહાલાંએ લઈ લીધું. પોતે નોકરી કરતી, પણ આ શરીર  
આવું ને આવું રહ્યું એટલે કોઈ ઠેકાણો નિંદાયા વગર જવી ન શકી.

યારે બોલ્યા છુ  
ત કોણ આજે

ને મહી દીધુ  
પારનવાર માલ  
માં પોતાની  
ચયસોનું લેવા  
જ જબ કોઈ  
ટકોર કરી કે,  
વા છો??"

બાબ વળનપર  
હતી, પણ  
હતું. આવી  
અફસોસના  
છે. અંહીં  
કંઈક ભૂત

ન બહેનનો

મનગરની  
પૂરાં થયાં.  
મેઉ ક્યાંક  
ભણાવી  
હતું નહીં.  
આ શરીર  
ન શકી.

આજ જ એનું કે દુઃખ એના દેહને ભાંગી ન શક્યું. સ્વભાવ જ એવો  
કે વિપત્તિના જાં વિસોટા ન પડવા આપે લોકોને વિંતા જ એ વાતની  
થઈ પડી કે આટલી દુઃખી હોવા છતાં આવી માતેલી રહી જ કેમ શકે  
છે! એ જ દ્વિકર એના ઉપરી અધિકારીઓને થઈ પડી. ઘેર બેઠી. ઘણાં  
કરોપવાસ કર્યાં. ભૂખ્યાં રહેવામાં બાકી ન રાખી. પણ પાછી પીએ તેથે  
લોહી બની જાય! લોકો અપકીર્તિ કરે તેનો કોઈ ધા જ ન હૂં. અમે  
પોતે પણ એના દેહની આ હીઠિલાઈથી એવા ગાહિ પોકારી ગયા કે  
પછી તો કુશંકાઓ જ કરવા લાગ્યા. મા પણ તેડારે નહીં. મહિને બે-ત્રણ  
ગુપ્તિયામાં જીવી કાઢતી; તેટલું હું અહીંથી મોકલતો. પણ મેં અહીં પરણી  
કાંબણું છે એવા ઉડતા સમાચારથી મા એને લઈ અહીં આવવા નિકળતી  
હતી. એ તો આને ઘેર જ મરી ગઈ, ને આ એકલી અહીં પહોંચ્યો."

"નન્દાંદ-ભોજાઈ બેઉને ફાંવી ગયું લાગે છે."

"અરે વાત પૂછો મા. પરસ્પર પાગલ બન્યાં છે. પોતાના જીવનની  
તલેતલ વાત એણે એણી ભાબીને કહી નાખી છે, ન ભોજાઈને હવે એક  
ઉધામો ઉપકર્યો છે."

"શું વળી?"

"શારદુને ફરી પરણાવવાનો."

સાંભળતાં જ રતુભાઈને કલેજે એક શેરડો પડ્યો - યાદો કે ઉનો  
તે તો તે પોતે પણ ન નક્કી કરી શક્યો. શિવાએ વાત પૂરી કરી -

"એ તો મારી સાચે ટો કરીને પણ મને રંગૂનના બંગાળી વડીલ  
પાસે લઈ ગઈ, આપણા હિંદી કાયદાનાં પોથાંથોથાં ઉથલાવરાયાં, ને  
આ લગ્ન થઈ શકે કે કેમ તે નક્કી કરાયું. વધુ ખાતરી માટે કલકત્તાના  
નામાંકિત વડીલની સલાહ પણ આ બર્મા વડીલ દારા મંગાવરાવી. લગ્ન  
થઈ શકે તેમ છે, કારણ કે પતિએ ત્યાગ કર્યા સાત વરસ ઉપરની  
મુદત વીતી ગઈ છે. હવે હઠ લીધી છે કે કોઈક હિંદી ઉમેદવાર શોધી  
કાઢો."

રતુભાઈ કાંઈ ભોલી ન શક્યો. શિવે એને ચમકાવતો વધુ પ્રશ્ન

કંધો: "એવો કોઈ મળે ખરો?"

"જોખમ ઉઠાવનાર જોઈએ. છેવટે નિકાલ ગમે તે થાય, પણ જે ચાલ્યો ગયેલો ધણી પાછો આવીને ખોટાસાચા પુરાવા ઊભા કરે કાયદાનો આશરો લે, તો વચગાળાની કમબળી વેઠવા તો માણસે તેવાર રહેવું જોઈએ."

"એવો તો આંદી કોણ મળે?" શિવે સૂચક ટકોર કરે.

બેઉ ઘેર પાછા ફર્યા. પછી રતુભાઈએ બેગ ઉપાડી.

"કુમ?" માનદ્ધલાએ ચમકીને પૂછ્યું.

"રંગૂન જઈને રાત રહીશ."

"આહી શા માટે નહીં?"

"ત્યાં કામ છે."

એ અસત્ય હતું.

એની આંખો શારદુને શોધતી હતી. માણસ જેમ શ્લોગ્રાફને ફેમમાં મઢીને જોવા ઈચ્છે છે તેમ રતુભાઈ પણ શારદુને પોતે સાંભળેલા એના હિતિહાસના ચોકઠા વચ્ચે એક વાર જોવા ઉત્સુક હતો. પોતે જોયેલી તે તો તવારીખ વગરની મનુષ્યાદૃતિ હતી. હવે જોવી હતી જીવનકથાનાં નકશી વચ્ચે જરૂરી છબી. આદૃતિ ભવે એ-ની એ જ હોય, નિરીક્ષકની નજરમાં એનાં નોખનોખાં સ્વરૂપો સરજાય છે. આદૃતિ પોતે તો કશું જ નથી, જે છે તે નન્યું વાસ્તવ છે. ને વાસ્તવ તો હાડપિંજર જેવું છે; એમાં રૂધિરમાંસ પૂરનાર તો જીવનનાં વીતકો, જીવનસંસકારો અને જોનારની દાદ્યિ હોય છે.

શારદુ અંદર બેઠી બેઠી ભાઈના છોકરાને પંપાળી રહી હતી. બહાર એ આવી ન શકી. પણ એ જેને અઢેલીને બેઠી હતી એ ભીત પણ, એના શરીરની વીજળીનો સંચાર અનુભવી રહી હતી. શારદુને ભય લાગ્યો કે ભીત ઓગળી રહી છે કે શું!

કાળ-વાક્યો

રંગુન શહેરમાં રાત રહીને રસુભાઈ જગયો તે દિવસ જનસમૂહ  
ભાલકલોલ હતો. નવીન આકંક્ષાએ ઠરાવઠીના અંતરમાં નાચતી હતી.  
જર્મનો વડો પ્રધાન ઊ-સો હુંગલન્ડ જવા ઊપડતો હતો. અંગ્રેજ સરકારે  
એને માનલખ્યું આમંત્રણ આપયું હતું. એ ત્યાં પહોંચે તેટલી જ રાહ  
હતી. બાબી જનોનાં નેત્રોમાં સંપૂર્ણ સ્વરાજ્યનાં સ્વાનાં ચમકતાં હતી.  
ચાંચિલને રીજવવા ઊ-સોએ ખાસ બબી બનાવટની ખુશબોદાર ચિરુંદેનો  
દાબડો સાથે લીધો હતો. સ્વરાજનું વરદાન લેવા જનાર આ પ્રતિનિધિની  
વિદ્યામાં 'ઊ-સો યાં ત્વા!' (ઊ-સો પાછો જા!) એવા વિરોધી પક્ષના  
પોકાર પણ ઊઠચા એને બીજે પક્ષે તિન્નામન્યે પણ બેલાયા. ઊ-સોનું  
વિમાન હુંગલન્ડ ભક્તી પાંખો ગજાવતું ગરુડગતિએ ઊડવા લાગ્યું એને  
રસુભાઈ, પોતાના હદ્યમાં શારદાના સ્મરણનો નવો બોજો ભરીને, પાછો  
પીમના આવ્યો.

પીમનામાં રોજ પ્રભાતે પહેલું કામ રસુભાઈને માટે નીમ્યાને ઘેર  
જઈ એના બાળકને રમાડવાનું રહેતું. ને દિવસથી એ કાંઉલે 'અકો'નો  
રાહ જોતો હતો. અકો ક્યાં ગયા છે? અકો ગયા છે યાંગાઉ. અકો તારા  
સાડુ કુંગી-પોશાક લેતા આવશે. તારે ભિક્ષા માગવાનાં પાતરાં લેતા  
આવશે. મારો કાંઉલે મોટા ઠાકમાડ સાથે કુંગી બનશે. કુંગીએ એને  
ચાંઉમાં તેડી જશે. ચાંઉમાં હું ને અકો તને મૂકવા આવશું. ત્યાં તારા  
કાન પણ વીંધશું. પછી તને ચાંઉમાં છીડીને પાછાં ચાલ્યાં આવશું. વળતે  
દિવસે પ્રભાતે કુંગીએ ભિક્ષા લેવા નીકળશે. આગળ એક મોટા કુંગી,  
તેની પાછળ તેથી નાના, તેની પાછળ તેથી પણ નાના, એમ એકની  
પાછળ બીજા, નાના ને નાના, ચૌંદ વરસના, બાર વરસના, નવ વરસના,  
છ વરસના, ને તેની પાછળ છેલ્લો મારો ચાર વરસનો બાળો કુંગી:  
પ્રત્યેકના હાથમાં અક્કેક પાતરું (ભિક્ષાપાત્ર): મારો બાળુડ જોગળના

હથમાં પણ બટકડું પાતડું. પીળાં પીળાં વસ્ત્રોની હાર, મોટા પગ ને  
નાના પગની હાર, લાંબી લાંબી લાર કતપર આવશે; માર્ગ ઉપર ઘેરઘેરથી  
સ્ત્રીઓ જોવાવશે. ચીનવશે કે ફ્યા! વહોરવા થોભો, રંક નારીના ચાવલ  
વહોરો! હુંયે જેણી હઈશ આપણી શેરીને નાકે. લળીને પોકારીશ કે  
'ચ્યાબા ફ્યા.' મા મા કરતો તું મને બાજી ન પડતો હો, કાંઊલે! ઘેલો  
બનીને મારી અੱજ ન પકડી લેતો. આઈ દિવસ તો કુંગી રહેજે, જેગી  
રહેજે. ગોઢમા ફ્યા (ગૌતમ પ્રભુ)ને રાહૂલ પણ તારા જેવડો જ હતો.  
તારા સરીઓ જ ફૂટડો હતો. તારા જેવી જ એને મા પશોધરા વહલી  
હતી. માંને એને લઈ ગોઢમાને વહોરાવી દીધો'તો, તોયે કંઈ માને જાલી  
હતી એણો?

આઈ દા'ડાના એ તો અણમોલ બાળજોગ સૌને માટે સર્જિયા  
છે, બાપુ! લિક્ષાનું પાત્ર ધરજે ને હું તને ચાવલ વહોરાવીશ. જગત તને  
જોવા મળશે. આવડો બાળ કુંગી જગતે કદી જોયો નહીં હોય. ભવના  
તારા ભાર ઉત્તરશે. તારા પિતાનાં પાપ પ્રજળશે. આઈ દા'ડે પાછુ  
વળજે.

ચાંઉમાં રહેતાં બીજા નહીં ને? રાતમાં બાને શોદીશ નહીં ને?  
કુંગીઓ તને મારશે નહીં હો! કરડી આંખો કરશે નહીં. કોઈ કટાણું  
વેણ કહે તો ગોઢમા બૌદ્ધની મૂર્તિ પાસે જઈને કહેજે. ફ્યા તારી ફરિયાદ  
સાંભળશે.

- ને જો હો! એક વાત કહું છું તે કોઈને કહીશ નહીં હો!  
ગોઢમા ફ્યાને છાનોમુનો પૂછી જોજે કે બાપુ ક્યાં હશે? મામા ક્યાં  
અલોપ થઈ ગયા? અને બાપુના ફરી મેળાપ થલાના! છે કે નહીં?

રાતે નીમ્યાએ 'અકો'ની વાત જોતા બાળકને ઉંઘાડતાં પહેલાં  
એની દીક્ષાનાં આવાં દિવાસ્વન ગુંથવાં ચાલુ રાખ્યાં હતાં. પ્રત્યેક ભ્રણી  
બાળકને માટે જીવનનો જે મહોત્સવ મનપતો, તે આઈ-પંડર દંહાડાની  
બાળ-દીક્ષા. એ માટેનું માતાપનું આ રટણ હતું. (છેક પ્રભુ બુદ્ધથી ચાલેતી  
આ પ્રથા હતી. પશોધરા પાસે લિક્ષાપાત્ર લઈ ઉભનારા ભગવાનને

મારે ખુદ દીકરો જ અર્પણ કર્યો હતો. પણ ભગવાનની ઠંડા રાહૂલ  
સંસારી રહે તેવી હતી. એટલે એજો થોડા દિવસનો બાળ-ભેણ રામાવી  
પછી રાહૂલને પાછો વાળ્યો હતો.) એ દીક્ષા અને કાન વાધવાની ડિયા,  
બેઠ બલદેશમાં જોડે જ થતાં. મરણોત્સવથીએ ચડી જાય તેવી આ  
બાળ-દીક્ષાને સારુ પોતાનો પુત્ર જટાઈ મોટો થઈ જાય તેવા સોશાલાં  
નીમા સેવતી હતી. રોજ ઉઠીને પાકી ખાતરી કરતી કે બાળક વધ્યો  
છે કે નહીં? વર્ષો બલે ઓછાં રહ્યાં, જરીક કાઢું કરી જાય, જરીક  
બોલતોચાલતો ને પોતાનાં વસ્ત્રો પહેરતો થઈ જાય તો પછી દીક્ષા  
ઉજવવી હતી.

પત્ર ચાલ્યો ગયે તો લાંબો ગાળો વીતી ગયો હતો. અધરાતે  
નીમા... એ! ના આગલા ઉચ્ચારની એ કંઈ હે જોતી રાહ જોતી  
નહીં. એવા ખાલી ભણકારા પોતાને વાગતા નહીં. ને લોકો પણ નીમાના  
કુપું થયેલા દાંપત્ય-સંસારની લપમાં કદી ઉત્તરતા નહીં. પોલીસે પણ  
હે તો નીમાના ઘર ફરતી મોડી રાતની છૂપી ચોકી નિષ્ફળ ગાંઝી  
છોડી દીધી હતી. પડેલા પથ્યરની સામે બુદ્ધુઠોનાં થોડાંક બુમરાણ  
કર્યા બાદ પાછાં સમયથળ બનીને વહેવા લાગતાં પણી જેવો જીવનનો  
પ્રવાહ પણ બની ગયો હતો. જૂનું રંગાલય ખાલી થયું હતું. આગલા  
નાટેએ વિદાય લીધી હતી. નવા અભિજ્ઞતાને નવા પાઠ ભણપ્તતી મા  
સજાવી રહી હતી. જિંદગી એક સાચી રંગભૂમિ હતી.

કાળાનીદરમાં ટેલી નીમાને એકાએક લાગયું કે કોઈક નીચેથી  
સાદ કરે છે: "મા-નીમા એ...!"

આ જૂનો બોલ નથી. "નીમા... એ" નથી આ તો સ્પષ્ટ  
સંભળાય છે. "મા-નીમા એ...!"

ભણકારા હશે. અત્યારે કોણ આવે?

ધીરા ધીરા બોલ ફરી વાર સંભળાયા: "મા-નીમા એ...!"

બીતાં બીતાં એજો બહાર આવી નીચે નજર કરી અંધકારમાં

કોઈક ઉલ્લં હતું.

પ્રભુ પદ્ધયા  
મોટા પગ ને  
ઉપર વૈરદ્ધોરથી  
નારીના ચાવલ  
ને પોકારીશા કે  
, કાંદુલે! હેલો  
એ રહેજે, જોગી  
નેવડો જ હતો.  
એધારા વધાલી  
ઈ માને અલ્લા

મારે સર્જયા  
લ. જગત તને  
હોય. ભવના  
દા'ડ પાછી

એ નહીં ને?  
કોઈ કટાણું  
એ કરિયાદ

નહીં હો!  
મામા કયા  
નહીં?  
તાં પહેલાં  
એક બ્રહ્મ  
દંડાડાની  
એ ચાલેલી  
મંગવાનને

“કોણ એ?”

“મા-નીમ્યા! જલદી ખોલ.”

કોનો અવાજ? વર્ષાથી અપરિચિત આ સ્વર કોનો સુણાય છે?  
અંદર જઈ, અભરાઈ પરથી લાંબી લાંબી એક ચીજ લઈ, એક

હાથે એ ચીજને ટકાર જાલી નીમ્યા નીચે ઉતરી.

એ ચીજ હતી - ધા.

બીજે હાથે બાર ઉઘાડ્યું: “કોણ એ?”

“હું માંગુ.”

“અકો!” નીમ્યાએ ભાઈને ઓળખ્યો અંદર લીધો શરીર પર  
કુંગવેશ નહોતો. એથી ઉલટો સરકારી યુનિફર્મ સજેલો.

“અકો!” નીમ્યાનો કંઈ ભરાઈ આવ્યો.

“આટલું જ કહેવા આવ્યો છું, નીમ્યા: માંગુ-પુ સલામત છે, પણ  
તારો હાથમાં એ જે દિવસ આવશે તે દિવસ એ આખો નહીં હોય,  
એના ટુકડા જ હો એમ લાગે છે. નીમ્યા! અહીંથી દૂર દૂર ચાલી જુઝ.  
ચો(શહેર)માં રહીશ નહીં, ટો-માં (જંગલનાં ગામડાંમાં) ચાલી જુઝ.  
ઉચ્ચાળા ભરી કરીને ભાગ્યો જો.”

“શા માટે, અકો?”

“નીમ્યા, વધુ પૂછતી નહીં; આંહીં ચાલ્યો આવે છે - મહાસંહાર.”

“અકો! આ તું શું કહે છે?”

“અફર ભાવિના બોલ ભાગ્યું છું, નીમ્યા! પ્રલય ચાલ્યો આવે છે.  
અનિના મેઘ તૂટી પડશે. આકાશ કોપશે, તઘુલા ત્રાટકશે - પણ  
પાકુના નહીં, અનિનગોળાના. ભૂગર્ભ ઝાટકશે. પૃથ્વી ને ગગન બને  
કાવતરું કરશે. માબાપ બાળકોને ભક્તી જશે. આગની રોશાની સો સો  
ગાઉ ફરતી દેખારો.”

“કોણ - કોણ? અકો! કોણ આવશે? કોણ સણગાવશે?”

“અમે, અમે જ પોતે. મહાસંહારની જબાન બનીને હું આવ્યો છું.  
નીમ્યા! ઉગાર શોધજો - તારો ને તારાનો. કોઈને કહેતી નહીં કે હું

આવો હતો. કહ્યા બેળી જ તું હતી—ન હતી બનશે ને તારુ કાંઈલેને  
પુછી ગળી જશે. ફયાના બોલ છે. રાજે ઉચ્ચાપત્રી જાઉ છું. નીમ્યા!  
અન્યો ખુલ્લા! રજા આપ!"

તે પછી પરોઢ પૂર્વે એક વાદળી રંગનું વિમાન - વિના અવાજે  
દુના એક જેતરમાંથી ઊડયું અને સિયામના પાટનગર બેંગાંકોણની  
દિશામાં ચાલ્યું ગયું. એનો જે પાઈલટ હતો તે બીજો કોઈ નહીં, પણ  
નીમ્યાનો 'અકો' માંંડ પોતે હતો, અને અંદર બેઠો હતો તે માંંડ-પૂરુષ હતો.  
આજો-બનેવી જાપાનના શાણિદ્રો બની વિમાન-સેનામાં પ્રવેશયા હતા.

મહાસંહારની આગાહીએ નીમ્યાની નિદરને ચટકા ભર્યા જ કાંઈ?  
ક્યારે મહાસંહાર? કોના તરફથી? શાને માટે? પોતે કોણું બગાડયું હતું?  
બ્રહ્મદેશીઓએ કોનો દોષ કર્યો હતો? ઠરાવદીએ કોને ધાન આપવાની  
જ પાડી હતી? અંહીં કોણ કોણે કાઢી મૂકૃતું હતું કે ખાઈ જતું હતું?  
નીમ્યાને વિશ્વ-ભરખતા જર્ઝન જંગની જાણ હતી, પણ જાંખી  
અંહીં. એ યુદ્ધને બ્રહ્મદેશને કશી નિસ્બત નહોતી, અંહીં તો બધાં  
ધર્મધોકર કમાતાં હતાં. યંત્રો ચલાવતાં હતાં. સોનાંરૂપાં પહેરતાં હતાં.  
અંહીં હજુ તીનજામ પે અટક્યા નહોતાં. તઘુલાની રેણૂરોળ કોઈએ  
નંધ કરાવી નહોતી. કાર્તિકી પૂર્ણિમાના તધી-જો-દીવા કોઈએ ઓલવાવ્યા  
નહોતી. અંહીં શા માટે સંહાર ચાલે?

ચીન ને જાપાન લડતાં હતાં, પણ તે તો દૂરદૂર- અંહીં તો ચીનાઓ  
દુરિયાન વેચી રહ્યા છે, અપાંઉ-શોપ ચલાવી રહેલ છે, બર્માઓને પરણી  
રહેલ છે, ચાવલના ધાનના સોદા કરતા બેઠા છે. અંહીં તો જાપાનીઓ  
પણ દુકાનો ચલવે છે, અને ઝોટોગ્રાહી કરીને પેટગુજરાતો મેળવે છે.

અંહીં ચીનાઓ કયાં એકબીજાનાં માથાં કાપે છે?

અને હવે તો ઉસો સ્વરાજના સહીસિક્કા કરવા સારુ જ લંડન  
ગયેલ છે. અંહીં શા સારુ આગનાં વર્ષણ થાય?

ડૉ. નૈતમના બાબલાને તો કોઈ સપાટો નહીં લાગી જાય ને?  
જલદી પ્રભાત પડે, તો હું ત્યાં જઈને બાબલાનાં માબાપને ચેતતું.

પ્રભાતે રતુભાઈ આવ્યો. તેની સાથે પોતે સદાના જેવી જ હસતી રહેવા પણ કંધ્યો. એના ગળા સુધી રાતની કાળ-વાણી બરી હતી. પજ અકો જિવરાવી ગયો હતો. એ કોઈ કુગીની જ ભવિષ્યવાણી વાયો હતો. કોઈને કહું ને તત્કાલે જ આસમાનના અભિનજણ તૂટી પડે તો! કહેવાયું નહીં હાય ક્યાંક કહેવાઈ જરો, તો ધ્વંસ ગારકી પડશે!

રતુભાઈની સોનારુપાની દુકાનના માલથાલ વેપાર વિશેનો અહેવાલ આપીને નીમ્યા રતુભાઈ સામે એવી નજરે જોતી હતી કે જાણે એને કાંઈક જરૂરી વાત કહેવી હતી. રતુભાઈ પજ એ રાહ જોઈને થોબ્બી ગયો. છેવટે નીમ્યાએ વાત કાઢી:

“અકો! તમારા દેશમાં જવાનું તમને કદી મન જ કેમ નથી થતું?..”

“આ પજ ક્યાં પરદેશ છે? આહીં તમે સૌ છો ને!”

“પજ દેશ જઈને હવે પરણશો કરો ને!”

“કુમ, અમા! બીક લાગી કે વળી આંહીના જુવાનોના ભાગમાંથી..

હું પજા એક બરમણાને ઓછી કરીશા!”

“હા, એ તો ખરું જ; આહીં કોઈને ન પરણશો, અકો. આખરું તો પોતાના દેશ જેવું કંઈયે સારું નહીં.”

“પજ દેશમાં મારે કોઈ નથી - અકો, અમા, અમે (મા), અફે (વાપ), મેમા (સ્ત્રી), કોઈ કરતાં કોઈ નથી. મારે તો સાચો સ્વદેશ આંહીં છે.”

“તો આપણે એમ કરીએ, આંહીંથી ક્યાંઈક ગામડામાં રહેવા ચાલ્યાં જઈએ; હું, તમે, ડોક્ટરનું કુદુંબ, મારી મા, એટલાં જઈએ..”

“ગામડામાં જઈને ખાઈએ શું? ધંધો ન ચાલે. પજ મા-નીમ્યા!

હું કદી નહીં ને આજે આટલી વિહુવળ કેમ દેખાય છે?”

“બીજું કંઈ નહીં, મને ગામડામાં રહેવા જવાનું દિલ થાય છે. કાઉલેને આહીં સારું રહેતું નથી..”

“તો જશું આપણે. તધી-નો (દિવાળી) કરીને જઈએ. તે દરમ્યાન આપણે ઉઘરાણી-પાઘરાણી પજ પતાવી લઈએ. સોનારુપાંને ઠેકાણાસર

બન્ના બજરમાં

મુકું એ પણ મુંઝવશવાળું કામ છે. હું સપેટા માટું."

"નાણ આપણો એકલાં નહીં, ડોક્ટર-અપણી પણ લેગું."

"તારું આજનું વેન પણ ભારી વિચિત્ર છે, અમા! હું, તને આજે ક્રેદિક યાદ આવ્યું લાગે છે."

પોતે પણ ચિંતામણ બની ચાલ્યો ગયો. આ રંગિલા બમ્માઓની રૂચ પણ ઉદારી તને અસાધ થઈ પડતી. સાત આગામી ને સાત પાછળી પેટીઓની ફિકર વેઠા, પરિષાહ-પુજના બળદિયા જેવા, પલપલ રણવા સિવાય બીજા કોઈ નાદને ન ઓળખતા ને પોકતી વેળા પણ ઓસ્ટીક ન છાતીએ સણાના ટેલિફોનો ગોઢવતા જુજરાતીઓને તો આનંદ કે ખુશમિજાજનો ઈશરી ઠંકાર છે; એમને એકેય વાતની કમીના નહીં હોય તો ખુદ આનંદોત્સવની અંદરથી પણ કઈ ને કઈ કકાસ ભેટો કરશે; પણ આ બબદેશી પ્રજાના પણી-શા હણવાણીં પ્રાણ પર કેમ આવાં આત્મપીડન ઉદ્ભવવા લાગ્યાં? નૃત્યમૂર્તિ નીમ્યા કેમ વિચારભારે અકળાવા લાગી? સારી સૃષ્ટિ રતુભાઈને ચકડોળ ચાડતી જશાઈ.

કારણ કે નીમ્યા ઉદાસ બની હતી!

23

### લગ્નના બજરમાં

"ઓહોહો! ભાઈ, આજકાલ તો તમારા ભાવ બંધુ પુછતા લાગ્યા છે.."  
ડૉ. નૌતરે રતુભાઈને સંતકારતો ખબર આપ્યા: "આપણા મનસુખલાલ  
અને એનાં પત્ની માંત્રે જે વાર તો આંદો ખાઈ ગયાં, કંઢો, હવે શો  
વિચાર છે!"

"શાન્દો?"

"એના જમાઈ બનવાનો."

“મને લગે છે કે હું દિવસે દિવસે સૌને માટે અંદરનું ‘ડસ્ટબ્લેન’ (કચરો નાખવાની સુધરાઈની પેટી) બનતો જાઉ છું.” રતુભાઈએ હસીને જવાબ આપ્યો.

તુરત હેમકુવરે ટકોર કરી: “વાહવા! વાહવા! આમ તો સ્વીકારિનું ઘણું ઉપરાણું લ્યો છો, પણ અંદરથી તો એને કચરો જ માનતા લગે છો.”

“કચરો છે? મનસુખલાલની બર્મા છોકરી શું કચરો છે, હું રતુભાઈ! તેવી ફક્કડ છોકરી છે!” આટલું બોલીને ડૉ. નૈતમે તુરત પણી સામે જોઈ લીધું ને ટોળ કર્યું: “ભૂલી જવાયું હો! માફ કરજે, પારકી છોકરીનાં વખાજ પોતાની બેરીની હાજરીમાં ન કરવાં જોઈએ..” “ને પાછો આટલો મોટો વારસો!” હેમકુવરબહેન રતુભાઈને લાલચ બતાવી.

“હા, એ એક મોટું આકર્ષણ ખરું.” રતુભાઈએ લહેર કરી.  
“એ આકર્ષણની વાત ભલે છોડિએ, રતુભાઈ!” હેમકુવરબહેન વાતને વિસ્તારવા માંડી: “પણ આ તો એક મોટું કર્તવ્ય બજાવવાનું છે. મનસુખલાલ તો હામ ભીડીને કહે છે કે ગુજરાતી કોઈ ન સ્વીકારે તો ઘેર જાય, હું બરમા જોડે પરણાવી દઈશ. પણ એ માર્ગ વિકટ છે. બાઈ જ પોતાની છોકરીને બર્મા સંસારમાં ધકેલવા નારાજ છે. બાવીશ વર્ષનું અનું પરણોતર, એકવીશ વર્ષની દીકરી, ઉછેરી આખી ગુજરાતી ઢબે, માંસમચ્છીને તો દીઠાં ન સહી શકે: એને વનસ્પત્યાહારી તો ઠીક, પણ ભજોલગણોલ બરમોય કોણ જરૂર? આપો ઉછેર જ જુદ્દો થઈ ગયો. બર્મા સંસ્કારમાં ઉછેરેલી છોકરી શ્રીમંત હોય તોય ગરીબને એને ભજોલી હોય તોય અભજાને જઈ શકે. પણ આ થોડું એમ કરી શકે છે?”

“એ પણ એક વિચિત્ર વાત નથી.” રતુભાઈએ હેમકુવરબહેન સામેથી ડૉ. નૈતમ પ્રત્યે વળીને કણું, “કે દરેક માણસ જીવાન થાય અને પાંચ પેસા કમાતો થાય કે તરત એને લગ્નના બજારમાં ઉભેલો ગૃહાવામાં આવે છે?”

“ઓટું શું છે?” ડૉ. નૌતમ બોલ્યા: “દરેક ‘નોર્મલ’ માસસનું તો

એમ જ માનવું ઘટે.”

“નોર્મલ એટલે?” રતુભાઈએ પૂછ્યું.

“શરીરથી સામાન્ય રીતે સશક્ત અને મર્દાઈવાળો, વૃત્તિથી અમિતભોગી, મનથી પ્રકૃતિલિત અને મગજથી વિચારશીલ.”

“તે ઉપરાંત શું કોઈ એવો સંજોગ નથી કે જે માસસને ‘નોર્મલ’ હોવા છીતાં પરણવાને નાલાયક ઠરાવે?”

“શ્રો સંજોગ?”

“કોઈ પ્રબળ આધાત લાગ્યો હોય, કોઈ ભયાનક સામાજિક અત્યાચાર એની આડે ઊભો થયો હોય.”

“એટલે શું તમે હિંદની પરાધીનતાની વાત કરો છો? ગાંધીજી લડત સથગાવવાના છે તેની કંઈ નડતર આવે છે?”

“ના રે ભાઈ, ના, એવી મોટી બાબતો તો કોઈને પરણતાં કે મરતાં રોકતી નથી. લડતોની વચ્ચેય લગ્ન, અને કારાવાસની અંદર પણ પ્રસૂતિ થઈ શકે છે.”

“તો શું આ ગુલામ દેશમાં ગુલામ સંતાનોની વૃદ્ધિ કરવાથી ડરો છો?”

“એમ પણ નહીં, એમાં તો હું ઊલયનો માનું છું. જેમ ગુલામો ઉમેરાય છે તેમ લડવૈયા પણ વધે છે ના!”

“તો પછી એવી શી ‘અંબોર્મલ સિચ્યુઅશન’ (અસાધારણ સ્થિતિ) તમને નહીં છે?”

“લ્યો નૌતમભાઈ, આ વાંચો.” એમ કહીને રતુભાઈએ પોતાના ગજવામાંથી ટ્પાલમાં આવેલો એક લાંબો કાગળ આપ્યો.

વાંચતા ગયા તેમ ડોક્ટરનાં ભવાં ચડગુંતર કરતાં ગયાં. થોડી વાર મોં લાલ થયું, થોડી વાર અંખો મિચાઈ ગઈ. એકધારી મુખછથાન રહી શકી.

“આને વંચાવું?” એણે વાંચીને પછી રતુભાઈને પૂછ્યું.

“જુરૂ.”  
હેમકુવરે પણ કાગળ વાંચો -

પૂજય શિરાંજન કાકા,

માંડ માંડ અધરથું લખ્યું છું, મારી બા મને લઈને જેતપુરથી આપ્યા  
આવી છે, એના ધરમગુડ પસે પરાણે મને ચોથા પ્રતની બાધા  
લેવચાવી છે, મને મહારાજ આગળા ભવની વાતો સંબળાવે છે તે  
મારાથી સંબળી જતી નથી, મને પરાણે શાસ્ત્રોનું ભજાતર ભજાવે છે,  
મારું મન તો જાણો છે, મારા બાપુએ મરતાં મરતાં તમને સોંપો છે,  
તમારી હાજરી નહીં તેટલામાં મારી બાબે મારું નસીબ કીરી નાખ્યું,  
સામા માનાસને કષય હતો એ શું મારી બા નહોઠી જાણતી? પંદર જ  
દિવસનું પરણેતર - ને હવે આંદ્રી શાસ્ત્રોનું કેદખાનું - ને માણે  
સાધુના ચોકીપહેરા કાકા, તમે ત્યાં બેઠા આનંદ કરતા હશો, યાદ  
કરજો, મારા બાપુએ - તમારા સગ્ગા મોયાભાઈએ - મરતાં મરતાં મારો  
હાથ તમને સોંપોહતો.

લિ. છોરુ તારાનાં પાયલાગણ્ણ.

કાગળ વાંચીને એની ફરી ગઈએ વાળતાં હેમકુવરબહેનને ઘણ્ણી  
મહેનત પડી, એને પછી વરવહુએ એકબીજા સામે ચાવી ચડાવેલાં યાંત્રિક  
પૂતળાં પેઠે જોયા કર્યું, રતુભાઈ તે વખતે પોતાની ડાયરીમાં કેટલીક  
વ્યાપારની નોંધો ટપકાતી રહ્યો હતો, એ પૂરી કરીને પોતે ગજવામાં  
સ્વસ્થપણે મૂકી, પેન પણ ઉપલા ગજવામાં ગોઠવી, પછી ઊઠીને કહ્યું:  
“લો ત્યારે, હવે અત્યારે તો જાઉ છું.”

કાગળ હેમકુવરબહેને એના સામે લંબાવ્યો તે એષો કશો જ  
ઉશ્કેચાટ બતાવ્યા વગર લઈ ફરી વાર કાળજીથી ગજવાની નોટમાં  
ગોઠવીને મૂક્યો.

શરતમુખી  
કાતિકી  
આ સંસાર  
મૃત્યુલોક  
અગાધ  
હંતું રેણ  
સાના હ  
જીલવાનાને  
આવ્યા  
નિમિત્વ

પામી  
નહોઠી  
તલસીત  
પણ ર  
આવર  
અભિન  
સ્વીકાર

રચેલું,  
દીવાર  
બનતો  
એની  
ખબર

## તાંકીનો

શાસ્ત્રમધ્યે માં ઠરાવદીના, દેશભરમાં પથરાયેલા અસંખ્ય ખોળાગ્રોમાં  
ક્રાંતિકી પૂર્વિમાનાં કલાયુક્ત ફિનસો હજારો મોહે તરતાં મુકાયાં હતા.  
આ સંચાર-સરિતામાં તરતા કોટિ કોટિ જીવન-પ્રદીપોનું અહીં કેમ જાબે  
મુલ્યાંનાં શાણાં માનવીએ ઉપમા-જગત સરજાયું હોય ને! નીચે  
અગાધ ઊડાશાખાર્ય ને અનંત વરમણો ધૂમરાવનું રહોલું ને આણું જાત  
હતું. તેને સંતપ્તાં, છલક છલક કલરવ ગાત્રી જળ-સપાટી હતી. દીપકો  
ગાળ હતા. સપાટીનો સ્વભાવ ઓલવવાનો હતો, દીપકોનો સંસ્કાર  
જીવાનો હતો. સપાટી દગલબાજ નહોંતી, દીપકો એને હેઠે રમવા  
આવ્યા. સપાટીએ મૃદુગો બજાયાં, દીપકોએ નૃત્ય દેખાજાયું. સપાટી  
તિમિરવઢ્ઠી હતી, દીપકો એના અંતર ઉપર તેજ રેલાવતા હતા.

નાચીને, તરીને અને તેજ રેલાવીને પછી સપાટીને ખોળે વિલય  
પામી જું એમાં જ દીપકોની સંતૃપ્તિ હતી. અમરતા તેમજે ઠંચીએ  
નહોંતી. તેમનાં રચનારાં અને તેમને તરતા મૂકનારાં પણ ચિરાયુને કાજે  
તલસતાં નહોંતાં. આ સુંદરતાને પોતાની કાણાંભગુરતાની ખબર હતી.  
પણ એના તો ઘડી-બે ઘડીના જલસામાં જ કેટલાં જોબન, કેટલી  
આવરદા, કેટલી અમરતા છુપાયાં હતાં! એકાદ પણ આનંદ રમીને અને  
અભિલ વિશ્વની સુંદરતામાં એકાદ કણ સૌનદર્યનો ઉમેરી આપીને પછી  
સ્વીકારી દેવાતો વિલય સેંકડો અનંતતાએ કરતાં પણ વધુ મધુર હતો.

નીમ્યા પણ, એક હાથે કાંઉલેને દોરતી, ને બીજા હાથમાં પોતાનું  
રહેલું, ચિત્રવંતું, નારંગી રંગનું ફિનસ લઈને નદી તરફ ચાલી જતી હતી.  
દીવાઓનું જળનૃત્ય નિહાળીને નીમ્યાનો પ્રાણદીપક પણ છંદાયમાન  
બનતો ગયો, એના પગમાં ફિના (ચંપલ)ના રૂમજુમાટનો સંચાર થયો.  
એની કર્મર દોલાયમાન બની. કાગળના ફિનસને કરપલ્લવમાં ડાબે  
ખબે પૂજન-થાળની અદાથી અદ્ધર ધારક કરીને નીમ્યા નર્તને ચઢી.

કાઉલે એના ઘથમાંથી છૂટી ગયો તેની એને સરત ન રહી.  
સેકડો લોકો તેની આસપાસ ચાલતાં હતાં. તેઓ પ્રશાંત હતાં.  
કોઈ કોલાહલ કરતું નહોતું. સેકડો પગની ફનાઓ જ ફક્ત ટ્યાક ટ્યાક  
તાલ આપતી હતી. તૌ એનું મુંગું નૃત્ય નિખળતાં નિરીકનારે ચાલ્યાં  
એને મન આ જાણો કે છેલ્લો તથીજો હતો. ફરી આવો વર્ષોસ્વર આવે  
કે ન આવે. ફરી નવાં ધાન પાકે કે ન પાકે. શારદલક્ષ્મી ફરી વરદાન  
દી કે ન દી. કમોદના ક્યારા કોણ જાણો ફરી ક્યારે જૂલશે. માટે કરી  
દી નૃત્ય! નવલાં ધાન્યનું નૃત્ય. નવલાં નીરનું નૃત્ય. શોષ વેળાની શરદનું  
નૃત્ય.

નિતરેલી શરદનાં વાદળાંએ ગગનને કંઠે જાણો કે ચાવલના  
પુંજુંજ ખડકદ્વા હતા.

નિરીતીરે એ થંભી એણો પોતાનું કણસ નીરમાં તરતું મૂક્યું. ને  
એ ઉઠી ત્યારે હૈયે ધ્રાસકો પડયો. બાજુએ જોયું. કાઉલે ક્યા?

“આ તારો કાઉલે, અમા!” એમ કહેતા લોકવુંદના એક પુરુષે  
કાઉલેને માતાનાં કરમાં આય્યો. કાઉલેને લઈને એ બરમો ચુપચાપ  
પાછળ પાછળ દીપદર્શને ચાલ્યો આવતો હતો.

બેભાન નીમ્યા શરમિંદી બની અને ક્ષણ ખાઈ ચમકી ઉઠી:  
“અરરર! કોઈ કુંગી મારા ઢંગ દેખી ગયા હોત તો!”

એ જ સમયે પૂર્ણિમાની ચાંદનીમાં માંડલે તરફની એ ઉત્તર દિશા,  
કોઈએ જાણો આગ મૂકી હોય તેમ સણગી ઉઠી. ભડકા! ભડકા! ભડકા!  
ભાઈની ભવિષ્યવાણીએ પહેલો પરચો બતાવ્યો. પ્રભાતે સાંભળ્યું  
કે બર્મા-રોડ પર જાપાનનાં વિમાનોએ અઢળક આગગોળા વરસાવ્યા છે.  
ચીનને જાપાન સામે જીતવા-જીતુંમાંવા માટેનો શસ્ત્રસરંજામ પહોંચતો  
કરનાર એ એક માત્ર વ્યવહાર-કેડાને જાપાન છૂંદવા લાગ્યું હતું. બર્માનો  
એક ગુનો થયો હતો કે ચીનને અને હિંદને સંયોજતી એ પુરાતન સરક  
બર્માની ભૂમિ પરથી પસાર થતી હતી. બિટને એ સરકને રક્ષણ આચ્યુ  
નહોતું. કારણ કે જાપાન હજુયે બિટનનું મિત્ર હતું, કારણ કે બિટન

જાપાનને શસ્ત્રસર્જામ બનાવવા અઢળક ધ્યાતુ વેચે જતું હતું.

\*

નીમ્યા જ્યારે નવાં ધાન્યને નૃત્યની અંજલિ આપી રહી હતી, તે વાગ્તે શામજી શેઠ કાર્તિકી પૂર્ણિમાનું નવું આવતું ધાન ખરીદત્ય હતું વીસ વર્ષે પણ એહો બર્મા ભાષા બોલવામાં શુદ્ધ મેળવવાની પરવા નહોતી કરી. એનો ઘોઘરો અવાજ ઓફિસમાં ગાજતો હતો:

“પણ-પણાને ચનૌરો ધલાવ સોરે-સભા શું કરવા યું? (તે અંગે “નીજેલું ધાન શા બાબત લઈએ?)” ધાન વેચવા આવેલા એક બરમા જે લીજેલું ધાન શા બાબત લઈએ?” ધાન વેચવા આવેલા એક બરમા

જે પોતે માથાઝોડ કરતા હતા.

“કાં શેઠ, હજુયે કાં ધાન ખરીદો?” શાંતિદાસ શેઠ કહ્યું.

“શું છે તે ન ખરીદું? ઊસોને તો ચર્ચિલે ચિટુટના બદલામાં બરાબરનો તમારો ચોડી દીધો છે. ઠીકાઠીકની ટપાટપી બોલી ગઈ છે. હમણાં તો હવે ઊસો જબ મારે છે. આંહીંથી આપણને કાઢી રિયો.”

“પણ જાપાન-અમેરિકાની વાતચીતોનો અંજામ તો જુઓ!”

“માર્યું ફરે છે જાપાન. એની પાસે સોનું ને વિમાનો જ ક્રાંતિયાં છે? આ આંહીં તો હું એકેએક જાપાનીને મળ્યો હું. જાપાનથી આવનારા આપણા ભાઈઓને મળ્યું હું. એકેએક કહે છે કે જાપાન મરી જશે. જાપાન પાસે વિમાન નથી, સોનું નથી, દાઢાં નથી, આમાં તે જાપાનનો ગજ વાગે? આશાય રાખજો મા. આંહીં લડાઈ ફડાઈ કાઈ હુંકે નહીં. ન બર્મા રોડ ને! ઈ તો અંગેજની જ દાનત ખોડું દોપડું છે, શેઠ! ચીનને મદદ દેવી નહીં પરવડતી હોય, પોતાની અને જાપાનની વચ્ચે વંચી લેવું હશે, એટલે કીદ્યું હશે કે હંબ મારા બાગે! ઉડાવ તું તારે કુરચા બર્મા રોડના! મારે બંધ કરીને દુનિયામાં ઉઘાડા પડવું, તે કરતાં તું જ માસું કામ પત્તાવ ને ભલા! આપણો તો રોટલાનું કામ છે કુટપણું? આ એમ છે મારા શેઠ! બીજું શું? આપણોય તે રોટલાનું કામ છે, ટપટપનું નહીં.”

લડાઈની ચાલનો શામજી શેઠનો ઉકેલ કારતક મહિનાની કમોદના

પ્રયુ પદ્ધાય

જી

પ્રશ્નાંત હતા,

ટ્યાક ટ્યાક

કનારે ચાલ્યાં

રોંલ્સ્બર આવે

ફરી વરદાન

શ. માટે કરી

નાની શરદનું

કે ચાવલના

તું મૂક્યું. ને

ક્રાં?

એક પુરુષે

નો ચુપચાપ

મકી ઉઠી:

ઉત્તર દિશા,

કા! ભડકા!

તે સાંભળ્યુ

રસાયા છે.

પહોંચતો

તું. બર્માનો

તાતન સર્ડક

કામ આખ્યું

કે બ્રિટન

અદ્યજ હગલા વચ્ચે આ પ્રકારનો હતો. એમને હંમેશાં રોટલાનું કામ હતું. ટપટપનું નહિં.

એમની વાત સાચી હતી: અહીં અનેક પેઢીઓ ઉધારીને જાપાનીઓ બેઠા હતા, એ પેઢીઓમાં કયા માલનો વેપાર ચાલે છે તેની બાંધ થોડાને ગમ પડતી. જાપાનીઓ બાધા જેવા, બેવકૂફ અને પોતાના દેશની અંદરખાળેની દ્વારાનુક દ્રશ્યાનો વારંવાર વિલાપ કરતા લાગત્યું અને બરમાઓ સગ્યા ભાઈઓ હોય તેવા સેહની સરવાણી રેલવાટે નેત્રે નિષાળી નિષાળી નમન કરતા.

તેમની નજર અમેરિકા પર મંડાઈ હતી. જાપાની પ્રતિનિધિ વોશિંગન જઈને લાઈટ હાઉસનાં પગચિયાં ઘસી રહ્યો હતો. પ્રમુખ રૂઝ્વેલ્ટનાં એ કેવાં ચરણો ચૂમતો હતો અને રૂઝ્વેલ્ટ-ચર્ચિલ એને કેવા દ્વારા હતા તેનાં વર્ષનોવાળાં રોજનાં છાપાં વંચાતાં. એ વાંચી વાંચીને પસાર થતી બર્માની પચરંગી દુનિયા આ બાધા જેવા બેઠેલા જાપાનીઓનાં મૌસ્યમે તાકતી. જાપાનીઓ વળી ઓર વધુ દિંગ્મૂઢતાનો દેખાવ ધારણ કરતા.

નીમ્યાને અને કાંઉલેને માટે રતુભાઈએ પાંચેક ગાઉ દૂરના ગામડામાં નાનું ઘર રાખ્યું હતું અને ત્યાં પોતે મોટરમાં જતો આવતો. હવે રતુભાઈ મોટરવાળો બન્યો હતો. બર્મા કુંદુંબોમાં જોઈતાં સુવર્ણાભરણો અને રત્નાભરણો સાથે રતુભાઈની શાખ જડાઈ ગઈ હતી. છેક શાન સ્ટેટના રાયજાદાઓનાં ઘરમાં પણ રતુભાઈના નામનો સિક્કો પડતો. માલ લઈ જઈને એમને અંગણો ઊભા રહેનાર આ યુવાન વેપારીને માટે અંતઃપુરનાં દ્વારો ઉઘડતાં જરીકે વાર લાગતી નહીં. એની પૂર્વે ગયેલા અનેક યુવાન બાબુઓ ડરનું કારણ બન્યા હતા. એ ભયને રતુભાઈના મૌના 'અમા' (બહેન) બોલે ભૂસી નાખ્યો હતો.

આ મોટર, આ રન્નો, શાન સ્ટેટના રાજ્યદરબારી અંતઃપુરોની આદરભરી અમાઓ, અને નીમ્યા-કાંઉલેની સંભાળ, બધાં વચ્ચે દેશવાસી ભત્રીજ તારો તરવરતી હતી. તારાને બચાવવા પોતે જવું જ જોઈએ.

સ્વીમર  
તારામંડ

મોતીબાં  
નાખ્યો

આગો! આગો!  
 તરાને ન છોડતે ન ઠિકિઠત સ્થળને કેકાણે ન પાડે ત્યા સુધી પોતાનો  
 કાંસંસાર સર્જિવિવાનો હક ન હોઈ શકે. એક પછી એક આગબોટ  
 કંઈની હિંદ જવા ઉપડતી હતી, પણ 'કાંઊલે'નું મોં દેખીને પોતે  
 અંકવાડિયું અંકવાડિયું મોંકું કરતો હતો. નીમ્યા પણ એને થોડુંક થોભી  
 જવા કહેતી હતી, અને વળી પાછી એકો માઉની તે રાતની ભવિષ્યવાણી  
 પણ કરીને રતુભાઈને જલદી ચાલ્યા જવા કહેતી હતી. નીમ્યા આગળ  
 એહે હજુ પોતાની સગી ભનીજી તારાની વાત ખુલ્લી કરી જ નહોતી.  
 રતુભાઈ સમજતો હતો કે બેંક મહિનામાં તો દેશનું કામ પતાવીને પાછા  
 આવી જવાશે, પોતે તારાને હરકોઈ ઉપાયે અંગી જ લેતો આવશે. પણ  
 નીમ્યાને તો લાંબી જુદાઈના ભાણકારો વાગી ગયા હતા. છ મહિના તો  
 એહે ઓછામાં ઓછા ટેવ્યા હતા. જેના આવાગમનનું ભાઈ ભાજી ગયો  
 છે તે મહાસંહારનો દેત્ય છ મહિના ચરીને તો પછી ચાલ્યો. જ જ્શો.  
 પછી તો પૂર્વવંદ સ્થિતિ પાછી વળશે, પછી તો ફરી સૌના-હીરાની દુકાન  
 ચાલુ કરશું, કાંઊલે પણ મોટો થઈ જ્શો, ખૂની પતી માંઉ-પૂ મારી પામીને  
 પાછી વળશે, એકો પણ આવશે અને રતુભાઈના ઉપકારો જાણી બધા  
 કૃત્યા રાજુ થશે?

## આગો! આગો!

સ્થીમર ઉપડતાં પહેલાં અડધા જ કલાકે, આજ ફાટીને અંદરથી  
 તારામંડળ જરે તેમ ખબરો તૂટી પડ્યા:

- ઓચિંતાં ગ્રાટકીને જાપાને પ્રશાંત સાગરમાં અમેરિકાના  
 મોતીબંદર (પર્લ હાર્ਬર)નો આખો અમેરિકન નૌકા-કાફલો તારાજ કરી  
 નાખ્યો છે.

અને રતુભાઈનાં પરિયાળ રજણી પડવાં  
હિન પર હિન: પ્રહર પછી પ્રહર: અને રેઝિયો જીવોજીતા ગયા કે  
આપાન નિલ્લીંડાની રમત જેટલી સહજતાથી પ્રશાંતના ટાપુઓને  
ઉપાડતું આવે છે.

જગતને આંખો ચોળીને સ્વરદ્ધ નજરે નિખળવાની સૂરજ પડે તે  
પૂર્વ તો આપાને મલાયાની સામુદ્રધુનીમાંથી બે ઉત્કૃષ્ટ અંગેજ  
રઘુજખાજોને પાતાળે બેસાર્યે મલાયામાં ઉપરથી કટકો ઉતાર્યા.  
પવનમાં જેમ તારીખિયાં પરથી ફાટતાં ફાટતાં પાનાં ઊડવા લાગે  
તેમ આપાની જંજાવાતમાં દુંગલન્ડ-અમેરિકાના પ્રાણાચ્ચારા પોસિફિક પ્રદેશનું

ઉપડવા લાગ્યા.  
વજકડાકો બોલ્યો - સિંગાપોર તૂટ્યું. શેખનાગની ફેંકા પરથી

ગોરી સત્તાની મેખ ઉખડી ગઈ.  
અરે પકડ, બ્રહ્મદેશમાંથી પેલા બાધોલા જેવા બેઠા બેઠા બગાસાં

ખાતા આપાનીઓ ક્યાં ગયા? શું પૃથ્વીએ પોતાનામાં સમાવી લીધા?  
આંધી આવે છે: અનિન્ય વંટોળ લાવે છે, મલાયાથી ઉપર ને

ઉપર આવે છે, સિયામથી સીધી ને તીરણી સબકારા કરતી આવે છે.

ભાગો, ભાગો, ભાગો! ઉઘરાણી-પાઘરાણી સમેટો, હાથ પરનાં  
ધાન હોય તે પાણીને મૂલે પતાવો, લક્ષ્મી હોય તે હિંદ ભેગી કરો,  
બૈરાં-છોકરાંને આગબોઠો પર ચડાવો, બળતું ઘર કુખ્યાપ્પણ કરો! આ  
કંઈ આપણો દેશ નથી. આ તો છે પારકી ભૂમિ, એને એના પ્રારબ્ધ  
પર છોડો. આપણું પ્રારબ્ધ લઈને આપણો ભાગો.

માલ હોય તેનો જલદી ખુરદી કરી નાખવાને માટે વેચાણનો એક  
મહાવંટોળ જાગ્યો. રતુભાઈએ પકડ ભાનભૂલ્યાની જેમ માંડલે, રંગુન  
અને શાન રાજ્યોની ઘૂમાઘૂમ માંડી દીધી, કારણ કે એની પેઢીમાં પારકી  
રકમ રોકતી હતી. એમાં મુખ્યત્વે કરીને સોનાંકાકી ને નીમ્યાની પક્ષ  
રકમો હતી. અનેક નાનાં નાનાં બર્મા કુટુંબો પાસેથી સોનાંકાકીએ અને  
નીમ્યાએ આંધી આપેલી થાપક પર એ પોતાનો ધંધો પાથરને બેઠો

હતો. એને શિરે સાપના ભારા હતા એ કોઈ હજુ ઉઘરાખીએ ફરકતું નહોંનું. ઉઘરાખીનો ટેકારો બોલાવતા તો શાંતિદાસ શેઠના સંધી સરીઓ મહેતાજીઓ અંટા ઉપર અંટા ખાઈ રહ્યા હતા.

ડિસેમ્બરની તા 23: લાપોરના અજિયાર -

રંગુનનાં રાંધ્યાં ધાન રજળી પડ્યાં. આકાશના કાકીડા હોય તેવા અનેદરંગી જાપાની વિમાનોએ પહેલી પ્રાઇટ દીધી અને પન્નિકાઓ વરસાવી: ખર્સી જણે, બાર બાર ગાઉ વેગળા ખર્સી જણે.

પછી તો પરોકે પરોકે, ઊગતા સૂર્યને અને વિસર્જન થતી રાતને જાપાને આગાની અંજલિઓ આપવા મંડી, કાળનાં કંકુડાં વેય્યે.  
“અભરદાર! માલ ફેરવતા ના!” સરકારી રખેવાળોએ પ્રજાના ભર્યા બંડારો પર તાળાં લગાવ્યા.

“સ્ટીમરો ક્યાં છે? અરે જલહી હિંદની આગબોટો લાવો, તો ભાગતાં થઈએ.” ભારતવાસીઓએ ચીસો પારી.  
આગબોટમાં જીવાઓ ઓછી થઈ: ગોરં હતાં તે સૌ પહેલાં બચવા ઊમટ્યાં.

“તો વિમાનો લાવો! માગો. તેટલાં નાણાં દઈએ, શાંતિદાસ શેઠનાં બાળકોને જોખીને સુવર્ણ દઈએ. એકાદું વિમાન આપો..”

“વિમાનની ટાંચાપ છે, શેઠ! વારો આવવા દો..”  
પહેલી જ વાર શાંતિદાસ શેઠને બ્રહ્મશાન થયું કે કોઈક વાર સોનાં પણ કાર્યસાધક બનતાં નથી.

જાન્યુઆરી માસ - અને મોલમીનનો ધંસ બોલ્યો. નિમત્તર બ્રહ્મદેશનું જળભરપૂર ચાવલ-કેન્દ્ર અને ગુજરાતી બાબુઓએ બાવડાને જોરે બાંધેલું, સમૃદ્ધિએ છલકાવેલું ઈરાવદી-તીરનું અજોડ પઢાઉ-પુષ્ય મોલમીન, હતું-ન હતું થયું.

ન ત્યાંથી રજળોલાં, આગબોટો વગર રહી ગયેલાં હજારો હિજરતીઓનો સંધ ચાલ્યો આવતો હતો પીમના અને માંડલે તરફ.

રતુભાઈ, ડૉ. નૌતરમ અને હેમકુવર ત્રણોએ ગુજરાતીઓને ઢોળ્યા.

સ્થાને સ્થાને ગુજરાતીઓએ આ અનાથોને આશરા, ભોજન અને આગળ  
વધવાની ખરચી પૂરી પાડવા માંડી ગુજરાતીઓ, બંગાળીઓ, પંજાਬીઓ,  
પુકા પ્રાંતના ગવલી લૈયાઓ, રેણીઓ - હિંદુ કે મુસ્લિમ સર્વ  
ભારતવાસીઓ સ્ટેશને સ્ટેશને પ્રસાદી તેમ જ સહાય પ્રાપ્ત કરીને આગળ  
વધાં ઓતચાઈ દિશાએ, આથમણા જળ-કડા ને ગગન-કડા તો ઝંઘાઈ  
ગયા હતા રંગૂનના બારામાં ખંદબદતી એ માનવજાત હતી કે જીવાત?

- જરા દૂરથી જોઈએ તો કહેવું કઠિન પડે.

ને રંગૂન-માંડલેની આ હજુયે ચાલુ રહેલી રેલવેલાઈન પર તે પછી

એક બિલ્બીધક્ક દશ્ય નજરે પડ્યું.  
કોઈ હથ છેદાયેલી, તો કોઈ નાક-કાન વગરની, તો કોઈ પગ

જ હારી બેઠેલી એ કોકા ઓરતો આવી રહી હતી?  
મોલમીનથી નાઠેલી ચીની સ્ત્રીઓ. તેમણે દશ્ય-જગતમાં જે  
ગુમાયું હતું તે તો દેખાતું હતું, પડા અદીકી રહી ગઈ તેમનાં અગોચર  
આતમ-જગતની જણાયો.

તેમનાં શિયળ રોળાયાં હતાં.

રસ્તે દુકાનો, હોટલો, નારી-ટેલો, જે કાંઈ હથ આવતું તે લૂંટાતું  
હતું, માંડ માંડ મોકો મળ્યો હતો.

\*

“હઠ છોડી દ્યો, ડૉક્ટર; તમારે ને હેમકુંવરબહેને ઊપરી જવું જ  
જોઈએ.”

“તમને સૌને મૂકીને?”

“હા, મૂકીને. તમારે માટે નહીં, હેમકુંવરબહેન. માટે મેં મારી નજરે  
જોયા છે ચિનાઈ સ્ત્રીઓના હાલહવાલ ને હું કલ્યાના કરતાંય કંપું છું.  
હેમકુંવરબહેનને નવમો માસ ચડી રહ્યો છે. એને કંઈક થાય તો આપણે  
ક્યાં લઈ જઈશું!”

“પણ તમે?”

“અમને જમડોય નથી ખાવાનો. અમે ગમે તેમ કરીને પહોંચશું.

માય પણ્યા

જન અને આગળ  
દાંચો, પંજાબીઓ,  
કે મુસ્લિમ સર્વ  
ત કરીને આગળ  
ન-કેડા તો ફેલાઈ  
હતી કે જીવાન?

ઠન પર તે પછી

1. તો કોઈ પગ

જ્યુ-જગતમાં જે  
તેમનાં અગોચર

પ્રવત્તું તે લુટ્યાનું

ઉપરી જું જ

મેં મારી નજીરે  
નરતંય કંપું છું.  
આય તો આપણે

રીને પછોંચશું

આગ્યો! આગ્યો!

147

આ વ્યો, આ વ્યો આ બે પેસેજ. સીધિયા સીમવાળી બોટ પરમ દિવસ  
જ જાય છે. ચાલો, ઉપરો. તમારો સામાન હું સર્વવાંસું છું.”  
વળતી સવારે ડૉ. નૈતમની મોટર એ દંપતીને અને રતુભાઈને  
લઈ રંગૂન તરફ ચાલી નીકળી.

એ જ સવારે રંગૂનની પૃથ્વીમાં ઉડે પેસી પેસીને પછી જાપાની  
બોંગાઓએ જવાણમુખીઓએ સર્જન્યા હતા. શહેરની બજારોમાં શાબો  
ખડકીને જાણો કે ફૂતરાં ને ગીધાડાં વેપાર કરતાં બેઠો હતાં. શાબો ઉપર  
થઈને મોટર ચાલી. રતુભાઈ હાકતો હતો. હેમકુપરલહેનને અંદર આંખો  
માંચાડી આડે પડજે કરી દીધાં. બાબલો ડૉ. નૈતમના ખોળામાં ઉંઘતો  
હતો. એ ફૂલને આ ધ્વંસની શી પડી હતી!

“જુઓ ડોક્ટર, શાંતિદાસ શેર્કની દુકાનના હાલ.” મોટર હાકતાં  
રતુભાઈએ બજારમાં આંખ તીરછી કરી બતાવ્યું. મૂએલા કાગડાઓનાં  
પાછાપીછાં પીંખાઈને ઉડતાં હોય તેવો એ દુકાનનો દેખાવ હતો.  
ઝેબાદીઓને ને બરમાઓ લુંટતા હતા. મિલિટરી ઉભી હતી; પણ તેમનું  
લક્ષ્ય બીજુ દિશામાં હતું!

મૂએલો કાગડો! આમાં એકાદ પીછાં - નાનકદું એકાદ - નીમ્યાની  
પેલી વીઠી હશે! પેલાં નધાં હશે! અરેરે! કોનું શું શું નહીં હોય!

મોટર આગળ ચાલી. બંદર થોડે જ દૂર હતું. સીમરના હંફિવાનો  
અવાજ સંભળાતો હતો. ફક ફક ધૂમાડ કાઢતું ભૂગળનું દેખાતું હતું. પણ  
ચોપાસ માઈલ માઈલ સુધીની જ્યાયામાં સળી મૂકુવાનોય મારગ નહોતો.  
માનવીઓની જીવાત છાણના પોદળામાં જાણો કે ઊભરાઈ પડી હતી.  
પુરુષોના હાકોટા, સ્ત્રીઓના કિકિયાટા, છોકરાંના રુદન, ડ્રો-પેટીઓની  
ઘડાઘડી, ઘક્કાઘકી, ટંયાફિસાદના કોલાહલ, પોલીસના કોરડાની  
ફડાફડી, પીઠ પર બેઠેલા ગોરા-કાળાઓના માર ખાતા દોડતા રિસ્થ  
ઝેંચનારાની હંફાંહારી, ઘોડાગાડીના લપસતા ઘોડાના એ ડામરની સડક  
ઉપર જીવલેણ પછડાટા - એ બધાની વચ્ચે મોટરને દોડવાનો સીધોદોર  
માંગ્યું પડી ગયો હતો.

## ઘર ભક્તિ

“પહોંચા છીએ, ડોકર!” બીજી વારનું ભૂગળું વાગ્યું તે સાથે જ રતુભાઈ હામ ભીડીને વાકીનો માર્ગ કાપવા સાડુ લેપડતું નિયર ફેરવવા જાય, ત્યાં જ એક સાર્જન આડો ફરી વળે છે, કરને વંખાવે છે, અને આશા કરે છે: “જોટ ડાઉન યુ ઓફલ: બેગ એન્ડ બેગેજ.” (તમે બધા જ તમારો ગાંસડાંપોટવાં સાથે ઉત્તરી જાઓ.)

“કો, ભાઈ?”

“સરકારને ખાપ છે.”

“પણ આ સ્ટીમર પર પહોંચવું છે.”

“શાન્દ પણ વધુ નહીં, ઉત્તરી જાઓ.”

ડોકર નૌતમ તો ચોકી ઉઠાવા. રતુભાઈએ પાછા વળીને કહ્યું:

“દલીલો નકારી છે, ઉત્તરો ડોકર!”

હેમકુવરબહેનને લબડધકડ બહાર કાઢીને કૂટપાથ પર બાબતાને લઈ ઉભેલા ડોકર જુઓ છે કે એ મિલિટરીએ કબજે લીધેલી કાર શહેરમાં જાય છે. તાબડતોબ પાછી આવે છે. એમાં બેઠેલાં ચાર ગોરં મોં દેખાય છે: એક સ્ત્રી છે, એક પુરુષ છે, બે બાળકો છે.

સ્ત્રીની આંખોએ ડો. નૌતમને જોયો. બેઉએ પરસ્પર ઓળખ્યાં પીમનાની કલબમાં તે દિવસે બર્મોલ્લારિકી ઈસુધર્મસેવિકા આવી હતી તે જ આ તો! ડો. નૌતમને દેખતાં જ એણે સાથેના પુરુષના કાનમાં બબડાઈ કર્યો: “જોયો પણ્યા! આ જ પેલો...” અને કાર એ કુંઠેબને ઉપાડી સ્ટીમર તરફ સરસડાઈ ચાલી.

એકાએક તીક્ષ્ણ અવાજે કોઈ દેત્ય ચીસ પાડી ઉઠયો. ભયની સાઈન બજી. ભાગો. શત્રુ-વિમાનનો આવી રહ્યાં છે.

ભયની સાઈન ભેગો તો સ્ટીમરનો પુલ મેંચાઈ ગયો અને વગર અવાજે સ્ટીમરે ભાગવા માંડવું. કોકા ચડી ગયું ને કોકા રહી ગયું એ

જાણવાની કષ્ટાનને પળ પજ નહોતી. ત્રણેક હજાર ઉત્પાદનો પર એક  
જ બોલ પડતાં કેવી હોનારત વાય તે કલ્પનાતીત હતું.

આગબોટને કંઈ સાથે બાંધતું સ્ફૂર્ત દોરદું તો ઉપરો જણું પજ  
બીજું એક દોરદું સરતી જતી આગબોટની ને કિનારાની વચ્ચે રચાયું  
“ઓ-ઓ-ઓ-ઓ-ઓ-” બોટના તૃત્ક પરથી હજાર ચિચિયારીઓના દળ  
દેવાયા.

‘હો-હો-હો-હો-’ કંઈથી સેંકડો ખાંખાકારો સામે જઈને સંઘાયા.  
પતિઓ ચરી ગયા હતા ને પત્નીઓ પાછળ પડી રહી હતી.  
માલાપ સામાન મૂકવા ઉપર પણ્ણેઓ હતાં ને નાનાં નિરાધાર બાળકો  
પાછળ રહી જઈ કિનારાને આંસુધારે ભાજવતાં હતાં.

અસહાય દશાની સામસામી દારુણ ચીસો પડતી હતી, ને દરિયો  
જાણો કે એ આઈદ ન સહેવતાં પછાડા મારતો હતો.

સાંભળ્યુ જે સહેવતું નથી, તે નજીરે નિહાળ્યુ અને જાતે અનુભળ્યુ  
કટલું કારમું હશે!

છે કોઈ આવી લેદકતા વિશ્વાના ઠિઠિસમાં?

છ, છ, - ગોરા યુરોપવાસીઓ હબસીઓને ગુલામો પકડતા, ને  
પછી મા કોઈકને ભાગે જતી, બાળક બીજાને પનારે પડતું, પતિ અને  
પત્નીને જુદા જુદા માલિકો ખરીદી ખરીદી કોરડાથી બરડા કાઢતા લઈ  
જતા, તેવી વિચ્છેદવેળાએ આવા જ ચિત્કાર ઉઠયા હશે શું આદ્ધિકાના  
કિનારાએ ઉપર?

“ઉપર આવો, ડેરી! દોડ્યા આવો!” મોટરમાંથી દોટ મારીને  
સ્થીમર પર ચરી ગયેલી પેલી ગોરી યુવતી ડેક પરથી પિતાને વ્યર્થ  
બોલાવી રહી હતી. એની સાથેનો પુરુષ અને બે બાળકો નીચે જેરી પર  
ઉભાં ઉભાં આગબોટ અને પૃથ્વી વચ્ચે પહોળાતું જતું ઈરાવદીની  
ખાડીનું ડહોળાયેલું અંતર નિહાળી રહ્યાં. તેમને પાછાં લઈને એ જ  
ડૉ. નૌતમની મોટર બહાર નીકળી ત્યારે ડૉ. નૌતમનો કાણલો હજુ કૂટપાથ  
પર સૂનમૂન ઉભો હતો. રતુભાઈ વાહન મેળવવા દોડધામ કરતા હતા.

વળીને કણું:

ર બાબલાને

લીધીલી કાર

ન ચાર ગોરા

દ.

ર ઓળખ્યા

આવી હતી તે

માં બબડાટ

બને ઉપાડી

દ્યો. ભયની

. અને વગર

હી ગણું એ

“એય આપવી ગાડી!” બાબલો બોલી ઉક્કો અને એ શબ્દે મોટરમાં  
પાછા જતા ગોરાના કાન ચમકાવ્યા તેણે મોટરધક્કાના કુટુંબને નજેરે  
નિહાળું અને છોકરાઓને કહ્યું: “પ્રભુએ જ આપજાને શિક્ષા કરું  
આપણી કેમ આ બીજાં જેઓ બોટ પર જતાં હો તેમની જ મોટર  
આપણે કેંઠવી લીધી!!”

“હું સ્વીમર નહીં મને, હું ડેડી?” સાત વર્ષના છોકરાએ બાપને

પૂછ્યું.

“સંભવ નથી, હવે તો બીજે જ કોઈ રસ્તેથી નીકળતું પડું  
બહેન એકલી ગઈ. એનો સામાન પડી આંદ્રી પડ્યો રહ્યો.”  
ચૌદ વર્ષની પુત્રીએ પૂછ્યું: “આપણે માટે જેની કાર લઈ લીધી  
એ ઇન્ડિયન સ્ટ્રી ફૂટપાથ પર બેસી કેમ ગઈ હતી, હું ડેડી?”

“એ સગર્ભી લાગતી હતી..”

“ઓ માય!”

એ ગોરાં અને પેલાં હિંદીવાનો, આગબોટ ચૂકેલાં બેઉ પાછાં  
ખીમના જવા સાડુ સ્ટેશન પર મળ્યાં. પાછા ગયા વગર છૂટકો નહોતો.  
રંગૂનના બારા પર બોંબમારો થવાની હવે ઘડીઓ જ ગણપતી હતી.  
સ્ટેશન પર ઉભાં ઉભાં જ તેમણે કડાકા સાંભળ્યા. બંદરના  
કુરચા ઉડતા હતા.

\*

શિવશંકરનું શું થયું હો? રતુભાઈ મુંજાવા લાગ્યો. ખનાન-ટો તો  
ઉદ્યોગનો પ્રદેશ છે, ત્યાં તો જાપાન ધ્વંસ કર્યા વગર રહેશે જ નહીં.  
ખનાન-ટો જવાની સંપાનો પડી બંધ પડી ગઈ હતી. કેટલા દિવસથી  
શિવને લખ્યું છે કે સૌને લઈને ખીમના ચાલ્યો આવ.

રતુભાઈ જાહીતા ગુજરાતીઓને ગોતતો, દ્રેનની રાહ જોતો ફરતો  
હતો, તે દરમ્યાન એ ગોરા પિતા અને એનાં બે બાળકો સાથે ડૉ. નૌતમ  
અને હેમકુવરબહેનનો સંપર્ક થયો. અંગેજના મોં પર શારમ હતી. એણે  
શબ્દોમાં ન માગેલી ક્ષમાપના મુંગી મુંગી એનાં નેત્રોમાંથી ટપકી રહી.

પ્રભુ પદ્માબદી

શરદે મોટરસાં  
કુંદને નજીરે  
ન શિક્ષા કરી  
મની જ મોટર

એકરાએ બાપને

મિકળનું પડશે  
એ.."

કાર લઈ વિધી  
ડેડી?"

ના બેઠ પાછાં

છૂટકો નહોતો

અણાતી હતી

જીવા.. બંદરના

ખનાન-ટો તો

લહેશે જ નહીં

ટલા દિવસથી

હ જોતો ફરતો

પાથે ડૉ. નૌતમ

મ હતી. એણે

મિટપ્ટી રહી.

## દર ભક્તિ

151

એલી બોટમાં બેસી ગયેલી બાઈ એની દીકરી હતી એ જાણ્યાં પછી ડૉ. નૌતમે કહ્યું: "તમારી પુત્રીને એક વાર મે કોચવી હતી. એને મે કાળમાં દેસા આપવાની ના કહેલી."

"તમે એ ઉચ્ચિત જ કર્યુ હતું." અંગેજનનો જવાબ અજયલીભયો આવ્યો: "હું એવા પારકા પુનરુદ્ધરાની સાકાઈ ચાલાઈને વિકાર્ય છું. મારી છીકરી એ છંટે ચરી છે. પણ તે મારી મરજી વિરુદ્ધ છે."

"તમે શું કરો છો?"

"ફ્યુમાં મારો પોતાનો મોટો ધધો છે."

ત્યાં તો ટ્રેન વાર્ડમાં આવી પહોંચી. માણસો એને ચોરી પડ્યાં. તરણેય વર્ગમાંથી એક પણ વર્ગમાં ઊભવાની જગ્યા નહીંતી. અને સંજોગો એવા હતા કે આ પછી બીજી ટ્રેન દોડતી હશે કે નહીં તે કહેવું કઠિન હતું.

ગોરો મિલિટરીનો મોટો કોન્ટ્રાક્ટર હતો. એને માટે લશકરી ડાબામાં જગ્યા થઈ. એ શરમાતો શરમાતો ડૉ. નૌતમ પાસે આવ્યો ને તેમને પોતાની સાથે આવી જવા વિનંતિ કરી.

"મારા સાથીદાર પણ છે, તમને બહુ બોજો થશે."

"કાંઈ નહીં, એ ક્યાં છે?"

"આ રહ્યા!... ઓ બાપ! એ તો બીજાં ત્રણને લાવે છે. હવે આપ અમારી પંચાતમાં ન પડો."

"કાંઈ હિકર નહીં, હું બધાં જ સારું જગ્યા કરી શકીશ, ચાલો." ગોરાએ પોતાની તરફથી આ ગુજરાતીને પહોંચેલ નુકસાનીનું વરક વાળવાનો નિશ્ચય કર્યો હતો.

રતુભાઈની સાથે શિવશંકરનું કુંદન હતું. ડૉ. નૌતમ રતુભાઈ દ્વારા શિવને ઓળખતા, પણ એની પત્ની જોડે પહેલો જ મેળાપ હતો. એની બહેન શારદુ તો હેમકુંવર માટે એક અસાધારણ કૌતુક જેવી બની ગઈ. ચટચટ સુવાવડ વિશે વાતો કરવા લાગી પડી. હેમકુંવરને મોટું આચાસન મળ્યું.

ધીમના પાછા પહોંચ્યા ત્યારે ત્યાં સ્ટેશન નહોંઠું કાટમાળનો  
કફૂસલો જ હતો.

શું થયું હતું?

પા કલાક પર રંગૂનથી એક સ્પેશિયલ માંડલે ગઈ. તેમાં હતું  
બર્માના ગવર્નર અને ચિનાઈ સેનાપતિ આંગ-કેં-શેક. બેઉ માંડલે જતા  
હતા. એમને આંધીથી નીકળી ગયે પાંચ જ મિનિટ વીતી. બીજી ઉત્પાદું  
દ્રેન આવી ઊભી રહી, એના ઉપર બોમ્બ વરસ્યા. પાંચ જ મિનિટનું  
ગાંધાતરી-ભૂલ જાપાન કરી બેઠું હતું.

“ત્યારે તો આપણાં તકદીર પાધરાં. દસ જ મિનિટ મોડા પહોંચ્યા,  
નહીંતર ઊડી જાત.”

બાપોરે એક વાગ્યે ખબર આવ્યા. માંડલેનો કિલ્લો સાફ્! અંદર  
સભા ભરી બેઠેલા અફ્સરો ઊડી ગયા.

આંગ-કેં-શેક?

હા, ગયો જ હતો એ અફ્સર-સભા સાથે મંત્રણા કરવા, પણ  
ઇષ્ટદેવ પાધરા હતા. કિલ્લો ઝૂકતાં પહેલાં પાંચ જ મિનિટે એની મોટર  
એને લઈને ત્યાંથી ચાલી નીકળી હતી.

ધીમનાના ભુક્કા થતા હતા ત્યારે હેમકુંવરબહેનને પ્રસૂતિની ઊની  
વેણું ઊપરી ચૂકી હતી.

ફક્ત એક થાંભલાને ટેકે એમના ઘરનો એક જ ઓરડો ટકી રહ્યો  
હતો, બાકીના મકાનના છૂંદા બોલ્યા હતા.

બળતા નિભાડામાં માંજારીનાં બાળવાળું માટલું સલામત રહી ગયું  
હતું એમ જૂની વાતો કહે છે. બળતા ને જમીનદોસ્ત બનતા એ  
મકાનની વચ્ચોવચ્ચે એક ખંડ આબાદ રહ્યો, ને તેની અંદર હેમકુંવરને  
પુત્રી પ્રસવી..

નળચું વધીરવાથી અને એટે પાટો બાંધવાથી વધુ વખત નહોતો.

\*

“બાકીનું ધીમના બાળી ભર્મ કરવું છે, શત્રુઓને હાથ કોઈ

સરંજામ જવા દેવો નથી." ભસ્તીભૂત ધરાની લચકરી સુચના છૂટી.

ધીકતી ધરા તો રશિયા કરતું હતું. એમ તો રશિયા અફ્બૂત  
મરણિયાપણાથી શત્રુઓનો સામનો પણ કરતું હતું.

રશિયાનાં એ બે કામોમંથી બર્માની વિટિશ સરકારે એકને જ  
અનુસરતું પસંદ કર્યું.

ધીકતી ધરા!

"શહેર ખાલી કરી જાવ. અમારે ધીકતી ધરા કરવી છે."

અરધા વાસાની છોકરી અને તાજી પ્રસૂતા સ્વીને લઈ નોતમે  
શહેર છોડ્યું. તેમને નીમ્યાવળા ગામડા સુધી લઈ જવાને સારુ  
રતુભાઈની મોટર પણ નહોતી રહી. સરકારી ઉપયોગ માટે એ તો  
રતુભાઈની ગેરહાજરીમાં જ ઉપરી ગઈ હતી.

પારકું સાધન સો ગણા મૂલે મેળવીને બને કુંદુંબો સાચે રતુભાઈ  
નીમ્યાને ગામડે ઉપડ્યો.

રસ્તે જ્યાં જુઓ ત્યાં ધા ઉછળતી હતી. સાઠ વર્ષો સુધી ચાલેલા  
પોતાના રાઝના શોષણાનું વેર વસૂલ કરવા બરમાઓ બહાર નીકળી  
પડ્યા હતી.

પણ આ ખાયારાની મોખરે તો એક બર્મા નારી બેકી હતી.  
રતુભાઈના ને શિવશંકરના લેબાસ પણ ઘાઉંબાઉ, લુંગી ને કોટના બનેલા  
હતા.

મોખરે બેઠેલી મા-હ્રલાના હાથમાં ધા હતી.

નારીના હાથની ધા તો નરના હાથની ધાને ધુજાવતી જ આવી  
છે. કઈ યુગો એ કથની કહેતા આવ્યા છે. મા-હ્રલાનો મોરો વાટપાડુઓને  
માટે વસમો બન્યો. નીમ્યાને ઘેર પહોંચી ગયાં.

નીજ રાત્રીએ રતુભાઈ, ડૉ. નૌતમ, શિવશંકર, નીમ્યા અને  
મા-હ્રલા મંત્રણા કરવા બેઠો. શારહુ સૂતી હતી. એને દેહ ધગશ ચડી  
ગઈ હતી. હેમકુંવરબહેનને નીમ્યા વારંવાર જઈ શેક આપતી હતી.

"નૌતમભાઈ!" રતુભાઈએ કહ્યું, "રંગૂનનો માર્ગ બંધ થઈ ગયો.

આસામના પલાડોનો માર્ગ જ હથમાં છે. માંડવે હજુ ઘેરાયું નથી, તાં જ તમે નીકળી જાઓ. ને શિવ તું?"

"હું! હું શા માટે કોઈ વિચાર જ કરું? આને હિંદ જવું હોય તો

બલે જતો." શિવે રમૂજીયે પત્ની તરફ અંગળી ચાંદી.

"મારે શા માટે જવું પડે? હું તો ખનાન-ટોથી જ નીકળવા નહોની

માગતી." મા-ધ્રુવએ જવાબ વાણ્યો.

"હું તો હિંદમાં ડગલું પણ દેવાનો નથી."

"હું તો હિંદમાં ડગલું પણ દેવાનો નથી." નજરે નિધાળો છે,

"પણ જાપાન આવે છે, અંગેજ ભાગે છે, નજરે નિધાળો છે,

ને?"

"તો શું છે?"

"નવા આવશે તે ભૂમ્યા દીપડા હશે."

"અકો!" નીમ્યાએ આવીને રતુભાઈને કહું, "તમારે તો જવું જ

પડશે." ડૉ. નૌતમે પણ યાદ આપ્યું:

"હા રતુભાઈ! તમારી ભતીજાનું નહીંતર શું થશે!"

રતુભાઈએ ડૉ. નૌતમને ઈશારે ચૂપ કર્યા એ ઈશારત જોઈ ગયેલી

નીમ્યાએ પૂછ્યું, "શું છે?"

મહામહેનતે ભતીજી તારાના પત્રની આખી વાત બહાર આવી.

"તો તો જાઓ જ." નીમ્યા આશા કરતી હોય તેમ બોલી.

"તો તો જાઓ જ." નીમ્યા આશા કરતી હોય તેમ બોલી.

"તમને મૂકીને જવાની છાતી નથી."

"કહું છું કે જાઓ. અમારી ચિંતા છોડો. અમારી તો આ ભૂમિ છે. અમારી તો છે આવશે તેને જરૂર પડશે. તમને પરદેશીઓને નવા આવનાર નહીં સહી લ્યે. નીકળવા તો નહીં પામો, ને વધુમાં ક્યાંક કેદ પકડાઈ જશો. કાં નવા ને કાં જૂના તમને જાસૂસીને માટે ઉડાડી દેશો, જાઓ, જલદી જાઓ."

"હું તો મા-નીમ્યા, મને કેટલો નાપાવટ ધારે છે!"

"નાપાવટ નહીં, પણ કાઈ વિચાર તો કરો! આ ડૉક્ટર બાબુ એકલા બે બાળકોને અને સુવાવડી સ્ત્રીને લઈને હિંદ કેમ પહોંચશે?

તમે હેમકુવરને ખાતર જાઓ..”

“વારુ, જાઉ છું. ને તું શિવ? તો તો નિશ્ચય જ કર્યો છે ન?”

“હા-જી.” ને એજે લલકાર્યું:

વહ ભી હેખા

વહ ભી દેખ વે!

“શિવ! નીમ્યાની સંભાળ રાખીશ ને?..

બોલતાં બોલતાં રતુભાઈ બીજી બાજુ જોઈ ગયો

“આંહી તો આવો, ડૉક્ટર!” નીમ્યા દોડતી તેડવા આવી.

શિવશંકરની બહેન શારહુના શરીરમાં મહાઉત્પાત મર્યાદે હતો.

ડૉક્ટરે જઈને તપાસણું. માથું ઢાળી ગયા. બહાર નીકળી શિવને  
ન રતુભાઈને એકાંતે કહ્યું: “લેગ! સામટી ચાર ગાંઠ! એક સ્ત્રી  
સુવાવડમાં, ને બીજી લેગમાં!..”

“એમ ઢગલો ન થઈ પડો, ડૉક્ટર!” રતુભાઈએ છાતી ખોંખારી;  
“આપણી એકની જ શું આ વાત છે? આજ તો બમની ગામેગામ  
હિંદીઓના ઘરેઘરમાં આ દશા હશે. પણ આ લેગની જો બહાર કોઈને  
જાડા થશે ને તો આપણા બાર વાગ્દી જવાના. લેગવાળાને ગોળીએ જ  
દેશ..”

“કોઈક બારણે બોલાવે છે..” નીમ્યા દોડતી આવી..

“કોણ છે?” સૌ ધૂજ્યાં.

“ગામનો તજી..”

તજી એટલે સરકારી મુખી.. એ બરમા મુખીએ આવીને નામવાર  
વિગતો પૂછી ને કહ્યું: “કોઈ ડૉક્ટર છે ન તમારી ટોળીમાં?”

“હા, કેમ?” રતુભાઈએ પૂછયું.

“મિલિટરીનો ઓર્ડર છે કે કોઈ ડૉક્ટરે બર્મા છોડવાનું નથી..”

“આ રહ્યો હું, ભાઈ! આ મૂળો હું આંહી..” એમ કહેતો શિવ,  
રખે ડૉ. નૌતમનો ઉલ્લેખ કોઈ કરી નાખે તે બીકે, એકદમ વરચે કુદાવી  
પડ્યો: “હું તો ક્યાંય જતો નથી. હું શું હજામ હું, કુભાર હું, કે મને

એવું પદ્ધાય  
નથી, ત્યાં  
કું હોય તો  
વા નહોતી

અધળો છો  
તો જવું જ

નેઈ ગયેલી  
ર આવી..  
બોલી..

આ ભૂમિ  
ઓને નવા  
ક્યાંક કેદ  
ડાડી દેશો..

કર બાબુ  
પહોંચશે?

પીમનામાં રહેતો હોવા છતાં મિલિટરીના આ હુકમની પણ ખબર નથી હોય? આ તો અહીં સુવાપનનો કેસ છે, તે હું અંહીં વિજિટે આવ્યો છું. જાઓ, જણાવી હો પીમના કે, ડૉ. નૌતમ અંહીં તમારી દેખરેખ તળે જ છે, ને તુરત પીમના પાછા આવે છે; અને જુઓ, તજી! મારું મો વગેરે બધું બરાબર જોઈ લેજો, પછી પાછા નથી ઓળખતા એમ ન કહેતા!"

"ના રે બાબુ, ના!" એમ બોલતા તજી આ નવા ડૉ. નૌતમનું ડાંચું પણ નિહાળ્યા વગર શરમાઈને ચાલ્યા ગયા.

"બોલો, બાઈ!" શિવે કહ્યું, "હવે તમે બેઉ છૂટા છો. રાત થોડી છે, વેશ આપો છો. બોલો, મારી શારદુને અંહીં મરતી મૂકવી છે? કે..."

"નાં, શિવ! એ મારી સાથે..." રતુભાઈએ બાંધ ચડાવી.

"સોંપું છું - મરે તો મૂકજો રસ્તામાં, ને જીવે તો હદ્દય જે કાંઈ સુઝાડે તે કરજો."

દવા ચાલુ થઈ ગઈ હતી. મોટર ખટારો મેળવી લીધો હતો. રાતોરાત પીમનાથી એક નિરાળા સ્ટેશને પહોંચવું હતું. ત્યાંથી કોઈ પણ ગાડી, કોઈ ગુરુજ ટ્રેન, કોઈ એન્જિન ટ્રોલી, જે કાંઈ તકદીરમાં હશે તે જરી જશે. પણ અહીં તો દિવસ ઉગવા દેવો નથી. ડૉ. નૌતમ જો ઓળખાઈ જશે તો રજણી પડશું.

કાંઉલે ઊંઘી ગયો હતો. નીમ્યાને તો 'અકો'ને વિદાય દેવાની પણ રેળા નહોતી. વહાલાં સ્વજનો જુદાં પડે છે ત્યારે ગદ્દગદિત બની અંસુ સારવાનો પણ અવકાશ જોઈએ છે. અંહીં તો ફાળ ને ફિફડાટ, ઉત્તાવળ અને ઉચાટ હતાં. ઓછામાં પૂરું અંધારી રાત હતી. સામાનના ચાર-પાંચ મુદ્દા સાથે લેવાની ભાંજગાડ હતી.

"હવે આ બેઉ જણીએને ઉપાડી ખટારામાં નાખે કોણ?"

"મને કંઈ નથી, હું તો ચાલી આવીશ," કહેતાં હેમદુંવરબહેન બાળકને તેડીને ચાલ્યા.

"બહિન કેસે જાયગી?" બેઠેલી માંહલા પૂછતી હતી. એનો સ્વર

જ કહેતો હતો કે એની છતી વલોવાતી હતી.

શારદુના શરીરને ઉઠાવવાનું કામ કોઈ પહેલવાનું હતું.

રતુભાઈએ શિવ સામે એક પલબર નજર કરી. ને શિવે કહ્યું:  
“હમ્ર! હવે પૂછવાનું શું છે? જુઓ, રતુભાઈ!” શિવ રતુભાઈના કાન  
પાસે ગયો. “હું તો અત્યારથી કન્યાગામ દઈ દઉ છું. પ્રભુ તમને...”

“બસ થયું, શિવ!”

એમ કહેતેકને આખાડેબાજ રતુભાઈએ શારદુના બર્યા બર્યા ઢેણે  
પોતાની ભુજાઓ ઉપર લીધો. પોતાની છતી પર શારદુની છતી આવી.  
પોતાના ખંખા પર શારદુનું માણું આવ્યું. જમણા હાથમાં કદળી-પગની  
પિંડીઓ આવી.

- અને અંતરમાં પ્રાર્થના આવી: “જીવનના દેવ! જીવનનો એક  
જ જ્યોતિકણ આપજો.”

એક પખવાડિયા પછી ટમું નામના ગામને સીમાડે જે સેંકડો માણસોનો  
પડાવ પડ્યો હતો તેમના દીદાર વિચિત્ર હતા. પડાવમાંથી કોઈક એક  
અનિર્વચનીય બદલો બફાતી બફાતી બહાર નીકળતી હતી. હજુદે  
ગાડાંની કતાર ચાલી આવતી હતી. જેઠ મહિનાની બાદ્દ લાગતાં મકોડાનાં  
ઘણા ઊમટે તેમ માનવી ઉભરાઈ ચાલ્યાં હતાં. માર્ય મહિનો હતો.

કાળા કીટોડા જેવા લેબાસમાં બે જણા એક ગાડા પાસે લોથપોથ  
પડ્યા પડ્યા વાતો કરતા હતા, ત્યાં ગામનાં કંગાલો તેમની પાસે માગતાં  
ઊભાં:

“તઠે એ... સેલેંયે લહેયે સીએને પેબા!” (ઓ શેઠજ, બીડી ને

ચા હોય તો આપો ને!

“હવે તું, બલાં થઈને જરૂર ઘણમ ત્વા કરો ને! ત્વો ને અહીંથી!..”  
પેલા બેમાંથી એક લર્મા-ગુજરાતીનું ખીચડું બાસું: “મારો સાળો અધ્ય  
તે કંઈ દેશ છે કંઈ દેશ! આ બેધાલ દશામાં પણ હજુ આપણને  
ખંખેરવામાં કંઈ કર્મિના નથી રાખવી! હંગેનથી અંહીં ટમુ લગ્ની છ  
દિવસને રસ્તે એક પણ ગામડું માર્ગા વગર રહ્યું છે! એક પણ બરમો  
ઓમ પૂછવા આવ્યો છે કે બાબુલે, કંઈ જોઈએ છે? ચાવલ કે ફૂધ  
લાવી આપું? બાંડી બાંડી આપું? બેલયનાં આપણાં ગાડાં લુંટવાં,  
આપણને પૂછપરદ કરી રંજાડવાં...”

“હવે એ કાષ્ય મૂકો, અને આમ જુઓ.” એના સાથીએ આથમણી  
દિશાએ અનંત અમાપ એવો ગિરિમાળાનો ગઢ બતાવતાં કહ્યું.  
“આ શું?” પેલા બાઈએ પૂછયું.

“બસ, આ જ નાંગા પણડો.”

“ઓહો! ત્યારે તો આની પછવાડ જ આપણો હિંદુસ્તાન.”

“હ-અં! પછવાડ જ! એટલે કંઈ વડી ટપવા જેટલી વાત નથી..  
પાકા છ દિવસનો ચડાવ-ઉતાર છે! ને શોઠ, જરૂર જરૂર આ નાંગાએને  
મજૂર રાખી લઈએ. નહીંતર રજણશું.”

“નાંગા સામે આવ્યાં છે, એમ ને! તથે તો હાશ! તથે તો હવે  
આ ભમરણી ભૂમિમાંથી છૂટવ્યાં! કરી છે ને કંઈ માયે! કુંગળી ને  
ભેસના ફૂધ સિવાય કંઈ મળે જ નહીં ને! એક એક વીસા ફૂધના  
(3½ શેરના) બાર બાર આના! અરે તારી જાતનું મિકૂન!”

(મિકૂનો એટલે ભેસનું ફૂધ મિકૂ: ભેસ; નો: ફૂધ.)

“અરે બાઈ!” સાથીએ કહ્યું, “જુંગલમાં તો એટલુંયે મળ્યું કહો  
ને! પણ મોલમીન-રંગૂનની આગબોટમાં તો કહે છે કે મૂઠીમૂઠી ચણા  
સિવાય કંઈ ખાવાનું છ-છ દિવસ નથી મળ્યું, અને મૂઠીમૂઠી ચણાના  
મૂઠીમૂઠી ઉપિયા ચૂકવવા પડ્યા છે.”

“ઓલ્યા બેઠા યુ.પી.વાળા બૈયા. ઈ તો દિવડા ઈ જ ને, જેના

સત જગ્યા રસ્તે મરી ગયા?"

"હા, ઈ જ. મરે ઈ તો અમરપદે કોઈ થોડે લાયું છે!" એમ કહેતો એ માણસ શુંકરો.

"એ પણ ઓળિ મદાસલ બાઈ રૂરે. હે મો શું વળી રહી હો? કોણે કાટ્યો એમાં કોઈ શું કરે? એનો ધક્કી મૂળો ને બીજો શું જવતો રેત!"

"ભાઈ! આપણાં બેગાળોકરાં દેશ લેળાં થઈ ગયાં એટલે સૂરે છે આ બધાં લાડ!"

"દેશ છે કંઈ - કમલભાત દેશ!" પેલા ભાઈએ વળી પણું શરૂ કર્યું: "નોટુંના થોકડા ગંડે બંધી લીધા ન હોત તો રસ્તે પણી પીવાય આપત? આમ જુઓ. આ મૂર્તિયું હાવી આવે. ડાકફણું જ લાગે છે કે બીજું કંઈ?"

બે-ગાળ બર્મા સ્ત્રીએ ચારે બાજુ ફરતી ફરતી આવતી હતી ને બધાને કહેતી હતી તેમ આ બે જગ્યાને પણ કહ્યું: "બાબુ ત્વામલા? (બાબુ, દેશ જાઓ છો ને?)"

"હા બાપ! ત્વામણું જ ના હવે તો!" એમ કહેતા આ બાઈ ડેકું ધૂષાવતા હતા.

"હા... અં... બાબુ ત્વામે! (બાબુજી દેશ જશો!)” પેલી સ્ત્રીએ સાઠી જ વાત કરતી હતી.

પણ એ શાબ્દોમાં આ ભાઈએ બંગ ઉકેલ્યો:

"ટણીયે છ્યેં બાપ! ટણીયે છ્યેં. તમારા દેશનો છેલ્લો છેડે આવો. રહ્યો તોય હજુ કેમ અમારો જીવ ખાવા ફરી છો, માવડિયું! આ ત્વામ્યા, બાપા! અમે તો હવે આ ત્વામ્યા પણ ભૂલશો નહીં, બરચ્યાંઓ, કે એક દિવસ અમે પાછા આવશું!"

એમ કહેતાં જ એણે ઉઠવા યલ કર્યો ને કહ્યું, “પગ તો સૂર્જીને થાંભલા થયા છે. આ ગાડાં! - એનાં મીંદાં જેવા બળદો! આ ગાડામાં બેસાય જ કરી રીતે? રાતે તાપણાં કરી કરીને જાગરણ કરવાં આ બધા

160

તખો અને ચબોજીની બીડ, અને દિવસે બસ લાગટ જાડીમાં જ ચાલ્યા  
કરવાનું. છ દિવસની લાગટ જાડી! અહોહો! જાડી તે કાંઈ બીજાની  
જાડી! મારગ વગરની ઘનધોર ઘારી જાડી. અહોહો! હે ભાઈ! આ  
જાડી કાંઈ નજરમાં બેસે છે? એકેય વાર કપાણી નથી લાગતી. આમાંથી  
લાકું નીકળે તેનો સુમાર જ ન રહે. નરદમ સોનાનું જ ટિંબર છે છો!  
કોઈક હી પાછા વળીએ તો આ બીડ ભૂલવા જેણું નથી.”

“પણ આપણા સામાનનું એક ગાડું કેમ હજુ આવ્યું નહીં!” બીજો  
ભાઈ ડેક ઉગમકી દિશાએ સધાન ઘાન ઝંગલ તરફ જોતો હતો.  
“આવી રયું, બાપ! દેશ છે કાંઈ ભાડોડ! માણસાઈ તો પાતાણે  
જિતરી ગઈ છે.”

\*

પડાવના બીજા એક ભાગમાં ડૉ. નૌતમ, રતુભાઈ, બે સ્ત્રીઓ  
અને બાળકોનો કાહલો બેઠો હતો. ચાર જણાએ ઉપાડી લાવેલી ડેણીમાં  
શારદુ સૂતી હતી.

કોઈ દેખી ન જાય તેમ ડૉ. નૌતમ એનું શરીર તપાસીને રતુભાઈને  
કહેતું હતું: “બચ્ચી જાય તો નવાઈ નહીં.”

“પણ હજુ આ બીજા છ દિવસ...”

“પહાડી હવા મદદ પણ કરે. પણ વરસાદ તોળાઈ રહ્યો છે તેની  
બીક છે... ઓ જુઓ, પેલો કોઈક ગોરો મારી સામે જોઈ રહ્યો છે.  
કૃંધાઈક ઓળખી પાડશે તો અંહીંથી હજુ મને પાછો ઘકેલશે. ઓ મારા  
બાપ! એ તો પાસે આવતો લાગે છે. લશકરી સી.આઈ.ડી. તો નહીં  
હોય? આવ્યો આ તો! નક્કી કોઈક...”

ત્યાં તો પેલા ગોરાએ દૂરથી લલકાર કર્યો: “હલ્લો!”

“હલ્લો! ઓહોહો! તમે અંહીં? અહીં કેમ?” ડૉ. નૌતમે પેલા  
ફ્યુવાળા અંગ્રેજને પિછાન્યો ત્યારે એનો ચાસ હેઠો બેઠો.

“અહીં જ હાઉં ને?”

“ક્યાં જાઓ છો?”

“બીજે કયાં વળી? ઓલ રોડ્ઝ લીડ દુ હિન્ડિયા. (બધા માર્ગો હિંદ જ લઈ જાય છે.)”

“એકલા છો?”

“ના, મારાં બે છોકરાં પજી છે ને!”

“પજી તમે તો ખાસ યુરોપિયનોને રસ્તે જઈ શક્યા હોતા!”

“હા, ને તે રસ્તે મને હાથી વગેરે વાહન પજી મળત. પરંતુ મને થયું કે જે રસ્તે હિંદીઓ જાય તે જ રસ્તે મારે જવું. તેમાં વળી તમે ભેટ્યા. તમે કયે માર્ગ આવ્યા?”

“પીમનાથી ગુડ્ઝ ટ્રેનમાં માર્ડલા, માર્ડલાથી લૉંચમાં મીસ્ટ્ઝ, મીસ્ટ્ઝથી ખટારામાં મનીલા, મનીલાથી મોટી લૉંચમાં કલેવા, કલેવાથી હંગોન હાડકાંમાં, ને હંગોનથી અંણી ગાડારસ્તે.”

“કેટલું હૂકામાં કહી નાખ્યું?” ગોરો ખાસ લઈ ગયો.

“દુઃખનાં લાંબાં બધાન શા માટે?” નૌતમનો સ્વર ક્ષીણ પડ્યો.

“તમારે હોડીઓ જેંચવી પડેલી?”

“હા જ તો. કંઠે કંઠે ઘગધગતી રેતીમાં ચાલીને દોરડાં જેંચવાં પડેલાં.”

“અમારી લૉંચમાં ગોરં જ હતાં. જવ્યા હતી છતાં દેશીઓને ન બેસવા દીધાં. લૉંચવાળાઓ હતા હિંદીઓ. તેમની ખોપરી તપી ગઈ. તે વખતે તો ન બોલ્યા, પજી પછી રસ્તે લૉંચમાં ભાર વધુ પડતો છે એમ કહી અમારી સ્ત્રીઓને ઉત્તરીને ચાલવા ફરજ પાડેલી. તેમાંથી કેટલીએ મરી ગઈ.”

“ગોરી સ્ત્રીઓ?” ડૉ. નૌતમ ચકિત થયો.

“હા. તમારાં પત્નીને હવે કેમ છે?”

“આ રહ્યાં,” ડૉ. નૌતમે પત્ની બતાવી, “હવે એ એકલી નથી.”

“શું કહો છો! પ્રસ્તવ થઈ ગયો! આજે કેટલામો દંહાડો?”

“અઢારમો નીજે વાસે જ અમે નીકળ્યાં.”

“ને બન્ને જીવે છે!”

“અલાઈવ ઓન કીડિંગ!” (લહેરથી જીવ છે.)

“અદ્ભુત!”

“મુસીબત ને મર્દાઈ, બેઠ જોડ ચાવે છે. આ બીજાં બાઈ. એને ખેગ હતો. એને અમે નેભાન સિધિતિમાં ઉકાવેલ. વાંચમાં બંડકિયાને તળિયે છુપાવીને લાવ્યા.”

આમ વાતો કરે છે ત્યાં તો -

“અરે ઓ, ડોક્ટર! પહોંચા છો ને શું?” એવા બરાડા પાડતા પેલા બેઠ મેલાં કપડાંવાળા સાથીઓ આવી પહોંચા: “ભલા આદમી! બોલતાય નથી?”

ગોરો વિનયથી દૂર ચાલ્યો ગયો.

“ઓહોહો! શામજી શેઠ, શાંતિભાઈ શેઠ! માંડ માંડ ઓળખાયા. હવે મહેરબાની કરીને મને ડોક્ટર કહી બોલાવતા નહીં, નીકર હું જહેર કરી આપીશ કે તમે બધા માલદાર છો; તો હમજાં આ ગોરો તમને પાછા ઉપાડશે. લશકરવાળો છે, હમજાં તમારાં જ નામ પૂછ્યા હતો.”

“કુ...ક! ચાલો હવે! આ તે કોઈ દેશ છે, બાઈ! આ દેશ તો કોઈ જાલિમનો નીકળ્યો, હો ડોક્ટર! આ દેશનાં માણસો મલકનાં ઉતાર. આ તમે બહુ વખાડતા, તો જોઈ લ્યો આ સંસકતીને. મારા બેટા ગામેગામ કહેતા આવે છે કે, “બાબુ ત્વામલા, બાબુ ત્વામલા! મારા બેટા, જેટલા બધાર એટલા બીજા ભોંમાં! નરતાર જાપાનને મળી ગયેલા, ન મીંબા તે કાંઈ મીંબા! જાપાનને દોરીને લઈ આવ્યા!”

“મુદ્દાની વાત કરોને, શામજી શેઠ,” નૌતમે કહ્યું, “આપનું નાણું તો બધું દેશ ભેગું થઈ ગયું છે ના?”

“ઈ તો થાય જ ના! નેણ્યનાં ગાડાં નેણ્યમા થોડાં રહે છે! આ તો હું પ્રસ્તાવી પેટછૂટી વાત કરું છું, કે આ પંદર દા'ડામાં આ દેશનાં લોકોએ અમને જે અનુભવ કરાવ્યો છે તેની કાંઈ વાત કરી જાય તેમ નથી, સાહેબ! વગર પેસે તો વગણી ઉપર મૂતરવાય તેયાર નહોતા. લાવા પેસા! ટખ્યા પેલા! નખ્યા પેલા! પેલા પેલા ને પેલા વિના બીજું

રટક નહીં. અને રાતે બસ ધા લઈને આવે ધમરોળવા."

"આપણેય, શેઠ! રબ્યા નાચા (પૈસા રૂપિયા) વગર આ લોકોની કઈ વઢાળી પર મૂત્રથી છીએ? યાદ તો કરો."

"હે તમે પાછા, ભાઈસા'બ! બળતામાં હી હોમો છો, હો ડોક્ટર! છેલ્લી ઘડીએ, આ ભમરાળો દેશ છોડતાંથી તમારાં મહેણાં મટ્યાં નહીં!"

"ત્યારે પછી હે એનો દેશ છોડતી રેળા છેલ્લી ઘડીએ એના જ વગોણાં કરશું!"

"ખાસું. ચાલો, કાનની બૂટ પકડી. હે, આ શું તમારો કાફલો? આ છોક્કું..."

"દેવનાં દીવિલ."

"અરે રંગ! જાતાં જાતાંથી આ દેશનો પાણીફેર વસૂલ કરતા જાઓ છો ને શું? ત્યારે તો પછી આ દેશનું વાંકુ રેના બોલો, મારા બાઈ! તમારું કામ તો બેવડે દોરે છો?"

"પાજા શાંતિભાઈ શેઠ!" નૌતમે કહ્યું, "તમે કેમ ચૂપ છો?"

"સહજ જ. અમારું એક ગાડું નથી આવ્યું."

"હે છોડોને ગાડાવાળી, શેઠ!" શામજી શેઠ ખીલ્યા હતા. "હે તો સુગલ ઉડાવો; જીવતા આવ્યા તેનો આંદ માણો. તમારી છાતી પર તો ગાડું જ ચડી ગયું છે. ગાડામાં હતું શું! જાવા દ્વો ને જખાનમમાં સમજો ને કે ગાડેથી જ પત્યું. નજરોનજર નથી જોયું? - કોલેરામાં ટપોટ્ય માણસો પડતાંતાં, મા સગા દીકરાને ડયકાં ખાતો મૂડીને ચાલી નીકળતીંતી, ને આપણાં ગાડાં મુડદાંને માથે થઈને ચાલતાં હતાં."

"આપણે જરાક છેટા જઈએ." ડૉ. નૌતમને પલ્લી તેમ જ શારદુનાં નબળાં મગજ પર ભયાનક છાપ પડવાની બીક લાગી.

"મારું તો ભાઈ, એવું કે મને ઈ બધાં મરદાંફરદાં દેખી ચીતરી ન ચડે. કંઈક જોઈ નાખ્યાં. આ શાંતિભાઈ શેઠ કંઈક સુગાળવા ખરા! જ્યાં એવું આવતું ત્યાં ઊંધું જ ઘાલી જતા હું તો ગાડાનાં પૈડાં ડેઢળ મરદાં ચેપાતાં જોઉ તોયે..."

ડૉ. નૈતમે પક્ષ આવી વાતોથી મોં કેરવી લીધું હતું. દૂરથી રતુભાઈ એક ડોળી અને ચાર ઉકાવનારાઓ લઈને આવતા હતા. એ નજીક આવતાં શામજી શેઠની નજરમાં ઓળખાઈ ગયા ને પોતે ગંભીર બનીને બોલ્યા: “ઓહો! આ ભાઈ પક્ષ તમારી ભેગા છે ને શું! તીક ત્યારે લ્યો, ડૉક્ટર! હવે તો આપકે વળી ક્યાંક આગળ ભેટી જશું. અમારે તો ગાડાની વાત જોવી પડશે.”

એમ કહીને એકો ને શાંતિદાસ શેડે ચાલતી પકડી. રતુભાઈને તેમને ખરેખર ભય લાગ્યો. ગોરા સાહેબ પોતાનો સામાન નાંગા લંગોટીદારોના શિર પર ઉપડાવીને ડૉ. નૈતમના પડાવ પર હાજર થયા. જોડે ને બાળકો હતાં. તેને હેમકુવરબહેન ડેત કરીને પોતાની પાસે બોલાવ્યાં, કાજુ વગેરે સૂકો મેવો આખ્યો. ગોરી કન્યા હેમકુવરબહેનની નવી બાલિકાને તેડવા પક્ષ લાગ્યો. તેમનો બધાંનો પડાવ એક રાત્રિ માટે સાથે થઈ ગયો.

પરોઢિયે તેમનું પહાડ-પરિયાણ શરૂ થયું. પગપાળાં બધાં પહાડ ચડવા લાગ્યાં. ડૉ. નૈતમે નાની છોકરીને લીધી. બાબલો ચારેક વર્ષનો ચાલવા લાગ્યો. એ દશ્ય દયામણું હતું. એને ગોરા સાહેબે પોતાને બધાંને ચડાવી લીધો. સુવાવડાં હેમકુવરબહેન પગ ઠેરવતાં ચાલ્યાં. શારદુની ડોળી અને રતુભાઈ આગળ નીકળી ગયાં હતાં.

અરુણ્ણોદય થતો હતો ત્યારે ડોળીવાળાઓના પહેલા વિસામે રતુભાઈએ ઊભા રહી, પહાડ પરથી પાછળ રહી જતા મુલક પર મીટ માંડી. બ્રહ્મદેશનું છેલ્યું દ્વાર છૂટટું હતું.

શતમુખી મા ઠરાવદીના કન્કમય ફંટા સુવર્જના લિસોટ જેવા જાણે હજુ દૂર દૂર દેખાતા હતા. ફ્યાનાં ઊંચાં શિખરો ચમકતાં હતાં. બુદ્ધની વામકી અને વિરાટ પ્રતિમાઓ, બેઠેલી અને સૂતેલી દેવમૂર્તિઓ, હજુ નયનોમાં રમતી હતી.

એ અંજી, લુગી અને અંબોડામાં પુષ્પો મફતી નારીઓ ફરી દેખવાની નહોતી. નીમ્યા અને માન્ધલાની મધુર વાળી અને સોનાંકકીનાં

શરીરને સંદર્ભ  
હતાં.

એ સ

તે પણી પણ

મીઠાં

નીમ્યા

દાંડા

પડવાં.

કૃ

બ્રહ્મદેશના

નીમ્યા, કા

તેમ

અ

હો તો!

મોહું લઈ

મ

જોઈ હ

હતું. અ

કોઈ દિ

બડબદી

ડોળી

બળી

માત્રા

ખોણો

શરીરને સદાસર્વદા મહેકાવતો તનાજા-લેખ, કાન અને નાકને હજુ ભરતાં હતા.

એ સર્વ ગયું શું? સ્વાનમાં જ જોયું રહ્યું શું? લિખસંગ્રામ વિરમે તે પછી પણ બ્રહ્મદેશમાં જવાનું કોણ જોયો ક્યારે થશે?

મીઠાંબોલાં માનવીઓ સાંભળ્યાં ને અંતર વલોવાઈ ગયું  
નીમ્યાનો કાંઉલે મને શોધતો હશે!

દડ-દડ-દડ આંઝો વહેવા લાગ્યો, આંસુનાં થ્યાં પર સૂર્યાંકરણો  
પડ્યાં.

હુ દિવાકર દેવ! તમે તાજી જ કાઈ સમાચાર લાવો છો  
બ્રહ્મદેશના! આગાં પ્રલયપૂર ક્ષયાં સુધી પહોંચ્યાં? એ સંહારના સોતમાં  
નીમ્યા, કાંઉલે ને મા-હ્લા સલામત છે?

તેમાંનાં શરીરોને તો ઘરના કે પરના લૂટારા સ્પર્શયી નથી ને?  
અતિસ્નેહ પાપાંકી બન્યો. આંશંકના ઓદ ઊછળ્યા, કંઈક થયું  
હશે તો! નીમ્યાના દેહ પર જાલિમોનાં હળ ચાલ્યાં હશે તો? તો હું શું  
મોહું લઈને ઘેર જીવતો રહીશ?

મા-હ્લા શું કરતી હશે? શારદુને વળાવતી એની આંઝો મેં ચાત્રિએ  
જોઈ હતી. એકો મારી સામે માત્ર મિટ જ માંચીને કહેવાનું કહી નાખ્યું  
હતું. આટલી વહાલી નષંદને વળાવતે મા-હ્લા ઊભી થઈ રહી; હવે  
કોઈ દિન કાગળ, તાર, સંદેશો કાઈ કરતાં કાઈ જ નહીં આવે-જાય!

જોષે પાતળામાં પુરાઈ ગયાં. ઉપર ભામરિયાં પાડી ફી વળ્યાં.  
બડલાડિયાં બોલી બંધ પડ્યાં. ત્યાંવાળાં ત્યાં-અંહીવાળાં આંહીં! શારદુની  
ગોળી તરફ પીઠ વાળીને જ એ ઊભો હતો.

શુદ્ધ બ્રહ્મદેશી અદાથી રતુભાઈ ધૂંટરિયે પડ્યો. ને એકો માથું  
ગોળી છેક ધરતીને કપાળ અડકાડ્યું. એકો પુકાર્યું:

“મને સાત વર્ષ સંઘરનારી, હે વસુંધરા! હે અન્નપૂર્ણા! લિચાર  
માત્રથી પણ મેં તારા અવગુણ જોયા હોય, તો માનજે કે પેટના બાળકે  
ખોણો બગાડ્યો છે.

“હે પાલક ભૂમિ! મારાં અનેક બાંદુઓએ છેલ્લાં સાઈ વર્ષમાં તારી કુસેવા કરી હશે. એમને ક્ષમા દેજે. એ શું કરે બાપડા? અમારી અંબા જ જજરિત, વૃત્તાયેલી અને ધાન્યાલીન છે; એટલે એમે આવ્યા તારે - દ્વારે, ભૂખનાં વડકાં ભરતાં એમે આવ્યા, અભજા અને અભસંસ્કારી સ્થિતિમાં. આવનું કેમ, પરને આગળે રહેનું ને વર્તનું કેમ, એની અભને ગતાગમ નહોલી; ક્ષમા દેજે.

“તને વગોવી હશે, વગર સમજ્યે. ક્ષમા દેજે.

“કોઈક દિવસ આવશે મારાં દેશવાસીઓ - તું આગળ તારાં

થઈને.

“કોઈક દિવસ તું પોતે જ બની જશે અમારી માતૃતનયા. આજે તો તને ઈરાદપૂર્વક ઉચ્છેદી છે.”

ફરી ફરી વંદનો કરીને એ ઉક્ખ્યો. આગળ ચાલ્યો. ડેણીમાં પડેલી શારદુએ ક્ષીણ નેતે રતુભાઈનું રહેલું મોં નિહાળું, ક્ષીણ સ્વરે એણે પૂછ્યું: “મારાં ભાભી કાંઈ બોલ્યાંતાં?”

“બધું જ કહીશ.” રતુભાઈના એ મીઠા જવાબે શારદુની છાતી

છલાવી.

શારદુની પથારી પાસે જ પંદર દિવસ ને પંદર રાત ગાળનાર રતુભાઈ શારદુને મન અજાક્યો નહોતો રહ્યો. દેશમાં જશું એટલે કોઈક નવી જ જીવન-હુનિયા ઉઘડવાનાં સ્વખોમાં એ મસ્ત રહેતી હતી. પગપાળો કાફ્લો આવી પહોંચ્યો. તેમણે રતુભાઈને ઘૂંટણિયે પડતો જોયો હતો. તેમણે પણ ઉભા રહીને છેલ્લી દસ્તિ બ્રહ્મદેશ તરફ નાખી લીધી.

“ચાલો, આપણો પણ પ્રાર્થના કરીએ, બરચ્ચાં.” કહીને ગોરા પિતાએ પોતાનાં નેઉ બાળકોને બ્રહ્મદેશ તરફ ઘૂંટણિયે જુકાવ્યાં. ડો. નૌતમ પણ પોતાની હેટ બગલમાં દબાવી પૂર્વ ભણી ઉભા રહ્યા.

સાંજ પડતાં કાફ્લો એક પણડ ચડીને પાછળ એની ખીણમાં ઉતરી ગયો. બ્રહ્મદેશ આડો પરિપૂર્જ પડદો પડી ગયો.

પ્રભુ

ગામંડુ

સરકારે

હતું. એ

સાહેબના

તો ગત

ખાવાનું

પાડી

જવાનો

નહોંતું.

હિંદીએ

પડાવે

બપોર

હેમંડુ

ભરોં

મેધા

એટલે

કર્યા

ચાલ

સાહે

પછાડો પછી પછાડો ઉભા હતા. પછાડોને કોઈ પણ નહોતો ગામનું નહોતું. જળશાય નહોતું. ઝૂપદીએ નહોતી. પછાડોને પેટાણે પેટાણે સરકારે નવી કરેલી પગદંડી પર થઈને હિંદીવાળાનું કિડિયાનું ચાલ્યું જતું. એ પગદંડીની કનારી નીચે હજારો ફૂટ ઊરી કદરાઓ હતી. સાહેબનો સાત વર્ષનો બાળક વિંતાનું કારણ હતો. જરીક પગલું ચૂકે તો ગતાગોળમાં જાય તેવો વિકટ માર્ગ હતો. રસે જે પાસે હોય તે જ ખાવાનું હતું, વેચેથી છેક નીચે ખીંચ સુધી ઉત્તરીને નાળ્યમાંથી મળે તે પાકી પીવાનું હતું.

ચડ ને ઉત્તર - ચડ ને ઉત્તર - પછાડની અન્તિમ અટવી ઓળણી જવાનો અન્ય કોઈ ઠિલાજ નહોતો. નહોતું ખરચર કે ગણિકું, બકરું પણ નહોતું.

હતા કેવળ લંગોટિયા કાળા મણિપુરી નાંગા મજૂરો - ને હિજરતી હિંદીઓ.

પહેલા દિવસની રાત એક ડોળી નદીના પટમાં ગાળવી પડી. પડાવે ત્યાં રાંધ્યું રીંધ્યું ને ખાઈ કરી રાતભર ચોકી રાખી.

વળતા દિવસના વહેલી પરોઢના સાડા ત્રણ વાગ્યે પડાવ ઉપડ્યો. બપોર સુધી ચાલ્યો. સાંજે અનરાધાર મે ત્રાટક્યો. સુવાવડી હેમકુંવરલહેન - ને એના જેવી તો કરીક, પલળતી પલળતી પ્રભુને ભરોસે આગળ ચાલી.

ત્રીજે દિવસે ગોરા સાહેબનો સાત વર્ષનો દીકરો, આગલા દિવસના મેઘમાં પલળીને આખી રાત એ જ વસ્ત્રભર ફૂકાતા પવનમાં સૂતેલો એટલે, સહેજ અસ્વસ્થ બન્યો. ને દિવસમાં ચુમ્માલીસ માઈલનો પંથ કર્યા પછી ત્રીજા રોજના બાબીસ માઈલ એને માટે વસમા બન્યા. એની ચાલ ધીમી પડી; પિતા-પુત્ર પાછળ રહ્યા.

સાંજે ત્રીજા પડાવ પર પહોંચીને સૌ રાહ જોતાં હતાં. છેવટે તેમણે સાહેબને બંધોલા પર કેવળ એકલા બાબલાને જ ઉપાડીને આવતો દીઠો.

નાની છોકરીને રમાડતી ગોરી કુમાર્ણિકા તો આ કાળા કાફલામાં

એકરસ બની ગઈ હતી. બાબુ પરિસ્થિતિએ કાળા-ગોરા અને જાંચ-નીચનો બેદ નામમાં પણ નહોટો રહેવા દીધો, એટલે બાકી રહી હતી શુદ્ધ માનવતા. ગોરી કન્યાએ પજા પંદર દિવસથી કષાં બદલ્યાં નહોટાં. સ્નાન પામી નહોટી. અરે, આખું બાફવા સિવાય બીજું કાઈ એને આવડનું નહીં, એટલે ખોરાક તો એને રતુભાઈ પકાવી દેતા.

સાહેલ આવીને પહેલાં તો નિરોતે બેઠા પછી એઝે માં લુંઘું.

કન્યાએ પૂછ્યું, “કેડો! રોભી કયાં?”

“પ્રભુને ત્યાં.” ગોરાએ ઉંચે આંખો કરી.

કન્યા આભી બની, આંખો ફાડી બાપ સામે જોઈ રહી. બાપે

કહ્યું: “ડાંલિંગ! રોભીને તો સંદર્ભે માટે પાછળ મૂક્યો.”

પછી તો ભાઈની બહેનનું ધાતીશાટ કલ્યાંત એ પડાવમાં રેલાયું. માવિલોણાં બે બરચાં હતાં. એમાંથી એક જાડો કે અટાિમાં ભૂલું પડી ગયું ને ગાયથી બન્યું.

“રડ ના, બેટા!” બાપે કહ્યું, “આ સુવાવડી લેડી દુખારો.”

રતુભાઈ, ડૉ. નૌતમ વગેરે સૌ દોડચા આવ્યા. પૂછવા લાગ્યા,

“રોભીને શું થયું?”

“કાલથી જ ન્યુમોનિયા હતો. રસ્તે ન્યુમોનિયા વધ્યો. ઓફાડવા-પાથરવાનું કાઈ નહોટું. મેં બીજે ખંધોલે એને ઊંચકિને રેહયો. માથે મે તો વરસતો જ હતો. રસ્તે જ રોભી ખતમ થયો.”

“પછી?”

“પછી શું? એક બાજુ મુડું મૂકી દઈને હું ચાલ્યો.”

“કાલે અસર હતી તો મને કેમ ન કહ્યું?”

“કહીને શું કરું? તમે થોડા ડૉક્ટર છો?”

ડૉ. નૌતમ લેવાઈ ગયા. એકો જ પોતાની જાત છુપાવી રાખી હતી. એકો કહ્યું: “મિત્ર! હું હીનભાગી ખરેખર ડૉક્ટર જ છું. પજા મારે છુપાઈને નીકળી જવું પડ્યું છે. રોભીની આવરદા તો ઈશ્વરાધીન વાત હતી. પજા હું ડૉક્ટર છતાં મારી ફરજ ન બજાવી શક્યો. વિશ્ર છે મને.”

પ્રભુ સિધાવ્ય

“તમે

ઠતલાર તે

ગોરા

ઢિંધીઓને

નાગ

નિહાળવા

હેમ

શરત આશ્વા

રહ્યો. એકો

જે અનુભૂ

વિસાતમાં

એના પત્ર

એમને છે

સાથે ચા

રા

કંઈક વિ

“

પજા ગુમ

હાથ મૂ

છે; વિધ

“

રહી. ૨

છંટકીર

“

સિગાર

મધુર

આતમ

“તમે શું કરો, મિત! મારા જેવા ગોરા પર તમને એટલો બધો હતબાર તે ક્યાંથી આવે કે સારી ઓળખાજ આપો!”  
ગોરાનું અવું મૃત્યુ અને આવી એના મૃતદેહની દરા, એ પરાધીન  
હિંદીઓને પહેલી જ વાર સાંભળવા મળી

નંગા પઢાડોના નિર્જન ખોળામાં માનવી માનવી વચ્ચેનો આ  
નિખાળવા મળેલો અભેદ કલ્યાણકર હતો, પણ અતિ કાચકારી હતો.  
હેમકુવરબહેને રોલીની બહેનને પોતાની ગોદમાં લઈને આખી  
ગત આચાસ્યે રાખી, ગોરો પિતા તો નંગાના નિખાલ શિખર જેવો બેસી  
રહ્યો, એણે ડૉ. નૌતમને ને રતુભાઈને કહ્યું: “યુરોપનું અક્કેક ધર આજે  
જે અનુભવી રહ્યું છે, એના પ્રમાણમાં મારા રોલીનું અવસાન શી  
વિસ્તાતમાં છે! અરે, એટલે દૂર કાં જવું? ઓ જુઓ પેલી પંજાબજ રડે!  
એના પતિ અને પુત્ર, નેઉને મેં રસ્તે ડયકાં ખાતા પડેલા દીઠા; અને  
એમને છેલ્યું પાણી પણ આપી શક્યા વગર એ બાઈને પોતાને સંગ્રામ  
સાથે ચાલી નીકળવું પડ્યું છે.”

રાતમાં ડૉ. નૌતમે કહ્યું: “સાહેબ, તમારી ને બહેનની મનોવ્યથાને  
કંઈક વિરામ મળે તેટલા સારુ આપણે આજ આંદ્ધી જ રોકાઈ જઈએ..”

“એકને ગુમાવ્યો છે, હવે આપણા પડાવમાંથી આ બીજા બાળકને  
પણ ગુમાવવો હોય તો રોકાઈએ,” સાહેબ ડૉ. નૌતમના બાબલાને શિરે  
હાથ મૂકીને કહ્યું, “ચાલો, ચાલો, રોકાવાનું હોય જ નહીં. આ તો સંગ્રામ  
છે; વિધાતા સામેનો..”

કંઈ તાકાતના એ નમૂના પ્રત્યે, કાફલાવાળી સર્વ આંખો ચોરી  
રહી. એ પોતે તો સિગારના સળગતા હોપકા પરથી મરેલી રાખને  
છંટકોરતો, ધીરે ધીરે જલતા છેડા પર જ તાકી રહ્યો હતો.

“સળગવું, રાખ થતાં જવું અને ખરતાં જવું - લાઈફ ઈઝ એ  
સિગાર, માય ઇન્ડઝ! (જીવન એક બીડી જ છે, મારા મિત્રો!)” એવા  
મધુર બોલ એ લૂટાયેલા પિતાના મોને વધુ મધુર બનાવતા હતો, અને  
આત્માને તો તેથીયે વધુ મધુર.

## પ્રભુ પદ્માવતી

“કમ અલોગ માય બોંડ, પેક અપ! નો પોતાંગ, નો વેઈટાંગ,  
નો લક્જરી ઓફ મોનીંગ, વી સીમલી કાન્ટ એફોર્ડ ઈટ. (ઉઠે  
બરચાંઓ! બચકાં બાંધો. રોકાંબ, રાહ જોવી, કે તુદનનો વેખવ માણાવો,  
એ કશું જ આપણને પરવતે તેમ નથી.)”

એમ બોલીને એણે ચાતના ત્રણ વાયે સૌને ઢાળી સાબદાં કર્યા  
અને એણે પોતાની પુત્રીને કહ્યું, “આમ આવ તો! જો હું તને એક  
તરકીબ કરી આપું.” એમ બોલીને એણે પોતાની પાસેનો એક કપડાનો  
કુકડો લઈ પુત્રીની પીઠ પર એનું ખોયું કસકસી આપ્યું ને પછી તેની  
અંદર, હેમકુવરબહેન પાસેથી નાની છોકરીને લઈને સુવાડી દીધી ને  
કહ્યું: “જો, આપણે બમ્મિના એક સુંદર સંભારણાને આ રીતે સાથે લઈ  
જઈ શકશું. બમ્મા અને ચીની સ્ત્રીઓને આમ બાળકો તેડતી જોઈ છે  
ને? અને હવે? ક્યાં ગયો મારો બાબલો? બાબલો! ઓ યુ વિટલ ડેવિલ  
બાબલો! કમ અલોગ! તને પણ વધુ કન્ફરેન્ચ સીટ કરી આપું.” એમ  
કહીને એણે બાબલાને ખંધોળે લીધો, ને બાબલાને પગ ડેરવવા પોતે  
ગળામાં એક રસી નાખી આડી લાકડી લટકાવી દીધી.

ભારે હૈયે ચાલી નીકળેલા એ સંઘમાં સાહેબની આવી કંઈક  
રમૂજો-રોનકો દેખી દેખી ડૉ. નૌતમ રતુભાઈને કહેતા હતા કે “અમારી  
વિદ્યામાં જે ‘દ્રાન્સફ્લુઝન ઓફ બ્લડ’ અર્થात્ એક શરીરમાંથી બીજા  
શરીરમાં રુધિરાન્તર કરવાનું છે, તે જ અંદી થઈ રહ્યું છે. આપણા  
ભરપૂર બાલ-વાત્સલ્યને આ સાહેબ પોતાના દરિદ્ર બનેલા અંત:કરણમાં  
રેઝે જાય છે.”

બાકીના જે પાંચેક પડાવો થયા, તેમાં સાહેબ આખા પડાવનાં  
છોકરાને એકઠાં કરી પોતે 55 વર્ષની વયના શરીરને વિસ્મયકારી સ્ફૂર્તિથી  
સ્ક્રીપિંગ-દોરી પર કુદાવતા, પછી પોતાની સામે એકાદ છોકરા-છોકરીને  
ઊભાં રાખી જોડલે સ્ક્રીપિંગ કરતા બિલાડી, કૂકડા, કૂતરા વગેરે  
પ્રાણીઓની તરેહવાર બોલીઓ કાઢીને એણે એવાં પ્રાણી વગરની એ  
ખાડસૂષિમાં ભરપૂર જનવસ્તીનો મધુર વિભ્રમ જગાવ્યો, અને

પ્રભુ વિદ્યાવ્યા

પગદીની ઉં  
પાણી પણ એ“આ  
રોલીને પહોંચ  
સાહેબપર હાસ્ય બ  
જરણાં ચાલતદીમ્બા  
અને સાહેબ  
થ પ્રોમીસડ  
પહોંચયું.”પાણ  
સૌને રોલી  
સંઘરણાં હ  
વખતે એક  
આપી રહ્યે  
ક્રોઈક હજુ  
પાછી હં  
હૈયાફૂટી!  
પણલીધી, ટ  
ઠપકો દ  
બાબલો  
અવાજ  
શિર પર

પગદરીની ઊંચી પણડ-ટેચેથી છેક નીચે તળેઠી સુધી બેતરી બેતરીને  
પાકી પણ એણે લાવી લાવી સૌને રિવરાયું.

"આ કંઈ ઉપકાર થોડો કરું છું!" એ કહેતા: "પ્રત્યેક વિપુ  
રોભીને પહોંચશે."

સાહેબનાં હોળટીખણો જોતી જોતી ડેણીમાં પહેલી શારદૂના મો  
પર હસ્ય ઉપસંહૃદી, ને એ ઉપસેલી ફિક્કી ચામડી પરથી અંસુના  
જરણાં ચાલતાં.

\*

ઈમ્ફાલ! - આખરે મણિપુર ઉંફ ઈમ્ફાલની મહેલાતો નજરે પડી,  
અને સાહેબ સૌથી પહેલો આનંદ-શોર કરી ઉઠ્યો: "લેન્ડ, માપ બોંડ,  
દ ગ્રોમીસ્ડ લેન્ડ! આખરે આપણી મનોરથસિદ્ધિનું સ્વર્ગધામ આવી  
પહોંચયું."

પણ એના હર્ષનાદને કાફલામાંથી એકેય જુણ જિલ્લા શક્તનું નહોતું.  
સૌને રોભીની ખોટ સાલતી હતી. હેમકુવરબહેન સૌથી વધુ વેદનાને  
સંઘરટાં હતાં. સાથેનાં કાજુ વગેરે મેવાનો ભાગ છેલ્લા પાંચ પડાવો  
વખતે એણે જ્યારે જ્યારે વહેંચ્યો હતો, ત્યારે દરેક વખતે બીજાં સૌને  
આપી રહ્યા પછી પણ ભૂલભૂલમાં એણે એક્કેક મૂઢી બરી રાખી હતી.  
કોઈક હજુ રહી ગયું છે એવો વિભ્રમ થતો, ને પછી પોતે મૂઢી ડબામાં  
પાછી ખંખેરી નાખી સ્વગત ઉદ્ગારો કાઢતી: 'ધાય ધાય રે મૂર્ઢ,  
હૃયાકૂટી!'

પલેલના કેમ્પમાંથી જ્યારે સાહેબે બાબલાને નીચે મૂડી વિદ્યાય  
લીધી, ત્યારે હેમકુવરથી ધૂસકે ધૂસકે રડી જવાયું. ડૉ. નૌતમે સખત  
ઠપકો દઈ એને માંડ ચૂપ કર્યા. ચાલી નીકળેલાં બાપ-દીકરીની પાછળા  
બાબલો ચીત્સ પાડતો દોડ્યો. તેને સાહેબે ધોઘર જિલાડાનો ધુરકાટબણ્યો  
અવાજ કાઢીને જરા જિવરાવી પાછો વાળ્યો, અને દૂર દૂર સાહેબના  
ક્ષિર પરથી ઊંચકાઈને હવામાં વીજાતી હેટ સૌને હેખાઈ.

\*

પ્રભુ સિદ્ધાય

ઓળખ્યો!

અને

“આ-

છ. નીમણા-

બેઠ

દર્શાવીને

ડૉ.

પોતાના

વાર

થઈ,

મનોવેદના

ઠશારતે

“

- એને

સ

ક્યાંથી?

“

બ્રહ્મદેશ

ભણ્યો

કૃદીઓ

ડબાની

ઓરાદ

અંગેજ

મા-હુ

તેજ :

એ?

### પ્રભુ પદ્ધતિ

172

હિંદમાં એક સ્ટેશને પેસેજર ટ્રેન આવીને એક પાયા પર ઊભી હતી. બીજી એક ટ્રેન આવીને પદ્ધતાના પાયા પર થંભી એ લશકરી ટ્રેન હતી. એના ડબાઓ ઉપર રેડ કોસના બિલ્લા ચીતરેલા હતા. એમાં લશકરી દરરીઓ હતા.

આ લશકરી હોસ્પિટલ-ટ્રેનના એક ડબામાં બે જગ્ઘા બેઠા હતા. તેમનાં માથાં, છાતી, હાથ, ખંબા સફેદ પાયામાં લપેટાયેલ હતાં.

સામે ઊભેલ પેસેજર ટ્રેનના ડબામાં આ બેઠની દાખ ચોંચી રહી. બંનેએ આંખો વડે સામસામી ચેષ્ટા કરી. પછી તેમાંના એકે બારી બહાર ડોકાઈને જોઈ લીધું કે નીચે ઊભેલ સંતોનું ધ્યાન બીજી બાજુ હતું; એણે સામા ડબાના કોઈક પેસેજર પ્રત્યે ધીરો અવાજ કર્યો: “બાબુ!... બાબુલે!... ડોક્ટર બાબુ! લતુબાબુ!”

તાજેતરમાં જ પોતે ત્યજેલી પ્રેમભૂમિનો એ પરિચિત સૂર કાને પડતાં જ પેસેજર ટ્રેનના બે હિંદી યુવાનોએ ચમકી ચોમેર જોયું. પલભર તો ભણકારા વાગ્યા: જાણો સોનાં-કાકી સ્વખમાં બોલાવી રહી છે.

પછી તેમણે ફરી વાર શબ્દ સંભળતાં સામેના ડબા તરફ નજર ઠેરવી, પાયપિંડીમાં જકડાયેલા એ બે જગ્ઘા એકદમ ઓળખાયા નહીં, એટલે એમાંના એકનો જમજ્ઝો હાથ ઊંચો થયો.

પણ હાથ ટૂંકી હતો; હોય તેથી અરધો જ હતો. એને પંજાને બદલે કૂઠી કોણી જ હતી. બેન્ડેજ બાંધેલી એ કોણી ઊંચી થઈને એ માણસને કપાળે અડકી.

એ સલામ કરતો હતો. એ સલામ ભયંકર હતી. એકાએક એ દેખીને રતુભાઈના મોંમાંથી ચિચિયારી ઉઠી.

“માંઉ-માંઉ!”

જવાબમાં સામા માણસે હસીને ડોકું હલાયું, ને કહ્યું: “ઓળખ્યો ખરો!”

બીજા માણસે રતુભાઈ સામે પોતાનો હાથ નહીં, કોણી પણ નહીં, પણ જમજ્ઝો પગ કપાળ સુધી ઊંચો કરી સલામ ભરી કહ્યું: “મને

ઓળખ્યો! હું માંઉ-પૂઃ”

અને એણે પોતાના બેઉ ખબા ડૉ. નૈતમ તરફ રજૂ કર્યા.

“અરરર!” ડૉક્ટરે ઉચ્ચાર્યુ. આના તો બેઉ હાથ ખલેથી જ ગયા.

છ. નીમ્યાનો વર!

બેઉ હુઠાઓ હસતા જ બેઠા હતા. હુઠા હાથ ને ખબા વારવાર દર્શાવીને કોઈક મોટી સિદ્ધિની જાગે વધાઈ ખાઈ રહ્યા હતા.

ડૉ. નૈતમને અને રતુભાઈને આ દર્શે અબોલ હિંમૂર બનાવ્યા. પોતાના અતિ નિકટનાં આ બેઉ બમા જુવાનોના છુંદાયેલાં માં ઓળખાતાં વાર થઈ, પણ ઓળખાવ્યા પછી જે એકાદે પલ વીતી તે દરમાનની મનોવેદના અકથ્ય હતી. અંખે જગજગિયાં આવ્યા. રતુભાઈએ હાથની ઠથારતે પૂછ્યું, “આ શું?”

“માંડલેનો કિલ્લો - જ્યાં તમારો લજ્જપત્રચાય અને ટિણક પુરાયેલા

- એને અમે ઉડાવ્યો. અમારા હાથ પણ ત્યાં હોમી આવ્યા.”

સમજતાં ઘડીઓ વીતી. આ બેઉ માંડલેનો કિલ્લો ફૂકવામાં ક્યાંથી? જાપાનીઓને મળી ગયેલા?

હાં હાં! તખીન પાર્ટીનો આ જલતો તિખારો માંઉ-માંઉ ભ્રલદેશમાંથી ગાયબ બન્યો હતો. બનેવીને લઈને જાપાનીઓમાં જ જઈ ભય્યો હોવો જોઈએ.

“નીમ્યાને...” માંઉ-પૂના મોંમાંથી આટલો બોલ પડ્યો ત્યાં તો કુદીઓની એ હોસ્પિટલ-દ્રેનનાં પૈડાં ફર્યા. ઘડીકમાં તો એ દ્રેનના છેલ્લા ડ્બાની પીઠ પરની લાલચોળ ત્રણ બતીઓ જ દેખાઈ ને અંધકારમાં ઓરાઈ ગઈ.

ભણોલોગજોલો જુવાન; અંખે-મોંએ માના જેવો ફૂટડો, ઘડાબંધી. અંગ્રેજ વાગ્ધારા રેલાવતો, વિચારવંત, કાળમાં ને કાળમાં કુંગી બનેલો. મા-હ્લાને ચાહનારો: છેલ્લે એને ખનાન-ટોનાં હુલ્લડ ચલવતો ને નારીના તેજ સામે પરાસ્ત બની પાછો વળેલો દીઠોંતો. પણ આ શું બોલી ગયો એ? માંડલેના કિલ્લાનો ધંસ ક્યાં ને આ ક્યાં! રતુભાઈને નીમ્યાએ

છેલ્લી વાત કઈ જ નહોતી.

સોનાંકાડી સાંભરી આવ્યાં. છેલ્લે છેલ્લે એક સોનાંકાડી જ મળ્યા વગરનાં રહ્યાં હતાં. સોનાંકાડી - પિતાએ પોતાની જીવાનીમાં કોઈક દિન ચાહેલી એ ગ્રોક! દરેક રીતે પૂરેપૂરી માતાપદ્ધતે પાત્ર એ કો-સ્વેનો તો આખો સમાગમ જ ડૉ. નૌતમના જીવનમાં ઝંકાર પડી રહ્યો.

\*

“આ બાબલો જોયો તમારો?” હેમકુંવરબહેને મહેસુલા વળોટાં પછી ડૉ. નૌતમને નવા ખબર આપ્યા: “પાજુ જ છે ના! શારદુભહેનને કહે છે કે: શાદુ મામી!”

ભરાવા લાગેલા શારદુના ગાલ, જેના ઉપર કાલરચીતરી કેશલાટે ઝૂલતી હતી, તે ગાલ કાનના મૂળ લગ્ની રાતાચોળ થયા.

“ભલે કહેતો!” રતુભાઈએ પૂર્ણવિરામ મૂક્યું. શારદુ વધુ લાલ બની ગઈ.

વઢવાડા કેમ્પ સ્ટેશન છોડીને દ્રેન આગળ વધી. વાંકાનેર આવવાને વાર નહોતી. પણ રતુભાઈની નજર સામે બે જ દશધો રમતાં હતાં: એક કોણી સુધી કપાયેલા હાથની નીમ્યાના અકોએ કરેલી સલામ ને બીજું સલામ જીલવાના એકેય હાથ વગરની પોતાની ખારી અમા નીમ્યાના નાથ માંઉ-પૂની સ્થિતિ:

નીમ્યાને આ સ્થિતિનું દર્શન કરી જ ન કરાવજો, હે મારા નાથ!

1896	જન્મ: 2
1912	અમરેલિ
1917	આર્થસ
1917	કોલેજ- ભાવન
1918	ધર્મ હ કૌટંદિ
1921	એમ. નોકરી આરં વતાં પાઇ